

Gujarat Chamber of Commerce and Industry



GCCI


GUJARAT CHAMBER OF
COMMERCE & INDUSTRY

BUDGET 2024

વિકાસના દાર્ઘવે
પર લઈ જવા
સક્ષમ બજેટ



Gateway To Growth




KUNVARJI

Kunvarji brings a wealth of knowledge accumulated over 60+ years of our commitment to growth. With the help of this knowledge, Kunvarji has consistently improved the lives of everyone we touch. No wonder then, Kunvarji continues to evoke a sense of trust whether it is Wealth Solutions, Agro Commodities, Real Estate Advisory, Integrated Logistics, Tech Solutions or Insurance Advisory.

Leading From The Front

Contents



President
Sandeep Engineer



Sr. Vice President
Rajesh Gandhi



Vice President
Apurva Shah



**Immediate
Past President**
Ajay Patel



Hon. Secretary
Gaurang Bhagat



**Hon. Secretary
(Regional)**
Jignesh Karia



Hon. Treasurer
Sudhanshu Mehta

We welcome your
feedback and suggestions.
Do write to us on :
bulletin@gujaratchamber.org

1. GCCI in Action04
2. GCCI Committee & Taskforce 2024-2520
3. Regional Chamber Activities22
4. UNION BUDGET - 2024 Booklet24
5. વિકાસના હાથવે પર લઈ જવા સક્ષમ બજેટ50
6. બજેટમાં ટેક્સ સ્લેબ બદલાતાં કરદાતાને રૂ. 17,500નો ફાયદો થશે70
7. ભાગીદારોને ચૂકવવામાં આવતી રકમ પર 10 ટકા TDS કરવો પડશે.....74
8. આવકવેરાના દરોડાના કેસમાં બ્લોક એસેસમેન્ટની સ્કીમ ચાલુ કરાઈ75
9. કરવિવાદના કેસોને ઝડપી ઉકેલવા વિવાદ સે વિશ્વાસની નવી યોજના જાહેર77
10. સોના-ચાંદીની ખરીદીમાં 10 પેસા TCS-TDS કરવાની જોગવાઈમાં રાહત આપી ..78
11. મધ્યમ કંપનીને સપ્લાયરની કેટેગરીમાં મૂકી નાની કંપનીઓની સલામતી વધારી80
12. નાના ઉદ્યોગોની સમસ્યાઓનો ઉકેલ હજીય છેટો જ છેટો86
13. સોના પરની આયાત ડ્યૂટી 9 ટકા ઘટાડી દાણચોરી પર બ્રેક લગાવી88
14. ખેડૂતોની આવક વધારવા માટે 10,000 FPOની રચના કરશે93
15. પગારની જોગવાઈનો લાભ તમામ ભાગીદારી પેઢીઓ નહિ લઈ શકે95
16. ગુણવત્તા ગુજરાત અભિયાનનો અમદાવાદથી આરંભ થયો97
17. સ્પેન્ટ એસિડની વોટરલેસ ટ્રીટમેન્ટ કરી 5 લાખ લિટર એફલુઅન્ટમાં ઘટાડો કર્યો..... 100
18. તમારા સંતાનને ભણવા કેનેડા મોકલવા માગો છો? ચેતી જજો 101
19. જંગલનો નાશ કરી વસ્તુઓ બનાવીને યુરોપ એક્સપોર્ટ કરશો તો સિલેક્ટ થશે 106

Disclaimer:

The articles contained in this publication represent the individual views and opinions of the writer and GCCI does not necessarily conform or share the same views with that of the writer. The article does not constitute comprehensive professional advice and is meant for information purposes only. The information, data and figures in the articles have been obtained or derived from sources believed to be reliable, but GCCI does not represent that this information is accurate or complete. Any opinions or estimates contained in the articles represent the views of the writer at that time and are subject to change without notice. Readers of this publication are advised to seek their own professional advice before taking any course of action or decision, for which they are entirely responsible. GCCI neither accepts nor assumes any responsibility or liability towards any reader of this publication in respect of the information obtained within this publication or for any decisions readers may take or decide not to take or fail to take, based on the contents of this publication.

Gujarat Chamber of Commerce & Industry, Ashram Road, P.O.Box No. 4045, Ahmedabad - 380 009.
Tel.: +91 79 26582301/ 2/ 3/ 4, Email : gcci@gujaratchamber.org, Web.: www.gujaratchamber.org

President Message



Sandeep Engineer

President, GCCI

Dear Members,

Warm greetings to you. I feel happy and privileged to communicate with you through this message for our Bulletin.

At the outset, I thank you for unanimously electing me as the President, GCCI for the year 2024-25. Right since the year 1949, Gujarat Chamber of Commerce & Industry has been consistent being the voice of Gujarat's trade & industry and with the great support received from all our Regional Chambers as well as our affiliated associations, as also through the tireless efforts of the galaxy of our Past Presidents, GCCI has relentlessly pursued our vision of "Grow Trade, Transform Gujarat". During the year ahead, we are fully committed to pursue this vision with same consistency, commitment & enthusiasm.

I also take this opportunity to congratulate our Senior Vice President Shri Rajeshbhai Gandhi, Vice President Shri Apurvabhai Shah, Hon. Secretary Shri Gaurangbhai Bhagat, Hon. Secretary (Regional) Shri Jigneshbhai Kariya and Hon. Treasurer Shri Sudhanshubhai Mehta for their election and wish them all the best.

We congratulate our Immediate Past President Shri Ajaybhai Patel for a highly eventful year and look forward to avail all his guidance and support during the year 2024-25.

On 23rd July, 2024, our Hon'ble Union Minister for Finance, Smt. Nirmala Sitharaman presented the Union Budget for the year 2024-25. In his response to this budget, our Hon'ble Prime Minister Shri Narendrabhai Modi called it the "Budget for Viksit Bharat". This once again signify the importance of this vision of our Hon'ble Prime Minister as also his unwavering commitment backed by the faith, support & commitment of the whole nation to make our nation India a "Developed Nation".

As it is evident, our united & concerted efforts will be the tool & path to fulfil "Viksit Bharat" mission. It will be imperative that the entire unorganized sector of our state and our nation is made part of the mainstream economy so that they can avail all the skills, knowledge & infrastructure that the organizations like GCCI can offer to them and help them grow exponentially in their respective fields of trade & industry.

It is with this vision in mind, that since the year 2023-24 we have introduced the concept of "Nominal Membership" in GCCI. This enables all small & marginal traders & industry people to join GCCI by just paying one time entrance fee which remains valid for a period of -3- years and which help them avail our entire infrastructure, our experience and our credibility in growing their respective trade & industry.

I earnestly request all our members to help us bringing more and more "Nominal Members" in our fold. Let me reiterate: this will prove a critical game changer in the mission of our economic growth.

As I mentioned earlier, Union Budget 2024-25 has been rightly termed as the "Roadmap to Viksit Bharat". Here I would like to quote one spiritual leader: "It is supremely important to be free from contradictions. The "Goal" and the "Way" must not be on different level. "Life & Light" must not quarrel. "Behaviour" must not betray "Belief."

The consistency of all our union budgets right through last one decade speaks volumes about our commitment to the mission of "Viksit Bharat". Each successive budget has proved to be the hallmark of "Fiscal Prudence". We are careful in how we spend our resources. Equally evident is our commitment towards "Infrastructure Development", "Capital Investment", "MSMEs", "Rural Consumption" & "Employment Generation". The budget also reflects being conscious of our demographic advantage the way we are investing in skill development.

India understands the importance of our defence preparedness since only then we can focus better

President Message

and pursue whole-heartedly our goals like manufacturing, providing world class services and developing enviable infrastructure across the length and breadth of our nation. It is heartening that Rs.4.55 lakh crore has been allotted towards Defence.

Capital Expenditure allocation of INR 11.1 trillion reflects Government's seriousness & consistency towards infrastructure development. Similarly, Government's commitment towards PMAY (Prime Minister's Awas Yojana) through allocation of INR 847 billion will help ensuring roof for countless families. The allocation of INR 100 billion towards Solar Power reflects our commitment towards sustainable development.

As I mentioned earlier, Government has been committed towards the growth of MSMEs and all the strength they can bring to the table in terms of "Make in India" mission as well as generating big scale employment opportunities.

For this purpose, Government has introduced new self-financing guarantee fund, for facilitating term loans to MSMEs for purchase of machinery and equipment without collateral or third-party guarantee. This will help drive credit demand in MSME segment for banks.

Similarly Public Sector Banks will be asked to develop in-house capabilities to underwrite MSME credit instead of relying on traditional external assessment methods. This will provide easier access for MSMEs towards Bank Credit. The introduction of credit support through a guarantee from a government promoted fund for MSMEs classified as "Special mention Accounts (SMA)" will provide support for MSME segment asset quality for banks.

Equally heartening is the decision to increase the limit for Mudra loans to Rs. 2 million from Rs. 1 million under "Tarun" category. This will surely give boost to MSMEs units and also Bank loan growth.

Government has decided to allocate INR 226 billion towards MISS (Modified Interest Subvention Scheme). This will prove to be a great support to farmers for their spending on their agricultural inputs.

The vision of creating Investment-ready "plug and play" industrial parks in or near 100 cities will provide greater pace to manufacturing activity.

The budget also allocates more than Rs.3 lakh crore for schemes benefitting women and girls which reflects the commitment towards availing full benefit of our entire work force.

The "Vivad Se Vishwas" scheme 2024 will bring greater transparency and alleviate the fear towards bureaucracy.

The Model Skill Loan Scheme to facilitate loans up to Rs. 7.5 lakh with a guarantee from a government promoted Fund is also a welcome step.

The increase in Standard Deduction Limit under the new tax regime from Rs. 50,000 to Rs.75,000 will add to the spending capacity of people.

The Union Budget recognizes the spirit of ensuring present well-being of the nation and citizens as well as being prudent towards future growth & development. It also reflects Government's commitment to balance economic growth, social welfare as well as fiscal responsibility as also providing all required means to our youths to develop their skills and put in their efforts towards nation building.

I look forward to communicate with you through our bulletins as also through various events round the year and request you to please share your suggestions with us so that we can better address issues concerning trade & industry.

Sandeep Engineer
President

GCCI in Action

THE 74TH ANNUAL GENERAL MEETING AND INSTALLATION CEREMONY OF PRESIDENT SHRI SANDEEP ENGINEER AND HIS TEAM FOR THE YEAR 2024-25 - DT. - 13-07-2024

The 74th Annual General Meeting and Installation Ceremony of the New Office Bearers of GCCI for the year 2024-25 was organized on 13th July 2024 today at Karnavati Club, Ahmedabad.

The meeting was attended by representatives of trade and industry from across Gujarat in large numbers. During the Annual General Meeting, the President Shri Ajay Patel gave a brief of the landmark events and activities held during the year and expressed his gratitude to all members and persons who contributed in making his tenure successful.

The annual accounts and other points were approved by the members unanimously in the Annual General Meeting.




their best wishes the new team of Office Bearers and elected Executive Committee members.

The Annual General Meeting was followed by the Installation Ceremony of the new Office Bearers. Shri Rajendra Shah, Chairman, Harsha Engineers International Ltd. graced the installation ceremony as chief guest and Shri Amit Baxi,

operation and active engagement throughout the year particularly highlighting the significance of Nominal Membership. He welcomed the newly elected Office Bearers and outlined the impactful initiatives implemented during his tenure, assuring members of the new team's commitment to furthering industry and trade interests. He emphasized ongoing representation efforts and affirmed the collective dedication to advancing the organization's goals and fostering community prosperity.

In his address, newly elected Senior Vice President Shri Rajesh Gandhi highlighted GCCI's seven-decade legacy as a key driver of Gujarat's business and industrial development. Under the leadership of former President Shri Ajaybhai Patel and newly elected President Shri Sandeepbhai, GCCI is broadening its reach by including small and marginal traders and industrialists as nominal members. This move aligns with Hon'ble Prime Minister Shri Narendra Modi's vision of a "Developed India" and a "5 Trillion Dollar Economy." The initiative aims to boost the state's economic progress, making GCCI's role and contributions increasingly vital in the coming years.



Shri Sandeep Engineer took charge as the new President of GCCI for the year 2024-25, while Shri Rajesh Gandhi took charge as the Sr. Vice President and Shri Apurva Shah took over as the Vice President. The names of the new Elected members of the executive Committee were also announced in the Annual General Meeting. Shri Ajay Patel and his team of Office Bearers for 2023-24 congratulated and conveyed

Chairman and Managing Director, Eris Lifesciences Ltd was the Guest of Honour for the occasion. Smt. Pratibha Jain, Mayor, Ahmedabad Municipal Corporation graced the ceremony with her distinguished presence.

Shri Ajay Patel, Immediate Past President, GCCI welcomed esteemed guests and members and expressed deep appreciation to all members for their continuous support, co-



In his address, newly elected President Shri Sandeep Engineer in his address expressed gratitude to the Esteemed Chief Guest Shri Rajendrabhai Shah; Guest of Honour Shri Amitbhai Baxi and other distinguished guests and acknowledged their presence and support. He highlighted the successful year under the leadership of Shri Ajaybhai Patel, emphasizing important initiatives such as expanding the membership base through the “Nominal Membership” and successful programs like “Udyog Jagat Ni Charcha,” and key activities such as hosting international delegations, partnering in Vibrant Gujarat, hosting interactive sessions with Hon’ble Union External Minister Shri S. Jaishankar and Hon’ble Union Finance Minister Smt. Nirmala Sitharaman and organizing various successful seminars such as International Conference on Waste and Water Management, Start-up Demo Days, Mega Blood Donation Drive, 3rd edition of Textile Leadership Conclave and Taxation related seminars. He also expressed gratitude to the leadership and committees for their contributions and charted goals for the coming year, focusing on representing MSMEs especially micro and small, establishing specialized training facilities for Entrepreneurship Development, maintaining industry relations, expanding activities and

contributing to national development by fostering the growth of industries and trade of State.

Shri Amit Baxi, Guest of Honour during his address mentioned though provoking quote that actors are often dubbed heroes, suggesting instead that entrepreneurs truly embody heroism. He stressed the idea that everyone possesses a unique narrative, but the key lies in progressing through the value chain, effectively managing capital and daring to take calculated risks. Highlighting the pivotal role of mentorship, particularly during formative stages, he stated that it is more important than mere financial backing. Shri Amit Baxi urged GCCI to prioritize the creation of more



mentorship opportunities, believing these initiatives not only enrich the learning experience but also significantly contribute to the growth and vitality of the industry.

Chief Guest of the occasion, Shri Rajendra Shah in his address congratulated newly elected President Shri Sandeep Engineer and team and stated under the decisive leadership of Hon’ble Prime Minister Shri Narendrabhai Modi, India is poised to emerge as a global powerhouse, a prospect that fills us with optimism. Looking ahead, we anticipate exciting years ahead. We must remain steadfast in our commitment to goals and uphold moral values to ensure guaranteed success. It is essential to maintain high aspirations and urged young entrepreneurs to persevere through challenges without resorting to shortcuts. Stressing the importance of Swadharma, the duty towards society must be fulfilled with utmost sincerity. He further stated that motivation and patience form a robust framework for entrepreneurial success, fostering innovation, resilience, and growth in the dynamic business.

Newly elected Vice President Shri Apurva Shah thanked all dignitaries for sparing their valuable time to grace the event and concluded the Installation Ceremony with Vote of Thanks.

**GCCI OFFICE BEARERS COURTESY MEETING WITH SHRI BHUPENDRABHAI PATEL,
CHIEF MINISTER OF GUJARAT, GOVT. OF GUJARAT**



Office Bearers of Gujarat Chamber of Commerce and Industry (GCCI) had courtesy meeting with the Hon'ble Chief Minister Shri Bhupendrabhai Patel. During the meeting, the Hon'ble Chief Minister extended his congratulations to the newly appointed office bearers of GCCI. The attendees included President Shri Sandeep Engineer, Vice President Shri Apurva Shah, Hon. Secretary Shri Gaurang

Bhagat and Hon. Treasurer Shri Sudhanshu Mehta. The discussion centered on the industrial growth of Gujarat, with particular emphasis on the development of the MSME and SME sectors. The Hon'ble Chief Minister reiterated the Government's ongoing commitment to fostering a more conducive environment for trade and industry advancement in the state.

**LECTURE ON DHARM AND INDUSTRY IN THE PRESENCE OF HIS HOLINESS ANANT VIBHUSHIT
DWARKA PEETH JAGADGURU SHANKARACHARYAJI SWAMI SHRI SADANANDA SARASWATIJI AND
SWAMI SHRI PARAMATMANANDA SARASWATIJI – DT. – 16-08-2024**



GCCI organized a lecture on the subject "Dharm and Industry" on 16th August, 2024 in the holy presence of His Holiness Anant Vibhushit Dwarka Peeth Jagadguru Shankaracharyaji Swami Shri Sadananda Saraswatiji and Swami Shri Parmatmananda Saraswatiji President, Sivananda Ashram Ahmedabad and General Secretary of Hindu Dharma Acharya Sabha.

Welcoming the participants on the occasion GCCI President Shri Sandeep Engineer expressed great joy and honour to have the



presence of His Holiness Dwarka Peeth Jagadguru Shankaracharya, Swami Shri Sadananda Saraswatiji and Swami Shri Parmatmananda Saraswatiji, President, Sivananda Ashram Ahmedabad. He remarked that while the whole world has been taking great strides towards prosperity and material well being at the same time spiritual values are depleting. He mentioned that it would be a bleak future if material success is not balanced by spiritual values as well as empathy towards other fellow human beings. He therefore emphasized the need of such lecture series which is focusing on “Dharma & Industry”.

Speaking on the occasion Swami Shri Parmatmananda Saraswatiji mentioned that it is not bad to create wealth, however our approach should be towards the greater good. He remarked that the Dharma should be reflected in our action: “Dharayati Iti Dharma”. We must distinguish between what is right and what is wrong. He appreciated GCCI initiative in organizing this lecture and congratulated President for the same and wish that GCCI will organized such religious events in the future.

In his discourse on the subject “Dharma & Industry” His Holiness Dwarka Peeth Jagadguru

Shankaracharya Swami Shri Sadananda Saraswatiji emphasized that we must work to create wealth, but we also must understand how to utilize the wealth. He remarked about the need to utilize the wealth for five things viz: Dharma, Yash, Personal use, for Business and for Community at large. He remarked that we all shall leave the world, but we shall carry only Dharma observed in life by us. He remarked that we must use our body, our mind and our resources towards nurturing Dharma.

The event concluded after the vote of thanks proposed by GCCI Hon. Secretary Shri Gaurangbhai Bhagat.

INDUSTRIAL VISIT TO HITACHI HI-REL POWER ELECTRONICS PVT. LTD., SANAND – DT. – 05-07-2024

The purpose of this industrial visit was to provide members of the Gujarat Chamber of Commerce and Industry (GCCI) with an opportunity to:

To explore the manufacturing processes and technological advancements in power electronics.

To understand Hitachi Hi-Rel’s role in the local and global market.

The visit began with a welcome address from Viralkumar Shah, Head OEM Development & Factory Operations, Voltas Beko who provided a brief overview of the company’s history, operations and product portfolio. Following the

welcome address, the participants were taken on a guided tour of the manufacturing facility. During the tour, the participants observed the various stages of production from the assembly of components to the final testing and packaging of finished products.

The company representatives

emphasized the importance of quality control throughout the manufacturing process. The participants were able to see firsthand the various quality checks that are conducted at each stage of production. The company has invested heavily in automation, which has helped to improve efficiency and productivity. The participants were impressed by the use of automated equipment in the manufacturing process.

The company is committed to sustainable manufacturing practices. The participants learned about the company's efforts to reduce its environmental impact by using recycled materials and energy-efficient technologies.

The industrial visit to Hitachi Hi-Rel Power Electronics Pvt. Ltd., was a valuable learning experience for the members of the GCCI. The participants gained a deeper understanding of the manufacturing processes involved in the production of power electronics and learned about the latest technologies and innovations being used in the industry. The visit also provided an opportunity for the participants to network with other industry professionals and learn about the challenges and opportunities facing the manufacturing sector in India.



List of Participants

Sr. No.	Name	Company Name
1	Navroz H Tarapore	Atmos Power Pvt Ltd
2	Vikas Modi	Shree Nakoda Tex Fab P Ltd
3	Kenil patel	Ikon multipack
4	Janak Patel	Pentaflex Films LLP
5	Harshad Kalal	Banthia Consultancy
6	Keyur Patel	A.K.International
7	Kumarpal Shah	Kumar electric and engg co
8	Tejas Mehta	Tejas Metal & Plast Products
9	MONIL PANCHAL	AQUASCAPE ENGINEERS PVT LTD
10	Prashant Patel	Prashant industries
11	Rahul Jain	Banthia Consultancy
12	Atul shah	Pioneer Industries
13	Vani Mehta	Bizkey Consultancy
14	Maninder Griglani	Anand Creation
15	BHAVIN VIKRAMBHAI SHAH	BHUVAN ENGINEERING
16	Amit Gohel	Eleics Design Private Limited
17	KANTILAL	KALAMEK GARMENTS
18	Karneek Vyas	Topline Switchgear Pvt. Ltd.
19	Dhruvin Patel	Topline Switchgear Pvt. Ltd.
20	Sparsh P Sharma	Pride Flexi Pack
21	Kishan Patel	Capital Engraving
22	Rajesh Kumar Hernwal	Katlax Enterprises Pvt. Ltd.

TRAINING ON MASTERING BUSINESS INTELLIGENCE TOOLS TO EMPOWER ANALYTICAL DECISION MAKING – DT. – 11-07-2024 - IT & ITES TASKFORCE

The training aimed to equip participants with essential skills in utilizing business intelligence (BI) tools effectively to enhance their analytical capabilities and decision-making processes.

The training began with a warm welcome to all GCCI members. The

objectives of the training were outlined, emphasizing the importance of mastering BI tools in today's competitive business landscape. Participants were encouraged to actively engage in the sessions to maximize their learning experience.

The training focused on the principles

of analytical decision making, covering key topics such as understanding decision criteria, exploring decision-making frameworks, and leveraging data-driven insights to make informed choices. Practical examples and case studies were used to illustrate the application of

analytical decision-making techniques.

Participants also delved into the data analysis process, covering fundamental steps such as data collection, data cleaning, exploratory data analysis (EDA) and statistical analysis. Emphasis was placed on the importance of data integrity and quality assurance in generating reliable insights.

The highlight of the training was the session dedicated to mastering BI tools. Participants were introduced to popular BI tools such as Power BI. They learned how to import data, create interactive dashboards and reports and perform advanced data analysis. Hands-on exercises allowed participants to apply their newfound skills in a practical setting.

The training concluded with a recapitulation of key learnings from



each session. Participants expressed satisfaction with the depth of knowledge gained and their ability to apply BI tools effectively in their professional roles.

Feedback highlighted the practical relevance of the training content and the expertise of the trainers from Dhey Consulting Services Pvt. Ltd.

LIVE TELECAST OF UNION-BUDGET 2024-25 – DT. – 23-07-2024

Today i.e. on 23rd July, 2024, Union Budget was announced by the Hon'ble Union Minister of Finance, Smt. Nirmala Sitharaman. In response to the Union-Budget, President GCCI, Shri Sandeep Engineer has applauded the union budget, noting the significant positive transformation of the Indian economy over the past decade and the comprehensive and forward-looking nature of the budget. He highlighted the commitment to economic growth, social welfare and fiscal responsibility, emphasizing the budget's focus on youth and employment generation with a special focus on rural agriculture economy and MSMEs, which are vital to the nation's progress. He also mentioned that budget aligns with the vision of Hon'ble Prime Minister Shri Narendrabhai Modi to make the Indian economy a \$5 trillion economy. He further added that the budget introduces safe harbor rates for foreign mining companies selling raw diamonds in India, which will benefit Gujarat's diamond industry. Additionally, the budget reduces the corporate tax rate for foreign companies from 40% to 35%, with the goal of attracting more foreign capital and strengthening Gujarat's status as a hub for the diamond industry.

Shri Apurva Shah, Vice President, GCCI welcomed the budget and appreciated the major announcements regarding MSMEs. He appreciated the announcements aimed at facilitating term loans for MSMEs to purchase



machinery and equipment without collateral or third-party guarantees. A new credit guarantee scheme will pool credit risks and provide guarantee cover upto Rs. 100 crore per applicant, funded by a self-financing guarantee fund, with borrowers paying upfront and annual guarantee fees. Public sector banks will enhance their in-house capabilities to assess MSMEs for credit, developing new models based on digital footprints rather than traditional asset or turnover criteria, thereby including MSMEs without formal accounting systems. Furthermore, the limit for Mudra loans will be increased from Rs. 10 lakh to Rs. 20 lakh for entrepreneurs who have successfully repaid previous loans under the 'Tarun' category. He commended these steps, noting their potential to significantly boost the rural economy and support MSMEs, the backbone of

the Indian economy.

Shri Gaurang Bhagat, Hon. Secretary, GCCI has welcomed the announcement of Investment-ready “plug and play” industrial parks to be developed in or near 100 cities. He appreciated government’s decision to reduce customs duties on precious metals. The customs duty on gold and silver has been reduced to 6% and on platinum to 6.4%. This move will have a positive impact on the jewelry sector and related industries, making these metals more accessible for both consumers and businesses

GCCI President and his team of office bearers especially highlighted and applauded below mentioned key positive initiatives announced in the Union Budget:

- Special focus on Rural Development with allocation of ₹2.66 lakh crore, focusing on infrastructure and support for manufacturing.
- New mechanism for facilitating continuation of bank credit to MSMEs during their stress period
- Turnover threshold of buyers for mandatory onboarding on TReDS platform to be reduced from ₹500 crore to ₹250 crore
- Investment-ready “plug and play” industrial parks to be developed in or near 100 cities
- PM Awaas Yojana – Urban 2.0 to cater to 1 crore urban poor with investment of Rs 10 lakh crore and have Central assistance of Rs 2.2 lakh crore over next five years.
- Several significant changes are made to customs duties aimed at stimulating various sectors of the economy. These include exempting three more cancer treatment medicines from customs duty and reducing customs duty on mobile phones, related parts, and chargers to 15%. Proposal of exempting



customs duty on 25 critical minerals and reducing it on two others. Customs duty on certain brood stock, shrimp and fish feed will be cut to 5% and on real down-filling material from duck or goose. The duty on MDI for manufacturing spandex yarn will be reduced to 5% from 7.5%, and the export duty structure on raw hides, skin, and leather will be simplified and rationalized. The customs duty on gold and silver



will be reduced to 6% and on platinum to 6.4%. Furthermore, customs duty will be removed on ferro nickel, blister copper and oxygen-free copper for manufacturing resistors

- For promoting women-led

development, the budget carries an allocation of more than ₹3 lakh crore for schemes benefitting women and girls

- Development of a taxonomy for climate finance for enhancing the availability of capital for climate adaptation and mitigation.
- Announcement of Vivad Se Vishwas Scheme 2024
- The Model Skill Loan Scheme will be revised to facilitate loans up to ₹7.5 lakh with a guarantee from a government promoted Fund
- To improve the socio-economic condition of tribal communities, the Pradhan Mantri Janjatiya Unnat Gram Abhiyan will be launched, providing saturation coverage for tribal families in 63,000 tribal-majority villages and aspirational districts, benefiting 5 crore tribal people
- To support youth ineligible for government schemes, financial assistance will be provided through e-vouchers for loans up to ₹10 lakh for higher education in domestic institutions, offering annual interest subvention of 3% to 1 lakh students each year.
- To enhance the standard deduction limit under the new tax regime from ₹50,000 to ₹75,000.
- The TDS rate on e-commerce transactions will be reduced from 1% to 0.1%. Additionally, credit for TCS will be given against TDS deducted from salary.

INTERACTIVE SEMINAR ON TECHNICAL ANALYSIS OF FINANCE BILL- DT – 25-07-2024 2024 GCCCI AND AHMEDABAD BRANCH OF WIRC OF ICAI



GCCI jointly with Ahmedabad Branch of WIRC of ICAI organized an Interactive Seminar on Technical Analysis of Finance Bill, 2024 at Pandit Dindayal Upadhyay Auditorium, Ahmedabad.

Shri Sandeep Engineer, President, GCCCI welcomed the participants by highlighting the Finance Bill's significant implications across various sectors nationwide. He emphasized that the session aimed to provide a detailed examination of its provisions, encouraging active participation and exchange of ideas among attendees to deepen their understanding of the budget's impact. He also emphasized the seminar's goal of fostering collaboration for the advancement of industries and the broader

economy.

Speaking on the occasion, Chairman, Ahmedabad Branch of WIRC of ICAI, CA. Sunil Sanghvi provided a brief introduction of the distinguished speaker, CA. (Dr.) Girish Ahuja, a renowned authority on taxation matters. He commended the efforts of both organizations in organizing the seminar, emphasizing its significance in facilitating a comprehensive understanding of the Finance Bill, 2024.

CA. (Dr.) Girish Ahuja delivered a detailed presentation on the Finance Bill, 2024, discussing key direct tax amendments and administrative changes addressing various complex issues with clarity and expertise. Key topics discussed



included implications surrounding share buybacks, simplifications in capital gains taxation, regulatory frameworks governing charitable trusts and mergers, review of the modifications in search operations including time duration changes, Vivaad se Vishwas 2024 scheme and relief measures for the late filing of TDS and TCS obligations. His insights provided attendees with a comprehensive understanding of the implications of the proposed changes in the bill.

The interactive Question and Answer session further enhanced participants' understanding of the nuances of the Finance Bill, 2024.



The seminar concluded with the vote of thanks proposed by CA Purushottam Khandelwal, Central Council Member of ICAI.

VISIT TO INDIAN RED CROSS SOCIETY - DT. -13-08-2024- MAHAJAN SHANKALAN TASKFORCE

GCCI's Mahajan Sankalan Taskforce organized a visit to the Indian Red Cross Society, Ahmedabad at the Kiran Chudgar, Redcross Shatabdi Bhavan on 13th August, 2024 followed by a felicitation ceremony for the participant associations in the Mega Blood Donation Drive organized in June 2024. The event was hosted at the Indian Red Cross Society's premises located at Kiran Chudgar, Redcross Shatabdi Bhavan, Naranpura, Ahmedabad.

It was an in-depth tour of the Indian Red Cross Society' facilities including Thalassemia Treatment. Indian Red Cross Society, Ahmedabad District Branch caters to more than 1200 thalassemia children who receives regular blood transfusion at Kiran Chudgar Ahmedabad Red Cross Shatabdi Bhawan. This facility is at the forefront of providing life-saving treatment and support to individuals affected by Thalassemia, a critical genetic blood disorder at free of cost. The tour offered insights into the advanced care and services



provided by the Red Cross to patients, showcasing their commitment to healthcare and humanitarian aid.

Following the visit, a felicitation ceremony was held to honor the associations that played a significant role in the Mega Blood Donation Drive organized by the GCCI, in which GCCI President Shri Sandeep Engineer; Senior Vice-President Shri Rajesh Gandhi; Vice President Shri Apurva Shah, Hon. Secretary Shri Gaurangbhai

Bhagat, Chairman of GCCI's Mahajan Sankalan Taskforce, Shri Ashish Zaveri and Chairman of Indian Red Cross Society, Ahmedabad Branch Shri Amit Doshi and other Office Bearers were present. Felicitation ceremony recognized the tireless efforts and contributions of these associations, led by GCCI in making the drive a resounding success, which has greatly contributed to the collection of 1446 units of blood.



S I N C E 1 9 4 6
MANIAR

You Name It We Shape It



Equipment to Empower A Global Tomorrow

Liquid / Solid Waste Handling Equipment
Truck mounted Cranes
Hydraulic Aerial Work Platforms

Nr. Ajit Mills Complex, Maniar Trailer Road,
Rakhial, Ahmedabad - 380 023. Gujarat, India.
Mob : 9825012223 / 9909991010
Phone : +91-79-2291 1636 / 2291 0405 Fax : 079-2291 1373
Email : cleancity@gmail.com, mkt@maniar.com
Web : www.maniar.com



ISO 9001 : 2015

VISIT OF NEW ZEALAND'S TRADE DELEGATION MR. TODD MCCLAY, HON'BLE MINISTER OF AGRICULTURE, FOREST & TRADE FOR GUJARAT – DT. – 14-08-2024 - INTERNATIONAL TRADE TASK FORCE

The Gujarat Chamber of Commerce and Industry (GCCI) recently hosted a significant meeting with the New Zealand trade delegation, including Mr. Todd McClay, Hon'ble Minister of Agriculture, Forest & Trade, and Mr. Patrick John, High Commissioner of New Zealand to India. The session, chaired by GCCI President Shri Sandeep Engineer, witnessed constructive discussions and outlined actionable steps for future collaboration.

The meeting commenced with warm greetings extended by Shri Sandeep Engineer, followed by Mr. McClay's expression of enthusiasm for the opportunity to engage with GCCI. Mr. McClay emphasized New Zealand's commitment to expanding bilateral trade and proposed exploring collaborative initiatives across various sectors.

Discussions included the potential for shared growth and innovation in agriculture, chemicals, dairy, tourism, bioenergy, and other sectors. The dialogue underscored the mutual interest in exploring advancements and sustainable practices, emphasizing the importance of joint efforts in these areas.

The role of academic exchanges and research initiatives was also discussed, with a focus on aligning educational and industry requirements



to foster innovation. GCCI expressed eagerness for collaborative projects and knowledge sharing to enhance industry capabilities and address common challenges.

Discussions also delved into potential collaborations in various sectors, recognizing the role of joint initiatives in driving economic growth and bilateral relations. The meeting highlighted the promotion of sustainable practices and explored avenues for cooperative endeavors in key industries.

The meeting concluded with a vote of thanks proposed by Mr. Graham Rouse, Trade Commissioner & Consul General for New Zealand to India & South Asia, symbolizing gratitude for the valuable insights and fostering a constructive dialogue. The session laid a strong foundation for future endeavors, emphasizing the shared commitment towards enhancing trade relations and fostering collaboration between GCCI and New Zealand.




VISIT OF MR. DAIZO ITO, EXECUTIVE VICE PRESIDENT, “BATTERY ASSOCIATION OF SUPPLY CHAIN” (REPRESENTED BY PANASONIC ENERGY) – DT. – 21-08-2024 - INTERNATIONAL TRADE TASK FORCE

The Gujarat Chamber of Commerce and Industry (GCCI) recently hosted a significant meeting with a delegation from the Japanese “Battery Association of Supply Chain” (BASC). The meeting included Mr. Daizo Ito, Executive Vice President of Panasonic Energy Company Ltd., Mr. Nobuto Nakanishi, Director of Policy & External Relations at Panasonic Energy, Mr. Saburo Nakao, Managing Executive Officer, and other representatives from BASC. The session, chaired by GCCI President Shri Sandeep Engineer, witnessed constructive discussions and outlined actionable steps for future collaboration.

The meeting commenced with a warm welcome extended by Shri Sandeep Engineer. He praised Panasonic Energy for its pivotal contributions to sustainable energy development and highlighted Prime Minister Shri Narendra Modi’s “Make in India” initiative and the “India-Japan Clean Energy Partnership Program.” Shri Engineer emphasized that the meeting was a valuable opportunity for fostering collaboration in the production of sustainable energy solutions.

Mr. Daizo Ito emphasized the significant role of Japanese corporations in advancing battery energy storage technologies and pursuing global partnerships. He outlined Panasonic Energy’s strategic plan to establish a manufacturing facility in Gujarat as



part of the “Make in India” initiative and highlighted the company’s ongoing efforts to enhance collaboration in the energy sector. Additionally, Mr. Saburo Nakao provided an overview of potential opportunities in the U.S. energy market and outlined Panasonic Energy’s investment strategy in India, including their plans for expansion within the country. Mr. Nobuto Nakanishi delivered an insightful presentation on battery safety.

Discussions also explored various opportunities for collaboration, including

advancements in energy storage technologies and sustainable practices. The dialogue underscored the mutual interest in enhancing cooperation and fostering innovation in the energy sector.

The meeting concluded with a vote of thanks proposed by Shri Navroz Tarapore, Chairman of the International Trade Taskforce. The session symbolized gratitude for the valuable insights shared and emphasized the commitment to strengthening trade relations and fostering collaboration between GCCI and the Japanese delegation.



Business Women Committee

KNOW YOUR COMMITTEE - BREAKING THE ICE, BUILDING THE FUTURE



Business Women Committee of GCCI had its first meeting, and we kicked it off with some fun ice-breaking activities! Laughter, connection, and fresh ideas flowed as we got to know each other better. Excited to see where this journey takes us as we empower and inspire together

BUSINESS WOMEN COMMITTEE LEADERSHIP HANDS CHANGE CEREMONY 2024-25 – DT.- 12-08-24



GCCI Leadership Hands Change Ceremony took place on 12th August, 2024 at a function organized at GCCI Premises, Ashram Road, Ahmedabad.

The Chief Guest on the occasion was Smt. Tejalben Amin, Chairperson, Navarachana Education Society.

On the occasion, outgoing Chairperson Smt. Kajal Patel handed over the charge to BWC Chairperson Mrs. Prachi Patwari.

In his welcome address GCCI

President Shri Sandeep Engineer extended warm welcome to the Chief Guest Smt. Tejalben Amin as well as all other guests and members. He congratulated outgoing Chairperson Kajalben Patel for her leadership and for various successful projects carried out during the year. He congratulated incoming Chairperson Mrs. Prachi Patwari and wished her success. He remarked about the important role women entrepreneurs would play

in making India a US 5 trillion-dollar economy. He remarked about the need to carry out projects so as to empower, educate and facilitate women entrepreneurs to rise to their highest potential. He also mentioned about enrolling more and more nominal members so as to help small traders and entrepreneurs. He emphasized to promote MSMEs as also focus on skill development and activities pertaining to Health & Education. He

had appreciated the large presence of participation.

In her address outgoing BWC Chairperson Kajal Patel mentioned about the year-round projects carried out by GCCI Business Women Committee. The video presentation of the year-round activities carried out under her leadership were applauded by all.

Accepting the charge as BWC Chairperson Prachi Patwari mentioned about GCCI Mission of “Grow Business & Transform Gujarat” and assured full support of BWC working towards this mission. She emphasized the importance of 3 Ls viz. Learning, Leadership & Leverage and requested members to imbibe the same. She thanked GCCI Leadership and President Shri Sandeepbhai for the trust reposed in her and assured to carry out year-round activities to empower, educate and facilitate women entrepreneurs towards the vision of “Viksit Bharat”.

In her address Chief Guest Smt. Tejalben Amin congratulated the outgoing Chairperson Smt. Kajalben Patel and her team for the excellent work done and wished every success to the incoming Chairperson Smt. Prachiben Patwari and her team. She



remarked that women entrepreneurs have contribution of about 14% and that of women MSMEs is about 20% which is less than the potential and there is a lot to do availing the democratic resources available to all. She mentioned about the need to raise the standard of living of all citizens with the focus on health and education which will help unleash huge potential for individuals, for society and for the

nation. She particularly emphasized the need to help and empower the women at grass roots level. She also gave introduction of her foundation Navarachna Education Society and its comprehensive towards skill development and education.

The ceremony was concluded after the vote of thanks by Smt. Gopi Trivedi, Member, BWC.

A TALK ON “LINKEDIN MASTERY” UNDER “TECH LEVEL-UP SERIES” – DT. – 22-08-24

GCCI, Business Women Committee organized a talk on “LinkedIn Mastery” – Unlocking Professional Potential under their “Tech Level-Up Series” on 22nd August, 2024. In her Welcome Address BWC Chairperson Prachi Patwari mentioned about the Internet Explosion and huge penetration of “Social Media” in the modern world. She remarked that while Internet & social media are great blessings, it is equally important to master them for their optimum use. She remarked



about the importance of “LinkedIn” platform. She welcomed the presence of Shri Mihirsinhji Parmar, CEO, Inkit Company and Founder

& CEO of Skillspire as the key note speaker on the occasion.

Ms. Namrata Kapil gave the introduction of Shri Mihirsinhji



Parmar to the audience. In his Key Note Speech Shri Mihirsinhji remarked about the explosion of digitalisation after the global pandemic of "Covid". He remarked that since there is a quantum jump of screen time of people at large, digital branding is much more



important than physical hoardings. He remarked that the presence of founder on social media will further push their brand. He remarked that "Visibility adds to Credibility". He explained importance of headline, summary, profile picture, banner and detailed explanation of "Skillset". He

requested participants to increase their followers and making content effective through the use of bullet point information. He emphasised the importance of consistency on social media. After the vote of thanks proposed by Ms. Gopi Trivedi the talk was adjourned.

GCCI BUSINESS WOMEN COMMITTEE MEMBER COURTESY MEETING WITH SHRI BHUPENDRABHAI PATEL, CHIEF MINISTER OF GUJARAT, GOVT. OF GUJARAT - DT. - 27-08-24



GCCI's Business Women Committee members with the Hon'ble Chief Minister Shri Bhupendrabhai Patel. The attendees included Chairperson Ms. Prachi Patwari, Co-Chairperson Ms. Asha Vaghasia, Co-Chairperson Ms. Shalu Lekhadia, Ms. Gopi Trivedi, Knowledge Series Head, Ms. Setu Patel, Business Development Head and other committee members.

The discussion focused on the need



for equality and parity, emphasizing the importance of providing equal opportunities and reducing societal disparities. It also addressed the enhancement of government scheme utilization to ensure that benefits are effectively received by the intended recipients. Additionally, the conversation explored methods to promote startups, including financial incentives and mentorship to encourage innovation. Stronger

measures to protect women across the state were advocated and the importance of skill development was highlighted, underscoring the need to equip youth with skills for improved employment prospects.

The Hon'ble Chief Minister reaffirmed the Government's commitment to creating a more supportive environment for the advancement of trade and industry within the state.

Youth Committee

INDUSTRY VISIT TO THE AMUL DAIRY PLANT – DT. – 23-07-2024



During the visit, the Youth committee took a tour of the processes involved in manufacturing and packaging of dairy products and interacted with the management team to understand the processes involved.

MEET THE NEW TEAM FOR THE YEAR 2024-25 FOLLOWED BY “REAL ESTATE PANEL” EVENT - DT.- 23-08-2024

GCCI, Youth Committee organized their “Meet the Team” programme on 23rd August, 2024 to introduce the team for the year 2024-25. It was followed by “Real Estate Panel” event.

In his Welcome Address, GCCI President Shri Sandeep Engineer highlighted the new initiatives planned by the team under Chairperson Shumona Agrawal to motivate young entrepreneurs and strengthen Gujarat’s economic and social fabric. He welcomed Mr. Sharvil Shridhar and Mr. Sameer Sinha to the GCCI Youth Committee’s Real Estate Panel, emphasizing that real estate is more than just construction; it’s about building communities and fostering innovation. Addressing the participants, GCCI Vice President Shri Apurva Shah congratulated Youth Committee for fine work that have done in the past and expressed good wishes for an eventful year ahead. GCCI Youth Committee Chairperson Ms. Shumona Agarwal made a detailed presentation about Youth Committee programmes, plans and their new team. She expressed heartfelt gratitude to the leadership for their trust and support.

For the year 2024-25, Shri Rohan



Kumar, Shri Harshil Khajanchi and Ms. Stuti Shah were installed as Co-Chairpersons. They then addressed the gathering.

Shri Sameer Sinha, Founder & Managing Director, Savvy Group shared how, in 1996, three friends fresh out of college envisioned building a commercial property. This led to the creation of Shapath 1, the first high-rise commercial building on SG Highway. He also highlighted that the greatest asset they’ve cultivated over the years is the

dedicated team they’ve built.

Sharvil Shridhar, Director of A. Shridhar Group, expressed his gratitude to GCCI and congratulated the Youth Committee on a successful year. He emphasized that it’s the story behind a product that drives its success and stressed the importance of stepping out of one’s comfort zone. During the panel discussion on Real Estate thread bare discussion took place about opportunities and challenges in Real Estate sector.

GCCI Committee & Taskforce 2024-25

Committees

No.	Committee Name	Chairman Name
1	ADRC Committee	Shri Mitulbhai Shelat
2	Agriculture Committee	Shri Gopalbhai Sutariya
3	Banking & Finance Committee	CA Surendra N. Shah
4	Business Women Committee	Ms. Prachi P. Patwari
5	Centre For Learning Committee	Shri Jainil H. Shah
6	Chemical Committee	Shri Yogesh Parikh
7	Constitution Committee	Shri Trilok R. Parikh
8	Digital Marketing, Digital Media and Bulletin Committee	Shri Pradip Jain
9	Education Committee	Dr. Rajul K. Gajjar
10	Food & Dairy Committee	Shri Kaushik D. Patel
11	Indirect Tax Committee	Shri Nayan R. Sheth
12	IPR Committee	Shri Aayush Modi
13	IT & ITES Committee	Shri Prerakbhai Shah
14	Laminates Committee	Shri Jikesh Thakkar
15	Legal Committee	Shri Tarak Damani
16	MSME Committee	Shri Tejas Mehta
17	Plastic Committee	Shri Tusharbhai Parikh
18	Real Estate Committee	Shri Varun Patel
19	Scrutiny Committee	Shri Mahendra N. Patel
20	Startup Committee	Shri Priyank Shah
21	Youth Committee	Ms. Shumona Agrawal Sutaria

GCCI Committee & Taskforce 2024-25

Taskforce

No.	Taskforce Name	Chairman Name
1	CSR Taskforce	Shri Apoorva N. Thakershy
2	Defence Taskforce	Shri Anshul J. Nanavaty
3	Direct Tax Taskforce	Dr. (CA) Jainik N. Vakil
4	Energy Taskforce	Shri Dharendra Doshi
5	Environment Taskforce	Shri Ankit S. Patel
6	Environmental, Social and Governance (ESG) Taskforce	Shri Sameer Sinha
7	Events & Exhibition Taskforce	Shri Rajesh Rawani
8	Films & Entertainment Taskforce	Shri Aasit Shah
9	Gems & Jewellery Taskforce	Shri Vipul Mehta
10	GIDC Taskforce	Shri Ajit N. Shah
11	Gujarat Udhog Jagat Ni Charcha Taskforce	Shri Vinod Malaviyaa
12	Hospital & Medical Taskforce	Dr. Bharat Gadhavi
13	Insurance Taskforce	Shri Nilesh Desai
14	International Trade Taskforce	Shri Navroz Tarapore
15	Logistics Taskforce	Shri Hiten Vasant
16	Mahajan Sankalan Taskforce	Shri Ashish Jhaveri
17	Membership Drive & Nominal Membership Taskforce	Shri Chintan Sheth
18	NRG Taskforce	Shri Himanshu Vyas
19	Pharma Taskforce	Shri Shrenik K. Shah
20	Press & Press Media Taskforce	Shri Jigish K. Shah
21	Textile Taskforce	Shri Saurin Parikh
22	Travel & Tourism Taskforce	Shri Sanjeev Chhajer

Regional Chamber Activities

VADODARA CHAMBER OF COMMERCE AND INDUSTRY



01st July, 2024: Awareness on 3 newly incorporated Criminal Laws

VCCI supported the Initiative of Vadodara Police towards conduction an awareness session on the enacted three new criminal laws Bharatiya Nyaya Sanhita (BNS), Bharatiya Nagarik Suraksha Sanhita (BNSS), and Bharatiya Sakshya Adhinyam (BSA) which are set to take effect from 1st July 2024, replacing the colonial-era Indian Penal Code (IPC), Code of Criminal Procedure (CrPC) and Indian Evidence Act. Present at the seminar were Shri Jyoti Patel, DCP Traffic Branch, Vadodara Police, VCCI Office Bearers, VCCI Managing Committee Members, Students from different institutions and representatives from different industries.



22nd July 2024: Live Telecast of Union Budget 2024-25 at VCCI: On this day Hon'ble Finance Minister, Smt. Nirmala Sitharaman ji presented the Union Budget 2024-25. The budget, reflected our collective aspirations towards building a robust economy and a prosperous nation. VCCI commends the transparent and inclusive approach taken in formulating this budget, which promises to catalyze growth of MSMEs. The live telecast of the budget was organized at VCCI Office in the presence of Office Bearers and Managing Committee Members. VCCI remains committed to working alongside the government to implement the vision laid out in this budget, fostering an environment conducive to business and societal progress. We welcome the strategic initiatives and reforms proposed and look forward to their positive impact on the industry and the country at large.



2nd to 4th August 2024: Office Bearers' visit to "The United Gujarati 2024 Summit" organized by Federation of Gujarati Associations of USA at Dallas. : The recent visit by the Office Bearers and Managing Committee Member of Vadodara Chamber of Commerce and Industry (VCCI) to the United Gujarati 2024 Summit at Dallas, USA marks a significant moment for the Gujarati community worldwide. This summit, organized by the Federation of Gujarati Associations of USA at Dallas, serves as a vital platform for networking, cultural exchange,



and discussing key issues that impact Gujaratis globally. The participation of VCCI's representatives underscores the importance of international collaboration and the shared vision of progress within the Gujarati diaspora. Such initiatives not only strengthen ties among Gujaratis across borders but also highlight the community's contributions to global economic and cultural landscapes. The VCCI's engagement at this event is a testament to their commitment to fostering unity and development among Gujaratis worldwide.

ZALAWAD CHAMBER OF COMMERCE AND INDUSTRY



તારીખ ૦૧ જુલાઈ ૨૦૨૪ના રોજ જીએસટી લાગુ થયાને ૭ વર્ષ પૂર્ણ થતા, સુરેન્દ્રનગર સેન્ટ્રલ જીએસટી, શ્રી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે પ્રેસીડેન્ટ હોટેલ, સુરેન્દ્રનગર ખાતે જીએસટી દિવસની વેપારી-ઉદ્યોગકારો, વ્યવસાયિકારો, સીએ, ટેક્સ એડવોકેટ, વિવિધ એસોસિએશનો સાથે ઉજવણી કરવામાં

આવી હતી. સીજીએસટીના સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી દ્વારા જીએસટી ને ૭ વર્ષ પૂર્ણ થતા મહત્વના સુધારાઓ અને તાજેતરમાં કરવામાં આવેલ સુધારાઓ અંગે માહિતગાર કરેલ. આ પ્રોગ્રામમાં સેન્ટ્રલ જીએસટીના વિવિધ ડિવિઝનના અધિકારીશ્રીઓ, ઝાલાવાડ ચેમ્બરના પ્રમુખ મયુરભાઈ ત્રિવેદી, ઉપ-પ્રમુખ દિનેશભાઈ તુરખીયા, માનદમંત્રી માધવીબેન

શાહ, સહ-માનદમંત્રી કેયુરભાઈ કોઠારી, વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સુમિતભાઈ પટેલ તથા શ્રી હેમલભાઈ શાહ, વિવિધ વેપાર-ઉદ્યોગના એસોસિએશનના હોદ્દદારો, સુરેન્દ્રનગર જીએસટી બાર એસોસિએશનના હોદ્દદારો અને સભ્યો, ટેક્સ પ્રેક્ટીશનર મિત્રો તથા વેપારી-ઉદ્યોગકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

RAJKOT CHAMBER OF COMMERCE AND INDUSTRY



રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યુનિયન બજેટ ૨૦૨૪-૨૫ ને સરળ રીતે સમજવા માટે જગવિખ્યાત કરવેરા સલાહકારશ્રી મુકેશભાઈ પટેલના વક્તવ્ય કાર્યક્રમનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું... જેમાં બહોળી સંખ્યામાં સભ્યશ્રીઓ જોડાયેલ હતા.



રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા PGVCL ના એમડીશ્રીમતી પ્રિતી શર્મા મેડમના અધ્યક્ષસ્થાને તથા વિવિધ સબ ડિવિઝનના અધિકારીશ્રીઓ સાથે વિજળીને લગતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવેલ...

UNION BUDGET - 2024

The Budget booklet 2024 is prepared by the Direct Tax Task Force of the GCCI. This Committee strives to prepare and cover all the amendments pertaining to Income Tax announced by the Finance Minister in the Budget (Finance Act) in an extremely simple and lucid language. The endeavor behind circulating this booklet is to help all our members at GCCI to interpret and understand the provisions and amendments in relation to Income Tax laws on their own without any help of a Tax expert. Trust you will find this initiative useful.

CA (Dr.) Jainik N. Vakil
Chairman, Direct Tax Task Force



CA (Dr.) Jainik N. Vakil
Chairman, Direct Tax Task Force

1. CHAPTER 1: RATES OF INCOME TAX.....	25
2. CHAPTER 2: AMENDMENTS IN RELATION TO CAPITAL GAIN	30
3. CHAPTER 3: MEASURES INCREASING/WIDENING TAX BASE.....	33
4. CHAPTER 4: ADMINISTRATIVE AND ASSESSMENT RELATED CHANGES	35
5. CHAPTER 5: TAX PROVISIONS PERTAINING TO TDS & TCS	39
6. CHAPTER 6: PROVISIONS AFFECTING TRUSTS AND INSTITUTIONS	43
7. CHAPTER 7: OTHER MISCELLANEOUS CHANGES	44
8. CHAPTER 8: INDIRECT TAXATION (GST)	46

RATES OF INCOME TAX

I. Individual & HUF – There is no change in tax rates in case of old regime as compared to F.Y.2023-24. However, w.e.f. 01st April, 2024, the following revised slabs of income tax rates shall be applicable for the taxpayer declaring income under new regime.

➤ Taxpayer: Individual (Non-Resident or Resident aged less than 60 years) and HUF

Option 2 - New Regime (Refer points below)	
Total Income	Tax Rates
Up to INR 3,00,000	Nil
INR 3,00,001 - INR 7,00,000	5%
INR 7,00,001 - INR 10,00,000	10%
INR 10,00,001 - INR 12,00,000	15%
INR 12,00,001 - INR 15,00,000	20%
More than INR 15,00,000	30%

Option – 1 (No change)	
Total Income	Tax Rates
Up to INR 2,50,000	Nil
INR 2,50,001 - INR 5,00,000	5%
INR 5,00,001 - INR 10,00,000	20%
More than INR 10,00,000	30%

➤ **Taxpayer:** Individual (Resident Senior Citizen (>=60 Years but <80 Years))

Option 2 - New Regime (Refer points below)	
Total Income	Tax Rates
Up to INR 3,00,000	Nil
INR 3,00,001-INR 7,00,000	5%
INR 7,00,001-INR 10,00,000	10%
INR 10,00,001-INR 12,00,000	15%
INR 12,00,001- INR 15,00,000	20%
More than INR 15,00,000	30%

Option – 1 (No change)	
Total Income	Tax Rates
Up to INR 3,00,000	Nil
INR 3,00,001 - INR 5,00,000	5%
INR 5,00,001 - INR 10,00,000	20%
More than INR 10,00,000	30%

➤ **Taxpayer:** Individual (Resident Super Senior Citizen (>=80 Years))

Option 2 - New Regime (Refer points below)	
Total Income	Tax Rates
Up to INR 3,00,000	Nil
INR 3,00,001 - INR 7,00,000	5%
INR 7,00,001 - INR 10,00,000	10%
INR 10,00,001 - INR 12,00,000	15%
INR 12,00,001 - INR 15,00,000	20%
More than INR 15,00,000	30%

Option – 1 (No change)	
Total Income	Tax Rates
Up to INR 5,00,000	Nil
INR 5,00,001 - INR 10,00,000	20%
More than INR 10,00,000	30%

Points to be noted:

i. New tax regime is the default tax regime and taxpayer specifically needs to opt for old regime in case if he would want to claim benefit of deductions and his overall tax liability under the old regime is lesser than the new regime.

ii. Taxpayers declaring income under new tax regime i.e. reduced tax rate cannot avail certain exemptions/deductions. Illustrative list of such exemptions/deductions that the taxpayer cannot claim under new tax regime is as below:

- Additional Depreciation
- Deduction towards House Rent Allowance (HRA)
- Interest in respect of housing loans for self-occupied property
- Donation or expenditure for scientific research
- Deductions in respect of –
 - ✓ Various Investments such as PPF, LIC, etc. under section 80C
 - ✓ Medical Insurance premium or Amounts paid towards family pension
 - ✓ Donations under section 80G
 - ✓ Interest on savings deposits or post office deposits etc.



- Further Alternate Minimum Tax (AMT) is not applicable if income is taxed under new tax regime and AMT credit available will lapse.
- iii. For Individuals (declaring income under Old Regime) whose Income does not exceed INR 5,00,000, rebate from tax is available of INR 12,500 or 100% of tax, whichever is lower.
- iv. For Individuals (declaring income under New Regime) whose Income does not exceed INR 7,00,000, rebate from tax is available of INR 25,000 or 100% of tax, whichever is lower.
- v. Standard deduction of INR 75,000 from Salary Income allowed under the new tax regime only and INR 50,000 for old tax regime. Deduction of employer contribution in pension fund allowed upto 14% of salary.
- vi. With the benefits being given to New Regime, below table illustrates various scenarios after considering the above amendment:

(Amt. in INR Lakhs)

Particulars	Scenario 1		Scenario 2		Scenario 3		Scenario 4	
	Old	New	Old	New	Old	New	Old	New
Income	7.00	7.00	25.00	25.00	100.00	100.00	600.00	600.00
Std. ded	0.50	0.75	0.50	0.75	0.50	0.75	0.50	0.75
Salary deductions (HRA etc.)	0.50	-	2.00	-	5.00	-	10.00	-
Int on home loan (24b)	2.00	-	2.00	-	2.00	-	2.00	-
Deductions u/s 80	1.50	-	2.50	-	2.50	-	2.50	-
Total Income	2.50	6.25	18.00	24.25	90.00	99.25	585.00	599.25
Basic Tax	-	-	3.53	4.18	25.13	26.68	173.63	176.68
Surcharge	-	-	-	-	2.51	2.67	64.24	44.17
Cess @ 4%	-	-	0.14	0.17	1.11	1.17	9.51	8.83
Tax Payable	-	-	3.67	4.34	28.74	30.52	247.38	229.68
Preferable	Indifferent		Old Regime		Old Regime		New Regime	

- I. Association of Persons, Body of Individuals and Artificial Juridical Person: There is no change in rates in case of old regime as compared to F.Y.2023-24. However, w.e.f. 1st April, 2024, the following revised slabs of income tax rates shall be applicable.

Option 2 - New Regime (Refer points below)	
Total Income	Tax Rates
Up to INR 3,00,000	Nil
INR 3,00,001 - INR 7,00,000	5%
INR 7,00,001 - INR 10,00,000	10%
INR 10,00,001 - INR 12,00,000	15%
INR 12,00,001 - INR 15,00,000	20%
More than INR 15,00,000	30%

Option - 1 (No change)	
Total Income	Tax Rates
Up to INR 2,50,000	Nil
INR 2,50,001 - INR 5,00,000	5%
INR 5,00,001 - INR 10,00,000	20%
More than INR 10,00,000	30%

In case of Individuals, HUF, AOP*, BOI, AJP, **Surcharge** is applicable at following rates:

Total Income	Tax Rates
INR 50,00,000 - INR 1,00,00,000	10%
INR 1,00,00,001 - INR 2,00,00,000	15%
INR 2,00,00,001 - INR 5,00,00,000	25%
More than INR 5,00,00,000	37%

- Alternate Minimum Tax rate is 18.5%.
- However, maximum surcharge on income by way of dividend or capital gain income under the provisions of 111A, 112 and 112A shall be 15%.
- Also, in case of Individuals, HUF, AOP*, BOI, AJP

declaring income under New Regime, the surcharge rates shall not exceed 25% even if the total income is above INR 5,00,00,000 for Financial Year 2024-25.

- Marginal relief has also been provided in all cases where surcharge is proposed to be imposed. Health and Education Cess is at 4%.

*Surcharge rates for AOP with all members being company, cannot exceed 15% for total income exceeding INR 1,00,00,000.



I. Firms (including LLPs): No change in rates as compared to F.Y. 2023-24.

- Firms (including LLPs) are taxable at 30%. Surcharge at 12% is applicable where total income exceeds INR 1,00,00,000. Health and Education Cess is at 4%.

- Also, a Firm / LLP shall be liable to pay AMT (Alternate Minimum Tax) at 18.5% of Adjusted total income (plus Surcharge and Health & Education Cess as applicable) where the normal tax liability is less than 18.5% of Adjusted total income.

I. Domestic Companies:

Domestic Manufacturing Companies set up on or after 01/10/2019 and commenced manufacturing till 31/03/2024	
Engaged solely in business of manufacture, production, research or distribution of article or Thing	
Tax Rate with respect to income from business of manufacture, production, research or distribution of article or thing	
Tax Rate (Without Specified benefits or deductions#)	15%
MAT	Not Applicable
Surcharge	10%
Health and Education Cess	4%
Income which is not incidental to manufacturing or production of an article or thing, for which no specific rate is provided in this section & from short term capital gains on sale of assets on which no depreciation is allowable under the provisions of the Act	
Tax Rate (Without Specified benefits or deductions#)	22%
Surcharge	10%
Health and Education Cess	4%
Income from the business transactions arranged in a manner or for some other reason, the profits earned by the company is more than the ordinary profit earned in such business, any such more profit as determined by the income tax officer	
Tax Rate (Without Specified benefits or deductions#)	30%
Surcharge	10%
Health and Education Cess	4%

Any Domestic Companies opting for concessional rate of tax	
Tax Rate (Without Specified benefits or deductions#)	22%
MAT	Not Applicable
Surcharge	10%
Health and Education Cess	4%

Other Domestic Companies with turnover exceeding INR 400 Crores in F.Y. 2022-23	
Tax Rate	30%
MAT	15%
Surcharge:	
More than INR 1,00,00,000 up to INR 10,00,00,000	7%
Exceeds INR 10,00,00,000	12%
Health and Education Cess	4%

Any Domestic Companies not opting for concessional rate of Tax and Turnover does not exceed INR 400 Crores in F.Y. 2022-23	
Tax Rate	25%
MAT	15%
Surcharge:	
Income More than INR 1,00,00,000 up to INR 10,00,00,000	7%
Income Exceeds INR 10,00,00,000	12%
Health and Education Cess	4%

Specified benefits and deductions:

- Deduction available for units established in special economic zones
- Additional Depreciation and Investment Allowance
- Various deductions for donation or expenditure for scientific research
- Deduction for capital expenditure for specified business u/s 35AD
- Deductions in respect of tax holidays as specified

under the Act

- Any brought forward depreciation and losses if such losses were incurred in respect of above-mentioned deductions.

I. Foreign Companies:

Foreign Companies	
Tax Rate	35%
MAT	15%
Surcharge:	
More than INR 1,00,00,000 up to INR 10,00,00,000	2%
Exceeds INR 10,00,00,000	5%
Health and Education Cess	4%

II. Co-operative Societies:

➤ Normal Tax rates for Co-operative Societies:

Taxable Income	
Up to INR 10,000	10%
INR 10,001 to INR 20,000	20%
More than INR 20,000	30%
AMT	15%
Surcharge:	
More than INR 1,00,00,000 up to INR 10,00,00,000	7%
More than INR 10,00,00,000	12%
Health and Education Cess	4%

➤ Co-operative Societies resident in India:

Co-operative Societies opting for concessional rate of tax	
Tax Rate (Without Specified benefits or deductions#)	22% (u/s 115BAD)
AMT	Not Applicable
Surcharge	10%
Health and Education Cess	4%

➤ Resident Manufacturing Co-Operative Society:

New Manufacturing Co-Operative Society set up on or after 01/04/2023 and commenced manufacturing upto 31/03/2024
Engaged solely in business of manufacture, production, research or distribution of article or Thing

Tax Rate with respect to income from business of manufacture, production, research or distribution of article or thing	
Tax Rate (Without Specified benefits or deductions#)	15%
AMT	Not Applicable
Surcharge	10%
Health and Education Cess	4%
Income which is not incidental to manufacturing or production of an article or thing, for which no specific rate is provided in this section & from short term capital gains on sale of assets on which no depreciation is allowable under the provisions of the Act	
Tax Rate (Without Specified benefits or deductions#)	22%
Surcharge	10%
Health and Education Cess	4%
Income from the business transactions arranged in a manner or for some other reason, the profits earned by the co-operative society is more than the ordinary profit earned in such business, any such more profit as determined by the income tax officer	
Tax Rate (Without Specified benefits or deductions#)	30%
Surcharge	10%
Health and Education Cess	4%

Specified benefits and deductions:

- Deduction available for units established in special economic zones
- Additional Depreciation and Investment Allowance
- Various deductions for donation or expenditure for scientific research
- Deduction for capital expenditure for specified business u/s 35AD
- Deductions in respect of tax holidays as specified under the Act.
- Any brought forward depreciation and losses if such losses were incurred in respect of above-mentioned deductions.

Further, if a co-operative society opts to pay taxes at concessional rates, it shall not be taxed under the Alternate Minimum Taxes (AMT) regime and accordingly, will have to forgo all the unutilized AMT Credit.



AMENDMENTS IN RELATION TO CAPITAL GAIN

➤ **Streamlining of Holding Period for classification of Capital Assets into Long term/Short term (w.e.f. 23/07/2024)**

- In order to rationalize and simplify the taxation of capital gains, change has been made to now have only 2 holding periods for determining whether the capital gains arising shall be considered as short-term or long-term.
- For all listed equity shares, units of equity-oriented funds or units of a business trust, the holding period will be 12 months. For all other capital assets, viz. bonds, debentures, gold, property, unlisted shares etc., the holding period will now be 24 months (some of these assets were previously having a holding period of 36 months to be classified as long term).
- Further, currently, any gains arising on Market Linked Debentures (MLDs) is taxable as short-term capital gains, **irrespective of the period of holding of such debentures**. Now, Specified Mutual Fund (Fund which contains $\geq 65\%$ Debt portion), Unlisted Debentures and Unlisted Bonds have also been added to this list. Thus, **any specified mutual fund, unlisted bond / unlisted debenture shall be taxable as short-term, irrespective of their holding period.**

Summarizing the above, by way of tabular information below:

Sr No.	Capital Assets	Holding Period to classify the asset as long term (Up to 22/07/2024)	Holding Period to classify the asset as long term (w.e.f.23/07/2024)
1	Listed securities, units of equity-oriented fund	12 months	12 months
2	Other listed units (units of business trusts / investment funds etc.)	36 months	12 months
3	Unlisted shares, immovable properties	24 months	24 months
4	Unlisted Debentures, Unlisted Bonds, Specified Mutual Fund	36 months	Short term irrespective of holding period
5	All other assets (gold etc)	36 months	24 months

➤ **Simplification and uniformity of capital gains tax rates (w.e.f. 23/07/2024)**

- Finance Bill 2024 has brought about changes in the rates for short-term capital gains and long-term capital gains arising on STT paid equity shares, units of equity oriented mutual funds and units of a business trust. The rate of tax on short-term gains on STT paid equity shares, units of equity oriented mutual funds and units of a business trust has increased from 15% to 20% and the rate of tax on long-term capital gains has increased from 10% to 12.5%.
- However, some corresponding relief has been provided for market investors, by raising the annual exemption limit for long-term capital LTCG from Rs. 1 lakh to Rs. 1.25 lakhs.
- To bring parity in taxation between residents and non-residents in respect of the rate changes being brought about, corresponding provisions under the Act dealing with non-resident taxation of such capital gains have also been amended to align with the new rates as applicable to Residents.
- The current rate of tax on long-term capital gains for all

other capital assets is 20%. In order to unify the rate of tax on long-term gains across the board, budget 2024 has revised the long-term tax rate of 20% and brought it down to 12.5%

- However, for immovable properties purchased before 23rd July 2024, Individuals/HUFs now will have an option to pay capital gains tax either at the rate of 20% with indexation or 12.5% without indexation. Although, it is to be noted that benefit of such indexation should not result into capital losses in the hands of the taxpayer. This means that by opting for indexed cost of acquisition as an allowable cost that results into a capital loss, then such capital loss shall not be allowed to be set off against other Capital Gains. Also, it is worthy to note that for claiming exemption under from payment of Long-Term Capital Gains Tax (Section 54) one will have to make investment of an amount ignoring the indexation. This essentially means that the option for selecting tax rate of 20% / 12.5% with / without indexation is only for computing tax liability and not for arriving at the amount of capital gains that will have to be reinvested (if so desired by the taxpayer) for claiming LTCG tax exemption.

Summarizing the above, by way of tabular information below:

A) Long-term capital gains regime for residents

Sr No.	Particulars	Rate of Tax (Current Regime)	Rate of Tax (Proposed Regime)
1.	Listed Shares (STT Paid), Listed debentures and bonds, Units of equity oriented mutual funds (STT paid), Units of business trusts (REITs/ INVITs) (Listed and STT paid)	10%	12.5%
2.	Unlisted shares, Immovable Properties	20% (with indexation)	12.50%*
3.	Specified Mutual Funds, Unlisted Debentures and Bonds	20%	Slab Rate

B) Short-term capital gains regime for residents

Sr No.	Particulars	Rate of Tax (Current Regime)	Rate of Tax (Proposed Regime)
1.	Listed Shares (STT Paid), Listed debentures and bonds, Units of equity oriented mutual funds (STT paid), Units of business trusts (REITs/ INVITs) (Listed and STT paid)	15%	20%

C) Long-term capital gains regime for Non-Residents

Sr No.	Particulars	Rate of Tax (Current Regime)	Rate of Tax (Proposed Regime)
1.	Listed Shares (STT Paid), Listed debentures and bonds, Units of equity oriented mutual funds (STT paid), Units of business trusts (REITs/ INVITs) (Listed and STT paid), Unlisted shares	10%	12.5%
2.	Immovable Properties	20%/10%	12.50%
3.	Unlisted Debentures, Bonds	10%	Slab Rate

Transfer of capital asset by gift, will or under a trust restricted to Individuals / HUFs (w.e.f 01/04/2024)

- Currently, Income tax provisions does not explicitly provide any restrictions with respect to who / what can make or receive a gift. Thus, the tax payers have argued in the past that the transfer of shares or other capital assets by a company without consideration can also be considered as a gift and thereby outside the ambit of transfer thus not being subjected to capital gains tax.
- Now, this Budget specifically provides that any transaction involving a transfer of a capital asset pursuant to **gift, will or an irrevocable trust, by a person other than individual or HUF, will be regarded as transfer thereby subjected to capital gains.**
- **Cost of acquisition in the case of shares transferred under IPO (w.e.f. 01/04/2018)**
- In common parlance, it's an understanding that gains from listed shares (held for long term) will be taxable under Section 112A (earlier at the rate of 10%, now 12.5%), it is worthwhile to note that Section 112A in its origin does not use the word listed rather the benefit of Section 112A can be taken by any shareholder holding shares held for long term, **if STT has been paid on the purchase and sale of such shares.**
- Further, there is a notification from CBDT which states that benefit of Section 112A can be availed even if no STT has been paid at the time of purchase in case where STT was not required to be paid, **one of such situations is subscription/purchase of shares of an unlisted company.**
- So, certain Promoters who were transferring their shares pursuant to OFS during an IPO of Company, used



to offer their gains under Section 112A, as STT was required to be paid on the transfer where the shares are offered under OFS. **It is to be noted that this transfer of shares pursuant to OFS, was a transfer of unlisted shares as the same are listed only on next day at 10 AM in the morning after transfer to the allottees under an IPO.**

- The point of contention lied in the determination of cost of acquisition (COA) for such shares offered under IPO as OFS to arrive at the amount of Capital Gains. The mechanism for determination of COA provides the benefit of grandfathering provisions introduced in Budget 2018, (i.e., it grandfathers long term gains till 31.01.2018 and allows a FMV (Fair Market Value) on 31.01.2018 as COA.
- Now to determine this COA, it provides various situations within itself such as
 - Shares listed as on transfer as well as on 31.01.2018,
 - Shares listed on transfer date but not listed on 31.01.2018, **However, it does not entail a situation wherein the shares were unlisted on both the occasions i.e., on the date of transfer as well as on 31.01.2018.**
- So, some taxpayers who sold their shares in OFS were taking a view that as the mechanism for determination of COA is not defined in case where shares are unlisted as on transfer date as well as on 31.01.2018, the case should be considered where the computation mechanism as provided in the tax laws fail and no tax will be applicable on such transfer of shares under OFS as there was no provision in the tax law to determine the cost of acquisition of such shares to arrive at the Capital Gains.
- This was clearly against the intention of the law and thus to remove this lacuna in the law, finance minister has made a retrospective amendment to provide for how to determine the FMV as on 31.01.2018 in a case where the shares are unlisted on transfer date as well. FMV will be the indexation benefit on COA till FY 2017-18.



Budget


MEASURES INCREASING/ WIDENING TAX BASE

➤ Revised Tax treatment on Buy-Back of Shares (w.e.f 01/10/2024)


- There were two commonly ways for privately held companies to distribute their surplus funds:
 - (1) Dividend (Companies use surplus cash to distribute their reserves to the shareholders)
 - (2) Buyback (Companies use surplus cash to buy their own shares from the shareholders)
- Before Finance Act 2020, dividends distributed by the Companies were subjected to Dividend Distribution Tax (DDT) in the hands of the Company and consequentially the same was exempt in the hands of shareholders. After Budget 2020, DDT has been abolished and dividend has been made taxable in the hands of the recipient as per the normal slab rate of the recipient. However, Buyback continued to be taxed in the hands of company (on the difference between buyback price and the amount which was received by the company for issuance of such shares). The rate of tax on such buyback was 23.296% clearly making it a good arbitrage for companies to distribute the surplus by way of buyback as compared to dividend distribution.
- This Budget now removes this arbitrage and both viz. Buyback and Dividend shall be taxed similarly in the hands of the shareholder i.e. Buyback tax on company has been removed and the tax on buyback has been


levied in the hands of the recipient.

- This Budget specifically states that amounts received on buyback by the shareholders shall be considered as deemed dividend in the hands of the shareholders. The tax on such deemed dividend shall be applicable under the slab rates applicable to the taxpayer.
- No cost shall be allowed against such deemed dividend income.
- The Cost of acquisition of shares which are offered for buyback by the shareholders shall be treated as a Capital Loss (Short term/long term depends on the period of holding) in the hands of shareholders. Hence, when the shareholder has any other capital gain from sale of shares or otherwise subsequently, he would be entitled to claim his original cost of acquisition of all the shares (i.e. the shares earlier bought back plus shares finally sold).
- Revision in rates of Securities Transaction Tax (STT) (w.e.f 01/10/2024)
 - There has been a humongous growth in derivative (futures and options) markets in recent times and trading in such derivatives accounts for a large proportion of trading in stock exchanges.
 - In view of putting a check over this exponential growth of the derivative markets, it is proposed to increase the rate of STT on Future and Option Transactions as under:



- There has been no change in the applicable STT on purchase and sale of equity shares.
- **Reporting of Income from renting out residential house (w.e.f. 01/04/2024)**
 - To reduce one's tax liability, certain taxpayers have been taking advantage by showing their Rental Income earned on House Property under the head "Profits and gains of business or profession" (no restriction on amount that can be claimed as deduction) instead of reporting under "Income from House Property" (standard deduction restricted to 30% of house property income). Thus, there was a definite tax savings in the hands of the tax payer by disclosing such rental income under the head of Profits and gains of business or profession instead of rightly classifying it under the head Income from House Property.
 - In the view of the above, the budget states/ clarifies that any income from renting out of residential property shall not be chargeable under the 'Profits and Gains from Business and Profession' head, but under the head 'Income from House Property'.
- **Inclusion of taxes withheld outside India for purposes of calculating total income (w.e.f 01/04/2025)**
 - Current provisions of Income-tax Act imply that any taxes deducted at source whether in India or outside shall be deemed to be income received in the hands of taxpayer while computing the total income of the Assessee.
 - However, it had been observed by the tax authorities that certain tax payers were not including their income withheld (TDS) outside India for the purpose of calculating their total income whilst still claiming credit for the taxes withheld abroad resulting into a double advantage due to the exclusion of such income from their total income calculation, while simultaneously claiming a credit for the foreign taxes withheld.
 - In order to address this issue, this Budget explicitly states/ clarifies that taxes withheld outside India (in respect of which taxpayer is allowed credit against his tax liability) shall form a part of taxpayer's gross total income.





ADMINISTRATIVE AND ASSESSMENT RELATED CHANGES

➤ **Introduction of New Block Assessment scheme in cases of search (w.e.f 01.09.2024)**

- The Budget reintroduces revival of block assessment provisions which was prevalent until 2003. This system focuses on the assessment of undisclosed income discovered during search and seizure operations. The re-introduction of block assessment aims to streamline tax administration, reduce litigation and quick disposal of search cases.
- Key Points and Analysis of Amendments proposed related to Search proceedings are as under:
 1. The provisions introduced under this scheme shall be applicable only to those cases, wherein a search is initiated or books of accounts, other documents or any assets are requisitioned on or after the 01st September, 2024. This means that the Existing Provisions will be applicable to all the search

proceedings initiated on or after 01st April, 2021 but before 01st September, 2024.

2. The 'block period' will include the year in which the search or requisition was initiated and six years prior to search year.
3. All the pending proceedings related to block periods will be effectively terminated, and the income for these periods will thereafter be assessed only under the block assessment framework. There will be one consolidated assessment for the block period. Till block assessment is completed, no further assessment/reassessment proceedings shall take place in respect of the period covered in the block.
4. Total Income under this Block assessment scheme shall be considered of the following:
 - a) Income disclosed in the Income Tax return filed during post search proceedings. (Opportunity to

declare to Income Tax Office in response to a notice requiring to file return of income).

- b) Income assessed previously under any Regular assessment/ reassessment proceedings.
 - c) Income declared in the Original Income Tax returns or Income Tax returns filed in response to a notice.
 - d) Income of the ongoing year, based on entries in the books of accounts and other documents up to the date of the last authorization for search or requisition.
 - e) Undisclosed income detected by the Tax Officer during the Block assessment proceedings.
5. Time limit for completing the block assessment of the searched assessee shall be 12 months from the end of the month in which last search was made or last requisition was made.
 6. Tax at the rate of 60% shall be charged on the total income for the block period, irrespective

of prevailing tax rates. This tax rate of 60% shall be increased by any applicable surcharge. (however, at present no surcharge is proposed for income chargeable to tax for the block period.)

7. No interest under Sections 234A, 234B, or 234C shall be levied.
8. Penalty at the rate of 50% shall be levied on such undisclosed income assessed for the block period instead of 200% levied in normal cases for misreporting of income. This is a highly beneficial provision, as even though income is detected during search, the same will not attract huge penalty i.e. 200% of tax payable. However, no penalty shall be levied if the assessee declares undisclosed income in the Income Tax Return filed in response to notice in the post search proceedings and pays the tax along with the return. These are beneficial provisions, as even though income not disclosed earlier and disclosed during search and paid taxes thereon, then no penalty shall be attracted.
9. Where the Tax Officer is satisfied that he has found or is in possession of any such information regarding any undisclosed income pertaining to any person other than assessee that has been searched, then he shall hand over such information to the Jurisdictional Tax Officer of such other person for further course of action.

➤ **Time limits to issue notice for conducting Reassessment Proceedings (w.e.f 01.09.2024)**

- **Time limit to issue notice for conducting reassessment proceedings**

Quantum of Escaped Income	Earlier Timelines	Revised Timelines
Less than Rs. 50 Lacs	3 years from the end of relevant assessment year	3 years and 3 months from the end of relevant assessment year
Equal to or more than Rs. 50 Lacs	10 years from the end of relevant assessment year	5 years and 3 months from the end of relevant assessment year

➤ **The word “information” to include data collected during survey proceedings (w.e.f 01.09.2024)**

- In the course of reassessment proceeding u/s 148, first the Tax Officer is required to issue a notice to the assessee stating that the **basis of information** under which the assessment proceedings has been initiated along with a copy of the order stating that it is a fit case of income escapement, requiring the assessee to furnish Income Tax Return within 3 months (Opportunity to declare).

- Now, the term ‘information’ has construed to have wider meaning. It includes the information collected from Survey Proceedings conducted on or after the 01st September, 2024 if it suggests that income chargeable to tax has escaped assessment.

➤ **Setting off and withholding of refunds in favor of Income Tax Office (w.e.f. 01.10.2024)**

- At present the Tax Officer has power to adjust the refund against any tax demand that is outstanding from the assessee and to withhold refund in a case where the assessment or reassessment proceedings are pending. Moreover, no additional interest on such adjusted refund is paid to the assessee for such period till the time refund is withheld.
- To withhold the refund, the Act provides the below conditions to be satisfied by the Tax Officer:
 - 1) He should form opinion that granting of refund is likely to adversely affect the revenue and
 - 2) He has to record the reasons in writing for withholding the refund.
- Now, in order to further empower the tax office, wherein to withhold the refund, Tax Officer has to satisfy only one condition that is to record the reasons in writing for withholding the refund.
- Further under existing provisions, the refund can be withheld only until the date of completion of assessment proceedings. Now, this budget has increased the timelines to withhold refund for an extended period that is - up to 60 days (without interest) from the date on which such assessment proceedings are completed.

➤ **Revised timelines for filing appeals to the Income Tax Appellate Tribunal (ITAT) (w.e.f 01.10.2024)**

Particulars	Earlier Timelines	Revised Timelines
Time limits for filing an Appeal to ITAT	60 days from the date of order	2 months from the end of the month in which order is passed

➤ **Other changes relating to Assessment procedure (w.e.f 01.10.2024)**

- The CBDT has the powers to authorize income tax authorities to condone delays in filing tax returns for claiming exemptions, deductions, refunds, or other reliefs, to prevent taxpayers from facing genuine hardship. From this budget, IT Department will consider returns filed in lieu of condonation received from the Income Tax Office, as a filing of original return and all the provisions applicable to filing, assessment,

reassessment etc. that apply to original returns shall be applicable to such returns. However, the assessment in such cases shall be completed within 12 months from the end of the financial year in which such return is filed.

- The Power of CIT(A) has been expanded to permit them to set-aside the matter or refer the same back to the Assessing Tax Officer, in matters relating to Best Judgement Assessment (where taxpayer does not submit any information/date to the Tax Office and hence the Tax Officer does the assessment on his best judgement.) Further, the Tax Officer shall be required to pass an order in such matters within 12 months from end of financial year in which order of CIT(A) is passed. Under the existing regulations, CIT(A) himself had to pass orders to complete proceedings and did not have the leeway to refer/involve Assessing/Tax Officer in this matter.
- **Power to Adjust seized assets against liabilities under Black Money Act (w.e.f 01.10.2024)**
- Currently, the Income Tax Act allows adjustment of seized assets against any pre-existing liabilities under the Income Tax Act, Wealth Tax Act, Expenditure Tax Act, Gift Tax Act and Interest Tax Act.
- Now, this provisions are widened to allow adjustment against liabilities under the provisions of Black Money (Undisclosed Foreign Income and Assets) and imposition of Tax Act, 2015 (**Black Money Act**).
- **Tax clearance Certificate for persons leaving India (w.e.f 01.10.2024)**

- Currently, the Income Tax Act requires for below category of persons to obtain tax clearance certificate
 - (a) who is domiciled in India at the time of his departure; and
 - (b) such persons which in the opinion of Tax Officers render it necessary to obtain a Tax Clearance Certificate
- Thus, while leaving India such Individuals are required to take a tax clearance certificate from an Income Tax Authority stating that they do not have any existing liabilities under the Income Tax Act, 1961, Wealth Tax Act, Expenditure Tax Act and Gift Tax Act.
- Now, these provisions are widened to cover liabilities under the Black Money Act for obtaining a Tax Clearance Certificate.
- **Introduction of Vivad Se Vishwas Scheme, 2024 (VSVS)**
- Government has brought back the Vivad se vishwas scheme, 2024 in order to settle all the pending litigations. **This scheme is applicable to those Assesseees whose cases are pending in Appeal* in an Appellate Forum as on 22nd July, 2024.**
- Appellate Forum includes:
 1. Commissioner of Income Tax (Appeals)
 2. Income Tax Appellate Tribunal (ITAT)
 3. Dispute resolution panel
 4. Hon'ble High court
 5. Hon'ble Supreme Court
- The amount of Tax payable under VSVS is stated under:

Sr. No.	Tax Arrear	Amount Payable under VSVS before 31.12.2024	Amount Payable under VSVS after 01.01.2025 but before the last date (to be notified later)
1	Appeal pending in relation to disputed tax, penalty and interest at any appellate forum filed after 31 st January 2020 but before 22 nd July 2024	Basic disputed tax	Basic disputed tax plus + 10% interest
2	Appeal pending related to disputed tax, penalty and interest at any appellate forum on or before 31 st January 2020	Basic disputed tax + 10% interest	Basic disputed tax + 20% interest
3	Such Appeal matters where there is no demand in relation to disputed tax but only for penalty/interest etc. filed after 31 st January 2020 but before 22 nd July 2024	25% of interest or penalty or fee	30% of interest or penalty or fee
4	Such Appeal matters where there is no demand in relation to disputed tax but only for penalty/interest etc. filed on or before 31 st January 2020	30% of interest or penalty or fee	35% of interest or penalty or fee
5.	Appeal filed by the Income Tax Authority	50% of tax disputed in relation to the issue	50% of tax disputed in relation to the issue
6.	Appeal filed by the Assessee on an issue on which a favourable decision is already received earlier for a different year in its own case	50% of tax disputed in relation to the issue	50% of tax disputed in relation to the issue

- VSVS shall not be applicable in the following cases:
 - i) Assessment proceedings conducted pursuant to Search.
 - ii) Prosecution has been initiated for such tax arrears or against such person.
 - iii) Tax arrears relating to an Undisclosed Income from a source located outside India or an Undisclosed Asset outside India.
 - iv) Assessment made based on the Information received under Double Tax Avoidance Agreements.
 - v) Order of detention has been made under the Conservation of Foreign Exchange and Prevention of Smuggling Activities Act against such person.
 - vi) Any person notified under trial of offences relating to transactions in securities.
- The Tax Officer shall pass an order determining the tax arrears of the person admitting to pay under VSVS, within 15 days of filling a declaration.
- The person filing such declaration shall pay the amount as determined by the authority within 15 days from the date of receipt of order.
- * **Assesseees whose matter are still at assessment stage i.e. no order has been made by a Tax Officer before 23/07/2024 are not eligible for VSVS.**
- **Changes related to issuing Notice and Attachment of properties involved in benami transactions (w.e.f 01.10.2024)**
- The current and revised timelines for issuance of notice and attaching benami properties is presented in below table:

Particulars	Current time limits	Revised Time limits
Time limit to furnish reply to notice issued to benamidar / beneficial owner	Not provided	Maximum 3 months
Maximum time limit /tenure for which property can be provisionally attached	90 days	4 months
Maximum time limit within which the order with respect to continuing/revoking / attaching or not attaching the property to be taken	90 days	4 months
Time limit for Initiating Officer to draw up the statement of case and refer the same to the Adjudicating Authority	15 days from the date of Attachment	1 month from date of order



- **Relaxation of Penalty of benami property (w.e.f 01.10.2024)**
- Currently, the offence of benami transaction is punishable with a penalty of rigorous imprisonment for minimum one year to maximum seven years along with fine extending to 25% of the fair market value of the benami property. This penalty is same for a Benamidar or a Beneficial Owner or **Any Person who abets or induces any person** to enter into a benami transaction.
- Now, in order to obtain evidence against Beneficial Owner, this budget has empowered the Authorities to provide immunity from such penalty to any person making full and true disclosure of the whole circumstances relating to the benami transactions that facilitate the Authorities in gathering evidence/ conclusion of matters against the Benamidar.
- **Non applicability of Penalty for failure to furnish Foreign Assets in the return of income (w.e.f 01.10.2024)**
- Currently, the provisions of Black Money Act provides for
 1. Penalty for failure to furnish Income Tax Return by a resident person having income from foreign or assets held by him outside India
 2. Penalty for furnishing incorrect or inaccurate particulars about foreign income or an asset located outside India
- In this Budget, the said sections of the Black Money Act are amended to provide that the penalty shall not apply in respect of an asset (other than immovable property) where the aggregate value of such assets does not exceed Rs. 20 lacs. In case of failure to report immovable property then penalty to be levied (irrespective of the value of the property).



TAX PROVISIONS PERTAINING TO TDS & TCS

➤ Certain changes in rates for Taxes Deducted at Source and other provisions

A) For Residents

- This Budget proposes to rationalize and simplify the TDS rates in respect of certain nature of transactions mentioned in the table below.

Sr No.	Particulars of payment/ Nature of transaction	Section	Present TDS rates	Proposed TDS rates	Applicable With effect from
1	Payment of insurance commission to Individuals/HUF	194D	5%	2%	01/04/2025
2	Payment of taxable maturity proceeds to a policy holder of life insurance policy	194DA	5%	2%	01/10/2024
3	Payment of Commission etc. on sale of lottery tickets	194G	5%	2%	01/10/2024
4	Payment of commission or brokerage	194H	5%	2%	01/10/2024
5	Payment of rent by certain individuals or HUF	194-IB	5%	2%	01/10/2024
6	Any contractual payments, brokerage, commission, professional fees etc. paid by individuals or HUF	194M	5%	2%	01/10/2024
7	Payment of certain sums by e-commerce operator to e-commerce participant	194-O	1%	0.1%	01/10/2024
8	Payments made to Partners by Firms (New Levy)	194T	-	10%	01/04/2025

- There is no change in respect to TDS on salary, TDS on Virtual digital assets, TDS on winnings from lottery, race horses etc., payment on transfer of immovable property and payments to non-residents etc.
- Earlier TDS at the rate of 20% was required to be deducted on payment made by Mutual Funds or UTI in respect of repurchase of its units or termination of any

plan. Now, the said provisions are omitted and hence no TDS is liable to be deducted by Mutual Funds or UTI on repurchase of its units or termination of any plan.

- Currently, no TDS is required to be deducted for any amount paid to partner by the firm. The budget (w.e.f 01.04.2025) has widened its provisions to also cover payments made by firm to their partners in the nature

of interest, remuneration or commission and a TDS at the rate of 10% is to be deducted by the firm if such payment exceeds Rs.20,000. Further, there may be a situation where a partner's remuneration depends on the firm's profitability, which is practically determined once the firm's books are closed for the financial year.

Consequently, firms might need to finalize their accounts simultaneously by the financial year-end, considering the due date for depositing TDS for the March quarter is April 30th. Therefore, to deduct TDS on partner remuneration for the year ending on March 31st, the firm's books of accounts may need to be closed before this period.

B) For Non-Residents

- The below table summarizes the rates of TDS for incomes earned by non-residents.

Sr. No.	Nature of Income	Rate of TDS for transfers taking place before 23 rd July, 2024	Rate of TDS for transfers taking place on or after 23 rd July, 2024
1	LTCG on listed equity shares or units of an equity-oriented fund/business trust exceeding Rs. 1,25,000	10%	12.5%
2	LTCG on unlisted shares & securities of a privately held company	10%	12.5%
3	LTCG on any assets other than shares & securities	20%	12.5%
4	STCG on listed equity shares or units of an equity-oriented fund/business trust	15%	20%
5	STCG on unlisted shares & securities of a privately held company	30%	30%
6	STCG on any assets other than shares & securities	30%	30%
7	Income from other sources such as dividend, interest etc. in the hands of a foreign company	40%	35%

➤ Ease of claiming credit for TCS collected/TDS deducted by salaried employees (w.e.f. 01.10.2024)

- Currently, an employer is required to deduct tax from the salary payable to employee after considering all the other income as declared by the employee (i.e. computing the tax liability of the employee and deducting TDS accordingly).
- However, any Taxes collected at source (TCS) in the hands of such employees were not being considered as a tax credit of such employee.
- Hence, a situation would arise where the TDS deducted from the employee would be higher than his actual tax liability, resulting into a case of refund of taxes.
- This budget now permits to give credit of TCS paid by the employees while calculating the tax liability of the employees and the TDS thereon, which resolves the issue of higher TDS and consequential refunds.

➤ Increased interest rates for late payment of TCS (Harmonization with TDS provisions) (w.e.f 01.04.2025)



- Currently, simple interest at the rate of 1% per month is required to be paid on TCS collected but not paid to the credit of Government. While simple interest @ 1.5% per month is required to be paid on late deduction/payment of TDS.

- Now, in order to align the provisions of TDS and TCS and to provide a deterrent to delayed payments of TCS, interest at an increased rate of 1.5% is required to be paid if the TCS is collected but not deposited with the Government.
- It should be noted that in case where TCS has not been collected itself, interest at the rate of 1% will continue to apply.
- **Credit of TCS in the name of minor allowed to be claimed in the hands of parent. (w.e.f 01.01.2025)**
- As per the current provisions, a minor child's income is clubbed with the parent. However, there are no provisions according to which TCS paid in the name of minor is allowed to be claimed by the parent.
- Now, to overcome such genuine difficulty to the tax payer, this budget has facilitated to give credit of the TCS paid in the name of minor child, to the parent with whom the income of the minor is clubbed while filing income Tax return.
- **TCS on luxury goods (w.e.f 01.01.2025)**
- Currently, TCS is required to be collected by every seller, who receives consideration exceeding Rs. 10 lacs for the **sale of a motor vehicle**.
- Now, as a measure to widen the proper tracking of expenses, this budget has extended the applicability of collection of TCS on **all luxury goods** exceeding Rs.10 Lacs. A list of such luxury goods will be notified later.
- **Clarification on deduction of TDS on Sale of Immovable Property (w.e.f 01.10.2024)**
- Currently, TDS is required to be deducted at the rate of 1% on transfer of Immovable properties other than Agricultural Land if the sale value of such a property exceeds Rs. 50 Lacs.
- The interpretation relied by the tax payers and industry at large was that this limit of Rs. 50 Lacs was to be applied in respect of each individual buyer in case of



immovable properties acquired in joint names. Hence even if the value of the immovable property exceeded Rs. 50 lacs but the individual share of a particular buyer did not exceed Rs. 50 Lacs then no TDS was being deducted.

- Now, this budget clarifies that where there is more than one buyer or seller in respect of same immovable property, then for the purpose of deduction of TDS, the limit of Rs. 50 Lacs to be seen as an aggregate of the amounts paid or payable by all the purchasers to all the sellers towards the purchase of such immovable property (i.e. limit of Rs 50 Lacs to be seen as qua the property and not qua the purchaser/seller)
- **Clarification in case of certain payments to be subjected at 10% TDS (w.e.f 01.10.2024)**
- Currently, TDS is required to be deducted @ 1%/2% (under section 194C) for payment for carrying out any work (including supply of labour for carrying out any work) in pursuance of a contract.
- Whereas TDS is required to be deducted @ 10% (under section 194J) for payments made to certain professionals etc. with whom contracts were entered by the assessee.
- Certain assessee/tax payers were using the beneficial rate of 1%/2% even for payments made to professionals etc. considering such payments in pursuance to a contract and hence liable to TDS u/s 194C.
- In order to remove the overlap and misuse of unintended benefit, Section 194C is proposed to be amended to explicitly exclude payments for services which fall within the ambit of section 194J.
- **TDS and TCS required to be deducted on purchase and sales of goods are eligible for lower rate deduction (w.e.f 01.10.2024)**





- Currently, certificate for lower rate deduction cannot be obtained for TDS required to be deducted for purchase of goods and TCS for sale of goods. (Rate @ 0.1%)
- It is observed that taxpayers that are incurring losses and facing cash flow crunches are required to wait for the refund of tax deducted or collected resulting into financial hardship.
- Now, the provisions are amended to cover TDS and TCS required to be deducted/collected for sale of goods eligible for lower tax deduction/collection certificates.
- **TCS not to be collected from non-tax payers (w.e.f. 01.10.2024)**
- Currently, TCS is required to be collected on selling of alcoholic liquor, forest produce, scrap etc. Such TCS is also collected from tax payers whose income is exempt from tax and are not required to file return of income.
- Now, to provide relief to such assesseees, it proposed to provide that no collection of tax shall be made in respect of transactions (to be notified later), from such persons.
- **Restriction on time limit to file TDS/TCS corrected returns beyond 6 years (w.e.f. 01.04.2025)**
- Currently, TDS/TCS statements are required to be filed within prescribed time limit. However, already filed statements can be corrected/revised any time after the original statements are filed.
- Now, in order to put certainty and finality on the filing process of TDS and TCS statements, it is proposed that no corrective/revised statements can be filed beyond 6 years.
- **Penalty for failure to furnish TDS/TCS returns within one month (w.e.f. 01.04.2025)**
- Assesseees face great inconvenience if the TDS/TCS statements to be filed by deductors/collectors are not furnished in time, as the same leads to mismatch in TDS/TCS during processing of income tax returns and raising of infructuous demands.
- Currently, penalty can be levied on non-filing of TDS/TCS statements only after one year from the due date of filing such returns.
- Now, to ensure better compliance, it is proposed to reduce the time to levy penalty from one year to one month from the due date of filing such returns.
- **Reducing the time limit to declare a tax payer as a TDS/TCS defaulter (w.e.f. 01.04.2025)**
- Currently if any resident does not deduct/collect TDS/TCS or fails to pay deducted/collected TDS/TCS to the government, an order can be passed within 7 years for declaring such person as an assessee in default. Whereas no such time frame was provided where the deductor was a non-resident.
- Now, vide this budget the time limit for passing of an order deeming a person (resident/non- resident) to be an assessee in default for failure to deduct whole/ part of tax is reduced and the proposed time limit is:
 - 6 years from the end of financial year in which TDS was deductible or
 - 2 years from the end of the financial year in which the correction statement is filed by the taxpayer, whichever is later.

PROVISIONS AFFECTING TRUSTS AND INSTITUTIONS

- **Single regime governance for charitable trusts (w.e.f. 01.10.2024)**
 - The Income Tax Law has two primary tax regimes for charitable trusts, religious trusts, educational institutions/universities, hospitals and other not for profit organizations to claim their income as exempt from tax.
 - One regime under clause (23C) of section 10 of the Income tax act.
 - The other regime governed by sections 11 to 13 of the Income tax act.
 - Each regime outlines different procedures and conditions for granting/rejecting of approvals/registration and claiming exemption on the income earned etc.
 - This budget has now proposed to simplify procedures and reduce administrative burden by migrating all the provisions affecting the trusts provided under Section 10(23C) to Section 11 to 13 of the Income Tax Act. (Single Regime governance for charitable trusts).
 - Certain eligible modes of investment specified in clause (23C) of section 10 will be available under the second regime through an amendment in the Income Tax Act.
 - **Power of Condoning the delay in Filing registration/exemption application by trusts in hands of the tax office (w.e.f 01.10.2024)**
 - A trust or institution seeking Income Tax registration must apply to the tax office within 6 months from the commencement of its activities. There are instances where trusts or institutions are unable to meet these timelines and thus no exemptions are allowed, potentially leading to tax liability on their income or permanent exit from the exemption benefits.
 - Now, this budget has liberalized the provisions for trust registration by empowering the Principal Commissioner/Commissioner of Income Tax to condone such delay in filing applications if there is a reasonable cause for the same.
 - **Increase of Timelines for filing an application by the trust to facilitate donors to claim tax deduction on donations made (w.e.f. 01.10.2024)**
 - Income Tax Act (Section 80G) provides approval to certain trusts to receive donations whereby the donors become eligible to claim deductions in respect of donations made.
- To claim the above benefit, trusts shall file the application within 6 months from the date of commencement of activities. Delay in filing such applications inadvertently leads the trusts in losing approval and the donors becoming ineligible to claim deduction of donation paid to the trusts.
- Now, this budget has proposed to increase these timelines (to be notified later) for filing applications for registrations.
- **Increase in Timelines to Dispose Applications by Income Tax Authorities (w.e.f. 01.10.2024)**
 - Currently, Trusts have to apply to the Income Tax Office for approval in order to claim their income as exempt income (Section 12AB) as well as to ensure that the donors are eligible to claim deduction in lieu of donations made to the trusts (Section 80G).
 - These applications filed for the above purpose must be processed by the Principal Commissioner or Commissioner of Income Tax within 6 months from the **end of the month** in which they are filed.
 - Now, the timelines for disposal of these applications are extended to 6 months from the **end of the quarter** in which the application is filed.
- **Miscellaneous Clarifications**
 - A clarification is being given vide this budget that when a registered not-for profit organization merges with another not-for profit organization, then there would be no levy of tax provided that both the not-for profit organizations are registered entities and also have similar objects. (w.e.f. 01.04.2025)
 - Any donations/contributions made to the National Sports Development Fund would be eligible for deduction under Section 80G of the Act. (w.e.f. 01.04.2024)



OTHER MISCELLANEOUS CHANGES

➤ **Increased deduction of remuneration paid to partners (w.e.f 01.04.2024)**

- Currently, a partnership firm can pay maximum remuneration of Rs. 1,50,000 to working partners in case of loss. In case of profits, a maximum remuneration of 90% is allowed for profits upto Rs. 3,00,000 and for profits over and above Rs. 3,00,000 a maximum remuneration of 60% paid to working partners is allowed as a deduction in the hands of the firm.

Quantum of Profits	Quantum of deduction in the hands of the firm
For the first profits of Rs. 3,00,000 or in case of loss	Higher of Rs. 1,50,000 or 90% of profits
On balance profits above Rs. 3,00,000	60% of profits

- In this budget, the limits of maximum permissible remuneration to be paid to the partners as an eligible deduction has been enhanced. Now, a maximum remuneration of Rs. 3,00,000 can be paid in case of loss. Whereas, in case of profits, a maximum remuneration of 90% is allowed for profits upto Rs. 6,00,000 and for profits over and above Rs. 6,00,000 a maximum remuneration of 60% paid to working partners is

allowed as a deduction in the hands of the firm.

Quantum of Profits	Quantum of deduction in the hands of the firm
For the first profits of Rs. 6,00,000 or in case of loss	Higher of Rs. 3,00,000 or 90% of profits
On balance profits above Rs. 6,00,000	60% of profits

➤ **No deduction allowed for amount paid as a settlement of an offence (w.e.f 01.04.2024)**

- As per the current provisions, any amount paid as a penalty in case of an offence is not allowed as a deductible business expense. (Penalty imposed by judicial authorities/regulators)
- Now, the scope of restricting the allowable deduction has been increased by way of disallowing any amount paid to settle any offence under any law. (Includes even amounts paid by way of settlement without it being in the nature of penalties such as compounding fees paid to RBI, amounts paid to revenue authorities for regularization etc.)

➤ **Widening the scope for levying penalty for furnishing inaccurate SFT forms (w.e.f 01.10.2024)**

- As per the current provisions, a penalty of Rs. 50,000

shall be levied for furnishing inaccurate information where the tax payer was required to furnish a statement of financial transactions (**SFT FORM's**). This penalty was levied when the tax payer intentionally provides incorrect information to income tax authorities.

- Now, this provision has been widened and penalty can also be levied even in cases where such incorrect information is due to bonafide/genuine reasons and even if it is unintentional or without the knowledge of the taxpayer. Hence, more caution is required while furnishing the SFT Forms to the income tax department.
- **Penalties to be levied on liaison offices in India (w.e.f 01.04.2025)**
- Currently, a non-resident having a liaison office (an entity established in India only to facilitate transactions of its head office situated outside India) has to furnish a statement to Income tax department every year furnishing the details of the activities undertaken by it. However, there was no penalty if there is a delay in furnishing of such information.
- Now, a penalty amounting to Rs. 1,000 per day has been imposed if there is a failure to furnish such information within 60 days from the end of the financial year.
- **Removal of angel tax in the hands of Privately held Companies (w.e.f 01.04.2025)**
- Currently, if a privately held company issues its shares at a price higher than the fair market value, then such excess amount received by the company over and above the fair market value is taxable in the hands of the company (Angel Tax).
- Now, w.e.f. 01st April 2025, this angel tax has been withdrawn. Hence, the privately held companies (specially startups) can issue their shares at a higher price than the fair market value. This shall considerably ease the fund raising process in case of privately held companies as the commercial valuation will not have to be justified against valuation arrived under methods prescribed by the Income Tax Rules.
- However, the companies that shall undergo a fund raise by way of issuance of shares have to be careful and vigilant regarding establishing the genuineness of the source of the funds as well as the investors.
- **Non-resident E-com operators now subjected to tax on withdrawal of Equalization levy (w.e.f 01.08.2024)**
- Currently, there is an equalization levy of 2% for the non-resident Ecommerce operator providing services in India, i.e. 2% is deducted by the service recipient while making payment to the NR Ecommerce operator for its services. Thus, the income earned by the NR from such

Ecommerce services is exempt.

- Now, in order to align the taxation of NR Ecommerce operators with the other non-residents, this equalization levy is withdrawn and consequently the exemption provided is also withdrawn.
- **Power of Transfer Pricing Officer to Scrutinize Specified Domestic Transactions (w.e.f 01.04.2024)**
- Currently, the Transfer pricing officer has the power to compute Arm's Length Price for any international transactions, whether the same has been referred by the Tax Officer or not and whether the same is reported in Form 3CEB (Transfer Pricing Report) or not.
- Now, this budget empowers the Transfer Pricing Officer to even compute Arm's Length Price for the Specified Domestic transactions along with the International Transactions whether or not referred by the Tax Officer and whether the same is reported in FORM 3CEB.
- Specified Domestic Transactions are those domestic transactions undertaken by the related enterprises with each other, to which provisions of transfer pricing are applicable.
- **Changes related to International Financial Services Centre (IFSC) (w.e.f 01.04.2024)**
- Current Income tax regulations exempt income of the Specified Funds on transfer of certain assets. Earlier the definition of Specified Funds only covers the Category III Alternative Investment Funds (AIFs). Now, this budget has widened the definition of Specified Funds to cover certified Retail Scheme and an Exchange Traded Fund (ETF) regulated under the IFSC Regulations. Further, interest and dividend income received by the Specified Funds shall be exempt from levy of surcharge.
- Earlier, if an Indian company has borrowings from non-resident associated enterprise, then maximum interest upto 30% of EBITDA was allowed as a deduction from the business income. Now, this budget has excluded Finance companies located in IFSC from this restriction.
- Currently, as per Income Tax Act (Section 68), when any sum is found credited in the books of accounts from any person (excluding Venture capital funds registered with SEBI) and no explanation or source of such credit entry has been furnished or the explanation is not found to be satisfactory by the Income Tax Officer, then such amount shall be charged to income tax as unexplained cash credits. Now, this budget has excluded sum received from Venture Capital Funds registered under IFSC from the purview of Section 68. Hence, the source of amounts received from Venture Capital Funds in IFSC is not required to be explained.

GST

INDIRECT-TAXATION (GST)

➤ **Benefit to claim ITC after restoration of GSTIN (retrospectively applicable w.e.f. 01.07.2017)**

- Budget 2024 now allows conditional relaxation to claim ITC in cases where returns for the period from the date of cancellation of registration to the date of revocation of such cancellation (restoration of GSTIN) are filed by the registered person within 30 days of the order of restoration. This is provided that the conditions mentioned to claim eligible ITC have been met with on the date of the order of cancellation.
- However, it is expressly stated that no refund shall be available in respect of tax paid or ITC already reversed in GST returns.
- The following information is illustrated in a tabular form as under:

Events	Date
GST Registration cancelled by the Department	01.07.2024
Restoration of cancelled GST registration	31.12.2024
Late date to avail ITC for FY 2023-24 (under current regulations for a live GSTIN)	30.11.2024
Extended last date to avail ITC for FY 2023-24 (for restored GSTIN)	30.01.2025

➤ **Extension to claim ITC for FY 2017-18 to 2020-21**

- Currently, in order to claim ITC, businesses have to claim the same in GSTR-3B. Initially, when GST was introduced there were certain issues faced by the businesses in filing of GSTR-3B within timelines mentioned in the GST regulations and consequentially this led to businesses not being able to claim ITC and its related litigations.
- This budget now by way of clarification states that the time limit to claim such ITC for the financial years 2017-18 to 2020-21 stands uniformly increased to 30th November 2021. This will help businesses who had failed to file the claim of ITC for the financial years 2017-18 to 2020-21 within the timelines mentioned in the GST Act.
- The below tabular information explains the relief given to businesses to claim ITC for their earlier years which shall help them even if under litigation:

Financial Year	Last date to avail ITC (As per current GST Regulations)	Extended date to avail ITC
2017-18	23.04.2019	30 th November 2021
2018-19	20.10.2019	
2019-20	24.10.2020	
2020-21	24.10.2021	

➤ **Revised Pre-Deposit limits for filing Appeals (w.e.f. 01.08.2024)**

- The changes in the pre deposit for filing an Appeal is as per the below table:

Applicable Forum	Existing limits for Pre-deposits	Proposed limits for Pre-deposits
Commissioner Appeals (1 st Stage of Appeal)	10% of Disputed Tax (Maximum upto Rs. 50 Crores)	10% of Disputed Tax (Maximum upto Rs. 40 Crores)
GST Appellate Tribunal (2 nd Stage of Appeal)	Additional 20% of Disputed Tax (Maximum upto Rs. 100 Crores)	Additional 10% of Disputed Tax (Maximum upto Rs. 40 Crores)

➤ **Simplified GST Assessment Procedure (w.e.f FY 2024-25)**

- Currently, the notices for determination of tax not paid, short paid, ITC wrongly availed or utilized and tax erroneously refunded are governed under separate provisions:

1. Other than fraud, willful misstatement or suppression of facts (Section 73)
2. Fraud, willful misstatement or suppression of facts (Section 74)

- Now, this budget has combined these two separate provisions and inserted a new Section 74A for conducting GST Assessment from FY 2024-25. A comparison of present provisions and new provision is presented in table below:

Particulars	Section 73	Section 74	Section 74A
Nature of cases	Non-Fraudulent	Fraudulent	All
Applicability for the period	Upto FY 2023-24	Upto FY 2023-24	From FY 2024-25 onwards
Time limit to issue Show cause notice	3 months prior to below time limit for order	6 months prior to below time limit for order	42 months from the due date of Annual Return
Time limit to issue order	3 years from the due date of Annual return	5 years from the due date of Annual Return	12 months from issuance of Show cause notice
Maximum penalty	10% of disputed tax or Rs. 10,000 whichever is higher	100% of disputed tax	<u>Non-Fraudulent:</u> 10% of disputed tax or Rs. 10,000 whichever is higher <u>Fraudulent:</u> 100% of disputed tax

➤ **Availability of Input Tax Credit for tax paid on goods seized**

- Presently, ITC is restricted/ not allowed for GST paid under Sections 74 (Fraud/willful misconduct) and Sections 129/130 (Seizure of goods and vehicles).
- Going forward from FY 2024-25, only ITC pertaining to cases of tax payment due to fraud will be restricted. Whereas, ITC for taxes paid under Section 129 (after the detention and seizure of goods) and Section 130 (following the confiscation of goods or conveyances) shall be available.

➤ **Mandatory filing of TDS Returns**

- Budget 2024 now requires every registered person deducting tax at source (TDS) under the provisions of GST to file a return for the month in which such deductions have been made i.e. TDS Deductor registrations, irrespective of whether any deduction has been made in the said month or not. In essence a monthly TDS return is required to be filed irrespective of the fact whether any transactions have taken place in that particular month.

➤ **Authorized Representative can appear in case of Summons**

- Provisions of GST Act empowers a Proper Officer to summon individuals for testimony or document production in inquiries.

This Budget now allows the person against whom a summon is issued to appear either in person or through an authorized representative.

➤ **Regularization of GST non-compliance due to Trade Practices**

- This Budget has proposed to empower the Government to rectify instances of non-levy or short levy of GST on goods or services due to prevalent trade practices. This will be facilitated through a notification issued upon GST Council recommendations, exempting such unpaid or underpaid taxes from further payment. However, it does not contain provision to refund the tax payers who have paid excess GST.

➤ **Time Period for Issuance of Self-generated Invoice in case of RCM for purchases from Unregistered dealer**

- This budget has specified that if the recipient issues a self-invoice (for Supplies under RCM), the time of supply shall be the earlier of the payment date or the self-invoice date.
- It aims to standardize the invoicing and time of supply provisions for RCM supplies availed from unregistered suppliers.

➤ **Refund Restrictions for Zero-Rated Supplies subjected to export duty**

- Currently, the GST law prohibits refund of unutilized input tax credit on zero-rated supply of goods which are subjected to export duty.
- This budget has also proposed to prohibit refund of IGST paid

on zero rated supply of goods which are subjected to export duty. It shall also provide for class of persons (to be notified later) who may make zero rated supplies of goods and refund of IGST paid on such supplies can be claimed.

➤ **Changes related to Anti Profiteering Investigations (w.e.f 01.04.2025)**

- This Budget authorizes the Principal Bench of the GST Appellate Tribunal (GSTAT) to examine or adjudicate anti-profiteering cases.
- The government is also empowered to provide a sunset clause for accepting applications for anti-profiteering investigations.

➤ **Insurance and Reinsurance Services**

- This budget clarifies that the following shall neither be considered as supply or goods or services
 1. Apportionment of co-insurance premiums by the lead insurer to co-insurers for jointly supplied insurance services
 2. Services provided by an insurer to a reinsurer for which a commission is deducted from the re-insurance premium paid by the insurer, provided the reinsurer pays GST on the total reinsurance premium.

➤ **Exempted Extra Neutral Alcohol (ENA) from levy of GST**

- Currently, GST is being charged on supply of ENA or rectified spirit. Now this budget has excluded ENA or rectified spirit used for manufacturing of Alcoholic Liquor for human consumption from levy of GST.

CONTRIBUTORS



Shri Bakul Parikh



Mr. Yash Shah



Mr. Dipen Shah



Mr. Jigar Patel



Mr. Bhaskar Patel



Mr. Sulabh Patel



Mr. Mohit Balani



Mr. Kaushal Kapasi



Mr. Karan Shah



A MENU YOU
WON'T WANT TO *miss*

Open for all (including non-members)

Reserve your table today by calling us on
+91 76008 50638

FOLLOW US



 **GULMOHAR GREENS - GOLF & COUNTRY CLUB**



વિકાસના હાથવે પર લઈ જવા સક્ષમ બજેટ



બા

બાયબેંકના માધ્યમથી ઈન્કમે-ટેક્સમાં દસ ટકાનો ફાયદો ઉઠાવતી કંપનીઓ હવે તે ફાયદો લઈ શકશે નહિ. કંપનીઓ તેમની પાસેના

રિઝર્વ ફંડ શેરહોલ્ડરને આપે તો તેના પર તેમણે 30 ટકાના દરે ટેક્સ ભરવાનો આવતો હતો અને બાયબેંક પર 20 ટકાના દરે ટેક્સ ભરવાનો આવતો હતો. તેથી તેઓ ડિવિડંડ આપવાને બદલે બાયબેંક કરીને રિઝર્વ ફંડનું વિતરણ કરવાનું પસંદ કરતી હતી. હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે શેર્સના બાયબેંક અંગેની નવી જોગવાઈની બજેટમાં જાહેરાત કરી દીધી છે. આ નવી જોગવાઈ પહેલી ઓક્ટોબર 2024થી અમલમાં આવી જશે. કંપનીઓ

ઈચ્છે તો પહેલી ઓક્ટોબર પહેલાં એટલે કે 30મી સપ્ટેમ્બર સુધીમાં બાયબેંકનો ઈશ્યુ લાવી શકે છે. હા, તેને માટે એક શરત રાખવામાં આવી છે. કંપનીઓએ આ અગાઉ બાયબેંક કર્યાને એક વર્ષ વીતી ગયેલું હોવું જોઈએ.

ઈન્કમેટેક્સ એક્ટ તૈયાર કરવા માટે નિયુક્ત કરવામાં આવેલી કમિટીના સભ્ય અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ગિરીશ આલુજાનું કહેવું છે, “કંપનીઓ બાયબેંક ઓફ શેર્સનો ખોટો એડવાન્ટેજ લેતી હતી. કંપનીઝ એક્ટની કલમ 68 પ્રમાણે શેર્સ બાયબેંક કરનારી કંપનીઓએ 20 ટકાના દરે ટેક્સ ભરવો પડે છે. તદુપરાંત બાર ટકા સરચાર્જ અને 4 ટકા એજ્યુકેશન સેસ ચૂકવવાં પડે છે. તેને બદલે કંપનીઓ ડિવિડંડ ડિસ્ટ્રિબ્યુશન કરે તો તેના પર

તેમણે 30 ટકા ટેક્સ ભરવાનો થતો હતો. તેમ જ 12 ટકા સરચાર્જ અને ચાર ટકા એજ્યુકેશન સેસ ચૂકવવાનાં આવે છે. આમ નવથી દસ ટકાનો તફાવત આવતો હતો. તેથી બધી જ કંપનીઓ લિસ્ટેડ હોય કે અનલિસ્ટેડ હોય, કંપનીઓ ડિવિડંડ આપવાને બદલે બાયબેંક કરવાનું જ પસંદ કરતી હતી. આમ બાયબેંકમાં સરકારના દસ ટકાની રેવન્યુ લોસ આવતી હતી. બાયબેંકની લિસ્ટેડ અને અનલિસ્ટેડ બંને કંપનીઓને છૂટ હતી.”

ગિરીશ આલુજા કહે છે, એક જમાનામાં બાયબેંકને કારણે થતી આવક પર શેરહોલ્ડર્સ કલમ 10(38) હેઠળ કરદાતા ટેક્સ ભરતા નહોતા. જ્યારે કંપનીઓ તો તેના પર આમેય ટેક્સ ભરતી નહોતી. ત્યાર બાદ અમે બજેટમાં કલમ 115 ક્યૂએ

શેરના બાયબેંકની
સંપૂર્ણ આપકને
ડીમ્ડ ડિવિડંડ ગણી
ટેક્સસ્લેબ પ્રમાણે
વેશે લેશે

કંપનીઓને બાયબેંકની
ઘચ્છા હોય તેઓ પહેલી
ઑક્ટોબર 2024 પહેલાં
બાયબેંકનો ઇશ્યુ લાવી
અંડવાન્ટેજ લઈ શકે

લગભગ આપતા વર્ષથી
ભાગીદારી પેઢીઓને પણ
નવા ટેક્સ રિજિમનો
લાભ આપી દેવામાં આવે
તેવી સંભાવના

**24 મહિના પછી કરતા
વેચાણ પર લોન્ગ ટર્મ
કેપિટલ ગેઇન ટેક્સ 10
ટકાથી વધારીને 12.5 ટકા
કરવામાં આવ્યો**

**2001માં રૂ. 4700ના ભાવે
સોનું ખરીદનાર લોન્ગ
ટર્મ કેપિટલ ગેઇનની
જોગવાઈને કારણે બોજ
છ ગણો વધતાં નારાજ**

ઉમેરી છે. આ કલમના માધ્યમથી બાયબેંક પર ટેક્સ જમા કરાવવાની જવાબદારી કંપનીને માથે નાખવામાં આવી હતી. હવે કલમ 115 ક્યૂએ નાબૂદ કરી દેવામાં આવી છે. તેમ જ બાયબેંક હેઠળ મળતી જે તે રકમને કલમ 2/20 (એફ) હેઠળ ડીમ્ડ ડિવિડંડ ગણી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ જોગવાઈને કારણે કરદાતાએ રૂ. 100ની કિંમતે શેર ખરીદ્યો હોય. આજે તે શેરની કંપની રૂ.1000ની કિંમત ચૂકવીને બાયબેંક કરે છે. આમ શેરની બાયબેંક પેટે શેરહોલ્ડરને થયેલી સંપૂર્ણ આવક - બાયબેંકની આવક કે ડીમ્ડ ડિવિડંડ - ગણીને તેના ઇન્કમેટેક્સના 5, 10, 20 અને 30 ટકાના સ્લેબ પ્રમાણે ટેક્સ વસૂલવામાં આવશે. આ સંજોગોમાં કરદાતાએ ઇન્વેસ્ટ કરેલા રૂ.100 પણ તેની ડિવિડંડની આવક બની જશે. કરદાતા આ ખર્ચને આવક ગણવા સામે સવાલ કરે તેવી શક્યતા રહેલી છે. આ રીતે થયેલી સો ટકા રકમને ડિવિડંડની આવક ગણવામાં આવશે. તેમાંથી કોઈ પણ રકમને કલમ 57 હેઠળ ખર્ચ તરીકે કોઈ પણ બાદ કરવાની છૂટ આપવામાં આવી નથી. આમ બાયબેંકની સંપૂર્ણ આવક પર ટેક્સ ચૂકવવો પડશે. ઇન્કમ ડોમ અધર સોર્સિસ તરીકે આ ટેક્સ ચૂકવવો પડશે.”

બાયબેંકમાં શેર ખરીદવા ઇન્વેસ્ટ કરેલી રકમ પણ બાદ મળશે

હવે સવાલ એ થાય છે કે શેર્સ ખરીદવા માટે કરેલા ઇન્વેસ્ટમેન્ટનું શું થશે? તેનો જવાબ આપતાં ગિરીશ આહુજા કહે છે, શેર્સના બાયબેંક માટેની કિંમતમાં અવેજ-કન્સિડરેશન પ્રાઇસ તરીકે શૂન્ય રૂપિયા ગણવામાં આવશે, પરંતુ તમારી



ઇન્ડેક્સેશન અને LTCGની નવી સિસ્ટમમાંથી કરદાતાને એકની પસંદગી કરવાની તક આપી

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મહેશ છાજેડ કહે છે, “મિલકતના વેચાણમાં થતા લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની નવી જોગવાઈને કારણે નાના મિલકતમાલિકોને ખોટ જઈ શકે છે. આ ખોટ ન જાય તે માટે તેમને ઇન્ડેક્સેશનનો અને નવી વ્યવસ્થામાંથી કોઈ પણ એક વ્યવસ્થા સ્વીકારવાનો અવકાશ આપવો જોઈએ. તેને ઇન્ડેક્સેશન થકી લાભ થતો હોય તો તે સિસ્ટમને અનુસરી શકે અને ઇન્ડેક્સેશન સિવાયની સિસ્ટમને ફોલો કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેમને ઇન્ડેક્સેશન સાથે અથવા તો ઇન્ડેક્સેશન વિના લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડે છે. આ વ્યવસ્થા ચાલુ રાખવામાં આવે તો નાના મિલકતમાલિકોને માથે કેપિટલ ગેઇન ટેક્સ પેટે મોટી રકમ જમા કરાવવાનો બોજો ન આવે તેવી સંભાવના છે. આવકવેરાનું રિટર્ન નવા

રિજિમમાં કે જૂના રિજિમમાં ભરવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે તે પ્રમાણે જ લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં લાભ આપવો જરૂરી છે.” સરકારે આ વિકલ્પ આપવાનો નિર્ણય લઈ લીધો છે. પરિણામે કરદાતા પોતાને અનુકૂળ વિકલ્પ પસંદ કરી શકે છે.



ફોરેન ફંડવાળાઓને તકલીફ હતી. તેઓ કહેતા હતા કે બાયબેંક આવે ત્યારે અમને પૈસા મળતા હતા. અહીં તેનો ટેક્સ કંપનીઓ ભરે છે. પરંતુ અમારા દેશમાં અને બાયબેંકના અમારા પોતાના ખરીદ ભાવ અને કંપનીના બાયબેંકના ભાવ વચ્ચેના ગાળાને કેપિટલ ગેઇન ગણીને અમારી પાસેથી અમારા દેશમાં કેપિટલ ગેઇન ટેક્સ વસૂલવામાં આવે છે. વિદેશની સરકારો એવી દલીલ કરતી હતી કે તમે ટેક્સ ચૂકવ્યો જ નથી. ટેક્સ તો બાયબેંક કરનારી કંપનીએ ચૂકવ્યો છે. તેથી તમને તે ટેક્સની કેડિટ મળી શકે જ નહિ. હવે બાયબેંકમાં ફોરેન કંપનીઓને જે લાંબા ગાળાનો નફો થશે. તેને અહીં ડિવિડંડ ગણવામાં આવશે. આ ડિવિડંડ પર અહીં જ બાયબેંકમાં શેર્સ આપનાર ફોરેન ફંડ પાસેથી ટેક્સ વસૂલી લેવામાં આવશે. આ ટેક્સ અહીં વસૂલી લેવાયો હોવાથી તેમને તેમના દેશમાં તે ટેક્સની કેડિટ પણ મળશે. આ ટેક્સ પણ બંને દેશ વચ્ચે થયેલી સમજૂતી-સંધિ કે ટ્રીટી પ્રમાણે લેવામાં આવશે. આ સંધિ પ્રમાણે કેટલાક દેશો પાસે 8 ટકા, કેટલાક પાસે 15 ટકા અને કેટલાક પાસે 20 ટકા ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. ગિરીશ આહુજા કહે છે, “ફોરેન ફંડને કારણે પણ બાયબેંક પરના ટેક્સની જવાબદારી કંપનીઓને માથેથી ખસેડીને બાયબેંકનો લાભ મેળવનારાઓ પર શિફ્ટ કરવામાં આવ્યો છે. તેમને માટે પણ એલટીસીજી 12.5 ટકા પર લાવી દેવામાં આવ્યો છે.”



ખરીદકિંમત રૂ. 100 છે. તેવા સંજોગમાં રૂ.100 કેપિટલ લોસ તરીકે સરભર કરી આપવામાં આવશે. આ કેપિટલ લોસને કલમ 74 હેઠળ અન્ય કેપિટલ ગેઈન સામે સેટ ઓફ તરીકે મેળવી શકાશે. આઠ વર્ષ સુધી લોસને કેરી ફોર્વર્ડ કરીને ગમે ત્યારે સેટ ઓફ કરી શકાશે. હા, હજીય કંપનીઓ 30મી સપ્ટેમ્બર સુધી બાયબેંક કરી શકે છે. 30મી સપ્ટેમ્બર સુધી બાયબેંક કરીને કંપનીઓ તેમના 9થી 10 ટકા ઈન્કમેટેક્સની બચત કરી શકે છે.

હા, આ બાયબેંક કરવા માટે એક બીજી શરત મૂકવામાં આવેલી છે. જે કંપનીએ ભાર મહિનાના ગાળામાં શેર્સ બાયબેંક ન કર્યા હોય તેમને જ 30મી સપ્ટેમ્બર 2024 સુધીમાં બાયબેંક કરવાની તક મળશે. હજી ત્રણથી ચાર મહિના પૂર્વે જ બાયબેંક કરનાર ટીસીએસને બાયબેંક કરવાની તક મળશે નહિ.

ઈન્ફોર્મેશન ટેકનોલોજીના સેક્ટરની કંપનીઓ મોટા પ્રમાણમાં બાયબેંક કરે છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ સહિતની ભાર જેટલી આઈટી કંપનીઓએ 2020થી 24ના ચાર વર્ષના ગાળામાં રૂ. 1 લાખ કરોડથી વધુ રકમના શેર્સનું બાયબેંક કર્યું છે, પરંતુ હવે બજેટના માધ્યમથી કલમ 115 ક્યૂએ નાબૂદ કરી દેવામાં આવી હોવાથી કંપનીઓને બાયબેંકનો ઈશ્યુ લાવીને રિઝર્વ ફંડ શેરહોલ્ડર્સમાં ડિસ્ટ્રિબ્યુટ કરી દેવાનું આકર્ષણ ઓછું થઈ જશે. હવે કંપનીઓ દ્વારા કરવામાં આવતા બાયબેંક થકી શેરધારકને થનારી આવકને તેના આવકવેરાના સ્લેબ પ્રમાણે વેરાની વસૂલાતને પાત્ર ગણવામાં આવશે. તેમાંથી તેની ખરીદકિંમત પણ બાદ આપવામાં આવશે નહિ. તેની ખરીદકિંમતને શૂન્ય ગણીને ખરીદકિંમતને ખોટ તરીકે દર્શાવીને તેના અન્ય શેર્સ પરના કેપિટલ ગેઈન સામે એડજસ્ટ કરી લેવાની છૂટ આપવામાં આવી છે. આ નવી જોગવાઈને પરિણામે સ્કિપમાં થતાં સહાકીય રોકાણો પણ ઓછાં થશે. હા, તેને કારણે જેન્યુઈન ઈન્વેસ્ટર્સ પર થોડી નકારાત્મક અસર પણ પડશે. તેમણે ડિવિડંડની આવક પર 30 ટકાના દરે આવકવેરો ભરવો પડશે. આમ જેન્યુઈન ઈન્વેસ્ટર્સ પર ટેક્સનો દસેક ટકાનો બોજો વધી જશે. સરકાર માને છે કે ડિવિડંડ અને બાયબેંક એકસરખી જ બાબત છે તેથી તેના પર ટેક્સ પણ એકસરખો જ હોવો જોઈએ.

નવી રિટર્ન સિસ્ટમમાં વધુ અડવાળેજ આપ્યા

તેની સામે નવી સિસ્ટમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે ઝીરોથી ત્રણ લાખ સુધીની આવક પર કોઈ જ ટેક્સ લેવામાં આવ્યો નથી. ત્રણ લાખથી સાત લાખની આવક પર માત્ર 5 ટકા ટેક્સ લાગુ કરીને મોટો ફાયદો કરાવ્યો છે. તેમાં કરદાતાને સીધો રૂ. 5000ના વેરાનો લાભ આપવામાં આવ્યો છે. પહેલાં રૂ. 6થી 7 લાખની આવક પર રૂ. 10,000નો ટેક્સ લાગુ પડતો હતો. બીજો એડવાળેજ રૂ. 6થી 9 લાખની આવકના જૂના 15 ટકાના સ્લેબને બદલે રૂ. 7થી 10 લાખ રૂપિયા સુધીની આવકના સ્લેબને 10 ટકા ટેક્સના દાયરામાં લાવી દેવામાં આવ્યો છે. આમ નવા ટેક્સ રિજિમમાં જનારાઓને બીજો રૂ. 10,000નો ફાયદો કરાવ્યો છે. પહેલાં રૂ. 9 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ લાગતો હતો. તે વધારીને હવે રૂ. 10 લાખ સુધીનો કરી દીધો છે. તેથી રૂ. 9થી 10 લાખ સુધીને વધારાની એક લાખની આવક પર રૂ.10,000નો વધારાનો એડવાળેજ આપ્યો છે. બીજું પગારદારોને નવા રિજિમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ. 50,000થી વધારીને રૂ. 75000 કરી આપવામાં આવ્યું છે. ઓલ્ડ રિજિમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન માત્ર 50,000નું જ રાખવામાં આવ્યું છે. એક સમય હતો જ્યારે ઓલ્ડ અને ન્યુ રિજિમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન એક સરખું આપવામાં આવતું હતું. આમ નવા રિટર્નના રિજિમ તરફ ધીમે ધીમે લોકોને ખેંચી રહ્યા છે.

શોર્ટ ટર્મ 12 મહિના પછી ને લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન 24 મહિના પછી ગણાશે

અત્યારે સ્ટોક ઈન્વેસ્ટર્સ 12 મહિનામાં શેર્સ વેચી દે તો તેણે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ભરવો પડે છે. આ શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 15 ટકાથી વધારીને આ વરસના બજેટમાં 20 ટકા કરી દેવામાં આવ્યો છે. તેની સામે લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 24 મહિના પછી કરવામાં આવતા વેચાણ પર લાગુ કરવામાં આવ્યો છે. લોન્ગટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 10 ટકાથી વધારીને 12.5 ટકા કરી દેવામાં આવ્યો છે. 23મી જુલાઈ 2024થી જ આ નવી જોગવાઈ લાગુ કરી દેવામાં આવી છે. આ પગલું કેમ લેવામાં આવ્યું તેને જસ્ટિફાય કરતાં ગિરીશ આહુજા કહે છે, “શરબજાર કૂદકે અને ભૂસકે વધી રહ્યું છે તે જોતાં શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સનો બોજો તે સહન કરી શકશે. તેનાથી શેરહોલ્ડર્સને બહુ મોટો ફરક પડશે નહિ. તેમની મોટી કમાણીમાંથી સરકારને થોડુંક આપવાનું આવશે તેની સામે કોઈને બહુ મોટો વાંધો નહિ જ હોય. હા, તેમાંથી બચવા શોર્ટ ટર્મમાં નીકળી જવાનું ઓછું પસંદ કરવું જોઈએ. લોન્ગ ટર્મ ઈન્વેસ્ટર્સ બનવા તરફ સરકાર રોકાણકારોને ધકેલી રહી છે.” લાંબા ગાળાનું રોકાણ બજાર માટે હિતકારક ગણાય છે.

ગિરીશ આહુજા કહે છે, “હવે કંપની દ્વારા કરવામાં આવતા બાયબેકમાં મળતી રકમ ડિવિડંડ હોવાથી કંપનીઓએ આવકવેરા ધારાની કલમ 194ની જોગવાઈ હેઠળ 10 ટકાના દરે તે ચુકવણી પર ટીડીએસ ભરવો પડશે. અગાઉ સેક્શન 222-એ, બી, સી, ડી અને ઈ લાગુ પડતી હતી. હવે તેના ઉપરાંત 222-એફ હેઠળ કંપનીએ દરેક કરદાતાને બાયબેકમાં આપવામાં આવતી રકમમાંથી 10 ટકા ટીડીએસ કરીને સરકારને જમા આપવો પડશે.

આમ બાયબેકને હતોત્સાહ કરીને સરકારે તેની ઈન્કમેટેક્સની આવકમાં વધારો કરી દેવાનો રસ્તો ખોલી આપ્યો છે. કંપનીઓ બાયબેક નહિ કરી શકે તેવું નથી, પરંતુ તેને શેરહોલ્ડરના હાથમાંના નફા તરીકે ગણતરીમાં લેવામાં આવશે અને તેના ટેક્સ સ્લેબ પ્રમાણે તેના પર ટેક્સની જવાબદારી આવશે.”

જોકે બાયબેકમાં ખરીદકિંમતને પણ ડિવિડંડની આવક ગણી લેવાના પગલાને કેટલાક વેરા નિષ્ણાતોએ વખોડી કાઢ્યું છે. તેને કેપિટલ લોસ તરીકે ગણતરીમાં લેવાને કારણે નાના કરદાતાઓને ભોગે કંપનીઓને ફાયદો થશે. શેરનો ઈશ્યુ લાવ્યા હોય ત્યારે કંપની શેરની ફેસ વેલ્યુ ઉપરાંત પ્રીમિયમ પણ લે છે. બાયબેકનાં નાણાં આ પ્રીમિયમની રકમમાંથી ચૂકવવામાં આવતાં હોવાનું ઘણા કિસ્સાઓમાં જોવા મળે છે. તેથી કરદાતાએ ચૂકવેલા પ્રીમિયમની રકમને પણ ડિવિડંડ ટેક્સ હેઠળ વેરા પાત્ર બનાવવી ડિવિડંડ ટેક્સના સિદ્ધાંતની વિરુદ્ધ છે. હા, શેરની ખરીદ કિંમતને કેપિટલ લોસ-મૂડી પોટ ગણીને આગામી આઠ વર્ષ સુધી કેપિટલ ગેઈન સામે




તેને સેટ ઓફ કરવાની તક જરૂર આપવામાં આવશે. આ લોસ ત્યાર બાદના પહેલા જ નાણાકીય વર્ષમાં સેટ ઓફ તરીકે મેળવી શકાય છે. આ નવી જોગવાઈની અસરની વાત કરતાં નિષ્ણાતો કહે છે કે પહેલાં બાયબેકની આવકને ડિવિડંડ ગણીને તેના પર મહત્તમ 30 ટકા ટેક્સ ઉપરાંત ભાર ટકા સરચાર્જ અને ચાર ટકા એજ્યુકેશન સેસ લેવામાં આવશે. આ રકમ લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સથી વધી જવાની સંભાવના રહેલી છે. બીજું, શેર્સ વેચવામાં આવશે ત્યારે જ બાયબેકમાં ગયેલી પોટને સેટ ઓફ કરી શકાશે. આ સેટ ઓફ નીચા દરે કરવાની નોબત આવી શકે છે. આ અનિયમિતતા ટેક્સ સિસ્ટમમાં



બે કે પાંચ કરોડથી વધુ આવક ધરાવનારાઓને ફાયદો

જેની આવક રૂ. 5.78 કરોડની આવક હતી. જૂના રિજિમમાં રિટર્ન ફાઈલ કરવા ગયા તો તેનો ટેક્સ બહુ જ ઊંચો આવતો હતા, પરંતુ નવા ટેક્સ રિજિમમાં ગયા તો તેને પરિણામે વેરામાં 25 લાખની બચત થઈ ગઈ. તેમાં સરચાર્જ, 234 એ, 234 બી અને 230 હેઠળના એડવાન્સેજ લેતા વેરાના બોજમાં રૂ. 25 લાખનો ઘટાડો આવી ગયો. આ જ રીતે રૂ. 2 કરોડથી વધુ આવક ધરાવનારાઓને પણ વેરામાં બહુ જ મોટો ફાયદો મળી રહ્યો છે. જૂની સિસ્ટમમાં 37 ટકા સરચાર્જ ચૂકવવો પડી રહ્યા છે. તેની સામે નવી સિસ્ટમમાં 25 ટકા સરચાર્જ ચૂકવવો પડી રહ્યો છે. તેથી આ ફરક આવી રહ્યો છે. તેથી જ રિટર્ન ફાઈલ કરો ત્યારે જૂની સિસ્ટમમાં કેટલો લાભ મળે છે અને નવી સિસ્ટમમાં કેટલો લાભ મળે છે તે ચકાસીને દરેક કરદાતા કે કરદાતાના રિટર્ન ફાઈલ કરનારા ચકાસી જુએ તે જરૂરી છે. ત્યાર બાદ 90 ટકા કરદાતાઓ નવા રિજિમમાં જ રિટર્ન ફાઈલ કરવાનું પસંદ કરશે. તેથી જ ગયા વર્ષે ફાઈલ થયેલાં કુલ રિટર્નમાંથી 66 ટકા રિટર્ન નવાં રિજિમમાં ફાઈલ થયાં હતાં. આ વરસે નવા રિજિમમાં રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યા હજીય વધી જવાની શક્યતા રહેલી છે.



**શોર્ટ ટર્મ
કેપિટલ ગેઇન
ટેક્સ 15 ટકાથી
વધારીને આ વરસના
બજેટમાં 20 ટકા કરી
દેવામાં આવ્યો**


ક્ષતિ હોવાનો નિર્દેશ આપે છે. બીજી તરફ લિસ્ટ થયેલી સિક્યોરિટી તથા એસટીટી-સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ પેઈડ સિવાયની કોઈ પણ એસેટ્સનું 24 મહિના પહેલાં વેચાણ કરે તો શોર્ટ ટર્મ કેપિટલ અને 24 મહિના પછી વેચાણ કરશે તો લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગુ પાડવાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે.

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મહેશ છાજેડનું કહેવું છે કે, “ડિબેન્ચર, ગોલ્ડ, બોન્ડ સહિતની અસ્ક્યામતો પર લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ગણવાનો 36 મહિનાના ગાળાને ઘટાડીને 24 મહિનાનો કરી દેવામાં આવ્યો છે. તેમ જ લિસ્ટેડ સિક્યોરિટીઝ પરનો રૂ. 1 લાખ સુધીનો લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન માફીને પાત્ર હતો તે વધારીને હવે 1.25 લાખ કરી દેવામાં આવ્યો છે. જમીન, મકાન, સોનું અને તમામ પ્રકારનાં બોન્ડ, ડિબેન્ચર પર પરનો લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 20 ટકાથી ઘટાડીને હવે 12.5 ટકાના કરી દેવામાં આવ્યો છે. અગાઉ લોન્ગ ટર્મ કેપિટલ ગે ઈ ન

ટેક્સનો દર 20 ટકા હતો અને તેમાં મિલકતના ઈન્ડેક્સેશનનો લાભ આપવામાં આવતો હતો. હવે ઈન્ડેક્સેશનનો આ લાભ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. પરિણામે મિલકતની કિંમત-ખરીદકિંમત અથવા પહેલી એપ્રિલ 2001ની સાલની વાજબી કિંમત ગણીને તેના વેચાણ થકી થયેલા નફા ઉપર ઈન્ડેક્સેશનના લાભ આપ્યા વિના 12.5 ટકા લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વસૂલવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે મિલકત પરનું ઈન્ડેક્સેશન કાઢી નાખ્યું છે. હા, પહેલી એપ્રિલ 2001 પહેલા તમે મિલકત એટલે કે પ્રોપર્ટી ખરીદી હોય તો તેમાં ઈન્ડેક્સેશનનો લાભ મળશે, પરંતુ તે પછીના ગાળા માટે ઈન્ડેક્સેશનનો લાભ આપવામાં આવશે જ નહિ. કલમ 2 (42)એ હેડળ કેપિટલ ગેઈનની ગણતરી કરવી પડતી હતી. ઈન્ડેક્સેશન કાઢી નાખવાને કારણે નાની અને સસ્તી મિલકતના માલિકોને નુકસાન જવાની શક્યતા હોવાનો નિર્દેશ એડવોકેટ હિરેન વકીલ આપી રહ્યા છે. બજેટ 2024માં આવકવેરા ધારાની કલમ 48(2)ને રદ કરીને સ્થાવર મિલકત, સોનું ચાંદી તથા મૂડીના સ્વરૂપમાંની અન્ય કોઈ પણ મિલકત વેચવામાં આવે તો અત્યાર સુધી તેના પર ઈન્ડેક્સેશનનો લાભ કરદાતાને મળતો હતો. તેની તારીખ 23મી જુલાઈ 2024થી રદ કરવામાં આવી છે. તેની અસરો નાના કરદાતાઓ માટે કરભારણ વધારનાર સાબિત થશે. જેની મિલકતની કિંમત વધારે હશે તેને ફાયદો થશે, કારણ કે કરનો દર નાણામંત્રીએ 20 ટકાથી ઘટાડીને 12.5 ટકા કરી દીધો છે.

ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો એક કરદાતાએ તેની સ્થાવર મિલકત 2001માં રૂ. 1 કરોડમાં ખરીદી હોય અને આ મિલકત 22મી જુલાઈ 2024 સુધીમાં તેણે વેચી હોત તો તેની ઈન્ડેક્સ કોસ્ટ 363 પ્રમાણે ગણતાં રૂ. 3.63 કરોડ થાય છે. તેની વેચાણકિંમત રૂ. 4.17 કરોડ થાય છે. એડવોકેટ હિરેન વકીલનું કહેવું છે કે આ સંજોગોમાં લાંબા ગાળાનો મૂડી નફો રૂ. 54 લાખ થાય છે. તેના



પર 20 ટકાના દરે 10.80 લાખ રૂપિયા કેપિટલ ગેઈન થાય છે. આ જ મિલકત જો પહેલી ઓગસ્ટ 2024એ વેચવામાં આવે તો તેની રૂ. 4.17 કરોડની વેચાણકિંમતમાંથી 2001ની સાલની રૂ. 1 કરોડની ખરીદકિંમત બાદ કરી દેતાં તેનો લાંબા ગાળાનો મૂડી નફો રૂ. 3.17 કરોડનો થાય છે. તેના પર તેણે 12.5 ટકા લેખે 39,62,500 રૂપિયા એલટીસીજી ભરવાનો થાય છે. આમ તેણે કર પેટે રૂ. 28.82 લાખ વધુ ચૂકવવાના આવશે.

બીજી તરફ 2001ની સાલમાં રૂ. 1 કરોડમાં સ્થાવર મિલકત ખરીદી હોય અને 22મી જુલાઈ 2024ના 10.75 કરોડમાં વેચવામાં આવે છે. ઈન્ડેક્સ કોસ્ટને ગણતરીમાં લેતાં તેમાંથી રૂ. 3.63 કરોડ બાદ કરતાં લાંબા ગાળાનો મૂડી નફો રૂ. 7.12 કરોડનો થાય છે. તેના પર તેણે 20 ટકા લેખે રૂ. 1,42,40,000 ભરવાના થાય છે પરંતુ આ જ મિલકત પહેલી ઓગસ્ટ 2024ના વેચવામાં આવે તો તેણે રૂ. 10.75 કરોડની મળેલી કિંમતમાંથી ખરીદકિંમત રૂ. 1 કરોડની બાદ કરી દેવામાં આવે તો તેના પર રૂ. 9.75 કરોડનો મૂડી નફો થાય છે. આ સ્થિતિમાં કરદાતાએ 12.5 ટકા લેખે 1,21,87,500નો એલટીસીજી ભરવાની નોબત આવે છે. આ સ્થિતિમાં રૂ. 20.5 લાખની આવકવેરાની ચોખ્ખી બચત થાય છે. ગિરીશ આહુજાનું કહેવું છે કે, “ઈન્ડેક્સેશન કાઢી નાખવાને કારણે અને લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન 12.5 ટકા કરી દેવાને પરિણામે પ્રોપર્ટીના સોદા ઓન મનીથી કરવામાં આવતા હતા તે બંધ થઈ જવાની સંભાવના છે. હવે તમામ સોદાઓ વાઈટ મનીથી જ થશે. બ્લેક મનીનું ચલણ પ્રોપર્ટી માર્કેટમાંથી ઓછું થઈ જશે.”

ગિરીશ આહુજા તેનું પણ ઉદાહરણ આપે

01

શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 15 ટકાથી વધારીને આ પરસના બજેટમાં 20 ટકા કરી દેવામાં આવ્યો છે.



02

પહેલી જાન્યુઆરી 2025થી નવી જોગવાઈ અમલમાં આવી જશે

03

લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ગણવા માટે નવી અને જૂની બંને સિસ્ટમ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો

04

ટીડીએસના ક્વાર્ટર્લી સ્ટેટમેન્ટ હોય તેમાં માત્ર 6 વર્ષ સુધી જ કરેક્શન કરવાની છૂટ આપવામાં આવશે


05

અત્યાર સુધી માત્ર મોટરની ખરીદી પર ટીસીએસની લાગતી જોગવાઈ કઈ વસ્તુઓ પર લાગશે તેની જાહેરાત કરાશે




ટીડીએસ-ટીસીએસ રિટર્નમાં કરેક્શનની મર્યાદા ઘટાડી

ટીડીએસ અને ટીસીએસના સ્ટેટમેન્ટ ત્રિમાસિક ધોરણે જમા કરાવતા હતા. આ સ્ટેટમેન્ટમાં 15-15 વર્ષ સુધી કરેક્શન કરવામાં આવી રહ્યાં છે. ટીસીએસનાં ક્વાર્ટર્લી સ્ટેટમેન્ટ હોય કે પછી ટીડીએસનાં ક્વાર્ટર્લી સ્ટેટમેન્ટ હોય તેમાં માત્ર 6 વર્ષ સુધી જ કરેક્શન કરવાની છૂટ આપવામાં આવશે. તેમાં હવે પછી 6 વર્ષથી આગળના ગાળામાં કરેક્શન કરી શકાશે જ નહિ. ખોટો ટીસીએસ અને ખોટો ટીડીએસ કર્યા હોવાનું જણાવીને 15-15 વર્ષ સુધી કરેક્શન કરવામાં આવતાં હતાં. 26એએસમાં રિફલેક્ટ નથી થતો તેવું કારણ આગળ કરીને તેમાં ફેરફાર કરતાં રહેતા હતા. તેના પર હવે બ્રેક લાગી જશે. આ પદ્ધતિમાં અત્યાર સુધી ચાલતી આવતી ગેરરીતિઓ અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.



છે, “2001 પહેલાં જમીન ખરીદી હોય કે 2020 પહેલાં જમીન ખરીદી હોય તેમને ઓછા દરે જમીન મળેલી છે, પરંતુ કોવિડ પછી જમીનના ભાવ સાતમે આસમાને પહોંચી ગયા છે. આ ગાળામાં કોઈએ રૂ. 10 લાખમાં મિલકતની ખરીદી કરી હતી. પહેલી એપ્રિલ 2001ના તેનું મૂલ્ય પણ 10 લાખ જ હતું. આજે તે મિલકતના ભાવ વધીને રૂ. 10 કરોડ થઈ ગયા છે. હવે રૂ. 10 કરોડ પર ઈન્ડેક્સેશન

ગણ્યા પછી લોન્ગ ટર્મ કેપિટલ ગેઈનમાં 36.30 લાખ બાદ મળી રહ્યા છે. તેના પર 3.63 ટકાનો ઈન્ડેક્સેશનનો લાભ મળી રહ્યો છે. હવે બાકીની રકમ પર 20 ટકાના દરે લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ભરવો પડી શકે છે. આમ રૂ. 9.54 કરોડ પર 20 ટકાના દરે લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ભરવાનો આવે તો અંદાજે રૂ. 1.95 કરોડ વત્તા સરચાર્જ અને એજ્યુકેશન સેસ ચૂકવવાં પડશે. હવે સુધારેલા નિયમ હેઠળ તેમણે રૂ. 9.54 કરોડના કેપિટલ ગેઈન પર 12.5 ટકાના દરે 95.48 લાખ વત્તા સરચાર્જ અને એજ્યુકેશન સેસ ચૂકવવાનાં આવશે. આમ તેમને તેનાથી લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં અંદાજે સીધો 90 લાખનો ઘટાડો આવી જાય છે. તેથી ઘણા લોકો નવા સુધારાથી ખુશ છે. હવે સ્ટેમ્પ ડ્યૂટીની વેલ્યુ પર કે તેનાથી વધુની કિંમત પર વેચો તમારે 12.5 ટકા લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો જ પડશે. માત્ર 12.5 ટકા ચૂકવીને તમારા વાઈટનાં નાણાં વધી રહ્યાં છે. હા, તેના પર સરચાર્જ અને એજ્યુકેશન સેસ ચૂકવવાં પડશે. તેનાથી કેટલાકને



**આપકપેરા
દિર્ઘના નવા
શિજિમમાં જ પધુ
લાભ આપીને કલદાતાઓને
નવા શિજિમ તરફ લઈ
જવાનો પ્રયાસ કર્યો**



મૅન્યુફેક્ચરિંગ કંપનીઓને 15 ટકા ટેક્સની વ્યવસ્થાનો લાભ બંધ કર્યો

હા, માત્ર 15 ટકા ટેક્સ ભરીને અન્ય જવાબદારીમાંથી મુક્તિ મેળવી લેનારી મૅન્યુફેક્ચરિંગ કંપનીઓ માટેની જોગવાઈનો અમલ પૂરો થવાનો સમય 31મી માર્ચ 2024નો હતો. આ સનસેટ ટાઈમ લંબાવી નથી આપવામાં આવ્યો તે એક દુઃખદાયક બાબત છે, પરંતુ સરકારનું માનવું હતું કે આ એક્સટેન્શન આપવામાં આવશે તો નવા ઉદ્યોગની સ્થાપના કરવા પર બ્રેક લાગી જશે. વચગાળાનું બજેટ ફેબ્રુઆરી 2024માં રજૂ કરવામાં આવ્યું ત્યારે આ રજૂઆત કરવામાં આવી હતી. તે રજૂઆતને 2024-25ના સંપૂર્ણ બજેટમાં પણ ધ્યાનમાં લેવામાં આવી નથી. તેથી 31મી માર્ચ 2024 પછી નવી મૅન્યુફેક્ચરિંગ કંપની ચાલુ કરનારાઓએ 22 ટકા ટેક્સ અને સરચાર્જ ભરવો પડશે. તેમને 15 ટકા ટેક્સની સુવિધાનો લાભ મળશે જ નહિ. સરકારે આ લાભ હજી એક બે વર્ષ સુધી લંબાવવો જોઈતો હતો, કારણ કે સહકારી સોસાયટીઓને તો તેનો લાભ માત્ર એક જ વર્ષ માટે મળ્યો છે. મૅન્યુફેક્ચરિંગ કંપનીઓને 15 ટકા ટેક્સ ભરીને અન્ય જોગવાઈઓમાંથી મુક્તિ આપવાની જોગવાઈને આગામી વર્ષમાં ચાલુ રાખવામાં આવશે કે નહિ તે નિશ્ચિતતાથી કહી શકાય તેમ નથી, પરંતુ જો સરકાર તેમને 15 ટકા ટેક્સની જોગવાઈનો લાભ આપવાનું ચાલુ રાખશે તો તે સૌના હિતમાં હશે તેટલું કહી શકાય તેમ છે.



ફાયદો થશે અને કેટલાકને નુકસાન પણ થશે. જૂની મિલકત પર 20 ટકાનો દર નુકસાનકારક સાબિત થતો હતો. 12.5 ટકામાં તેમને ફાયદો થશે. પહેલાં વાર્ષિકનાં નાણાં બતાવવા માટે 20 ટકા ચૂકવવા પડતા હતા. આમ 12.5 ટકામાં તમારી નવી મૂડી બની રહી છે.” મોટા ભાગના કિસ્સાઓમાં 20 ટકા એલટીસીજીને કારણે વધુ ભારણ આવતું હતું. નવી વ્યવસ્થામાં એલટીસીજીનું ભારણ ઘટી રહ્યું છે. અલબત્ત, તેના પર સ્ટેમ્પ ડ્યૂટી વધારે ચૂકવવી પડશે તે પણ નિશ્ચિત જ છે, પરંતુ આ નાણાં કાયદેસર શેરબજારમાં ઈન્વેસ્ટ કરવાનો ઓપ્શન મળી જશે. તેમાંથી પણ તગડી કમાણી કરવાનો રસ્તો ખૂલી રહ્યો છે.

પરંતુ 2001માં સોનું ખરીદીને રાખી મૂકનારાઓ આ નવી જોગવાઈને કારણે અત્યંત નારાજ થયેલા છે, કારણ કે તેમને માથે લોન્ગ ટર્મ કેપિટલ ગેઈનની મોટી જવાબદારી આવી રહી છે. પહેલી એપ્રિલ 2001ના અરસામાં દસ ગ્રામ સોનાનો ભાવ રૂ. 4700ની આસપાસનો હતો. આજે દસ ગ્રામ સોનાનો ભાવ રૂ. 74000થી 76000ની આસપાસનો છે. તેથી 23 વર્ષ પહેલાં સોનું ખરીદીને આજે વેચનારાઓને લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન તરીકે મોટી રકમ ચૂકવવી પડે તેમ હોવાથી તેઓ સહજ નારાજ છે. તેના પર તેમણે 12.5 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે. તેમને 10 ગ્રામ સોના પર રૂ. 70000નો કેપિટલ ગેઈન થાય છે તેમ ગણી લઈએ. તેના પર તેમણે કેપિટલ ગેઈન તરીકે રૂ. 8750 ચૂકવવા પડશે. સો ગ્રામ સોના પર આ ટેક્સની જવાબદારી 87,500ની થઈ જશે. આમ તેમણે દસ ગણો ટેક્સ કેપિટલ ગેઈન પેટે ચૂકવવો પડી રહ્યો હોવાથી તેઓ નારાજ થઈ રહ્યા છે.

જોકે જમીન કે મકાનની બાબતમાં કલમ 54 અને 54 (એફ)નો લાભ ગણ્યો જ ન હોવાથી કેટલાક નવી જોગવાઈ ઉચિત ન હોવાનું જણાવે છે. તેનો જવાબ આપતાં ગિરીશ આહુજા કહે છે, “તમે જમીન રૂ. 2 કરોડમાં ખરીદી છે. તેની ઈન્ડેક્સેશન પ્રમાણેની કિંમત રૂ. 3 કરોડ થાય છે. આ જમીન રૂ. 5 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી વેલ્યુ પર તમે વેચી દીધી. આ સ્થિતિમાં કેપિટલ ગેઈન રૂ. 2 કરોડનો થશે. પાંચ કરોડની વેચાણકિંમતમાંથી ઈન્ડેક્સેશન સાથેની રૂ. 3 કરોડની કિંમતની બાદબાકી કરી નાખો. આ સંજોગોમાં રૂ. 2 કરોડનો કેપિટલ ગેઈન ટેક્સ થશે. કલમ 54નો લાભ લેવા માટે તમે રૂ. 2 કરોડનું જ રોકાણ કરી શકો છો. આમ તમે રૂ. 2 કરોડ પડતર કિંમતના અને રૂ. 1 કરોડ ઈન્ડેક્સેશનના મળીને રૂ. 3 કરોડ ઘરે લઈ જાવ છો. હવે કેપિટલ ગેઈન 3 કરોડ ગણાશે. ત્રણ કરોડ ઓછા વ્યાજદરે રોકવા પડશે. ઘરે માત્ર તમે કરેલા રોકાણની પડતર કિંમત જ લઈ જઈ શકશો. ત્રણ કરોડ પૂરા રોકાણો તો જ તમને કલમ 54ની જોગવાઈનો પૂરો લાભ મળશે. આમ કલમ 54નો લાભ લેવા માટે કેપિટલ ગેઈનની સંપૂર્ણ રકમને રોકવી પડશે, કારણ કે કલમ 54માં માત્ર ને માત્ર કેપિટલ ગેઈનની રકમને ગણતરીમાં લેવામાં આવી છે. તેથી કલમ 54નો લાભ લેવામાં નુકસાન થશે. હા, તેની સામે કલમ 54(એફ)




ભાગીદારી પેઢીની બાદબાકી કેમ?

હા, માત્ર એક જ ક્ષેત્રને નવા રિજિમમાં સમાવાયું નથી તેમાં ભાગીદારી પેઢીઓનો સમાવેશ થાય છે. કંપની, કો-ઓપરેટિવ સોસાયટી, વ્યક્તિગત કરદાતા કે હિન્દુ અવિભક્ત પરિવાર, એસોસિયેશન ઓફ પરસન અને બીઓઆઈ માટે નવા રિજિમની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ ભાગીદારી પેઢી માટે નવા રિજિમની વ્યવસ્થા કેમ નથી કરવામાં આવી તે એક મોટી વાત છે. આજકાલ લોકો એલએલપી અને ભાગીદારી પેઢીમાં જ વધુ બિઝનેસ કરતા થયા છે. ભાગીદારી પેઢી માટે ટેક્સનો સ્લેબ 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરી દેવો જોઈએ અને તેમના પરનો સરચાર્જ પણ ઘટાડી દેવો જોઈએ. કદાચ ફેબ્રુઆરી 2025માં આવનારા બજેટમાં ભાગીદારી પેઢી માટે પણ નવું રિજિમ લાગુ કરી દેવામાં આવશે. તેમાં પણ કોઈ ડિડક્શન ન મળતાં મોટું નુકસાન જવાની શક્યતા નથી. ભાગીદારી પેઢીને 80-સી કે 80 ડીના લાભ મળતા નથી. તેમને તો માત્ર 80 આઈએ અને 80 આઈબી સહિતની કલમોના લાભ આપવામાં આવી રહ્યા છે. ભાગીદારી પેઢીને પણ નવા રિજિમનો લાભ આપવામાં આવશે.

ડિબેન્યર, ગોલ્ડ, બૉન્ડ પર લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ગણવાનો 36 મહિનાથી ઘટાડીને 24 મહિનાનો કરી દેવામાં આવ્યો

ભાગીદારી પેઢી માટે ટેક્સનો સ્લેબ 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરી દેવો જોઈએ અને તેમના પરનો સરચાર્જ પણ ઘટાડી દેવો જોઈએ




**આપકપેરા
રિટર્નના નવા
રિજિમમાં જ વધુ
લાભ આપીને કરદાતાઓને
નવા રિજિમ તરફ લઈ
જવાનો પ્રયાસ કર્યો**

નો ઉપયોગ કરનારાઓને ફાયદો મળશે. કલમ 54(એફ)નો લાભ લેવા ઈચ્છનાર જમીન વેચીને રહેઠાણની મિલકતની ખરીદી કરે તો તેને વધુ લાભ થાય છે. તમારો કેપિટલ ગેઈન રૂ. 2 કરોડનો હતો અને તમે પૂરા રૂ. 5 કરોડ રોકી દીધા તો તમને બે કરોડનો ફાયદો મળતો હતો. હવે રૂ. 5 કરોડ મકાનમાં રોકી દેવામાં આવે તો કેપિટલ ગેઈન રૂ. 3 કરોડનો મળશે. આમ કલમ 54(એફ) ફાયદાકારક બની ગઈ છે. આમ રૂ. 5 કરોડ હાઉસિંગ પ્રોપર્ટીમાં લગાવી દેવાથી રૂ. 3 કરોડનો કેપિટલ ગેઈનનો લાભ મળી રહ્યો છે. કલમ 54(એફ)માં રોકાણ કરનારા મોટા ભાગનાને ફાયદો થવાની શક્યતા રહેલી છે. હા, કેટલાક અપવાદરૂપ કિસ્સાઓમાં નુકસાન પણ થઈ શકે છે.”

હવે કલમ 54ઈસીની વાત કરીએ. 54ઈસીમાં રોકાણ કરનારાઓને 5.25 ટકા વ્યાજ મળે છે. તેની સામે બજારમાં 8થી 10 ટકાનો ગેઈન મળતો હોય તેવા સંજોગોમાં 54ઈસી હેઠળ રોકાણ કરવાનું બહુધા લોકો પસંદ કરશે નહિ. કલમ 54-ઈસી હેઠળ મહત્તમ રોકાણ 50 લાખનું કરી શકાય છે. તેમાં વળી 5 વર્ષનો લોક ઈન પિરિયડ પણ લાગુ

પડે છે. તેથી કેપિટલ ગેઈન અંગે નિર્ણય લેતાં પહેલાં બારીકાઈને જોઈ પરખીને નિર્ણય લેવાનો રહેશે, કારણ કે 23મી જુલાઈ પહેલા શર્સ વેચનારે લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન પેટે 20 ટકા ચૂકવવાના આવશે, જ્યારે 23મી જુલાઈ પછી શર્સ વેચનારે લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન પેટે 12.5 ટકા ચૂકવવાના આવશે. આમ તમને પોતાને જે ફાયદાકારક લાગતો હોય તે જ નિર્ણય લેવો જોઈએ. નુકસાન થતું હોય તેનાથી દૂર રહેવું જોઈએ. હા, કેપિટલ ગેઈનમાં એક્ઝમ્પ્શનની લિમિટ પહેલાં રૂ. 1 લાખની હતી તે હવે વધારીને રૂ. 1.25 લાખ કરી દેવામાં આવી છે. તેને કારણે નાની મિલકત વેચનારાઓને થોડો ફાયદો મળી શકશે. મોટા રોકાણકારોને કે મોટી પ્રોપર્ટીની લે-વેચ કરનારાઓને 10 ટકા કે 12.5 ટકાને કારણે બહુ મોટો ફેર પડતો હોય તેવું જણાતું નથી.



**લાગીદારી પેઠીઓ માટેની
પગારની મર્યાદા વધારી**

હવે પાર્ટનરશિપ ફર્મની વાત કરીએ. તેમાં પગાર મળે છે. હા, કલમ 40 (બી) હેઠળ તેમાં પગારની મર્યાદા મૂકવામાં આવેલી છે. પહેલાં ત્રણ લાખ પર 90 ટકા અથવા 1.5 લાખ, બેમાંથી જે વધુ હોય તે આપવામાં આવે છે. બાકીની આવક પર 60 ટકા પગારની મર્યાદા મૂકવામાં આવી હતી. આ ત્રણ લાખની મર્યાદા વધારીને છ લાખ કરી આપવામાં આવી છે. પહેલાં છ લાખ પર 90 ટકા અથવા ત્રણ લાખ જે વધુ હોય તે આપવાની જોગવાઈ લાવવામાં આવી છે. બાકીની આવક પર 60 ટકાની જોગવાઈ રાખી છે. આમ થોડી પગારમર્યાદા વધારી આપવામાં આવી છે.

બિનનિવાસી ભારતીયોને ફાયદો કરાવ્યો

હા, ભારત સરકારના એલટીસીજી અંગેના નિર્ણયથી બિનનિવાસી ભારતીયો-એનઆરઆઈ-નોન-રેસિડન્ટ ઈન્ડિયન્સ બહુ જ ખુશ છે. બિનનિવાસી ભારતીય પાસે અમદાવાદમાં એક મિલકત છે. તેઓ બીજી મિલકત ખરીદવા જ નથી માગતા. તેમને લાગતું હતું કે તેમણે અગાઉ ખરીદેલી મિલકત પર થયેલા નફા પર 20 ટકા લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડે છે તે બહુ જ મોટી રકમ છે, પરંતુ હવે તેમણે 12.5 ટકા જ ચૂકવવા પડશે. આ નાણાં કદાચ ઈન્વેસ્ટમેન્ટ વિના ચૂકવવા પડશે. તેઓ નફાના તે પૈસા વિદેશ પણ લઈ જઈ શકશે, કારણ કે દર વર્ષે કાયદાકીય જોગવાઈ હેઠળ એક અબજ ડોલર દેશની બહાર લઈ જવાની તેમને છૂટ છે. આમ કેપિટલ ગેઈનમાં કોઈકને લાભ તો કોઈકને નુકસાન થયું છે. હા, જે મિલકતમાલિકોને ઈન્વેસ્ટમેન્ટને કારણે કેપિટલ ગેઈનમાં લાભ મળતો હતો તેઓ આ જોગવાઈથી નારાજ થયેલા છે. આ બધી જ જોગવાઈ કલમ 242 સાથે વંચાણે લેવાતી કલમ 111એ, 112 અને 112એ હેઠળ કરેલી છે.



જૂની રિટર્ન સિસ્ટમ વિદાય લેશે, નવી પર કરદાતાને ખેંચી જશે

કરદાતા માટેની જૂની રિટર્ન સિસ્ટમ વિદાય લેશે એમ બધા જ કહેતા હતા. કલમ 80 C હેઠળ મળતા લાભ કરદાતાઓ જતાં કરવા માગતા નથી. છતાં સરકાર આ બાબતમાં મક્કમ રહી હોવાથી આવનારા વર્ષોમાં કમને તે સ્વિકારવી પડશે. દેશમાં એવા સંખ્યાબંધ કરદાતાઓ છે જેઓ કલમ 80સી રૂ. 1.5 લાખ કે 80 ડી હેઠળ નાના કરદાતા રૂ. 25000 અને સિનિયર સિટિઝન રૂ. 50,000નો એડવાન્ટેજ મેળવે છે. તેમને ખબર છે કે તેઓ ગેરકાયદે ઈન્વેસ્ટમેન્ટ બતાવીને વેરામાંથી રકમ બાદ મેળવી રહ્યા છે, કારણ કે 98 ટકા રિટર્નની સ્ક્રુટિની થતી જ નથી. તેથી ખોટો બેનિફિટ લઈને નીકળી જાય છે, કારણ કે 80સી અને 80ડીના ઈન્વેસ્ટમેન્ટના કોઈ પુરાવા જ આપવા પડતા નથી.

ગિરીશ આહુજા કહે છે, “બીજું હાઉસ રેન્ટ અલાવન્સના 70 ટકા ક્લેઈમ બોગસ છે. કેટલાક કરદાતાઓ તેમના પિતાને, તેમની માતાને, તેમના ભાઈને કે પછી કેટલાક તો તેમની પત્નીને હાઉસ રેન્ટ ચૂકવતા હોવાનું બતાવી રહ્યા છે. કોર્ટનાં બે જજમેન્ટ છે તેમાં તમે તમારી પત્નીને ભાડું ચૂકવીને તે આવકમાંથી બાદ મેળવી શકો છો. પગારદારો ડોનેશન પણ ઘણું આપે છે. આ ડોનેશન પણ બોગસ જ છે. તેથી જ ટેક્સ રિટર્નની નવી સિસ્ટમ લાવવામાં આવી રહી છે. જૂની સિસ્ટમને અલવિદા કરવામાં આવી રહી છે. હજી સરકારમાં જૂની ટેક્સ સિસ્ટમ દૂર કરવાની હિંમત જ નથી. જૂની સિસ્ટમને તેના કુદરતી મૃત્યુ તરફ સરકાર લઈ જવા માગી રહી છે.”

તેથી જ જૂની સિસ્ટમમાં કોઈ પણ એડવાન્ટેજ આપવામાં આવ્યો નથી. જૂની સિસ્ટમમાં કલમ 80સીના એડવાન્ટેજમાં વધારો ન કર્યો. કલમ 80ડીના લાભ ન વધાર્યા. નિર્મલા સીતારમણે બજેટમાં જે એડવાન્ટેજ આપ્યો છે તે માત્ર ને માત્ર નવા રિટર્નની સિસ્ટમમાં જ આપ્યા છે.

તેમાં સૌથી પહેલો એડવાન્ટેજ છે ટેક્સ સ્લેબમાં આપ્યો છે. જૂની સિસ્ટમમાં 0થી 3 લાખની આવક પર કોઈ જ ટેક્સ લેવામાં આવતો નથી. તેમ જ 3થી 6 લાખ આવક પર પાંચ ટકા ટેક્સ લેવાતો હતો. 6થી 9 લાખની આવક પર 10 ટકા, 9થી 12 લાખની આવક પર 15 ટકા અને 12થી 15 લાખની આવક પર 20 ટકા અને 15 લાખથી ઉપરની આવક પર 30 ટકા ટેક્સ લેવામાં આવે છે. આમ જૂના રિટર્ન માટે ટેક્સ સ્લેબમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.

જૂની સિસ્ટમ નાબૂદ કરવામાં આવતો અવરોધ

ગિરીશ આહુજા કહે છે કે, ઓલ્ડ રિજિમને સાવ જ નાબૂદ કરી દેવાની સરકારની હિંમત નથી. તેનુંય કારણ છે. જૂની રિટર્ન સિસ્ટમમાં સેક્શન 10/17 હેઠળ ડિડક્શન આપવામાં આવી રહ્યું છે. તેમાં સંસદસભ્યને કે પછી વિધાનસભ્યને મળતું કોઈ પણ રેઈલી અલાવન્સ એટલે કે રોજનું ભથ્થું અને કોન્સ્ટિટ્યુઅન્સી અલાવન્સ આપવામાં આવે છે તે સંપૂર્ણપણે વેરા માફીને પાત્ર

50 લાખથી વધુની કિંમતની મિલકત પર એક કે 20 ટકાના દરે કરકપાત કરવી ફરજિયાત કરવામાં આવી

TAX



ભારતમાં કૂઝપ્રવાસની આવક પર 20 ટકા ટેક્સ

ગુજરાતીઓ વિદેશ ફરવા જાય છે. તેમાંય ખાસ કરીને કૂઝમાં પ્રવાસ કરવા બહુ જ જાય છે. સરકાર ઈચ્છે છે કે કૂઝનો પ્રવાસ કરવા ભારતીયો દેશની બહાર ન જાય. તેને માટે વેરામાં એનઆરઆઈને લાભ આપવાની જોગવાઈ બજેટના માધ્યમથી કરવામાં આવી છે. તેઓ કૂઝ ભારતમાં લાવીને તેના પર આવક કરે તો તે આવક પર 20 ટકાના દરે જ વેરો વસૂલવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. તેને કોઈ ડિડક્શન આપવામાં આવશે નહિ તેમ જ તેને કોઈ ખર્ચ પણ બાદ આપવામાં આવશે નહિ. તેમણે કુલ આવક પર માત્ર 20 ટકાના દરે ટેક્સ ભરી દેવો પડશે. તેને માટે નવી કલમ 44 (બીબી) (સી) દાખલ કરવામાં આવી છે. તેનો લાભ એનઆરઈને જ આપવામાં આવશે. ભારતીયો કૂઝની વ્યવસ્થા કરે તો તેમને આ લાભ આપવામાં આવશે નહિ.



ગણવામાં આવ્યું છે. નવી રિટર્ન સિસ્ટમમાં આવે તો તેમને આ ભથ્થું જરાય બાદ મળતું નથી. સંસદસભ્યો અને વિધાનસભ્યોને ટેક્સ ચૂકવવો પસંદ ન હોવાનો નિર્દેશ તેના પરથી મળી રહ્યો છે. અમે જ કાયદો બનાવનારા છીએ. અમે કેમ ટેક્સ ભરીએ. તેથી જ કલમ સેક્શન 10/17 જૂની રિટર્ન સિસ્ટમમાંથી પણ હટાવવી પડશે. આ કલમ હટાવવાની હિમ્મત સરકાર નહિ કરે ત્યાં સુધી જૂની રિટર્ન સિસ્ટમ ચાલુ જ રહેશે. આમ જૂની રિટર્ન સિસ્ટમ કરતાં નવી રિટર્ન સિસ્ટમમાં એડવાન્ટેજ વધારે આપવામાં આવી રહ્યો છે.

જેમની આવક રૂ. 2 કરોડ કે રૂ. 5 કરોડથી વધારે છે તેમને પણ ફાયદો થઈ રહ્યો છે. તેમની પાસેથી લેવાતો સરચાર્જ 37 ટકાથી ઘટાડીને 25 ટકા કરી દેવામાં આવ્યો છે. પરિણામે આ આવકના સ્લેબમાં આવતા કરદાતાઓ એકદમ ખુશ છે. શેરબજારમાંથી થતી કમાણી પર 15 ટકા સરચાર્જ લેવામાં આવી રહ્યો છે. શેરબજારમાં સરચાર્જ 15 ટકા છે, પરંતુ તેને કારણે બાકી આવક વધી જાય છે. તેના પરનો આવકવેરો ચૂકવવાનો આવે છે. તેના પર સરચાર્જ 37 ટકા ભરવાનો થતો હતો. હવે તેમણે સરચાર્જ 25 ટકા જ ચૂકવવો પડશે.

10 ટકા ટીડીએસ કરવો પડશે

પરંતુ એક તકલીફ ઊભી કરી દીધી છે. આવકવેરાના કાયદાની નજરમાં પેઢી કરતાં ભાગીદાર અલગ જ હસ્તી ગણાય છે. તેમાં ભાગીદારને કંપનીના માલિક ગણવામાં આવતા નથી. તેમને કર્મચારી નથી ગણવામાં આવતા તો માલિક પણ ગણવામાં આવતા નથી, પરંતુ પાર્ટનરશિપ એક્ટમાં આ પ્રકારની જોગવાઈ નથી. કલમ 45(3) હેઠળ ભાગીદારી પેઢીમાં કોઈ પણ મૂડી ઉમેરવામાં આવે તો ભાગીદારને ટેક્સ ભરવો પડતો હતો. કલમ 45(4) ભાગીદારી ડિઝોલ્વ કરવામાં આવે ત્યારે જે રકમ આપવામાં આવે તેના ટ્રાન્સફર ગણવામાં આવે છે. હવે ભાગીદારી પેઢીમાં પગાર લેશો અને મૂડી પરનું વ્યાજ પણ લેશો તો તેના પર ટીડીએસ કરવાની જોગવાઈ દાખલ કરી દેવામાં આવી છે. તેમણે આ માટે બજેટમાં કલમ 194(ટી) કાઢી નાખી છે, કારણ કે કલમ 192 હેઠળ આ લાભ મેળવી શકાતા નહોતા. તેમાં કંપનીના માલિક અને કંપનીના કર્મચારીના સંબંધ હોવા જરૂરી હતી. કલમ 194(ટી) માં કંપનીના માલિક અને કંપનીના કર્મચારીનો સંબંધ હોવો જરૂર નથી. પરિણામે હવેથી ભાગીદારી પેઢીના માલિકો જે રકમ પગાર તરીકે લેશે અને જે રકમ મૂડી પરના વ્યાજ તરીકે લેશે તેના પર 10 ટકાના દરે કરકપાત-ટેક્સ ડિડક્શન

એટ સોર્સ કરવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. આ રકમ આવકવેરા ખાતામાં જમા કરાવી દેવી પડશે. ટીડીએસ પેમેન્ટ કરતી વેળાએ જ કે પછી કેડિટ આપતી વેળાએ જ કરવો પડશે. પેમેન્ટ કે કેડિટ આપવામાં આવે, તેમાંથી જેનો સમયમાં જે વહેલો આવ્યો હોય ત્યારે તે આપવું પડશે. હવે ભાગીદારો પગાર કેવી રીતે લઈ શકશે અને તેના પર આ ટીડીએસ કઈ રીતે કરવામાં આવશે તે સ્પષ્ટ થવું જરૂરી છે. તેમાં લગાવેલી મૂડી પર બાર ટકાના દરે લગાવવામાં આવતું વ્યાજ તો વર્ષના અંતે પણ આપી શકાશે. કેટલાક ભાગીદારો પગારનો ખર્ચ વર્ષના અંતે દર્શાવે છે. ત્યાર બાદ કલમ 40(બી) ની જોગવાઈ પ્રમાણે ગણતરી નક્કી કરીને પગાર



નક્કી કરે છે. તેઓ વર્ષ દરમિયાન પગાર ન લેતા હોવાનું દર્શાવે છે. દર મહિને ભાગીદારો કેપિટલ અકાઉન્ટમાંથી ચોક્કસ રકમનો ઉપાડ કરતા રહે છે. હા, સરકાર માને છે કે પગાર તો દર મહિને થવો જોઈએ. હવે કેપિટલ અકાઉન્ટમાંથી કરવામાં આવતા ઉપાડને પગાર પેટે ઉપાડવામાં આવે છે કે અન્ય સ્વરૂપે તે પણ દર્શાવવું પડશે. આ ઉપાડ પગાર તરીકે કરવામાં આવ્યો હશે તો તેના પર પણ 10 ટકાના દરે ટીડીએસ કરવો પડશે. તેથી હવે કલમ 194(ટી)ની જોગવાઈ હેઠળ દરેક ઉપાડ પર દસ ટકા ટીડીએસ ફરજિયાત કાપવો જ પડશે. પગાર અને વ્યાજના ઉપાડ બંને માટે આ જોગવાઈ લાગુ કરી દેવામાં આવી છે.



પરિણામે કેટલાક ભાગીદારો પગાર લેવાનું જ બંધ કરી દેશે. પગાર લેશે તો પણ 30 ટકાના દરે ટેક્સ લાગશે અને ભાગીદારી પેઢીની આવક તરીકે દર્શાવવામાં આવશે તો પણ તેના પર 30 ટકાના દરે જ ટેક્સ ચૂકવવો પડશે. તેના પર સરચાર્જ પણ ચૂકવવો પડે જ છે. તેથી તેઓ પગાર લેવાનું બંધ કરી દે તેવી શક્યતા છે. તેઓ નફાનો હિસ્સો લેવાનું પસંદ કરશે. નફાનો હિસ્સો તો પૂરો માફ છે, પરંતુ કેટલાક ભાગીદારો ચોક્કસ કારણોસર પગાર લેવાનું પસંદ કરે છે. તેમના પગાર અલગ હશે અને નફાનો હિસ્સો પણ અલગ હશે. તેમાં વ્યક્તિએ વ્યક્તિએ અલગ ગણિતો બેસાશે. હવે એલએલપી સહિતની દરેક કંપનીઓએ કે ભાગીદારી પેઢીએ પગારનું કે વ્યાજનું ચુકવણી કરતી વખતે 10 ટકાના દરે ટીડીએસ ફરજિયાત કરવો જ પડશે.

શૈક્ષણિક સંસ્થાઓને બિઝનેસ કરવાની છૂટ આપી દીધી

કલમ 47, ક્લોઝ થ્રીના માધ્યમથી બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ અત્યંત મહત્વની છે. કેપિટલ એસેટ્સના ટ્રાન્સફરને લગતી આ કલમ છે. એસેટ્સ ગિફ્ટ તરીકે કેપિટલ એસેટ્સ આપવામાં આવે કે પછી કોઈ ઈરિવોકેબલ ટ્રસ્ટને આપવામાં આવે અથવા તો વસિયત કરીને આપવામાં આવે તો તેને ટ્રાન્સફર નથી ગણવામાં આવતું. તેના પર ટેક્સ નથી લાગતો, પરંતુ આ સંદર્ભમાં કોર્ટના બે ચુકાદાઓ આવી ગયા છે. એક ટ્રસ્ટે અન્ય કોઈને કેપિટલ એસેટ્સ ગિફ્ટ કરી કે પછી કોઈ કંપનીએ અન્ય કંપનીને કેપિટલ એસેટ્સ ગિફ્ટ કરી તો તેને ટ્રાન્સફર ગણવામાં આવશે નહિ. તેના પર કોઈ જ ટેક્સ લાગી શકે નહિ તેવો કોર્ટનો ચુકાદો આવ્યો. સરકારે આ ચુકાદાને અસરહીન કરી દેવા માટે કાયદો જ બદલી નાખ્યો છે.

હવે સરકારે એવી જોગવાઈ કરી કે ગિફ્ટ તરીકે કે વસિયતથી કોઈ વ્યક્તિગત કરદાતા, હિન્દુ અવિભક્ત પરિવાર કે પછી ઈરિવોકેબલ ટ્રસ્ટ અથવા તો ટ્રસ્ટ દ્વારા અથવા તો વસિયતનામું કરીને અન્ય રીતે કેપિટલ એસેટ્સ ટ્રાન્સફર કરવામાં આવે તો તેવા સંજોગોમાં તેને ટ્રાન્સફર ગણવામાં આવશે નહિ, પરંતુ એક કંપની બીજી કંપનીને કેપિટલ એસેટ્સ ટ્રાન્સફર કરશે તો તેને ટ્રાન્સફર ગણવામાં આવશે. તેને માટે નવી કલમ 47(30) ઉમેરવામાં આવી છે.

અહીં એક વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે. ત્રણ વર્ષ પહેલાં કલમ 10 (23) (સી) અને કલમ 11 (12)માં કોઈ ફરક જ નહોતો. તમે કલમ 11 (12)માં તમે 9-એ ફાઈલ કરી શકો છો. કલમ 10(23)માં 9-એ ફાઈલ કરી શકાતા નથી. કલમ



ભાગીદારી પેઢીને નવી રિટર્ન સિસ્ટમનો લાભ મળશે

હા, માત્ર એક જ ક્ષેત્રને નવા રિજિમમાં સમાવાયું નથી. તેમાં ભાગીદારી પેઢીઓનો સમાવેશ થાય છે. કંપની, કો-ઓપરેટિવ સોસાયટી, વ્યક્તિગત કરદાતા કે હિન્દુ અવિભક્ત પરિવાર, એસોસિયેશન ઓફ પરસન અને બીઓઆઈ માટે નવા રિજિમની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ ભાગીદારી પેઢી માટે નવા રિજિમની વ્યવસ્થા કેમ નથી કરવામાં આવી તે એક મોટી વાત છે. આજકાલ લોકો એલએલપી અને ભાગીદારી પેઢીમાં જ વધુ બિઝનેસ કરતા થયા છે. ભાગીદારી પેઢી માટે ટેક્સનો સ્લેબ 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરી દેવો જોઈએ અને તેમના પરનો સરચાર્જ પણ ઘટાડી દેવો જોઈએ. કદાચ ફેબ્રુઆરી 2025માં આવનારા બજેટમાં ભાગીદારી પેઢી માટે પણ નવું રિજિમ લાગુ કરી દેવામાં આવશે. તેમાં પણ કોઈ ડિડક્શન ન મળતાં મોટું નુકસાન જવાની શક્યતા નથી. ભાગીદારી પેઢીને 80-સી કે 80 ડીના લાભ મળતા નથી. તેમને તો માત્ર 80 આઈએ અને 80 આઈબી સહિતની કલમોના લાભ આપવામાં આવી રહ્યા છે. ભાગીદારી પેઢીને પણ નવા રિજિમનો લાભ આપવામાં આવશે.



વિવાદ સે વિશ્વાસ: વ્યાજ-દંડ પિના ટૅક્સ ભરી દો

વિવાદ સે વિશ્વાસની વધુ એક યોજના આપી દેવામાં આવી છે. પહેલા 2020માં વિવાદ સે વિશ્વાસની યોજના આપવામાં આવી હતી. વિવાદ સે વિશ્વાસમાં તમારી સામેના કાયદાની કોર્ટમાં કરેલા કેસ ખતમ કરાવી દેવાની જ વાત કરવામાં આવી છે. તેને માટે તમારે ભરવાપાત્ર ટેક્સ જ ભરી દેવાનો છે. તેના પર વ્યાજ અને પેનલ્ટી ચૂકવવાની આવશે નહિ. આ રીતે સરકાર પેનલ્ટી કેસ ઓછા કરવા માગે છે. તમે ટેક્સ ભરી દો અને કોઈ પણ જાતનો કેસ નહિ કરો તો તમારી સામેના કેસ નીકળી જશે. માત્ર ટેક્સ ભરવાનો જ આવશે. સ્કીમ હવે નોટિફાય કરવામાં આવશે. તેના નિયમો થોડા સમયમાં જાહેર કરી દેવામાં આવશે. તેનાથી સંખ્યાબંધ કેસો ઓછી થઈ જશે. કોર્ટ કેસના ખર્ચા વધી રહ્યા છે. તે પણ સરકારે ઘટાડવો છે. સરકાર પણ બહુ મોટી રકમ આવવાની બાકી છે તેના ખચાલોમાં રાચવાને બદલે જેટલું હાથમાં તેટલું બાથમાંની માનસિકતાથી આ સ્કીમ લાવ્યા છે. વરસો સુધી રિકવરી જ આવતી નથી તે સરકારની મોટી સમસ્યા છે. આ યોજનાનો લાભ લઈ લેવામાં જ માલ છે. સરકારને તેનાથી ફાયદો થાય છે.

10(23)માં અલગ અલગ 23 જોગવાઈ કરવામાં આવેલી છે. તેમાં બહુ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ બે કલમ અલગ અલગ કેમ રાખવામાં આવી છે. આ બે કલમની જરૂર નથી. એક કલમ હટાવી દેવી જોઈએ. ગયા વર્ષે આ કલમ હટાવી નહોતી. આ વખતે એક કલમ હટાવી દેવામાં આવી છે. તેમણે બંને કલમ મર્જ-વિલીન કરી નથી. આપણી પાસે કલમ 10(23) (સી) (3) (આઈ) (એબી) છે. કલમ 10(23) (સી) (3) (આઈ) (એસી) છે. કલમ 10(23) (સી) (3) (આઈ) (એડી) છે. કલમ 10(23) (સી) (3) (આઈ) (એઈ) છે. તેની નીચે ચાર કલમ આઈવી છે, કલમ વી છે. કલમ વીઆઈ છે અને કલમ વીઆઈ (એ) પણ

છે. કલમ (3) આઈવી) શૈક્ષણિક સંસ્થાઓ માટે એટલે કે નફાના હેતુથી ન ચાલતી યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે છે. નફો કરવા માટે નહિ, માત્ર શિક્ષણ આપવા માટે જ આ સંસ્થાઓ ચલાવવામાં આવતી હોવી જોઈ. આ સંસ્થા સંપૂર્ણ ખાનગી માલિકીની હોય કે પછી સરકારનું તેમાં આંશિક મૂડીરોકાણ હોય તો તેને વેરામાફીનો લાભ આપવામાં આવ્યો છે. કલમ 3 (આઈએ) (એસી) હેઠળ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટને પણ શિક્ષણ આપવાના હેતુથી હોવાથી અને નફો ન કરવાના હેતુથી સક્રિય થઈ હોવાથી વેરામાફીનો લાભ આપવામાં આવ્યો છે. કલમ (3) (આઈ) (એડી) છે જેમાં રૂ. 5 કરોડથી વધુની આવક ન ધરાવતી

સંસ્થાઓ છે. તેમ જ (3) (આઈ) (એઈ) છે, જેમાં રૂ. 5 કરોડથી વધારેની આવક છે. આ ચાર કલમોમાં જરાય ફેરફાર કર્યો નથી. આ ચાર કલમ એટલે કે આઈવી છે, કલમ વી છે. કલમ વીઆઈ છે અને કલમ વીઆઈ (એ)માં ફેરફાર કરવા માટે મંજૂરી લેવી જરૂરી છે. હવે નવી જોગવાઈ કરીને જણાવી દીધું છે કે પહેલી ઓક્ટોબર 2024 પછી અરજી કરનારાઓને મંજૂરી જ આપવામાં આવશે નહિ. હવે મંજૂરી મળશે જ નહિ તો અરજી કરનારાઓને

10 લાખથી વધુની મૂલ્યની વસ્તુની ખરીદી પર હવે એક ટકો TCS થશે

ટીસીએસનો વ્યાપ વધારીને ઘડિયાળ, દાગીના, ફર્નિચર, જરઝવેરાતના રૂ. 10 લાખથી વધુના રકમ પર વેચાણ કરનાર વેપારીએ ખરીદી કરનાર પાસેથી ટીસીએસની રકમ વસૂલીને સરકારમાં જમા આપવી પડશે. કારની ખરીદી પર એક ટકા ટીસીએસ કરવામાં આવે છે. એ જ રીતે 10 લાખથી વધુની કિંમતની વસ્તુઓની ખરીદી પર એક ટકાના દરે ટીસીએસ કરવો પડશે. વસ્તુની વેચાણ પેટે મળતી રકમ 10 લાખથી વધુની થશે ત્યારે તેને માટે એક ટકા ટીસીએસની જોગવાઈ લાગુ પડશે. તેને માટે આવકવેરા ધારાની કલમ 206 સીમાં સુધારો કરવામાં આવ્યો હોવાનું જણાવતાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સપન વસા કહે છે કે ટીસીએસને પાત્ર કઈ કઈ વસ્તુઓ બનશે તેની યાદી સરકાર નોટિફિકેશનના માધ્યમથી ટૂંક સમયમાં જાહેર કરશે. અત્યાર ટીસીએસ દારૂના વેચાણ, જંગલનાં ઉત્પાદનો, ભંગાર અને દસ લાખથી વધુની કિંમતની મોટર પર જ લેવામાં આવતો હતો. આમ નવા નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણન ટીસીએસનો સ્કોપ વધારી દીધો છે.





મનેકમને 11 (12) (13) હેઠળ જ અરજીઓ પ્રોસેસ કરાવવાની ફરજ પડશે. જૂની મંજૂરીઓ ચાલતી જ રહેશે. પાંચ વર્ષે તેમણે રિન્યુ કરાવવાની નોબત આવશે ત્યારે તેમણે પણ સમગ્ર પ્રક્રિયા કલમ 11 (12) (13) હેઠળ જ કરાવવી પડશે. તેની સાથે પ્રોવિઝોન 2ની જોગવાઈઓ પહેલી ઓક્ટોબર 2024 પછી લાગુ પડે નહિ તેવી જોગવાઈ કરી દેવામાં આવી છે. આમ પહેલી એપ્રિલ 2024 પછી નવી અરજીઓ મંજૂર કરવામાં આવશે જ નહિ. તેથી અરજી કરનારાઓએ કલમ 11 (12) (13) ની જોગવાઈ હેઠળ જ અરજી ફરજિયાત કરવી પડશે. ન્યુ ગ્લોબલ સોસાયટીના સુપ્રીમ કોર્ટના ચુકાદામાં જણાવવામાં આવ્યું છે કે સંસ્થા માત્ર ને માત્ર એજ્યુકેશનના હેતુથી જ ચાલતી હોવી જોઈએ. આ ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું કે તમે તમારી શૈક્ષણિક સંસ્થાનું ઓડિટોરિયમ ભાડે આપો છો તો તે આવકને વેરામાફીના લાભ મળી શકે જ નહિ. તે આવક પર સંપૂર્ણ વેરો ભરવો પડશે, કારણ કે તે ઓડિટોરિયમ તમે બાળકોના હિત માટે આપતા નથી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું તું કે તમે કલ્યાણ કાર્ય કરો તો તે તમારી સંસ્થાના વિદ્યાર્થીઓ માટે જ કરો. અન્ય માટે નહિ. હા, આ રીતે તેમને 11 (12) (13) તરફ ધકેલી દઈને તેમને બિઝનેસ કરવાની છૂટ આપી દીધી છે. ટ્રસ્ટના હેતુની સાથે સાંયોગિક રીતે ભળી જતો હોય તે બિઝનેસ કરી શકશો તેવી છૂટ આપી દેવામાં આવી છે. આ રીતે કલમ 11 (4)માં શૈક્ષણિક સંસ્થાઓને લાવી દેવામાં આવી છે. પરિણામે શૈક્ષણિક સંસ્થાઓ પણ ખુશ થઈ ગઈ છે. 10 (23) (સી)ને વિદાય આપી દેવામાં આવી છે. આ કલમ પહેલી ઓક્ટોબર 2024 પછી અસ્તિત્વમાં રહેશે જ નહિ. આમ શૈક્ષણિક સંસ્થા માટે અરજી કરનારાઓએ કલમ 22 અને કલમ 23ની જોગવાઈ પર નજર નાખવાની ફરજ પડશે નહિ. આ બંને કલમને ભૂલી જાવ. શૈક્ષણિક સંસ્થા માટે નવા નિયમ લાગુ



43 (બી) (એચ)નો અમલ એક વર્ષ મુલતવી ન રાખ્યો

ગિરીશ આહુજાનું કહેવું છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ફોરમમાં 43 (બી) (એચ)ની જોગવાઈનો અમલ એક વર્ષ માટે મુલતવી રાખવાનો નાણામંત્રી નિર્મલા સીતારમણે વાયદો કર્યો હતો, પરંતુ તેનો અમલ મુલતવી રાખવામાં આવ્યો નથી. આ કાયદાને કારણે કરાર કર્યા હોય તો 15 દિવસમાં અને કરાર ન કર્યા હોય તો 45 દિવસમાં પેમેન્ટ ન આપે તો તેનો ખર્ચ રિટર્નમાં મજરે આપવામાં આવશે નહિ. તેમ જ તેના પર વ્યાજ અને પેનલ્ટી પણ લાગુ પડશે. નાણામંત્રીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ફોરમ પરથી આપેલા વાયદાનું પાલન કર્યું નથી.

ટીડીએસ જમા કરાવવા વધુ સમય આપ્યો

સૌથી મોટો લાભ કલમ 276 (બી) હેઠળ આપવામાં આવ્યો છે. ટીડીએસ કરી લેવામાં આવતો હતો. સરકારની તિજોરીમાં મોડી જમા કરાવવામાં આવતો હતો. ટીડીએસની રકમ જમા કરાવવામાં એક, પાંચ કે પંદર કે પછી પચ્ચીસ દિવસનો વિલંબ કરવામાં આવે. સરકાર તરફથી કલમ 276 (બી) હેઠળ કેસ કરી દેવામાં આવતો હતો. આ કેસમાં ઓછામાં ઓછા 3 મહિના અને વધુમાં વધુ સાત વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ છે. આ સજાથી બચવા માટે કરદાતાઓ દોડતા હતા અને કમ્પાઉન્ડિંગ કરાવતા હતા. બે પાંચ દસ દિવસનો વિલંબ તો કોઈથી પણ થઈ જ જાય છે. આ પ્રકારની ભૂલ થવા સહજ છે. હવે ક્વાર્ટર્લી રિટર્ન ફાઈલ કરવાનું હોય છે. ત્રણ મહિના પૂરા થયા પછી એક મહિનાની અંદર આ રિટર્ન ફાઈલ કરી દેવાનું હોય છે. ક્વાર્ટર્લી સ્ટેટમેન્ટ ફાઈલ કરતાં પહેલા ટીડીએસ કર્યો હોય અને તે રકમ જમા ન કરાવી હોય તો તે રકમ જમા કરાવી દેવાની છૂટ નવી વ્યવસ્થા હેઠળ આપવામાં આવી છે. હવે એપ્રિલ મહિનામાં કરેલો ટીડીએસ જુલાઈની 31મી પહેલાં જમા કરાવી દેવાની છૂટ આપવામાં આવી છે. મે મહિનામાં કરેલો ટીડીએસ 31મી જુલાઈ પહેલાં જમા કરાવી દેવાની છૂટ આપવામાં આવી છે. જોકે આ જોગવાઈ પહેલી ઓક્ટોબર 2024થી અમલમાં આવી રહી છે. ત્યાર બાદ આ રીતે ટીડીએસ કરનારાઓ ટીડીએસ કરીને લીધેલી રકમ જમા કરાવી શકે છે. આમ નવી વ્યવસ્થા હેઠળ ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ટીડીએસ કાપીને સરકારમાં જમા ન આપ્યો હોય તો તે રકમ 31મી જાન્યુઆરી 2025 સુધીમાં જમા આપી દેવાની રહેશે. તેમની સામે કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે નહિ. તેમણે આ બાકી રકમ પર વ્યાજ ચોક્કસ ચૂકવવું પડશે. પ્રોસિક્યુશન અને કમ્પાઉન્ડિંગની જફામાંથી મુક્તિ મળી જશે. ટીડીએસમાં પણ આ જ પ્રકારની વ્યવસ્થા દાખલ કરી દેવામાં આવી છે. આ બહુ મોટી રાહત છે.



વિદેશપ્રવાસના રોકડ ખર્ચમાં પણ પકડાઈ જવાની શક્યતા

તમે વિદેશ ફરવા જાવ છો. તમે રોકડા ચૂકવીને મોટી ખરીદી કરો છો. પાછા ફરતી વખતે એરપોર્ટ પર તેના પર ચૂકવેલા વેટની કેડિટ લો છો. હા, તમે વાઈટના પૈસા ખર્ચા હોય અને વેટની કેડિટ લે છે. રોકડાથી ખર્ચેલા એટલે કે બિનહિસાબી નાણાંથી કરેલી ખરીદીનાં નાણાં પણ એરપોર્ટ પર વેટ કેડિટ લેવામાં આવે છે. તમને કદાચ ખબર નહિ હોય કે આ વેટની કેડિટનો રેકૉર્ડ ભારત સરકાર પાસે આવી જ જાય છે. ભારત સરકારને વિશ્વના 126 દેશોમાંથી વેટ કેડિટનો રેકૉર્ડ મળે છે. આ રેકૉર્ડ જોયા પછી સરકાર તમને પૂછશે કે તમે વિદેશ ગયા હતા ત્યારે તમે કઈ વસ્તુની ખરીદી કરી લાવ્યા હતા. આ વસ્તુની ખરીદી માટેના પૈસાનો સોર્સ શું છે. હવે સમય બદલાઈ ચૂક્યો છે.


વેરો ભરો અને આનંદથી જીવોના સિદ્ધાંતને વરીને જીવવાનો સમય આવી ગયો છે. ખોટું કામ કરીને બચી જવાનો સમય હવે રહ્યો નથી. જેટલો ટેક્સ ભરશો તેટલી શાંતિ તમારા જીવનમાં આવશે. બિનહિસાબી નાણાં તમને પોતાને કે પછી તમારા સંતાનોને બરબાદ કરે છે. હિસાબી નાણાં જ કામ આવે છે, કારણ કે આપણે ત્યાં વેલ્થ ટેક્સ નથી. તેમ જ રાઉલ ટેક્સ પણ નથી. અન્ય કોઈ ટેક્સ નથી. માત્ર ઈન્કમેટેક્સ જ છે. હવે લોકોની માનસિકતા પણ બદલાવા માંડી છે. તેમાંય વળી સાડા બાર ટકાનો ઈન્કમેટેક્સ હોય તો તે જરૂર ચૂકવી દેવો જોઈએ.

કરી દેવામાં આવ્યા છે. હવે રિન્યુઅલ પણ 11 (12) (13)નાં નવાં નોર્મ્સ પ્રમાણે મંજૂરી મેળવી શકશો. આ જોગવાઈથી દરેક ખુશ થયા છે. આમ આવકવેરા ધારામાં બે સમાંતર કલમ હતી તે કાઢી નાખી છે.



શાળાઓના અને શૈક્ષણિક સંસ્થાઓના વિલીનીકરણની છૂટ આપી

બે શાળાઓ કે પછી શૈક્ષણિક સંસ્થાઓ એકબીજામાં વિલીન થઈ જવા માગે છે. કલમ 115 (ટી.ડી.)માં લખવામાં આવ્યું હતું કે બે સંસ્થાઓનું વિલીનીકરણ થઈ શકશે. તેના પર કોઈ જ ટેક્સ લાગશે નહિ, પરંતુ શાળાઓનું વિલીનીકરણ કઈ રીતે કરવું જોઈએ તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. હા, કંપનીઓના જોડાણ માટે કેટલીક શરતો આપવામાં આવી છે, પરંતુ વિલીનીકરણ માટે એવી કોઈ જ શરતો આપવામાં આવી નહોતી. તેથી શાળાઓ કે શૈક્ષણિક સંસ્થાઓ મૂંઝાતી હતી. કંપનીઓના જોડાણ માટેની શરતોમાં જોડાણ કરનારી કંપનીઓની તમામ અસ્ક્યામતો અને લાયેબિલિટી (જવાબદારીઓ) ટ્રાન્સફર કરી શકાતી હતી. 75 ટકા શેરહોલ્ડર જે સંસ્થા સાથે જોડાણ કરે તેના શેરહોલ્ડર બની જશે જેવી જોગવાઈઓ હતી જ હતી, પરંતુ વિલીનીકરણ એટલે કે મર્જર માટે આ પ્રકારની કોઈ જ શરતો તૈયાર કરીને મૂકવામાં આવેલી નથી. તેને માટે કલમ 12 (એસી) દાખલ કરી દેવામાં આવી છે કલમ 12 (એસી)માં જણાવવામાં આવ્યું છે કે મર્જર થશે તો બે રજિસ્ટર્ડ કે માન્યતાપ્રાપ્ત સંસ્થાઓનું જ થશે. અનરજિસ્ટર્ડ એટલે કે રજિસ્ટ્રેશન ન ધરાવતી સંસ્થાઓનું મર્જર થઈ શકશે નહિ. જે સંસ્થાઓ રજિસ્ટ્રેશન ધરાવતી હશે તેમની વચ્ચે જ રજિસ્ટ્રેશન થઈ શકશે. બેમાંથી એક પણ સંસ્થા રજિસ્ટર્ડ નહિ હોય તો તેમની વચ્ચે મર્જર થઈ શકશે નહિ. બીજું, બંનેનો સંસ્થા ચલાવવા માટેનો ઉદ્દેશ કે હેતુ એકસમાન જ હોવો જોઈએ. ત્રીજું, મર્જ થઈ રહેલી બે સંસ્થાઓ સંપૂર્ણપણે રજિસ્ટર્ડ થયેલી અને માન્યતા મેળવી ચૂકેલી સંસ્થાઓ હોવી જોઈએ. ચોથું, મર્જરની દરખાસ્ત માટે આવેલી સંસ્થાઓ કઈ શરતને પાળશે તો જ તેમના મર્જરને મંજૂરી આપવામાં આવશે તે નક્કી કરવામાં આવશે. આ શરત અરજી કર્યા પછી બતાવવામાં આવશે, કારણ કે બે સંસ્થાઓના કોર્પસ છે. નોન-કોર્પસ છે. આ તમામને લગતી શરતો તેમને અરજી કર્યા પછી બતાવવામાં આવશે. કોર્પસનું શું કરવું, નોનકોર્પસનું શું કરવું અને લાયેબિલિટીનું શું કરવું તેની સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. આમ





ચેરિટેબલ ટ્રસ્ટની સમસ્યાનો પણ અંત આવ્યો

ચેરિટેબલ ટ્રસ્ટ રજિસ્ટ્રેશન માટેની અરજી કરે તો તેની મંજૂરી મળવામાં વિલંબ થઈ જતો હતો. તેથી રજિસ્ટ્રેશન મળતું જ નહોતું. હવે ડિલે કોન્ડોન કરવાની એટલે કે અરજી મંજૂર થવામાં વિલંબ થયો હોવાનું સ્વીકારી લેવામાં આવશે. તેમ જ ચેરિટેબલ ટ્રસ્ટોને વિલંબ માફ કરીને તે ગણામાં મળતા ટ્રસ્ટ તરીકેના કાયદેસરના લાભ પણ આપવામાં આવશે. વિલંબનાં કારણો વાજબી હોવાં જરૂરી છે. વિલંબનાં કારણો વાજબી હશે તો તમને અરજી કર્યા તારીખથી મંજૂરી મળી ગઈ હોવાનું માની લેવામાં આવશે. ત્યાર બાદ કરવામાં આવેલા દરેક વ્યવહારને ચેરિટેબલ એક્ટની જોગવાઈ હેઠળ કરેલા માન્ય વ્યવહારો ગણવામાં આવશે. આ જોગવાઈ કલમ 139 (9એ)માં કરી દેવામાં આવી છે. કલમ 139(9એ) હેઠળ ડિલે કોન્ડોન કરી દેવામાં આવશે. આમ ચેરિટેબલ ટ્રસ્ટના રજિસ્ટ્રેશનમાં થતાં વિલંબનો કાયમી ઉકેલ આપી દીધો છે. પહેલાં વિલંબ થાય તો બીજી વાર અરજી કરવી પડતી હતી. આમ જ્યારે પણ રજિસ્ટ્રેશન મળવામાં વિલંબ થાય ત્યારે ચેરિટેબલ ટ્રસ્ટ માટે અરજી કરનારાઓને કલમ 12 - એની જોગવાઈનો લાભ આપવામાં આવશે. તેમાં રજિસ્ટ્રેશન માટે વાજબી સમય આપી શકાયો નથી તેમ નવી જોગવાઈમાં જણાવી દેવામાં આવ્યું છે. પહેલા કોન્ડોનેશન નહોતું આપવામાં આવતું અને નવેસરથી અરજી કરવા જણાવવામાં આવતું હતું. ડિલે કોન્ડોનનો ઉદારતાથી સ્વીકાર પણ કરવામાં આવશે.

મર્જર માટેની શરતો નહોતી. હવે આ શરતો દર્શાવી દેવામાં આવી છે. આ દરખાસ્ત ચેરિટેબલ ટ્રસ્ટ અને રિલિજિયસ ટ્રસ્ટ બંને માટે આવી છે. તેઓ મર્જ થઈ શકશે, પરંતુ નવી ઉમેરેલી કલમ 12(એસી)ની જોગવાઈએ સંતોષવી તેમને માટે ફરજિયાત કરી દેવામાં આવી છે. આ મર્જર કરનારી સંસ્થાઓ પર 150 (ટીડી) લાગશે નહિ.

પગારદારોને ટીડીએસ અને ટીસીએસમાં રાહત આપી

પગારદારોએ મકાન વેચ્યું હોય તો તેમને મળેલી રકમમાંથી ટીડીએસ કરવામાં આવેલો હોય છે. મકાન ખરીદનાર ટીડીએસ કરીને આવકવેરા ખાતામાં તે રકમ જમા કરાવી દે છે. એક ટકાના દરે તે ટીડીએસ કરવામાં આવે છે. હવે પગારદારે તે રકમમાંથી રૂ. 10 લાખથી વધુના મૂલ્યની મોટરની ખરીદી કરી છે.

તેના પર એક ટકાના દરે ટીસીએસ કલેક્ટ કરવામાં આવ્યો. ઉપરાંત પોતાના બાળકને વિદેશ ભણવા મોકલ્યા પછી મોકલવા પડતાં નાણાં પરનો ટીસીએસ પણ થાય છે. આ કરદાતાની કંપનીના માલિક આ ટીડીએસ અને ટીસીએસને તેના ખાતામાં લઈને મજરે આપવાની પ્રક્રિયામાં સહકાર આપતા નહોતા તેથી પગારદારો પરેશાન હતા. તેઓ કોઈ અન્ય આવક પર ટીડીએસ કપાયો હોય તો તે મજરે લઈ લેવા તૈયાર હતા, પરંતુ મકાનના વેચાણ કે મોટરકારની ખરીદી અથવા તો પછી વિદેશ ભણવા ગયેલા સંતાનને મોકલેલાં નાણાં પર પાંચ ટકાના દરે

થયેલા ટીસીએસ અને ટીડીએસની રકમ મજરે અપાવવામાં સહકાર આપતા જ નહોતા, પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારમણે 2024-25ના રજૂ કરેલા બજેટમાં કાયદાકીય જોગવાઈ જ બદલી નાખી છે. પરિણામે કરદાતા તેણે વેચેલા મકાન, તેણે ખરીદેલી કાર કે પછી તેના વિદેશ ભણવા ગયેલા સંતાનને મોકલેલાં નાણાં પર થયેલા ટીસીએસ-ટેક્સ કલેક્શન એટ સોર્સ અને ટીડીએસ - ટેક્સ ડિડક્શન એટ સોર્સની રકમની વિગતો કરદાતા તેની કંપનીના માલિકને આપશે. કંપનીના માલિક ટીડીએસ અને ટીસીએસની ઉપરોક્ત રકમને ધ્યાનમાં લીધા બાદ બાકીની રકમ પર જ ટીડીએસ કરશે. આમ કંપનીના માલિક તે રકમને કંપનીના કર્મચારીને મજરે અપાવવામાં સહયોગ આપશે. જૂની વ્યવસ્થામાં પગારમાં તથા ઉપરોક્ત ત્રણ વહેવારોમાં પણ ટીડીએસ થતો હતો અને રિટર્નમાં આ તમામ ટીડીએસ-ટીસીએસ મજરે લેવાની પ્રક્રિયા કરવી પડતી હતી. હવે નાણામંત્રીએ કર્મચારીની કંપનીના માલિકના માધ્યમથી તે રકમ મજરે મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવી આપી છે. નાણામંત્રીએ ટીસીએસનો લાભ પગારમાં આપવાનો શરૂ કરી દીધો છે.

બીજી તરફ બજેટમાં કલમ 206(સી-1) (એફ) ઉમેરી દેવામાં આવી છે. આ કલમ અત્યંત ખતરનાક છે. તેમાં રૂ. 10 લાખથી વધુ રકમની મોટર ખરીદવામાં આવશે તો તેને માટે ચૂકવાયેલી રકમ પર એક ટકાના દરે ટીસીએસ કરવામાં આવશે. આ જ કાયદાકીય જોગવાઈ છે. રોલેક્સ ઘડિયાળ ખરીદવામાં આવશે તો પણ એક ટકાના દરે ટીસીએસ થશે, કારણ કે તેમાં અન્ય બીજી વસ્તુઓનો પણ ઉમેરો કરી દેવામાં આવ્યો છે. આ ખરીદી માટેનાં નાણાં ક્યાંથી લાવવામાં આવ્યાં તે કરદાતાએ બતાવવું પડશે. રોલેક્સની 18 લાખની કિંમતને ઘડિયાળ ખરીદી તેના પૈસા તમે ક્યાંથી લાવ્યા તે બતાવવું પડશે. આમ રૂ. 10 લાખથી વધુ મૂલ્યની વસ્તુની ખરીદી કરવામાં આવશે તો વેચાણ કરનારાએ તે રકમમાંથી એક ટકાના દરે ટીસીએસ



ફિમિલી પેન્શનમાં ડિડક્શન

ફિમિલી પેન્શન પર ડિડક્શન મળતું હતું તે વન થર્ડ કે રૂ. 15000નું હતું તેનાથી વધારીને વન થર્ડ કે રૂ. 25000થી ઓછું હોય તે આપવાનો ફેરફાર પણ કરવામાં આવ્યો છે.



કરવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. ભલેને આ વસ્તુ ચેકથી ચુકવણી ખરીદી કરી હોય તો પણ આ પૈસા ક્યાંથી લાવવામાં આવ્યા છે તે પૂછશે.

આ નવી જોગવાઈ છે. આમ વૈભવી વસ્તુઓની ખરીદી પર પણ સરકાર નજર રાખવા માંડી છે. તેના પર એક ટકાનો ટીસીએસ કરવાની જોગવાઈ કરી હોવાથી તેના પર સરકારની નજર રહેશે.

બે લાખથી વધુ કિંમતની વસ્તુ પર પણ સરકાર નજર રાખી રહી છે. ત્રણ લાખ રૂપિયાના મૂલ્યનું એક પર્સ હોય ને તેમાંથી રૂ. 1.99 લાખ રોકડામાં

આપી દો અને બાકીની રકમ ચેકથી ચૂકવીને એક ટકાના ટીસીએસથી બચવાનો રસ્તો કાઢવામાં આવી રહ્યો છે, પરંતુ બિલ તો એક જ છે તેથી તેનું સરકાર દ્વારા મોનિટરિંગ કરવું શક્ય બની ગયું છે.

વીમાના કમિશન ઉપરાંત બ્રોકરેજ પરનો ટીડીએસ 5 ટકાથી ઘટાડીને 2 ટકા કરી દેવાનો નિર્ણય લીધો



આમ અડધા પૈસા રોકડેથી અને અડધા પૈસા ચેકથી લઈને એક ટકા ટેક્સ બચાવવાની વાત કરનારાઓ તમને છેતરી રહ્યા છે. આ પદ્ધતિએ એક ટકા ટીસીએસ બચાવવો અર્થહીન છે.


હા, રૂ. 2 લાખથી ઓછી રકમની વસ્તુની ખરીદી કરી હોય તો તેમાં રૂ. 1.99 રોકડેથી ચૂકવી દઈને ટીસીએસની જફામાંથી મુક્ત મેળવી શકાય છે, પરંતુ બે લાખથી વધુ રકમનું બિલ હશે તો તેમાં પણ એક ટકા ટીસીએસ બચાવવાની ક્વાયત અર્થહીન બની જશે. હવે આ પ્રકારની દરેક ખરીદીના બિલ સરકાર પાસે પહોંચી જ જાય છે. નાની રકમની ખરીદીને જવા દો, પરંતુ મોટી


રકમની ચુકવણી થઈ હોય તેવા દરેક આર્થિક વહેવારનાં બિલ સરકાર પાસે મોજૂદ જ છે. ભલે કેશ ઓન ડિલિવરીના સ્વરૂપમાં ખરીદી હોય તો પણ તેનો રેકૉર્ડ સરકાર પાસે પહોંચી જ જાય છે. તમે તમારા પોતાના અંગે જે જાણો છો તેનાથી ઘણું વધારે ડિપાર્ટમેન્ટ કે સરકાર તમારા અંગે જાણે છે. તમે રિટર્નમાં બતાવો છો તે આવકથી વધારેનો ખર્ચ કરવામાં આવે તો પણ સરકારની નજર તેના પર રહે જ છે. તેથી દરેક કરદાતાએ ચેતતા રહેવાની જરૂર છે.

રિફંડનું વ્યાજ બચાવવા ટીડીએસના દર ઘટાડવા

હા, સરકારે ટીડીએસનું રિફંડ બહુ જ મોટું આપવું પડી રહ્યું છે. બે લાખ કરોડનું રિફંડ આપવાની ફરજ પડી રહી છે. આ રિફંડની રકમ પર વ્યાજ પણ ચૂકવવાની ફરજ પડી રહી છે. તેથી સરકારે ટીડીએસના દર ઓછા કરી દીધા છે. કલમ 194 (ટીએ) કલમ 194 (જી) હેઠળ ટીડીએસના દર ઓછા કર્યા છે. કલમ 194 (એચ), 194 (આઈ), 194 (આઈબી), 194 (એમ), 194 (એઓ) હેઠળ ટેક્સ ડિડકશન કરવાને જે દર હતા તે ઘટાડી દીધો છે. પાંચ ટકાનો ટીડીએસ ઘટાડીને બે ટકા કરી દેવામાં આવ્યો છે.

વીમાના કમિશન પરનો ટીડીએસ પાંચ ટકાથી ઘટાડીને બે ટકા કરી દેવામાં આવ્યો છે. જીવન વીમાની પોલિસી પરના ટીડીએસની રકમ 5 ટકાથી ઘટાડીને 2 ટકા કરી દેવામાં આવી છે. કમિશન અને બ્રોકરેજ પરનો ટીડીએસ પાંચ ટકાથી ઘટાડીને બે ટકા કરી દેવામાં આવ્યો છે. રૂ. 50,000થી વધારેનાં ભાડાંની ચુકવણી પર કલમ 194 (આઈબી) હેઠળ પાંચ ટકા ટીડીએસ હતો તે ઘટાડીને 2 ટકા કરી દેવામાં આવ્યો છે. કલમ 194 (એમ) હેઠળ વ્યક્તિગત કરદાતાઓ અને હિન્દુ અવિભક્ત પરિવારોના હિસાબોનું ઓડિટ નહોતું થતું. તેઓ રૂ. 50 લાખથી વધુની કિંમતના વક્સ કોન્ટ્રાક્ટ આપતા હતા તેમ જ રૂ. 50 લાખથી વધુ રકમ લઈને પ્રોફેશનલ સર્વિસ આપતા હતા. તેના પર પાંચ ટકા ટીડીએસ કરવામાં આવતો હતા. આ ટીડીએસ પણ પાંચ ટકાથી ઘટાડીને બે ટકા કરી દેવામાં આવ્યો છે. ઈ-કોમર્સ પર જે આર્થિક





વહેવારો થતા હતા તેના પર જે એક ટકાના દરે ટીડીએસ કરવામાં આવતો હતો તે ટીડીએસ 0.1 ટકા કરી દેવામાં આવ્યો છે. આમ ઇન્કમ કરતાં જે વધુ રકમના ટીડીએસ જમા કરાવવાની ફરજ પડતી હતી તેમાં સુધારો કરીને ટીડીએસની ટકાવારી ઘટાડી દેવામાં આવી છે. તેમ જ કલમ 194 (ક્યૂ) અને કલમ 206 (સીએચ)માં રૂ. 50 લાખથી વધુ રકમના માલની ખરીદી પર ટીડીએસ કે ટીસીએસ કરવો પડતો હતો તેને માટે કલમ 197 હેઠળ લોઅર ડિડક્શનનું સર્ટિફિકેટ લેવાની જોગવાઈ દાખલ કરી દેવામાં આવી છે. એક ટકાના દરે ટીડીએસ કરે તો લાખો અને કરોડોમાં ટીડીએસ થાય છે. તેટલો નફો પણ તેમનો ન હોય તેવી સંભાવના રહેલી છે. તેથી તેઓ રિફંડ ક્લેઈમ કરે છે. આ રિફંડની રકમ પર સરકારે વ્યાજ ચૂકવવું પડે છે. તેથી ટીડીએસના દર ઓછા કરવામાં આવ્યા છે.



ગિ રી શ આ હુજાનું કહેવું છે કે સરકારનું આ પગલું આવકારદાયક અને દરેકને માટે લાભદાયક છે.



જોકે નોન-રેસિડન્ટ માટેની ટીડીએસના દર ઊંચા રાખવામાં આવ્યા છે. નોન-રેસિડન્ટના કિસ્સામાં ટીડીએસ પૂરો કાપવામાં આવતો હતો.

કેપિટલ ગેઈન પર 20 ટકાના દરે ટીડીએસ કરવામાં આવતો હતો, પરંતુ હવે 12.5 ટકા ટેક્સ થઈ ગયો છે તેથી કલમ 150 (એબી), 150 (એસી), 150 (એસીએ), 150 (એડી) અને 150 (ઈ) દરેકમાં ટીડીએસ પહેલાં 20 ટકા કપાતો હતો. આ 20 ટકા પણ સંપૂર્ણ કિંમત પર કપાતો હતો, પરંતુ હવે 12.5 ટકા કાપવામાં આવશે. બિનનિવાસી ભારતીયની કોઈ પણ આવકમાં ટીડીએસ કાપવો જ પડે. નિવાસી ભારતીયના કિસ્સામાં ટીડીએસ ઓછો કરી શકે તેટલો ઓછો બીનનિવાસી ભારતીયના કિસ્સામાં કરી શકાતો નથી. ભારતમાંની તેમની પ્રોપર્ટી વેચનાર બીનનિવાસી ભારતીય હોય તો તેમના કેપિટલ ગેઈન પર 12.5 ટકાના દરે ટીડીએસ કાપવાનો આવશે. પહેલાં ટીડીએસનો દર પૂરી કિંમત પર કાપતા હતા. તેમાં કેપિટલ ગેઈન કેટલો હતો તે ખબર પડતી નહોતી. હવે તેમની કોસ્ટ ખબર હોય અને તેમને થયેલો નફો ખબર



પડે તો તેના પર 12.5 ટકાના દરે ટીડીએસ કરી લેવામાં આવશે. આમ બીનનિવાસી ભારતીયોને પણ રાહત આપવામાં આવી છે.

બ્લૉક એસેસમેન્ટની કલમમાં પણ ફેરફાર કરાયો

1995માં બ્લૉક એસેસમેન્ટનો કાયદો આવ્યો હતો. બ્લૉક એસેસમેન્ટમાં જુદા જુદા વર્ગની અસ્ક્યામતોનો સમાવેશ થાય છે. તેમાં બિલ્ડિંગ, મશીનરી, પ્લાન્ટ, ફર્નિચર જેવી સ્પર્શીને અનુભવી શકાય તેવી અસ્ક્યામતોનો સમાવેશ થાય છે તેમ જ સ્પર્શીને અનુભવી ન શકાય તેવી અસ્ક્યામતોમાં પેટન્ટ રાઈટ, ટ્રેડમાર્ક, લાઈસન્સ, ફેન્યાઈઝી અથવા અન્ય બિઝનેસના અધિકારો અને કોમર્શિયલ રાઈટ્સનો સમાવેશ થાય છે. તેને નોન ટાન્જિબલ-સ્પર્શીને અનુભવી ન શકાય તેવી

નોન-રેસિડન્ટ માટેના ટીડીએસનો દર ઊંચા રાખવામાં આવ્યા છે.



અસ્ક્યામતો તરીકે ઓળખાવવામાં આવે છે. 158(બી)થી આગળની કલમો તેને માટે લાગુ પડતી હતી. ત્યાર બાદ સર્ચ-દરોડાના કિસ્સાઓમાં લાગુ કરવા માટે કલમ 153(એ) 153 (બી) અને 153 (સી) લાવ્યા હતા. હવે કલમ 147 લાગુ કરવામાં આવી રહી છે.

હવે ફરી સરકાર બ્લૉક એસેસમેન્ટ ફરી ચાલુ કરશે. અત્યારે દરોડાના કેસમાં દરોડા પાડ્યા હોય તે તબક્કે જ કરદાતા તેની બીનહિસાબી આવક જાહેર કરી દે તો 78 ટકાના દરે ઇન્કમટેક્સ લાગતો



હતો. તેના પર 30 ટકા પેનલ્ટી લાગતી હતી, પરંતુ દરોડાના સમયે તેની બીનહિસાબી આવક જાહેર ન કરે તો 138 ટકાના દરે તેના પર ટેક્સ લાગતો હતો. તેમાં 78 ટકા ટેક્સ અને 60 ટકા પેનલ્ટી લાગતી હતી. હવે તમારા પર દરોડા પડ્યા હશે તો તેવા કિસ્સાઓમાં માત્ર મહત્તમ 60 ટકાના દરે ટેક્સ લગાવવામાં આવશે. હવે દરોડો પડે તો બ્લોક એસેસમેન્ટમાં 60 ટકાના દરે છ વર્ષના હિસાબો પર થતો વેરો વસૂલવામાં આવશે. તેના પર કલમ 234 (એ), 234 (બી) અને કલમ 234(સી) હેઠળ લગાવવામાં આવતું વ્યાજ લગાવવામાં આવશે નહિ. કલમ 270 હેઠળ લાગુ કરવામાં આવતી પેનલ્ટી પણ લાગુ પડશે નહિ. માત્ર છ વર્ષના હિસાબો પર એટલે કે બીનહિસાબી આવકો કે છુપાવેલી આવક પર 60 ટકાના દરે ટેક્સ ભરી દેવાનો આવશે.

હા, તમારે ત્યાં દરોડો પડ્યો હોય તેવા કિસ્સાઓમાં તમને છ વર્ષનાં રિટર્ન ફરીથી ભરવા જણાવવામાં આવશે. આ રિટર્નમાં તમારે તમારી તમામ

દરોડા પછી રિટર્ન ફાઇલ કરવા જણાવે તો તમે બિનહિસાબી આવક દર્શાવી દેશો તો 60 ટકા આવકપેરો ચૂકવી મુક્તિ મળશે

બીનહિસાબી આવકો જણાવી દેવાની રહેશે. તેમાં બધી જ બીનહિસાબી આવક તમે દર્શાવી દેશો તો તમારે 60 ટકાના દરે આવકવેરો ચૂકવી દેવાનો આવશે. છ વર્ષના હિસાબો પર તમારે 60 ટકાના દરે આવકવેરો ભરવો પડશે, પરંતુ તમે આ રિટર્નમાં બિનહિસાબી આવક દર્શાવશો નહિ તો તમારે 60 ટકાના ટેક્સ ઉપરાંત 30 ટકા પેનલ્ટી પણ ચૂકવવી પડશે. આમ કુલ આવકના 90 ટકા કર ચૂકવવો પડશે.

બીજું, તમે છ વર્ષનાં નવાં રિટર્ન ભર્યાં અને તમારી આવકમાં રૂ. 10 કરોડનો વધારો બતાવી દીધો. ત્યાર બાદ આકારણી અધિકારી તેની નવેસરથી આકારણી કરશે. તેને ન જાહેર કરેલી આવક રૂ. 15 કરોડ હોવાનું જણાશે. તેવા સંજોગોમાં તફાવતની 5 કરોડની આવક પર તેના પર 60 ટકા ટેક્સ ઉપરાંત પેનલ્ટી પણ વધુ ચૂકવવી પડશે. દરોડા પછી રિટર્ન ફાઇલ કરતી વખતે જૂના કાયદામાં જાહેર ન કરેલી આવક દર્શાવવાનું જણાવવામાં આવતું હતું, પરંતુ હવે એટલે કે 2024-25ના બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ હેઠળ તમારે છેલ્લાં છ વર્ષની કુલ આવક તમારા રિટર્નમાં દર્શાવવી પડશે. તમે તે ઇન્કમ પર જે ટેક્સ ચૂકવ્યો છે તે ટેક્સની બાદબાકી કરીને બાકીની ઇન્કમ પર તમારે ટેક્સ ચૂકવી દેવાનો આવશે. તેના પર 50 ટકા પેનલ્ટી પણ ચૂકવવી પડશે. આ આકારણી સામે અપીલમાં જવાનો માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે. અગાઉની આકારણી પડતી મૂકી દેવામાં આવશે. નવી આકારણીને જ ફાઇનલ ગણીને તેના પર ટેક્સ લેવામાં આવશે. આ નવી જોગવાઈ ઘણી જ સારી છે.

અત્યાર સુધીની વ્યવસ્થા હેઠળ છ વર્ષનાં રિએસેસમેન્ટ ચાલતાં હોય તો તેવા સંજોગોમાં ટાઈમ બાર થવા આવતા હોય તે વર્ષ માટે નોટિસ ઈશ્યુ કરી દેવામાં આવતી હતી. હવે તમામ છ વર્ષની સાથે જ આકારણી કરવામાં આવશે. એક એક વર્ષનાં રિટર્નના સંદર્ભમાં નોટિસ આપી દેવાની સિસ્ટમ કાઢી નાખવામાં આવી છે. આકારણી અધિકારી છ વર્ષના રિટર્નની એટલે કે કુલ આવકના

રિટર્નની ચકાસણી કરશે. તમારે છ વર્ષનો જે ટેક્સ ભરવાનો થાય તેમાંથી અને તમે ભર્યો હોય તે ટેક્સની બાદ કરી દેવામાં આવશે. બાકીનો ટેક્સ તમારે ચૂકવી દેવાનો આવશે. 60 ટકા ટેક્સ ચૂકવી દેવો પડશે. તમે સાચી આવક જાહેર કરી દેશો તો પેનલ્ટી લાગુ પડશે નહિ. તમને છોડી દેવામાં આવશે.

તમારા ઘરેથી અન્ય કોઈના નાણાં, દાગીના, સોનું કે અન્ય અસ્ક્યામત મળી આવે તો તેને માટે કલમ 158 (બી.ડી) લાગુ કરવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. તેને માટે દરોડા પૂરા થયા તારીખથી બાર મહિનાનો જ સમયગાળો નક્કી કરી દેવામાં આવ્યો છે. દરોડાની તારીખનો મહિનો પૂરો થયા પછી બાર મહિનાના ગાળામાં આકારણી કરી દઈને તમારી પાસેનો ટેક્સ વસૂલી લેવાની જોગવાઈ પણ નિર્મલા સીતારમણે 2024-25 ના બજેટમાં દાખલ કરી દીધી છે. તેની સાથે જ કલમ

TAX



148(એ) હેઠળની ઇન્કવાયરી અને નોટિસ આપવાની પ્રક્રિયા કાઢી જ નાખી છે. આકારણી અધિકારી તપાસ કરે, ત્યારબાદ કારણ આપે, ત્યારબાદ કરદાતાને રિટર્ન ફાઇલ કરવા જણાવે, ત્યારબાદ તમારી રજૂઆત કરવાની તક આપશે અને તે પછી નિર્ણય લેશે અને ઓર્ડર પાસ કરશે. પરંતુ આ પ્રક્રિયા કાઢી નાખી છે. કલમ 148ની પેટા કલમ 1માં જણાવી દેવામાં આવ્યું છે કે કોઈ પણ તેનું રિએસેસમેન્ટ કરશે નહિ. આકારણી અધિકારીને લાગશે કે તમારી આવક વધારે છે તો તે તમને નોટિસ આપી દેશે. એસેસમેન્ટમાં વધારાની ઇન્કમ છે તો તે અધિકારી કરદાતાને નોટિસ આપી દેશે. તમને પૂછશે તમારી આ આવક છે કે કેમ? હા, ત્યાર બાદ તમે જે રજૂઆત કરશો તે સાંભળશે પણ ખરો. તેણે આપેલી કારણદર્શન નોટિસનો કરદાતાએ જવાબ પણ આપવો જ પડશે. પહેલાં તમામ વિધિ કર્યા પછી આવક છુપાવી છે કે નહિ તે નક્કી કરવામાં આવતું હતું. હવે પહેલાં જ નક્કી કરી દેવામાં આવશે કે કંઈ આવક છુપાવી છે કે નહિ. તે પછી જ ઇન્કમ ટેક્સ પેમેન્ટની નોટિસ આપવામાં આવશે. કેટલીક આવકની ચોરી થયેલી જણાય છે તે જણાવી દેવાનું આવશે. આ સંદર્ભમાં પાર્ટીને કરચોરીની નોટિસ પણ તેઓ સીધી આપી શકશે. કઈ ઇન્કમ દર્શાવી નથી તે જણાવી દેશે. નોટિસ આપ્યા પછી તમારે સ્પષ્ટતા કરવાની રહેશે. તમારી સ્પષ્ટતા સંતોષજનક હશે તો તમારો કેસ સેટલ થઈ જશે. તમને સાંભળશે પણ ખરા. તેમાં નવેસરથી નોટિસ આપવામાં આવશે જ નહિ. તેને સંતોષ

નહિ થાય તો શો-કોઝ નોટિસનો જવાબ માગશે. ત્યાર બાદ પોતાનો નિર્ણય કરશે અને ઓર્ડર પણ આપી દેશે. કરચોરી કરી છે કે નહિ. આ ઓર્ડર 148(એ)ની પેટાકલમ 3 હેઠળ આપશે. ઓર્ડર આપ્યા પછી 148ની નોટિસ આપશે અને ત્યાર બાદ 147ની કલમ લાગુ કરી દેશે. તેનો સમયગાળો પણ ઘટાડી દેવામાં આવ્યો છે. પહેલાં ત્રણ વર્ષ અને છ વર્ષ હતાં. હવે કોઈ પણ આવક માટે ત્રણ વર્ષ કરી દેવામાં આવ્યાં છે. કરચોરીની રકમ 50 લાખથી વધારે હશે અને કોઈ અનિયમિત એન્ટ્રી હોવાનું જણાશે તો પાંચ વર્ષની ચકાસણી-નવેસરથી ચકાસણી કરવામાં આવશે. હવે 147માં પાંચ વર્ષના હિસાબોનું રિએસેસમેન્ટ થશે. પહેલાં છ વર્ષના હિસાબોની ચકાસણી કરવામાં આવતી હતી. આમ પાંચ વર્ષના રિએસેસમેન્ટ થશે. આમ આ આ કાયદો સરળ બનાવી દેવામાં આવ્યો છે.



શર્સ પર લેવાતા પ્રીમિયમનું શું કરવામાં આવશે

શર્સ અને તેના પરના પ્રીમિયમની વાતો બહુધા કોલકાતાથી જ આવે છે. રૂ. 10ની મૂળ કિંમતના શર્સ પર રૂ. 990નું પ્રીમિયમ લેવામાં આવે છે. નવી કંપનીના શર્સના પણ આટલા ઊંચા પ્રીમિયમ લેવાતા હતા. આમ ઓફર પ્રાઈસ રૂ. 1000ની રાખવામાં આવતી હતી. આ વ્યવસ્થાને માપમાં રાખવા માટે કલમ 56/2 કલોઝ (7પી) નાખવામાં આવી હતી. આ કાયદા હેઠળ શર્સના ઓફર ભાવમાં ફેર માર્કેટ વેલ્યુ પ્રમાણે જ પ્રીમિયમ લગાવવામાં આવશે. તેનાથી વધારે પ્રીમિયમ લેવામાં આવશે તો તે રકમને વેરાને પાત્ર બનાવી દેવામાં આવી હતી. આમ કલમ 11/2 હેઠળ તમારા શર્સનું વાજબી બજાર મૂલ્ય રૂ. 50 થાય છે તો તમે તેના પર 50 રૂપિયા સુધીનું પ્રીમિયમ લઈ શકો છો, પરંતુ જો તમે તેનાથી વધુ પ્રીમિયમ લેશો તો તે વધારાની રકમ ટેક્સને પાત્ર બનશે. આમ કંપનીએ રૂ. 40ના વધારાના પ્રીમિયમ પર કંપનીને માથે ટેક્સનો બોજો નાખી દીધો હતો. પહેલાં આ જોગવાઈ રેસિડન્ટ ઈન્ડિયન માટે લાગુ કરવામાં આવી હતી. સમય જતાં આ જોગવાઈ નોન-રેસિડન્ટ ઈન્ડિયનને માટે પણ લાગુ કરી દેવામાં આવી હતી. શર્સ પર પ્રીમિયમની મર્યાદા બાંધતી કલમ સાવ જ નાબૂદ કરી દેવામાં આવી છે. સ્ટાર્ટ અપને ધ્યાનમાં રાખીને આ જોગવાઈ કરવામાં આવી છે. સ્ટાર્ટ અપને એન્જલ ટેક્સ ખટકતો હતો. સ્ટાર્ટ અપ ચાલુ કરનારાઓ માને છે કે તેમને તેમના શર્સના મૂલ્ય તરીકે વધારા પૈસા મળી શકે તેમ છે. આ સિસ્ટમને કારણે તેમને ઓછા પૈસા મળી રહ્યા છે. તેથી ફોરેન કન્ટ્રીએ ભારત પર તેને માટે દબાણ વધાર્યું હતું. આ દબાણને વશ થઈને ભારત સરકારે પ્રીમિયમને નિયંત્રિત કરતી કલમ જ કાઢી નાખી છે.

હવે નવી કંપનીઓ આઈપીઓ લઈને આવશે તો તેઓ મન ફાવે તેટલું પ્રીમિયમ લઈ શકશે. તેના પરનું પ્રીમિયમ નક્કી કરવા પર કોઈ જ મર્યાદા લાગુ પડશે નહિ, પરંતુ એક વાર ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે કલમ 68 કંપનીને શર્સ માટેની અરજીનાં નાણાં મળે, શર્સ પર પ્રીમિયમનાં નાણાં મળે કે પછી શેર કેપિટલ મળે તો તેવા કિસ્સાઓમાં તે નાણાંનો સ્રોત બતાવવો પડશે એટલે જ નહિ. તેમાં નાણાં રોકનારે પણ તે પૈસા ક્યાંથી ઊભા કર્યા તે બતાવવા ફરજિયાત છે. અન્યથા તમે ગમે તેટલું પ્રીમિયમ લેશો તો તમને વાંધો નહિ આવે. વાજબી બજાર મૂલ્યથી ઓછા ભાવે શર્સ આપવામાં આવશે તો કલમ 56/2 (10)ની જોગવાઈઓ લાગુ કરવામાં આવશે. વાજબી બજાર મૂલ્ય કરતાં વધુ બજાર મૂલ્ય દર્શાવવામાં આવશે તો તેને માટે કલમ 56/2 (10)ની જોગવાઈઓ લાગુ કરવામાં આવશે નહિ, પરંતુ કલમ 56/2 (7પી) પૂરી હટાવી દેવામાં આવી છે.

બજેટમાં ટેક્સ સ્લેબ બદલાતાં કરદાતાને રૂ. 17,500નો ફાયદો થશે

બવી ટેક્સ સિસ્ટમમાં રિટર્ન ફાઇલ કરનારા કરદાતાઓને નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહતની જાહેરાત કરીને પગારદાર કરદાતાઓને આવકવેરામાં રૂ. 17,500ની રાહત કરી આપી છે. જોકે જૂની આવકવેરા સિસ્ટમમાં રિટર્ન ફાઇલ કરનાર કરદાતાઓને કોઈ જ લાભ ન આપવાનું નક્કી કર્યું છે. આ રીતે કરદાતાઓને નવી ટેક્સ સિસ્ટમમાં ટેક્સ રિટર્ન ફાઇલ કરવા તરફ ધકેલવાનો વધુ એક પ્રયાસ નાણામંત્રીએ કર્યો છે.

નાણામંત્રીએ 23મી જુલાઈએ સંસદમાં રજૂ કરેલા બજેટને પરિણામે પગારદાર કરદાતાઓને જ મહત્તમ રૂ. 17,500ની વેરારાહત મળી રહી છે. ન્યુ રિજિમમાં આવકવેરાનું રિટર્ન ફાઇલ કરનારા કરદાતાઓને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં રૂ. 50,000 હતું તે વધારીને રૂ. 75,000 કરી દીધું છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનનો આ લાભ નવી સિસ્ટમમાં રિટર્ન ફાઇલ કરનારને જ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂની સિસ્ટમમાં રિટર્ન ફાઇલ કરનારાઓને સ્ટાન્ડર્ડ ડિડક્શન તરીકે માત્ર રૂ. 50,000 જ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નોકરિયાત સિવાયના કરદાતાઓના આ નવી વ્યવસ્થાને કારણે વેરામાં રૂ. 10,000 સુધીની બચત કરાવી આપી છે. અંદાજે રૂ. 7 લાખની વાર્ષિક આવક ધરાવનારાઓને રૂ. 10,000નો ફાયદો ચોક્કસ થશે, એમ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હેત્વી રૂપેશ શાહનું કહેવું છે. દેશના અંદાજે કુલ 7 કરોડ કરદાતાઓમાં 50 ટકાથી વધુ કરદાતાઓ પગારદાર કરદાતાઓ છે. આવકવેરાનું રિટર્ન ફાઇલ કરવાની જૂની સિસ્ટમમાં



**રિટર્નના
ન્યુ રિજિમમાં
સ્ટાન્ડર્ડ ડિડક્શન
રૂ. 50,000થી વધારીને
રૂ. 75000 કરવામાં
આવ્યું**

**ઓલ્ડ
રિજિમમાં રિટર્ન ફાઇલ
કરનારાઓને સ્ટાન્ડર્ડ
ડિડક્શન પેટે
રૂ. 50,000 જ
મળશે**

TRADEMARK CAUTION NOTICE

TO WHOM SO EVER IT MAY CONCERN

Our Client, M & B Engineering LTD., (hereinafter referred to as our Client"), a body incorporate existing under the laws of India, having its place of business at 51, Chandroday Society, Sardar Patel Stadium Road, Bharat Colony, Naranpura, Ahmedabad. 380 014, Gujarat, India is the registered proprietor of the trade mark "PROFLEX" under following logo.



PROFLEX

Vide Registration no. **2039830** as of 19th October, 2010, with user from 1st November, 2001, in respect of roofing materials. Our Client has several other registrations of variants of the aforesaid trademark registered in respect of Real estate; Insurance, financial and monetary affairs. The said registrations are valid and subsisting as of date.

Our Client is an eminent entity indulged in manufacturing and marketing a wide range of roofing systems used in diversified industries. Being the registered proprietor of the aforesaid trademark and its variants, only our Client has exclusive common law rights and statutory rights to use the said trademark and its variants in relation to the abovementioned goods and to obtain relief in respect of infringement of the aforesaid trademark and its variants under relevant sections of the Trademarks Act, 1999.

The members of trade and public are hereby cautioned and notified against any unscrupulous manufacturers and traders, with whom our Client has no nexus or association whatsoever that may misrepresent or pass off their goods under the aforementioned trademark and its variants thereof or any other mark deceptively similar to our Client's registered trademark and its variants thereof. Therefore, the public is hereby cautioned against purchasing goods from any such individuals/entities.

Besides, the intermediaries engaged in providing portal for online selling and or advertising the goods for other vendors of similar goods under my clients' registered Trademark or resembling Trademark and or logo narrated herein above are also cautioned to cease and desist this unscrupulous trade practices.

Our Client alone is entitled to use the aforesaid trademark and its variants thereof or authorize others to use them pursuant to a licensing agreement to such effect. Notice is given to Whomsoever It May Concern that any use of the aforesaid trademark and its variants thereof or trademark(s) deceptively similar thereto, by any person(s) not authorized by our Client, will amount to violation of our Client's statutory as well as common law rights. In the event of infringement or violation of our Client's exclusive rights over the aforesaid trademark, our Client will be forced to initiate appropriate legal action.

The members of trade and public in general especially intermediaries as stated herein above, are also advised not to be attracted or enticed by any email communications, advertisements or solicitation made by any unauthorized entities. Our Client will take strict legal action against such entities and thwart their attempts to mislead the public at large.

Dated this day 24th of July, 2024

For **M & B Engineering LTD.:**

H.K. Acharya & Co.,
Advocate, Patent and Trade Marks Attorneys
19, Navrangpura Road, Swastic Society, Navrangpura,
Ahmedabad - 380009, Gujarat

Advocate
Zahid K. Shaikh
Pooja Acharya

દરેક કરદાતાને આ ફાયદા મળશે



વિગતો	આકારણી વર્ષ 2024-25				આકારણી વર્ષ 2025-26			
વ્યક્તિગત કરદાતા	નવી સિસ્ટમ				નવી સુધારેલી સિસ્ટમ			
કુલ આવક		10 લાખ	15 લાખ	20 લાખ		10 લાખ	15 લાખ	20 લાખ
કલમ 80 સી		0	0	0		0	0	0
હોમલોન વ્યાજ		0	0	0		0	0	0
સ્ટા. રિડક્શન		50000	50000	50000		75000	75000	75000
વેરાપાત્ર આવક		950000	1450000	1950000		925000	1425000	1925000
વ્યક્તિગત કરદાતા	ટેક્સ સ્લેબ	નવી સિસ્ટમ			ટેક્સ સ્લેબ	સુધારેલી સિસ્ટમ		
0 થી 2.5 લાખ	0	0	0	0	0	0	0	
2.5 થી 3 લાખ	0	0	0	0	0	0	0	
3 થી 5 લાખ	5	10000	10000	10000	5	10000	10000	10000
5 થી 6 લાખ	5	5000	5000	5000	5	5000	5000	5000
6 થી 7 લાખ	10	10000	10000	10000	5	5000	5000	5000
7 થી 9 લાખ	10	20000	20000	20000	10	20000	20000	20000
9 થી 10 લાખ	15	7500	15000	15000	10	2500	10000	10000
10 થી 12 લાખ	15	0	30000	30000	15	0	30000	30000
12 થી 15 લાખ	20	0	50000	60000	20	0	45000	60000
15 લાખથી ઉપર	30	0	0	135000	30	0	0	127500
ભરવાનો વેરો		52500	140000	285000		42500	125000	267000

પગારદાર કરદાતાને મહત્તમ રૂ. 7500નો ફાયદો થશે. દરેક કરદાતાને આ ફાયદો મળશે. તેની આવક ભલે ગમે તેટલી હોય તેને આ ફાયદો મળશે જ મળશે.

પગારદાર માટેની જૂની વેરા સિસ્ટમમાં સ્ટાન્ડર્ડ રિડક્શન રૂ. ૫૦,૦૦૦ જ રાખવામાં આવ્યું છે. જૂની વેરા સિસ્ટમમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેથી જૂની વેરા સિસ્ટમમાં રિટર્ન ફાઈલ કરનારા ૬૦ વર્ષથી નાની વયના વ્યક્તિગત કરદાતાઓને ૧૦ લાખની વાર્ષિક આવક પર રૂ. ૧.૫ લાખ કલમ ૮૦ સી હેઠળ બાદ મળશે. તેમ જ હોમ લોનના વ્યાજ પેટે રૂ. ૨ લાખ બાદ મળશે. જૂની સિસ્ટમમાં સ્ટાન્ડર્ડ રિડક્શન જે રૂ. ૫૦,૦૦૦ મળતું હતું તે યથાવત્ રાખ્યું છે. આમ તેને રૂ. ૧૦ લાખની આવકમાંથી રૂ. ૪ લાખ બાદ મળી જતાં તેની

વેરાપાત્ર આવક રૂ. ૬ લાખ બનતી હતી. છ લાખની આવકમાંથી અઢી લાખની આવક પર એક પણ રૂપિયો ટેક્સ ભરવો પડતો નહોતો. રૂ. ૩ થી ૫ લાખની આવક પર ૫ ટકાના વેરાના દર પર રૂ. ૧૦,૦૦૦નો ટેક્સ ભરવો પડતો હતો. તેમ જ ૫ થી ૧૦ લાખ સુધીની આવક પર ૧ લાખનો ટેક્સ ભરવો પડતો હતો. તેમ જ રૂ. ૧૨ થી ૧૫ લાખની આવક ૩૦ ટકાના સ્લેબમાં આવતી હોવાથી ટેક્સ વધીને રૂ. ૮૦,૦૦૦ થતો હતો. આમ રૂ. ૧૦ લાખની વાર્ષિક આવક ધરાવનારાઓને રૂ. ૩૨,૫૦૦નો, ૧૫ લાખની આવક ધરાવનારાઓને રૂ. ૧,૪૨,૫૦૦ અને રૂ. ૨૦ લાખની આવક ધરાવનારાઓને રૂ. ૨,૮૨,૫૦૦ ટેક્સ પેટે ભરવાના આવતા હતા. જૂની સિસ્ટમમાં રિટર્ન ફાઈલ કરનારાઓ માટે નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં સ્ટાન્ડર્ડ

રિડક્શન ૫૦,૦૦૦ જ રાખ્યું છે. તેથી વાર્ષિક ૧૦ લાખની આવક ધરાવનારાઓને વેરામાં કોઈ ફાયદો થયો નથી. આમ જૂની સિસ્ટમમાં ટેક્સ રિટર્ન ફાઈલ કરનારાઓને ખાસ કોઈ ફાયદો કરાવવામાં આવ્યો નથી. જોકે જૂની સિસ્ટમમાં રિટર્ન ફાઈલ કરનારા કરદાતાઓને સ્ટાન્ડર્ડ રિડક્શનનો લાભ ન આપવાના નાણામંત્રીના નિર્ણય અંગે વાત કરતાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મહેશ છાજેડ કહે છે કે, “સામાન્ય રીતે પગારદારોને કન્વેન્સ કે જવા-આવવાના થતા ખર્ચ, ગાડીમાં જવાના ખર્ચ સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને સ્ટાન્ડર્ડ રિડક્શન આપવામાં આવી રહ્યું છે. તેમાં નવી અને જૂની સિસ્ટમના કરદાતાઓ વચ્ચે ભેદ હોવો ન જોઈએ. નાણામંત્રીએ કરેલો આ ભેદ વાજબી જણાતો નથી.”



હવે 24 મહિના પછી ઍસેટ્સ વેચે તો લૉન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે

2001ને પાયાનું વર્ષ ગણીને ઇન્ફ્લેક્શનની ચાલુ કટેલી પ્રથા હવે નાબૂદ કરી દેવામાં આવી

લૉન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ગણવાની મહત્તમ મર્યાદા 36થી ઘટાડીને 24 માસ કરી દેવામાં આવી

લિસ્ટેડ સિક્યોરિટીઝ પરનો ૩.1 લાખ સુધીનો લૉન્ગ ટર્મ કેપિટલ ગેઇન માફીને પાત્ર હતો તે વધારીને હવે 1.25 લાખ કરી દેવામાં આવ્યો



સ્ટ થયેલી સિક્યોરિટી તથા એ સ ટી ટી - સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ પેઇડ સિવાયની કોઈ પણ ઍસેટ્સનું 24 મહિના પહેલાં વેચાણ કરે તો શોર્ટ ટર્મ કેપિટલ અને 24 મહિના પછી વેચાણ કરશે તો લૉન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પાડવાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે કરી છે.

આ સાથે જ લૉન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 24 મહિનાના ગાળા બાદના વેચાણ પર ગણવામાં આવશે. ડિબેન્ચર, ગોલ્ડ, બોન્ડ સહિતની અસ્ક્યામતો પર લૉન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ગણવાનો 36 મહિનાના ગાળાને ઘટાડીને 24 મહિનાનો કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ લિસ્ટેડ સિક્યોરિટીઝ પરનો રૂ. 1 લાખ સુધીનો લૉન્ગ ટર્મ કેપિટલ ગેઇન માફીને પાત્ર હતો તે વધારીને હવે 1.25 લાખ કરી દેવામાં આવ્યો છે.

લિસ્ટ થયેલા શેર્સ પર ભૂતકાળમાં 10 ટકા લૉન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગતો હતો તે વધારીને હવે 12.5 ટકા કર્યો છે. તેમ જ જમીન, બિલ્ડિંગ, સોનું, તમામ પ્રકારના બોન્ડ, ડિબેન્ચર પર પરનો લૉન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 20 ટકાથી ઘટાડીને હવે 12.5 ટકાના કરી દેવામાં આવ્યો છે.

અગાઉ લૉન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સનો દર 20 ટકા હતો અને તેમાં મિલકતના ઇન્ફ્લેક્શનનો લાભ આપવામાં આવતો હતો. હવે ઇન્ફ્લેક્શનનો આ લાભ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. પરિણામે મિલકતની કિંમત-ખરીદકિંમત અથવા પહેલી એપ્રિલ 2001ની સાલની વાજબી કિંમત ગણીને તેના વેચાણ થકી થયેલા નફા ઉપર ઇન્ફ્લેક્શનના લાભ આપ્યા વિના 12.5 ટકા લૉન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ વસૂલવામાં આવશે. પરિણામે હવે પછી ઇન્ફ્લેક્શન જાહેર ન કરવામાં આવે તેવી પણ શક્યતા રહેલી છે, એમ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મહેશ છાજેડનું કહેવું છે. આમ કેપિટલ ગેઇન ટેક્સની ગણતરીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ધરમૂળથી ફેરફાર કર્યા છે. અત્યારે કેપિટલ ગેઇનમાં ત્રણ હોલિડિંગ પિરિયડ હતા. 12 માસ, 24 માસ અને 36 માસનો સમય હતો. હવે માત્ર 12 અને 24 મહિનાના બે જ સ્લેબ કરી દેવામાં આવ્યા છે.

મકાન અને મિલકતની ખરીદી કરીને 24 મહિનાથી ઓછા સમય સુધી તે મિલકત પોતાની પાસે રાખી હોય તો તેવા કિસ્સાઓમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડતો હતો. આ વ્યવસ્થાને યથાવત્ જાળવી રાખવામાં આવી છે.

ભાગીદારોને ચૂકવવામાં આવતી રકમ પર 10 ટકા TDS કરવો પડશે

નાણા મંત્રી નિર્મલા સીતારમણે ટીડીએસની જોગવાઈમાં ફેરફાર કરીને ટીડીએસના દર 5 ટકાથી ઘટાડીને બે ટકા અને કેટલાક કિસ્સાઓમાં એક ટકાથી ઘટાડીને 0.1 ટકા કરી દેવાનો નિર્ણય કર્યો છે. જૂની વ્યવસ્થા હેઠળ ભાગીદારી પેઢી દ્વારા ભાગીદારોને ચૂકવવામાં આવતાં મહેનતાણાં, વ્યાજ, કમિશન પર કોઈ પણ જાતની કરકપાત-ટીડીએસ કરવાની જોગવાઈ નહોતી. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ જતીન સી. શાહનું કહેવું છે કે નાણામંત્રીએ ટીડીએસમાં સૂચવેલા સુધારાને પરિણામે ભાગીદારોને ચૂકવવામાં આવતી રકમ રૂ. 20,000થી વધી જાય તો તેના પર 10 ટકાના દરે ટીડીએસ કરવો પડશે.

પગાર, બોનસ, મહેનતાણાં અને વ્યાજની ચુકવણીની રકમ રૂ. 20,000થી વધારે થાય તો સલમ 194-ટી હેઠળ 10 ટકાના દરે ટીડીએસ કરવો પડશે

પગારદાર કર્મચારીએ વિદેશ ભણવા ગયેલા સંતાનને મોકલેલાં નાણાં પર થયેલા ટીડીએસની રકમ તેમ જ મોટરકારની ખરીદી પર થયેલા ટીડીએસની રકમ પગારની રકમમાંથી ટીડીએસ કરતી વેળાએ ટીડીએસની રકમ મજરે લઈ ગણતરીમાં લેવામાં આવશે. આ વ્યવસ્થાને કારણે કરદાતાના હાથ પહેલાંની તુલનાએ વધુ પગાર આવશે. તેથી તેના હાથમાં વધુ રોકડ રહેશે.

પગારદાર કરદાતાઓને ટીડીએસની ગણતરીમાં ટીડીએસ કપાવવામાં આવ્યો હોય તે અગાઉ ગણતરીમાં લેવામાં આવતો નહોતો. હવે ટીડીએસની કપાત ગણતરીમાં લેવામાં આવશે.

1 સલમ 194ડી હેઠળ વીમાના કમિશન પર પહેલાં 5 ટકા ટીડીએસ કરવામાં આવ્યો હતો તે હવે ઘટાડીને 2 ટકા કરી દેવામાં આવ્યો છે. પહેલી એપ્રિલ 2025થી નવા દર લાગુ પડશે

સલમ 194 ડીએ હેઠળ ગ્રુપન વીમા પોલિસીના પેમેન્ટ પર 5 ટકા ટીડીએસ હતો તે ઘટાડીને પહેલી ઓક્ટોબર 2024થી અમલમાં આવે તે રીતે બે ટકા કરી દેવામાં આવ્યો છે

2 સલમ 194 ગ્રુ હેઠળ લોટરી ટિકિટના વેચાણ પર મળતા કમિશનની રકમ પર 5 ટકા ટીડીએસ કરવામાં આવતો હતો તે પહેલી ઓક્ટોબર 2024થી ઘટાડીને 2 ટકા કરી દેવામાં આવ્યો છે

સલમ 194 એચ હેઠળ કમિશન તથા દલાલી પર 5 ટકા ટીડીએસ કરવામાં આવતો હતો તે પહેલી ઓક્ટોબર 2024થી ઘટાડીને 2 ટકા કરી દેવામાં આવ્યો છે

3 સલમ 194આઇબી હેઠળ ચોક્કસ વ્યક્તિ કે હિન્દુ અપિલક્ત પરિવાર દ્વારા ચૂકવવામાં આવતાં ભાડાં પર 5 ટકા ટીડીએસની જોગવાઈ પહેલી ઓક્ટોબર 2024થી બે ટકા કરી દેવામાં આવી છે

સલમ 194એમ મુજબ ઇ-ફોર્મ્સ ઓપરેટર્સ દ્વારા અન્ય ઇ-ફોર્મ્સ કરનારાને કરવામાં આવતા પેમેન્ટ પર 5 ટકા ટીડીએસ કરવાની જોગવાઈ સુધારીને 2 ટકા કરી છે

4 સલમ 194એમ હેઠળ કોઈ વ્યક્તિ કે હિન્દુ અપિલક્ત પરિવાર દ્વારા દલાલી, પ્રોફેશનલ સર્વિસ, કે કોન્ટ્રાક્ટના પેમેન્ટ કરવામાં આવ્યા હોય અને તે રકમ રૂ. 50 લાખથી વધારે હોય તો તેના પર કરાતો ટીડીએસ પહેલી ઓક્ટોબર 2024થી ઘટાડીને બે ટકા કરી દેવામાં આવ્યો છે.

5 194ઓ હેઠળ ઇ-ફોર્મ્સ ઓપરેટર દ્વારા અન્ય કોઈ ઇ-ફોર્મ્સ સાથે સંકળાયેલી વ્યક્તિને પેમેન્ટ કરવામાં આવતી રકમ પર એક ટકા ટીડીએસ કરવાની જોગવાઈ હતી તે ઘટાડીને 0.1 ટકા (10 પેસા) કરી દેવામાં આવી છે. આ જોગવાઈ પહેલી ઓક્ટોબર 2024થી લાગુ પડશે.



**પહેલાં 10 વર્ષ
સુધીના કેસ
રિઓપન થતા હતા,
હવે છ વર્ષના જ
બ્લૉક પિરિયડની
આકારણી
નપેસરથી કરવામાં
આવશે**

આવકવેરાના દરોડાના કેસમાં બ્લૉક અસેસમેન્ટની સ્કીમ ચાલુ કરવામાં આવી

આ

વકવેરાના દરોડા પડ્યા હોય તેવા કિસ્સાઓમાં કરદાતાઓ માટે બ્લૉક અસેસમેન્ટની સ્કીમ ફરીથી ચાલુ કરવાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી છે. ભૂતકાળમાં 2003ની સાલમાં આ સ્કીમ બંધ કરી દેવામાં આવી હતી. બજેટમાં આ સ્કીમને પાછી ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આવકવેરા ધારાની કલમ 158 બી અને 158 બીએ હેઠળ આ સ્કીમ ચાલુ કરવામાં આવી છે. પહેલી સપ્ટેમ્બર 2024 પછી કોઈ પણ કરદાતાને ત્યાં દરોડા પાડવામાં આવશે તો તેમને માટે આ નવી સ્કીમ લાગુ કરવામાં આવી છે. બ્લૉક અસેસમેન્ટમાં કરદાતાને ત્યાં જે વર્ષ દરોડા પડ્યા હશે તેની આગળનાં છ વર્ષ અને ચાલુ આકારણી વર્ષ સહિત સાત આકારણી વર્ષના હિસાબોની સાથે આકારણી કરવામાં આવશે. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હેમ છાજેડનું કહેવું છે કે આકારણીની પ્રક્રિયા બાર મહિનામાં પૂરી કરી દેવાનું જણાવવામાં આવ્યું છે. અધિકારીઓએ છેલ્લું પંચનામું કર્યું તે તારીખ પછીના બાર મહિનામાં આકારણીની કામગીરી પૂરી કરી દેવાની રહેશે. આવકવેરા ધારાની કલમ 153 બી, 153 સી અને 153 ડી હેઠળ આ કામગીરી બાર માસમાં પૂરી કરવાની રહેશે. દરોડા પાડવા માટે જે તારીખ કમિશનર અધિકૃત કરે તે તારીખથી છ મહિનાની અંદર દરોડા પાડનાર અધિકારીએ આકારણી અધિકારીને દરોડા દરમિયાન મળી આવેલી બધી જ વસ્તુઓ સુપરત કરી દેવાની રહેશે.

દરોડા દરમિયાન આવકવેરાની ચોરીની જે વિગતો હાથ લાગી હોય, વેપારીના ચોપડા, હિસાબો સહિત જે કોઈ પણ સ્વરૂપમાં કરચોરી કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હોય તો તેને આધારે દરેક વર્ષની છુપાયેલી આવક

બ્લૉક પિરિયડની આકારણીના કુલ વર્ષના ગાળાની આકારણીના દરેક વર્ષ માટે તેને ગણતરીમાં લેવામાં આવશે.

દરોડા પાડવામાં આવ્યા હોય તેના છ માસની અંદર જ દરોડા પાડનારા અધિકારીઓએ દરોડાને લગતો સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરીને આકારણી અધિકારીને મોકલી દેવાનો રહેશે. આકારણી અધિકારીએ એક વર્ષમાં તેની આકારણી કરી દેવાની રહેશે.

આવકવેરા ધારાની કલમ 158 બીએફ હેઠળ કરવામાં આવેલી જોગવાઈ મુજબ દરોડા હેઠળની આકારણીની રકમ પર કેટલાક વ્યાજ અને પેનલ્ટી લાગુ પડશે નહિ. આમ કલમ 132-એ, 234 એ, 234 બી, 234 સી હેઠળ વ્યાજ તથા કલમ 270 એ મુજબ પેનલ્ટી પણ લાગુ પડશે નહિ. પરિણામે આવકવેરાની કલમ 113 મુજબ જાહેર ન કરેલી આવક પર 60 ટકાના દરે ટેક્સ લાગુ પડશે. કરદાતાએ તેના આવકવેરાના રિટર્નમાં પહેલી સપ્ટેમ્બર 2024 પછી પાડવામાં આવેલા દરોડામાં જાહેર ન કરેલી આવકનું રિટર્ન સમયમર્યાદામાં ફાઈલ ન કરે તો જાહેર ન કરેલી આવકવેરાની રકમ પર માસિક 1.5 ટકાના દરે વ્યાજ વસૂલવામાં આવશે. તેમ જ છુપાયેલી આવક પર 50 ટકા સુધીનો દંડ વસૂલી શકશે.

અત્યારે 2021થી દરોડા દરમિયાન 50 લાખથી વધુ રકમ છુપાયેલી હોવાનું બહાર આવે તો કેસ રિઓપન કરીને 10 વર્ષ સુધીની આકારણી કરવા માટેની સત્તા હતી. હવે મહત્તમ છ વર્ષનાં રિટર્ન ફરીથી ચકાસશે. જૂની વ્યવસ્થા હેઠળ દર વર્ષે એક એક વર્ષનો કેસ રિઓપન કરતા જતા હોવાથી વરસો સુધી કરદાતાને સર્ચની આકારણી માટે ધક્કા ખાવા પડતા હતા. હવે આ જફામાંથી કરદાતાને મુક્તિ મળશે.



આવકવેરાના કેસના રિઓપનિંગ માટે જોઇન્ટ કમિશનરની મંજૂરી મેળવવી પડશે

ક

રદાતાએ છુપાવેલી કે જાહેર કરવાની રહી ગઈ હોય તેવી આવકના કિસ્સામાં આકારણી અધિકારીએ આકારણી કે પુનઃ આકારણી કરતાં પહેલાં આવકવેરા ધારાની કલમ 148 - એ (3) મુજબ કરદાતાને રિટર્ન ફાઈલ કરવા માટે ત્રણ મહિના સુધીના સમયગાળા માટે નોટિસ આપવાની રહેશે. પહેલી સપ્ટેમ્બર 2024થી નવી જોગવાઈ લાગુ કરવામાં આવશે. આવકવેરાની કલમ 148 અને 149 હેઠળ ત્રણ વર્ષનાં રિટર્ન સામાન્ય સંજોગોમાં રિઓપન કરી શકાશે, પરંતુ જો રૂ. 50 લાખથી વધુ રકમની આકારણી રહી ગઈ હોય તો તેવા કિસ્સાઓમાં સવા પાંચ વર્ષનાં રિટર્ન રિઓપન કરવાની સત્તા આપવામાં આવી છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બીરેન ડી. શાહનું કહેવું છે કે અગાઉ જે 6 વર્ષ અને 10 વર્ષની સમયમર્યાદા હતી તે ઘટાડીને 6 વર્ષ કરી દેવામાં આવી

છે. આ ફેરફારને કારણે કરદાતાઓને ખાસ્સી રાહત મળી જશે.

કરદાતાને આપવામાં આવેલી નોટિસ સાથે જ આવકવેરા અધિકારીએ કરદાતાને તેણે પોતે કરેલી સૂચિત આકારણીનો ઓર્ડર પણ મોકલવાનો રહેશે, પરંતુ આકારણી અધિકારીને

કલમ 135 એ હેઠળ માહિતી મળી હોય તો તેવા સંજોગોમાં ચોક્કસ ઓથોરિટીની આગોતરી મંજૂરી મેળવ્યા વિના નોટિસ આપી શકશે નહિ. આવકવેરાના કેસ રિઓપન કરવા માટે આવકવેરા ધારાની કલમ 151માં ફેરફાર કરીને અગાઉ જે મંજૂરી કમિશનર, ચીફ કમિશનર, પ્રિન્સિપલ ચીફ કમિશનર પાસેથી લેવાની હતી તે જ મંજૂરી એડિશનલ કમિશનર, એડિશનલ ડાયરેક્ટર કે જોઈન્ટ ડાયરેક્ટર પાસેથી લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આવકવેરા અધિકારીએ આપેલી સમયમર્યાદામાં કરદાતા રિટર્ન ફાઈલ ન કરે તો તે કલમ 139(1) હેઠલ રિટર્ન ન ફાઈલ કરવામાં આવ્યું હોવાનું ગણી લેવામાં આવશે.

જૂની વ્યવસ્થા હેઠળ કેસના રિઓપનિંગની મંજૂરી કમિશનર, ચીફ કમિશનર, પ્રિન્સિપલ ચીફ કમિશનર પાસેથી લેવાની હતી



કરવિવાદના કેસોને ઝડપી ઉકેલવા વિવાદ સે વિશ્વાસની નવી યોજના જાહેર

ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડીને યોજનાના નિયમો અને શરતોની જાહેરાત કરવામાં આવશે. કરદાતાઓની અપીલના કેસોનો ઝડપથી નિકાલ કરવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં વિવાદ સે વિશ્વાસ તકની નવી યોજના જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના અંગેનું નોટિફિકેશન આગામી દિવસમાં બહાર પાડવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. અત્યારે આઠથી દસ લાખ કેસો પેન્ડિંગ પડ્યા હોવાનું માનવામાં આવે છે, એમ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મહેશ છાજેડનું કહેવું છે. અગાઉ 2020માં વિવાદ સે વિશ્વાસ તકની સ્કીમ જાહેર કરવામાં આવી હતી. આ સ્કીમમાં 31મી જાન્યુઆરી 2020 સુધીની જે અપીલો પેન્ડિંગ હતી તેને કમિશનર અપીલ, ટ્રિબ્યુનલ, હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જે અપીલો પેન્ડિંગ હતી તેને કરવિવાદમાંથી મુક્ત કરવાની યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજનાને ઘણો સારો પ્રતિભાવ મળ્યો હતો. તેમાં ઘણા કેસોનો નિકાલ પણ આવી જતો હતો.

ટૂંક સમયમાં નોટિફિકેશન
બહાર પાડીને યોજનાના
નિયમો અને શરતોની
જાહેરાત કરવામાં આવશે



કરકપાતની રકમ જમા કરાવવામાં વિલંબ થાય તો જેલની સજા કરવાની જોગવાઈમાં રાહત આપી

કરકપાતની રકમ નિર્ધારિત તારીખથી બે દિવસ પણ મોડી જમા કરાવે તો તેને જેલની સજા કરવા માટે કોર્ટ કાર્યવાહી કરવામાં આવતી હતી તેમાં ફેરફાર કરીને ટીડીએસના ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ સુધીમાં તે રકમ જમા કરાવી દે તો તેવા કિસ્સામાં કોર્ટ કાર્યવાહી ન કરવાની જોગવાઈ કરી દેવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં કરેલી આ જોગવાઈને કારણે કરદાતાને મોટી રાહત મળી જશે. કોઈ પણ વ્યક્તિને કરવામાં આવતી કોઈ પણ રકમની ચુકવણીમાંથી કરવાને પાત્ર બનતી કપાતની રકમ સમયસર સરકારમાં જમા ન

કરાવે તો ત્રણ મહિનાથી સાત વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી હતી. આ જોગવાઈમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે

**ટીડીએસનાં રિટર્ન
ફાઈલ કરતાં પૂર્વે તે
રકમ જમા કરાવી દે
તો કોર્ટ કાર્યવાહી નહિ
કરાય**

આંશિક રાહત આપી છે, એમ ડૉ. અંકિતા સંચેતીનું કહેવું છે. કેટલાક કિસ્સાઓમાં કરદાતા બીમાર હોય કે પછી બહારગામ ગયા હોય તેવા કિસ્સાઓમાં પણ ટીડીએસની વિલંબિત ચુકવણી માટે કોર્ટ કાર્યવાહી થઈ જતી હતી. આવકવેરા અધિકારીઓના જક્કી વલણને કારણે કરદાતાઓને ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હતો. ભૂતકાળમાં એક જ દિવસનો વિલંબ થતાં કરદાતા સામે કોર્ટ કાર્યવાહી કરી દેવામાં આવતી હતી. એક દિવસના વિલંબ માટે જેલની સજા કરવા જેવાં આકરાં પગલાં લેવામાં આવતાં હતાં.

બુલિયન ટ્રેડર્સ અને
ચાંદીના વેપારીઓના
કરોડો રૂપિયા સરકારની
તિજોરીમાં અટવાઈ જતાં
બચી જશે

કલમ 194-ક્યૂમાં
રાહત આપી હોવાથી ઓછા
દરથી કપાત કરવાનું
પ્રમાણપત્ર આવકવેરા
કમિશનર પાસેથી મેળવી
શકાશે

કેમિકલ, કાપડ, ટેકસ્ટાઇલ
ગાર્મેન્ટ, ટિમ્બર, સ્ટીલ
અને સ્ટીલનો ભંગારના
વેપારીઓને લોઅર
ટીડીએસની વ્યવસ્થાનો
લાભ મળશે

સોના-ચાંદીની ખરીદીમાં 10 પૈસા

TCS-TDS કરવાની જોગવાઈમાં રાહત આપી

ક

કલમ 194 ક્યૂ હેઠળ લોઅર ડિડકશન કરવાની મંજૂરી માગવાની છૂટ વેપારી આલમને આપવામાં આવી હોવાથી વેપારીઓના સરકારની તિજોરીમાં કરોડો રૂપિયા અટવાઈ જતાં અટકી જશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં કરેલી નવી વ્યવસ્થા હેઠળ વેપારીઓને લોઅર ટેક્સ રેટ માટે અરજી કરવાની છૂટ આપવાનો નિર્ણય લીધો છે.



આ નવતર વ્યવસ્થાનો લાભ સોના-ચાંદીના વેપારીઓ ઉપરાંત કેમિકલ, કાપડ, ફાર્મસ્યુટિકલ્સ મેન્યુફેક્ચરર્સ, હોલસેલર્સ, રિટેલર્સ, રેડીમેડ ગાર્મેન્ટ, ટિમ્બર, સ્ટીલ અને સ્ટીલનો ભંગાર તથા હાર્ડવેર સહિતના સંખ્યાબંધ બિઝનેસ સાથે સંકળાયેલા અને વાર્ષિક રૂ. 10 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનારા વેપારીઓને મોટી રાહત મળશે.

આવકવેરા ધારાની કલમ 194 ક્યૂમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ માલની ખરીદી ઉપર પેમેન્ટ કરતી વખતે કલમ 194 ક્યૂની જોગવાઈ હેઠળ અને માલનું વેચાણ કરતી વખતે કલમ 206-સી (1) (એચ) મુજબ 0.1 ટકા એટલે કે રૂ. 100 પર દસ પૈસા પ્રમાણે ટેક્સ કલેક્શન એટ સોર્સ-ટીસીએસ કરવાથી સોના અને ચાંદીના વેપારીઓના કરોડો રૂપિયા સરકારની તિજોરીમાં અટવાઈ જતા હતા. સોના-ચાંદી ઉપરાંત 10 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા દરેક વેપારને આ જોગવાઈ લાગુ પડે છે તેમ જ કોઈ એક પાર્ટી સાથે એક વર્ષ દરમિયાન રૂ. 50 લાખથી વધુનો વેપાર કર્યો

હોય તેવા કેસમાં 10 પૈસાના દરે ટીડીએસ કે ટીસીએસ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે.

એડવોકેટ મૃદંગ વકીલનુ કહેવું છે કે 2024ના બજેટમાં કલમ 61નો ઉમેરો કરીને 194-ક્યૂમાં રાહત આપવામાં આવી હોવાથી ઓછા દરથી કપાત કરવાનું પ્રમાણપત્ર આવકવેરા કમિશનર પાસેથી મેળવી શકાશે. આ જોગવાઈને પહેલી ઓક્ટોબર 2024થી અમલમાં મૂકવાનો નાણામંત્રીએ નિર્ણય લીધો છે. આ જોગવાઈનો લાભ લેવા માટે વેપારીએ આખા વર્ષનું અંદાજિત નફા-નુકસાન ખાતાની વિગતો અને કયા વેપારી સાથે અંદાજે કેટલા આર્થિક વહેવારો થશે તેની વિગતો આકારણી અધિકારીને આપવાના રહેશે. તેમ જ કેટલો ટેક્સ કપાશે તેની વિગતો પણ આપવાની રહેશે. વેપારીના અંદાજિત નફાની સામે ટેક્સની ઊભી થનારી જવાબદારી કરતાં ટીડીએસ કે ટીસીએસ વધુ કપાતો હોય તો તેવા કિસ્સાઓમાં આકારણી અધિકારી તે દરેક વેપારીને સંબોધીને ઓછો ટીડીએસ કે ટીસીએસ કરવાની મંજૂરી આપી શકશે.

આ સર્ટિફિકેટ વેપારી સમક્ષ રજૂ કરીને તે મુજબ ઓછો ટીડીએસ કે ટીસીએસ કરાવવાની વ્યવસ્થાનો લાભ મેળવી શકશે. આમ વેપારીના બિનજરૂરી રીતે કરોડો રૂપિયા સરકારી તિજોરીમાં પડી રહેતાં અટકી જશે. તેમ જ આગોતરી મંજૂરી મેળવી હોવાથી આવકવેરા અધિકારીઓ તેની સામે કાયદાના ભંગની કાર્યવાહી પણ કરી શકશે નહિ. તેને કારણે વેપારી આલમને બહુ જ મોટો લાભ થવાની સંભાવના રહેલી છે.



રહેઠાણનાં ભાડાંની આવકને બિઝનેસ ઇન્કમ તરીકે બતાવી શકાશે નહિ

બજેટમાં નવી જોગવાઈ કરીને રહેઠાણનાં ભાડાંની આવકને બિઝનેસ ઇન્કમ તરીકે દર્શાવનારાઓ પર બ્રેક લગાવી દીધી છે. ભાડાંની આવકને હાઉસ પ્રોપ્ર્ટીની આવકના શીર્ષક હેઠળ બતાવવાની હોય છે, પરંતુ કરદાતાઓ તેને ધંધાકીય આવક તરીકે દર્શાવીને મકાનમાલિકો તેના પરનો કરવેરો ભરવાનું ટાળવા આવક ઓછી દર્શાવતા હતા.

રહેઠાણનાં ભાડાંની આવકને બિઝનેસની આવક તરીકે નહિ ઓળખાવી શકાય તે માટે પહેલી એપ્રિલ 2024થી જ આ જોગવાઈને લાગુ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલાક કરદાતાઓ તેમની ભાડાંની આવકમાંથી આવકવેરો બચાવવા માટે તેને બિઝનેસ ઇન્કમ તરીકે ઓળખાવતા હતા. તેમાંથી માણસોના પગાર, ગાડી, કોમ્પ્યુટર વગેરેના ઘસારા, ટ્રાવેલિંગ ખર્ચ સહિતના જુદા જુદા ખર્ચાઓ બાદ મેળવી લઈને આવક ઓછી દર્શાવતા હતા. આ રીતે આવકવેરાની મોટી ચોરી કરતા હતા. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અંકિત મહેતાનું કહેવું છે કે ઓનલાઈન રિટર્નને કારણે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાને પરિણામે આ હકીકત નાણાં મંત્રાલયના ધ્યાનમાં આવી ગઈ હતી. તેથી આ જોગવાઈ દાખલ કરવામાં આવી છે.


આ જ રીતે રૂ. 50 લાખથી વધુના મૂલ્યની સ્થાવર મિલકતના વેચાણના કિસ્સામાં

ખરીદનારે કલમ 194 આઈએ હેઠળ કુલ વેચાણની રકમના એક ટકા મુજબ ટીડીએસ કાપવો ફરજિયાત છે, પરંતુ કેટલાક કરદાતાઓ એક જ પ્રોપર્ટી બે કે વધુ વ્યક્તિના નામે હોય અને તેમને ચૂકવવા પાત્ર રકમ રૂ. 50 લાખથી ઓછી હોય તેવા કિસ્સાઓમાં તેમને ચૂકવવા પાત્ર રકમમાંથી ટીડીએસ કરતા નહોતા.

ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો કોઈ મિલકત રૂ. 60 લાખમાં વેચવામાં આવે છે. આ મિલકતના બે હકદાર છે. તેથી તેમને 30-30 લાખ ચૂકવવામાં આવે છે. આ પ્રકારના સોદાઓમાં કેટલાક કરદાતાઓ વ્યક્તિગત રકમ 50 લાખથી ઓછી હોવાથી કરકપાત કરતા જ નહોતા. કાયદાની આ છટકાબારીને ભૂરી દેવાના ઇરાદા સાથે પ્રોપ્ર્ટીદીઠ કિંમત રૂ. 50 લાખથી વધુ હોય તો તેવા કિસ્સાઓમાં પ્રોપર્ટીદીઠ એક ટકાનું ટી ડી એ સ કરવાનું ફરજિયાત કરી દેવા માં

આવ્યું છે. તેમાં વેચનાર કે ખરીદનાર ગમે તે હોય તેમાંથી કરકપાત કરવી ફરજિયાત છે. જોકે કરદાતાનો કાયદેસરનો પાન કાર્ડ નંબર ન હોય તો તેવા કિસ્સાઓમાં 20 ટકાના દરે ટીડીએસ કરવો ફરજિયાત કરવામાં આવ્યો છે.

**50 લાખથી વધુની
કિંમતની મિલકત પર એક કે
20 ટકાના દરે કરકપાત કરવી
ફરજિયાત કરવામાં આવી**




મધ્યમ કંપનીને સપ્લાયરની કૅટેગરીમાં મૂડી નાની કંપનીઓની સલામતી વધારી

ના

ની કંપનીઓની કલમ ૪૩ (બી)એચ દૂર કરવાની માગણીનો બજેટમાં અસ્વીકાર કરવામાં આવ્યો છે, પરંતુ તેની સામે મીડિયમ કંપનીઓને પણ સપ્લાયર તરીકે ગણતરીમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાથી તેમને પણ ૪૫ દિવસમાં પેમેન્ટ કરી દેવાની ફરજ પાડવામાં આવે તેવો નિર્દેશ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કરતાં આપ્યો છે. નાના ઉદ્યોગોની માફક કલમ ૪૩ (બી) એચ હેઠળ મીડિયમ ઈન્ડસ્ટ્રીઝને પણ ૪૫ દિવસના પેમેન્ટની શરત લાગુ પડી શકે તેમ હોવાનું એડવોકેટ અને જ્યુરીસ લીગલ પ્રેક્ટિશનર્સના સિનિયર પાર્ટનર અને નાના અને મધ્યમ ઉદ્યોગના એક્સપર્ટ અર્પિત કચોલિયાનું કહેવું છે. નાણામંત્રીએ નાના ઉદ્યોગની માફક મીડિયમ ઈન્ડસ્ટ્રીઝને પણ સપ્લાયર ગણવાનો ઈશારો કરીને તેને પણ ૪૫ દિવસના પેમેન્ટનો નિયમ લાગુ પડશે તેવો નિર્દેશ બજેટના માધ્યમથી આપ્યો છે. તેમ થાય તો નાના ઉદ્યોગની માફક મીડિયમ ઈન્ડસ્ટ્રીઝને પણ ૪૫ દિવસમાં જ પેમેન્ટ આપી દેવાનો નિયમ લાગુ પડશે.

અર્પિત કચોલિયા વધુમાં જણાવે છે કે એમએસએમઈ ડી એક્ટની કલમ 2006માં પ્રોવિઝન કરવામાં આવી છે. તેની કલમ કલમ 2 (એન)માં સપ્લાયરની ડેફિનેશન આપવામાં આવેલી છે. તેમાં લખેલું છે કે માર્કેટ એન્ડ સ્મોલને કલમ 243 બી (એચ) હેઠળ સપ્લાયર ગણવાનો નિર્દેશ આપ્યો છે. તેમાં મીડિયમનો નિર્દેશ કરવામાં આવેલો નથી. હવે નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં કલમ 243 (બી) (એચ) હેઠળના સપ્લાયરની વ્યાખ્યામાં મીડિયમ યુનિટનો ઉમેરો કરી દીધો છે. તેના પરથી પણ નિર્દેશ મળે છે કે મધ્યમ ઉદ્યોગોને આવરી લેવામાં આવ્યા છે. 2006ના એક્ટમાં હવે સપ્લાયરની વ્યાખ્યામાં માર્કેટ-સ્મોલ અને મીડિયમ ત્રણેય વર્ગની કંપનીઓ આવી જશે. તેથી સપ્લાયરની વ્યાખ્યા જ્યાં જ્યાં લાગુ પડે છે એટલે કે એમએસએમઈ સમાધાન, 243 બી (એચ) અને ટ્રેડ્સ પ્લેટફોર્મ દરેક સ્થાને મધ્યમ કદની કંપનીઓનો સમાવેશ થઈ જશે. પહેલાં 243 બી (એચ) માર્કેટ અને સ્મોલને લાગુ પડશે તેમ



દરેક નાની કંપનીની ડિજિટલ
ફૂટપ્રિન્ટ હોતી નથી. તેમને
માટે ડિજિટલ ફૂટપ્રિન્ટ
બતાવવી અઘરી છે. તેથી તેમણે
કન્સલ્ટન્ટ્સ હાયર કરવા પડશે.
આ કન્સલ્ટન્ટ્સ બેથી પાંચ ટકા
કમિશન લઈ જાય છે.



N.G. Group

- Gallops Infrastructure Ltd.
- N.G. Realty Pvt. Ltd.
- Gallops Infracon Pvt. Ltd.
- Ashwa Infracon Pvt. Ltd.
- N.G. Developers
- N.G. Corporation
- Gallops Enterprises Ltd.

Managing Director - N.G. Group (Gallops): Varun Patel has held the position of Managing Director at N.G. Group, specifically associated with Gallops. Under his leadership N.G. Group complete some amazing projects in the field of construction like Vestas (Denmark Wind Mill Manufacturing Company), Amazon (US Company), IBCC (US Company), Reliance (Indian Giant), Gallops Mall, Gallops Industrial Park, Tata (Croma - Indian Corporate) etc., So his role as Managing Director suggests a significant leadership position within the organization. Also his big role in 2 more company about Equiserch Broking Pvt. Ltd. about equity & finance.

President - Underwater Sports Association of Gujarat: Serving as the President of the Underwater Sports Association of Gujarat highlights Varun Patel's involvement in promoting and developing underwater sports in the state. This position likely involves overseeing and coordinating activities related to underwater sports.

Invitee Director - GIHED CREDAI Ahmedabad: GIHED CREDAI (Confederation of Real Estate Developers' Associations of India) Ahmedabad is an influential association in the real estate sector. As an Invitee Director, Varun Patel may have contributed to the real estate industry in Ahmedabad, possibly offering insights and expertise.




Director of Rajpath Club: Being a Director of Rajpath Club indicates his involvement in managing and overseeing the operations and activities of the club. Rajpath Club is a well-known social and recreational club in Ahmedabad, and this role suggests his commitment to community engagement.

Co-opt EC - Gujarat Chamber of Commerce & Industries: Serving as a Co-opted member of the Executive Committee at the Gujarat Chamber of Commerce & Industries implies that Varun Patel plays a role in shaping the policies and initiatives related to commerce and industries in the region.

Special Invitee Member in (BAI) Builders' Association of India: As a Special Invitee Member of the Builders' Association of India, Varun Patel may have been involved in discussions and decision-making related to the construction and real estate industry on a national level.

These roles and affiliations demonstrate Varun Patel's active involvement in various sectors, including real estate, sports, and commerce, and highlight his dedication to community and industry development. His contributions to these organizations and associations likely reflect his extensive experience and expertise as a business leader in Gujarat.

Varun Patel
N.G. Group

 varunpatel80  varunpatel80  varunpatel80

ફૂડ પ્રોસેસર્સ માટે ઇન્ડિયેશન સેન્ટર સ્થપાશે

સંદીપ સાંગલે કહે છે કે ફૂડ પ્રોસેસિંગના સેગમેન્ટની નાની કંપનીઓને માટે 50 ઈન્ડિયેશન સેન્ટર સ્થાપવા માટે નાણાકીય સહાય આપવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે તેમ જ નેશનલ એક્ટિવિટી બોર્ડની માન્યતા ધરાવતી 100 જેટલી લેબોરેટરી સ્થાપીને નાના ઉદ્યોગોના ફૂડ પ્રોડક્ટ્સની ગુણવત્તાની અને સલામતીનું પરીક્ષણ કરી આપવાની અને ગુણવત્તાને નિયંત્રિત કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેજસ મહેતા કહે છે, “ફોડન ફૂડ અને પ્રોસેસ ફૂડની ડિમાન્ડ સતત વધતી રહેવાની છે. તેથી આ પગલું ખરેખર આવકાર્ય છે.” અર્પિત કચોલિયા કહે છે, “પ્રોસેસ ફૂડની શેલ્ફલાઈફ વધારી આપે છે. તેમાં ખાસ પ્રકારનાં કિરણો પસાર કરીને તેની લાઈફ વધારી આપવાનું કામ કરે છે. તેનાથી ક્વોલિટી ઓફ ફૂડ વધી જશે. તેથી નાના ફૂડ પ્રોસેસર્સ તેના ફૂડની ક્વોલિટી સુધારી શકશે અને વિશ્વ બજારમાં જોઈતા સ્ટાન્ડર્ડને પહોંચી વળી શકશે.”



જણાવ્યું હતું. હવે સપ્લાયરની રેક્રુટમેન્ટમાં તેમણે મધ્યમ ઉદ્યોગોનો પણ સમાવેશ કરીને આડકતરો ઈશારો કરી દીધો છે કે કલમ 243 મધ્યમ કદની કંપનીઓને પણ લાગુ પડી જશે. આ રીતે માઈક્રો અને સ્મોલ કંપનીઓને જે લાભ મળતો હતો તે તમામ લાભ મીડિયમ કંપનીઓને પણ મળતો થઈ જશે.


બીજી તરફ હવે મધ્યમ ઉદ્યોગોને પણ પેમેન્ટ આપવામાં મોટી કંપનીઓ વિલંબ કરે તો વિલંબના ગાળા પર મોટી કંપનીઓએ મધ્યમ કદના સપ્લાયરને પણ વ્યાજ અને પેનલ્ટી ચૂકવવાં પડશે તેમ જ તેમને તેમના સરવૈયામાં તે ખર્ચ મજરે આપવામાં આવશે નહિ. આ સમસ્યાનો સામનો કરવા મોટી કંપનીઓએ તૈયાર રહેવું પડશે. તેમ થાય તો નાના ઉદ્યોગને ઓર્ડર ન આપીને મીડિયમ ઈન્ડસ્ટ્રીઝને ઓર્ડર

નાના અને મધ્યમ ઉદ્યોગ માટે બજેટમાં ઘિરાણ સરળતાથી મળે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે.



આપવાના મોટા ઉદ્યોગોના વલણ પર બ્રેક પણ લાગશે અને નાના ઉદ્યોગોની સલામતીમાં પણ વધારો થશે. અલબત્ત, સપ્લાય માટેના કરારમાં પેમેન્ટની સમયગાળો નક્કી કરવામાં આવ્યો હોય તો 15 દિવસમાં અને પેમેન્ટના સમયગાળા માટે કોઈ જ કરાર ન કરવામાં આવ્યો હોય તો 45 દિવસમાં નાના ઉદ્યોગોને તેમ જ મધ્યમ ઉદ્યોગોને પેમેન્ટ કરી દેવાની જોગવાઈ કરવામાં આવી

હોવાથી નાના ઉદ્યોગોને બદલે મધ્યમ ઉદ્યોગોને જ ઓર્ડર આપવાના વધવા માંડેલા ચલણ અને વલણમાં બદલાવ આવવા માંડશે. બીજા શબ્દોમાં કહીએ તો નાના ઉદ્યોગની સલામતી માટે 45 દિવસમાં પેમેન્ટ કરવામાં આવેલી જોગવાઈ ભૂમરેન્ગ થવાની એટલે કે તેમને સપ્લાયના ઓર્ડર મળવાના બંધ થઈ જવાની શક્યતા પર પડદો પાડી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો જણાઈ રહ્યું છે. નવા બજેટમાં નાના અને મધ્યમ ઉદ્યોગ માટે કરવામાં આ વેલી જોગવાઈ માં પ્રસ્તુત જોગવાઈ મોટામાં મોટી છે. 43-બી (એચ)માં મધ્યમ ઉદ્યોગોને તેમાં સમાવેશ કરી દેવામાં આવ્યો હોવાથી પેમેન્ટ આપવામાં ગલ્લાતલ્લાં કરતાં મોટા સપ્લાયર સામે સમાધાન પોર્ટલ પર કરવામાં આવતા કેસોમાં મધ્યમ કેટેગરીના ઉદ્યોગોને પણ સ્થાન મળશે. તેનાથી નાના ઉદ્યોગને 45 દિવસમાં પેમેન્ટ કરવાને કારણે નાની કંપનીઓને



ટ્રેડ્સમાં રૂ. 250 કરોડની લિમિટ કરતાં 7000 કંપનીઓ વધશે

ગુજરાતના ઈન્ડસ્ટ્રીઝ કમિશનર સંદીપ સાંગલે કહે છે કે, “ટ્રેડ્સ (TReds) પ્લેટફોર્મ પર સ્થાન મેળવવા માટેની મર્યાદા રૂ. 500 કરોડથી ઘટાડીને રૂ. 250 કરોડ કરવામાં આવી છે. આ પગલું લેવામાં આવ્યું હોવાથી કેન્દ્ર સરકારની માલિકીની જાહેર ક્ષેત્રની નવી 22 કંપનીઓ અને બીજી 7000 જેટલી ખાનગી કંપનીઓ પ્લેટફોર્મ પર ઓનબોર્ડ થશે. આમ આ કેટેગરીમાં મધ્યમ ઉદ્યોગોને પણ સ્થાન આપી દેવામાં આવ્યું છે.” અર્પિત કચોલિયા કહે છે, “ટ્રેડ્સ પ્લેટફોર્મ પર ફાઇનાન્સ કંપનીઓ બિડિંગ કરીને તે બિલના નાણાં ચૂકવી આપે છે. તેનાથી નાની કંપનીઓની આર્થિક ભીંસ એકદમ ઓછી થઈ જાય છે. બજેટમાં રૂ. 250 કરોડની કરવામાં આવેલી જોગવાઈને કારણે તેનો સ્કોપ ખાસ્સો વધી જવાની સંભાવના ઊભી થઈ છે. બીજું, મધ્યમ કદની કંપનીઓ પણ ટ્રેડ્સના પ્લેટફોર્મ પર તેમના નામ રજિસ્ટર કરાવી શકશે. મધ્યમ કદની કંપનીઓ પણ તેમના બિલ ટ્રેડ્સના પ્લેટફોર્મ પર બિડિંગ માટે મૂકી શકે છે.”



ઓર્ડર ન આપવાના મોટી કંપનીઓના વલણને પરિણામે ઊભા થયેલા વિવાદ પર પડદો પડી જશે.

નાના અને મધ્યમ ઉદ્યોગ માટે બજેટમાં ધિરાણ સરળતાથી મળે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે. અર્પિત કચોલિયા કહે છે, “મુદ્રા લોનમાં તરુણની કેટેગરીમાં અત્યાર સુધી રૂ. 10 લાખની આપવામાં આવતી લોનની મર્યાદા વધારીને

રૂ. 20 લાખ કરી દેવામાં આવી છે.

હા, અગાઉ આ કેટેગરીમાં લોન લેનારાઓએ તે લોન નિયમ મુજબ રેગ્યુલર ચૂકવી દીધી હોય તેમને જ આ લોનનો લાભ આપવામાં આવશે.”

ગુજરાત ચેમ્બરની એમએસએમઈ કમિટીના ચેરમેન તેજસ મહેતાનું કહેવું છે કે, “મુદ્રા લોનમાં રૂ. 10ને બદલે રૂ. 20 લાખ આપવાનો નિર્ણય બહુ જ સારો નિર્ણય છે. આ લોનનું ડિસ્બર્સમેન્ટ કેટલું સારી રીતે થાય છે તે વધુ મહત્વનું છે. સામાન્ય રીતે નાના ઉદ્યોગોને લોનની કે ફાઇનાન્સની જરૂર પડે ત્યારે મોટાં વિના કે કોલેટરલ વિના બેન્ક લોન આપતી નથી. આ જ ખચકાટ મુદ્રા લોનમાં પણ જોવા મળે છે. આ માટે રિઝર્વ બેન્ક અને કેન્દ્ર સરકાર બેન્કોને મેન્ડેડ આપે અને ઓછામાં ઓછા પેપરવર્કના માધ્યમથી આ લોનનું વિતરણ નાના ઉદ્યોગોને કરવામાં આવે તે જરૂરી છે. આ લોનનું ડિસ્બર્સમેન્ટ સમયસર થાય અને નાના ઉદ્યોગોને સમયસર ધિરાણ મળે તે વધુ અગત્યનું છે.”

તદુપરાંત કોલેટરલ કે થર્ડ પાર્ટીની ગેરન્ટી વિના જ મશીનરી અને સાધનો ખરીદવા માટે નાની અને મધ્યમ કંપનીઓને ધિરાણ આપવામાં આવશે. તેને માટેની ક્રેડિટ ગેરન્ટી સ્કીમ રજૂ કરવામાં આવશે. પરિણામે નાના અને મધ્યમ ઉદ્યોગોને સરળતાથી ધિરાણ મળતાં થશે. લોન મોટી રકમની જોઈતી હશે તો તેવા સંજોગોમાં અલગથી રચવામાં આવેલા સ્વ-ધિરાણ એટલે કે સેલ્ફ-ફાઇનાન્સ ગેરન્ટી ફંડમાંથી અરજદારને રૂ. 100 કરોડ સુધીની ગેરન્ટીનું કવચ પૂરું પાડવામાં આવશે. હા, લોનનું બેલેન્સ ઘટાડવા માટે લોન લેનારાઓએ અપફ્રન્ટ ગેરન્ટી ફી અને વાર્ષિક ગેરન્ટી ફી આપવી પડશે.

સંદીપ સાંગલે કહે છે કે કેન્દ્રના બજેટમાં જાહેર ક્ષેત્રની બેન્કો નાના અને મધ્યમ ઉદ્યોગોને ધિરાણ આપતી વખતે બહારની કંપનીઓએ આપેલા રેટિંગ પર મદાર બાંધવાને બદલે

માલની ગુણવત્તા સામે સવાલ ઊભો કરી દઈને બે ચાર વર્ષ સુધી પેમેન્ટ સ્થગિત કરાવી દેતી કંપનીઓ





પોતે જ કંપનીની વિગતો મેળવીને બેંક પોતે જ તેની આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરે તેવી વ્યવસ્થા ઊભી કરવી જરૂરી હોવાનું જણાવી બજેટમાં તેના પર ભાર મૂકવામાં આવ્યો છે તેમ જ નાના અને મધ્યમ ઉદ્યોગોની ડિજિટલ ફૂટપ્રિન્ટને પણ ધ્યાનમાં લેવામાં આવશે. આમ તેની પાસે ડિજિટલ પેમેન્ટ સહિતની કેટલી ડિજિટલ સુવિધાઓ છે તેના પરથી પણ કંપનીની ગુણવત્તા કે આર્થિક સંગીનતાનો અંદાજ મેળવીને બેંક તેમને ધિરાણ આપવા અંગે નિર્ણય લેશે. આમ એક નવા જ મોડેલને આધારે નાની કે મધ્યમ કદની કંપનીઓની કેડિટ પાત્રતાની આકારણી કરવાની સિસ્ટમ લાવવામાં આવી રહી છે. ગુજરાત ચેમ્બરના પૂર્વ પ્રમુખ શૈલેશ પટવારી કહે છે, “દરેક નાની કંપનીની ડિજિટલ ફૂટપ્રિન્ટ હોતી નથી. તેમને માટે ડિજિટલ ફૂટપ્રિન્ટ બતાવવી અઘરી છે. તેથી તેમણે કન્સલ્ટન્ટ્સ હાયર કરવા પડશે. આ કન્સલ્ટન્ટ્સ બેથી પાંચ ટકા કમિશન લઈ જાય છે.”

બીજું ટર્નઓવરના અને મિલકત-એસેટ્સના માપદંડને આધારે કંપનીની ધિરાણ મેળવવાની પાત્રતાનો નિર્ણય લેવામાં આવે તો નાની અને મધ્યમ કદની કેડિટ પાત્રતામાં ખાસ્સો સુધારો થવાની સંભાવના રહેલી છે. બીજું, આ વ્યવસ્થા આવતાં ફોર્મલ અકાઉન્ટિંગ સિસ્ટમ ન ધરાવતી નાની કંપનીઓને પણ કેડિટ મળતી થઈ જશે.

નાણાકીય લીડમાં સરકાર પડખે ઊભી રહેશે

નાના અને મધ્યમ ઉદ્યોગો માટે સ્ટ્રેસ પિરિયડ એટલે કે આર્થિક રીતે સંગીન હોવા છતાંય થોડા મહિનાઓ માટે આર્થિક ભીંસમાં આવી ગયેલી નાની કંપનીઓ માટે બેંક ધિરાણની સુવિધા ચાલુ રાખવા માટેની નવી વ્યવસ્થા 2024-25ના વર્ષના બજેટના માધ્યમથી ઊભી કરવામાં આવી રહી છે. આ વ્યવસ્થા હેઠળ નાની કંપનીઓ માટે સ્પેશિયલ મેન્શન અકાઉન્ટ ચાલુ કરવામાં આવશે. સ્પેશિયલ મેન્શન અકાઉન્ટ હોય તો તેને ચાલુ રાખવા અને નાની કંપનીઓની ફસાઈ ગયેલી મૂડીમાં વધારો થતો અટકાવવા માટે કંપનીને ખોડે જતી અટકાવવા માટે સરકાર પોતે ભંડોળ ઊભું કરીને નાની કંપનીઓને આર્થિક મુસીબતના સમયમાં ધિરાણ આપશે. અર્પિત કયોલિયા કહે છે, “નાની કંપનીઓને કુદરતી

આફતને કારણે મોટી મુસીબતનો સામનો કરવાનો આવે તો તેવા સમયે તેમને મદદરૂપ થવા માટે ખાસ ભંડોળ પણ ઊભું કરશે.”

ટ્રેડ્સ પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન વધે તે જરૂરી

પ્રસ્તુત જોગવાઈ અંગે પ્રતિભાવ આપતાં તેજસ મહેતા કહે છે: “રૂ. 500 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓને ટ્રેડ્સ પ્લેટફોર્મ પર રહેવા જણાવવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ થકી જ નાના અને મધ્યમ ઉદ્યોગોને પેમેન્ટ કરવાની વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ પ્લેટફોર્મ પર સંખ્યાબંધ કંપનીઓ હજી સુધી રજિસ્ટ્રેશન જ કરાવ્યું નથી. મોટી કંપનીઓ દ્વારા તેમના નામનું ટ્રેડ્સના પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવવામાં આવે અને નાની કંપનીઓના પેમેન્ટ સમયસર ન કરી શકે તો તેવા સંજોગમાં ટ્રેડ્સના પ્લેટફોર્મના માધ્યમથી બેંક પાસેથી કે પછી અન્ય ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી બિલ ડિસ્કાઉન્ટની સિસ્ટમથી નાની કંપનીઓ પેમેન્ટ મેળવી શકે છે. આ પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવે અને નાના સપ્લાયર દ્વારા કરવામાં આવેલા મટીરિયલની સપ્લાયને મંજૂરી આપી દેવામાં આવે તો બિલ ડિસ્કાઉન્ટની સિસ્ટમથી નાના ઉદ્યોગો સાત દિવસમાં પણ પેમેન્ટ મેળવી શકે છે. આ પ્લેટફોર્મ પર હવે રૂ. 250 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ પણ તેમના નામ રજિસ્ટર કરાવી શકશે. આ પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે,

બેંક મની અકાઉન્ટમાં ફેરફાર કરી લિમિટ વધારી

ભારતીય નાગરિક 20 લાખ સુધીની ફોરેન એસેટ ન બતાવે તો દંડ નહિ. થાય બેંક મની અકાઉન્ટમાં ફેરફાર કરીને 20 લાખ સુધીની જંગમ મિલકત રિટર્નમાં ન દર્શાવનાર દંડમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. આ માટે બેંક મની અનડિસ્ક્લોઝ ફોરેન ઇન્કમ એન્ડ એસેટ્સની કલમ 42માં ફેરફાર કરીને આ જોગવાઈ દાખલ કરી છે. જોકે કરદાતાએ તેની વિદેશમાંની સ્થાવર મિલકત બતાવવામાં ચૂક કરી હશે તો તે જરાય ચલાવી લેવામાં આવશે નહિ, એમ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સંજય શાહ જણાવે છે. કરદતા તેની વિદેશમાંની સ્થાવર મિલકત દર્શાવવાનું ભૂલી જાય તો તેને માટે તેને ચોક્કસ દંડ કરવામાં આવશે. આ જોગવાઈ બિનનિવાસી ભારતીય અને બિનનિવાસી અસામાન્ય નાગરિકને લાગુ પડશે નહિ. માત્ર ભારતીય સામાન્ય રેસિડન્ટને જ આ જોગવાઈ લાગુ પડશે.

પરંતુ તમામ મોટી કંપનીઓએ તેના પર રજિસ્ટ્રેશન કરાવ્યું નથી.” હવે રૂ. 250 કરોડના ટર્નઓવરવાળી કંપનીઓને તેના પર સ્થાન આપવામાં આવ્યું છે. રૂ. 250 કરોડના ટર્નઓવરવાળી કંપનીઓ કેટલું રજિસ્ટ્રેશન કરાવે છે તે આવનારા દિવસોમાં જ ખબર પડશે. આ રજિસ્ટ્રેશન કરાવે તો સમયસર પેમેન્ટ આવવાની શક્યતા વધી જાય તેમ છે. મોટા ભાગની મોટી કંપનીઓ કોઈ ને કોઈ કારણોસર પેમેન્ટ રિલે કરે જ છે. કેટલીક વાર સપ્લાય કરેલા માલની ગુણવત્તા સામે સવાલ ઊભો કરી દઈને એક બે ચાર વર્ષ સુધી પેમેન્ટ



સ્થગિત કરાવી દેનારી કંપનીઓ પણ મોજૂદ છે. આ પ્રકારના સંખ્યાબંધ કેસો ચાલી રહ્યા છે. તેથી જ તેનો અમલ ચુસ્તપણે કરાવવામાં આવે તે જરૂરી છે. સરકારનો ઈરાદો સારો છે, પરંતુ રજિસ્ટ્રેશનના અભાવે નાની કંપનીઓને તેનો જોઈએ તેવો એડવાન્ટેજ મળતો નથી.

ઈ-કોમર્સનાં હબ બનાવવામાં આવશે

નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના માધ્યમથી કુટિરઉદ્યોગ અને હસ્તકળાની પ્રોડક્ટ્સને દુનિયાભરના દેશો સુધી લઈ જઈ શકાય તે માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપના મોડેલ પર ઈ-કોમર્સ હબ વિકસાવવાનું આયોજન 2024-25 ના વર્ષના બજેટના માધ્યમથી કરવામાં આવ્યું છે. નવાં હબ ડેવલપ કરવાને પરિણામે એક જ છત નીચે એકસમાન રેગ્યુલેટરી ફ્રેમવર્ક અને લોજિસ્ટિકની વ્યવસ્થા હેઠળ વેપાર કરવાની તક મળશે. તેમ જ નિકાસ માટે જોઈતી એકસમાન સુવિધા દરેક કારીગરોને મળી રહેશે. અર્પિત ક્યોલિયા કહે છે, “નાની અને મધ્યમ કદની કંપનીઓ ઉપરાંત હસ્તકળાના કારીગરો અને કુટિરઉદ્યોગ કરતાં એકમો પણ જોડાઈ

શકશે. ગુજરાતમાં પણ આ પ્રકારનાં ઈ-કોમર્સ હબ આવવાની શક્યતા નકારી શકાતી નથી.” ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર-ડીપીઆઈ ડેવલપ કરવાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. સર્વિસ સેક્ટર માટેની આ માળખાકીય સુવિધાને પરિણામે નવી તક નિર્માણ થશે અને ખાનગી ક્ષેત્રમાં નવસંસ્કરણમાં એટલે કે ઈનોવેશનમાં વધારો થશે. તેજસ મહેતા કહે છે કે હસ્તકળાના કારીગરે ઉમદામાં ઉમદા પ્રોડક્ટ્સ તૈયાર કરી શકે છે, પરંતુ તેમની પાસે માર્કેટિંગની કુનેહ હોતી નથી. તેમને તેમની પ્રોડક્ટ્સ નિકાસના બજારમાં લોન્ચ કરીને એડવાન્ટેજ લેવાની તક પણ ઈ-કોમર્સ હબને કારણે મળશે. ઈ-કોમર્સ માટે સરકાર ઈ-કોમર્સ પ્લેટફોર્મ લાવે તો તેના થકી પણ નાના હસ્તકળા કારીગરોને મોટો લાભ મળશે. આ માટે ઓએનડીસી પ્લેટફોર્મ સરકારે તૈયાર કરવામાં આવ્યું છે. તેના થકી પોતાના પ્રોડક્ટ્સને પ્રમોટ કરવાની તક પણ નાના હસ્તકળા કારીગરો ઝડપી શકે છે. તેમની આવકમાં પણ વધારો થઈ શકે છે. પ્રાઈવેટ પ્લેટફોર્મના શોપણ સામે નાના ઉત્પાદકો રક્ષણ મેળવી જ શકશે.

ટૂંકમાં બજેટમાં કરવામાં આવેલી નવી જોગવાઈને પરિણામે નાની અને મધ્યમ કદની કંપનીઓને લોન કે નાણાકીય ધિરાણ ઝડપથી મળશે. પેમેન્ટની રિકવરી પણ ઝડપથી થવા માંડશે. સપ્લાયરની રેફિનેશનમાં મધ્યમ કદની કંપનીઓને સમાવી લેવામાં આવશે તો મધ્યમ કદની કંપનીઓને પણ નાના ઉદ્યોગ જેવા લાભ મળી જશે. તેને પણ વર્કિંગ કેપિટલ કે કાર્યકારી મૂડી ફરીથી રોટેશનમાં ઝડપથી આવી જશે. મધ્યમ કદની કંપનીઓ એમએસએમઈ સમાધાન પોર્ટલ પર પણ તેના પેમેન્ટની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી શકશે. ટ્રેડિંગ પ્લેટફોર્મનો પણ તેને લાભ મળતો થઈ જાય તેવી સંભાવના છે.

સિડબી નવાં શહેરોમાં શાખાઓ ચાલુ કરશે

સિડબીની સેવાઓનો લાભ નાનાં નાનાં ક્લસ્ટર્સને મળી રહે તે માટે ટિયર ટુ અને ટિયર થ્રી કેટેગરીમાં આવતાં શહેરોમાં તેની શાખાઓ ખોલવાનો નિર્ણય બજેટના માધ્યમથી લેવામાં આવ્યો છે. આ શાખાઓ આગામી ત્રણ વર્ષના ગાળામાં ખોલી દેવામાં આવશે. ચાલુ વર્ષે જ 24 શાખાઓ સ્થાપવામાં આવશે. તેને પરિણામે દેશના જુદા જુદા વિસ્તારમાં સક્રિય અંદાજે 242 ક્લસ્ટરમાંથી 268 ક્લસ્ટરને સિડબીની સેવાઓનો લાભ મળતો થઈ જશે. અર્પિત ક્યોલિયાએ આ પગલાને આવકાર્યું છે. તેજસ મહેતા કહે છે, “તેનાથી નાના અને મધ્યમ ઉદ્યોગોને સરળતાથી ધિરાણ મળતું થશે. ગુજરાતમાં નવસારી, અમરેલી જેવાં સેન્ટરના નાના ઉદ્યોગ સાહસિકોને તેનો લાભ મળતો થશે.”



નાના ઉદ્યોગોની સમસ્યાઓનો ઉકેલ હજીય છેટો જ છેટો

ના

ના અને મધ્યમ ઉદ્યોગોની અવગણના કરવી કોઈ પણ દેશ કે દેશની સરકારને પોષાય તેમ જ નથી. સિંગાપોર, બેલ્જિયમ અને જર્મની જેવા ડેવલપ કન્ટ્રીમાં એમએસએમઈનો જીડીપી-કુલ રાષ્ટ્રીય ઊપજમાં 65થી 70 ટકા ફાળો આપે છે. ભારતમાં નાના અને મધ્યમ ઉદ્યોગોનો જીડીપીમાં ફાળો 28થી 30 ટકા જેટલો જ છે. તેથી જ ભારતમાં રોજગારીની પણ મોટી સમસ્યા છે. આ સંજોગોમાં એમએસએમઈને પ્રોત્સાહન આપે તો રોજગારીની તક પણ વધે છે અને જીડીપીમાં પણ વધારો થાય છે. ગુજરાત ચેમ્બરના પૂર્વ પ્રમુખ શૈલેશ પટવારી કહે છે, “સરકારે આ વખતે એમએસએમઈ માટે 2024-25ના બજેટમાં સારી જોગવાઈ કરેલી છે, પરંતુ તેની સામે કેટલીક ગંભીર સમસ્યાઓ હજીય છે. મોટાં યુનિટ એમએસએમઈને કલમ 243 બી (એચ) ના લાભથી વંચિત રાખવા માટે નાના એકમો પાસેથી સીધી ખરીદી કરવાને બદલે વચ્ચે ટ્રેડર રાખવાની ફરજ પાડે છે. આમ નાના એકમ ટ્રેડરને આપે અને ટ્રેડર મોટી કંપનીને સપ્લાય આપે તેવી વ્યવસ્થા ઊભી કરવાની નાના એકમોને ફરજ પાડી રહ્યા છે, કારણ કે ટ્રેડરને 15 અને 45 દિવસમાં પેમેન્ટ કરી દેવાનો કાયદો લાગુ પડતો નથી. તેથી મોટી કંપનીઓ ટ્રેડરને પેમેન્ટ આપે તે પછી ટ્રેડર નાના અને મધ્યમ ઉદ્યોગોને



શૈલેશ પટવારી,
પૂર્વ પ્રમુખ GCCI

પેમેન્ટ આપે તેવી વ્યવસ્થા ઊભી કરી દીધી છે. ત્યાર બાદ મોટી કંપનીઓ 180 દિવસે પેમેન્ટ આપે તો તે પછી ટ્રેડર નાના એકમોને પેમેન્ટ આપે છે. નાના એકમોને ધંધો કરવો હોવાથી તેઓ લાચારીથી પણ આ વ્યવસ્થામાં જોડાઈ રહ્યા છે. આ સંદર્ભમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મારફતે રજૂઆત પણ નાણામંત્રી નિર્મલા સીતારમણને કરી હતી. બીજું, મોટા એકમે ટ્રેડરને પેમેન્ટ સમયસર આપી દીધું હોય અને તે ટ્રેડર નાના એકમને પેમેન્ટ ન આપે તો નાના એકમો તેની પાસેથી વસૂલ કરી રીતે કરે તે એક મોટી સમસ્યા બની રહી છે. મોટા યુનિટને સીધી સપ્લાય

આપી હોય તો તેની સામે લિટિગેશન કરવાની નાના સપ્લાયરને તક મળે છે. ટ્રેડર નાના એકમને સમયસર પેમેન્ટ આપે પણ ખરા અને ન પણ આપે તેવી સંભાવના રહેલી છે. આ એક ગંભીર સમસ્યા થઈ ગઈ છે. આ સમસ્યાનો ઉકેલ એ છે કે નાના એકમોની સપ્લાય સાથે સંકળાયેલા તમામને કલમ 243 બી (એચ) હેઠળ આવરી લેવા જોઈએ. આ અંગે યોગ્ય કરવાની ખાતરી પણ નાણામંત્રી નિર્મલા સીતારમણે આપી હતી, પણ બજેટમાં ગણતરીમાં લેવાયું નથી.”

ના ના અ ને મધ્યમ ઉદ્યોગ અંગેની વ્યાખ્યાની પણ સમસ્યા છે. તેમાં લેન્ડ અને બિલ્ડિંગ બનાવવા માટે કરેલા ખર્ચ સિવાયનો રૂ. 50 કરોડનો ખર્ચ કર્યો હોય તો તેને નાના, અતિ નાના એકમ તરીકે ગણતરીમાં લેવામાં આવે છે. તેની સાથે રૂ. 250 કરોડનું ટર્નઓવર હોય તેને મધ્યમ

કદના એકમ તરીકે જોવામાં આવે છે. રૂ. 1000 કરોડનું ટર્નઓવર હોય તો પણ મોટા ઉદ્યોગો તેને લાભ લેવા તેના એક જ યુનિટને ચાર અલગ અલગ યુનિટમાં વિભાજિત કરી દે છે. ચારેય વિભાગને નાના અને મધ્યમ કદના ઉદ્યોગની વ્યાખ્યામાં લઈ જાય છે. આ ચારેયમાં મધ્યમ કદના એકમ તરીકેનો અલગ અલગ લાભ છે. બીજી તરફ બેન્કો મધ્યમ કદના એકમને ફાઇનાન્સ કર્યું હોવાનું બતાવવા માટે આ રીતે મધ્યમ કદના એકમોમાં યુક્તિથી કન્વર્ટ કરી દેવાયેલા એકમોને ફાઇનાન્સ કરી દે છે. પરિણામે મધ્યમ કદની જેન્યુઇન કંપની ફાઇનાન્સથી વંચિત રહે છે. તેની સામે નાના એકમો તેમને રૂ. 2 કરોડની લોન આપવામાં ન આવતી હોવાની ફરિયાદ કોઈ બેન્ક સામે રિઝર્વ બેન્કને કરે ત્યારે તે બેન્ક રિઝર્વ બેન્કને જણાવી દે છે કે અમે તો અમારે એમએસએમઈ એકમને ફાઇનાન્સ કરવાનો ક્વોટા પૂરો કરી દીધો છે. આમ મધ્યમ કે એમએસએમઈના હિસ્સાની લોન

ખરેખર કોણ લઈ જાય છે તેની તપાસ થવી જરૂરી છે. નાની ઈન્ડસ્ટ્રીને રૂ. 1 કે 2 કરોડની લોન મળતી નથી. મોટી ઈન્ડસ્ટ્રી યુક્તિથી રૂ. 50 કરોડની લોન ચારચાર વાર લઈ જાય છે.

આ સંજોગોમાં એમએસએમઈની વ્યાખ્યા બદલવી જરૂરી છે. લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં કરેલા રોકાણ ઉપરાંત રૂ. 20 કરોડ સુધીનું જ રોકાણ કરનારને એમએસએમઈમાં સમાવિષ્ટ કરવા જોઈએ. તેમને માટે રૂ. 100 કરોડના ટર્નઓવરની મર્યાદા રાખવી જોઈએ. અત્યારે લેન્ડ એન્ડ બિલ્ડિંગના ખર્ચ ઉપરાંત રૂ. 50 કરોડના ઈન્વેસ્ટમેન્ટને અને રૂ. 250 કરોડના ટર્નઓવર ધરાવતી કંપનીઓને એમએસએમઈની વ્યાખ્યામાં સમાવવામાં આવેલી છે. અત્યારની વ્યાખ્યાનો ગેરલાભ ઊઠાવવામાં આવી રહ્યો છે. આ બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ બજેટમાં કંઈ જ રિફ્લેક્ટ થયું નથી. તે અમારી કમનસીબી છે.



**સરકાર
MSMEની
વ્યાખ્યા બદલે તો
ખરેખર જરૂરિયાતમંદ
કંપનીઓને જ ખાસ્સો
લાભ મળશે**



**સરકારે નવા બજેટમાં એમએસએમઈ માટે
2024-25ના બજેટમાં સારી જોગવાઈ કરી છે**



સરકારી ટેન્ડરમાં એમએસએમઈએ અર્નેસ્ટ મની ડિપોઝિટ ન કરવાની જોગવાઈ કરેલી છે, પરંતુ સરકારનાં તમામ ટેન્ડરોમાં ઈએમડી જમા કરાવવાની ફરજ પાડવામાં આવી રહી છે. તેથી નાના એકમો પર નાણાં રોકવાનું વધારાનું બર્ડન આવી રહ્યું છે. તમામ સરકારી સંસ્થાઓ ઈએમડી ભરાવે જ છે. બીજું બેન્ક ગેરન્ટી પણ માગવામાં આવે છે. પરફોર્મન્સ ગેરન્ટી પણ લેવામાં આવે છે. આ ગેરન્ટી ત્રણ કે પાંચ વર્ષ માટેની હોય છે. બેન્ક ગેરન્ટીમાં ઓર્ડરની રકમના 20 ટકા ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકવા પડે છે, પરંતુ આ મુદત પૂરી થયા પછી ઓરિજિનલ બેન્ક ગેરન્ટી રિલીઝ કરવામાં કંપનીઓ ગલ્લાંતલ્લાં કરે છે. સરકારી અધિકારી કહી દે છે કે અત્યારે મળતી નથી, રૂપિયા આપો તો શોધી આપું. પાંચ વર્ષની બેન્ક ગેરન્ટી બેન્કના અધિકારીઓ ઓરિજિનલ સર્ટિફિકેટ વિના રિલીઝ કરતાં જ નથી. આમ કંપનીઓના ગુલામ રહેવાની ફરજ પડે છે. શૈલેશ પટવારી કહે છે, “બેન્ક ગેરન્ટી રિલીઝ ન થાય ત્યાં સુધી બેન્ક તે કેડિટ ચાલુ જ રાખે છે. તેના પર વ્યાજ પણ ચૂકવવું પડે છે.”

સોના પરની આયાત ડ્યૂટી 9 ટકા ઘટાડી દાણચોરી પર બ્રેક લગાવી

ના

શામંત્રી નિર્મલા સીતારમણે 2024-25ના બજેટમાં સોના અને ચાંદી પરની કસ્ટમ્સ ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 9 ટકા કરી દઈને સૌથી પહેલાં તો દાણચોરી કરનારાઓનાં માર્જિન કાપી નાખ્યાં છે. દાણચોરી કરનારાઓને પ્રોત્સાહન જ ન રહે તેવી સ્થિતિ નિર્માણ કરી છે. એકસામટો 9 ટકાનો ઘટાડો કરીને દાણચોરી કોઈ લાભકર્તા જ ન રહે તેવી સ્થિતિ ઊભી કરી દીધી છે. પરિણામે સોના અને ચાંદીની ગેરકાયદે આયાત ઓછી થઈ જશે. 2013ની સાલ પછી

સોના અને ચાંદી પર લેવામાં આવનારી આ ઓછામાં ઓછી આયાત ડ્યૂટી થશે. શુદ્ધ-પ્યોર ગોલ્ડ પરની ઘટાડવા પાછળનો ઈરાદો બજારમાં સોનાના ભાવ ઘટે સરકારનો ઈરાદો હતો. સોના ઘટાડી દેવાની જાહેરાત કરવામાં સાથે જ સોનાના ભાવમાં 5 ટકાનો ઘટાડો આવી ગયો હતો.

સોના અને ચાંદીની આયાત પર બજેટ પૂર્વે 15 ટકા ડ્યૂટી લાગતી હતી. અત્યાર સુધી સોનાની આયાત પર બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી

10 ટકા લાગતી હતી તેમ જ તેના પર એંટ્રિકલ્ચર ઈન્ફાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ તેરીકે 5 ટકા લગાડવામાં આવતા હતા. આમ તેના પર કુલ 15 ટકા ડ્યૂટી લાગતી હતી. દાગીના બનાવનારાઓ સોનાની આયાત પરની ડ્યૂટીમાં ઘટાડો કરવાની સતત માગણી કરતા હતા. કેન્દ્રના વાણિજ્ય મંત્રાલય તરફથી પણ સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવાની સતત માગણી કરવામાં આવતી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમની માગણીનો સ્વીકાર કર્યો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં સોના-ચાંદી પરની ડ્યૂટીમાં 9 ટકાનો ઘટાડો કર્યો તેને પરિણામે સોનાના દસ ગ્રામના ભાવ રૂ. 75000થી ગગડીને રૂ. 69000માં સપાટીએ આવી ગયા હતા. સોનાના ઘટેલા ભાવ ફરી વધી જાય તે પૂર્વે લોકોની ખરીદી ચાલુ થઈ ગઈ છે. જ્વેલ પ્લસના પ્રમોટર જય બેગાની કહે છે, “ગ્રાહકોને લાગી રહ્યું છે કે સોનાના ભાવ દિવાળી સુધીમાં ફરી રૂ. 75000ની સપાટીને વળોટી જશે. તેથી અત્યારે ઘરાકીમાં જોર જોવા મળી રહ્યું છે. લગ્નપ્રસંગો આવવાના હોય કે નાના-મોટા પ્રસંગો આવવાના હોય તેમની ખરીદી ચાલુ થઈ ગઈ છે. સોનાની જેમ ચાંદીના અને પ્લેટિનમના ભાવ પણ નીચા આવ્યા છે, પરંતુ પ્લેટિનમમાં ગ્રાહકોને બહુ ભાવની વધગટની પડી હોતી નથી, કારણ કે ગોલ્ડની ખરીદી કરનારાઓની સંખ્યા સામે પ્લેટિનમની ખરીદી કરનારાઓની સંખ્યા માંડ બે-ત્રણ ટકાની જ હોય છે. તેથી



**જય બેગાની, પ્રમોટર
જ્વેલ પ્લસ**



ખનીજ ધાતુઓ પરની ડ્યૂટી ઘટાડી

સ્ટ્રોન્ટિયમ સલ્ફેટ, કોપર ઓર, કોબાલ્ટ ઓર, ટીન ઓર, ટંગસ્ટેન ઓર, મોલીબ્ડેનમ ઓર, ઝિરકોનિયમ ઓર, હેફનિયમ ઓર, વાનાડિયમ ઓર અને કોન્સન્ટ્રેટ પરની આયાત ડ્યૂટી 2.5 ટકાથી ઘટાડીને શૂન્ય ટકા કરી દેવામાં આવી છે.

તેમાં પ્રમાણમાં બહુ જ ઓછી અસર જોવા મળી છે.” વર્તમાન ભાવથી સોનાની ખરીદી કરી લેનારને આગામી દિવસોમાં વધનારા ભાવનો ઝંડવાન્ટેજ મળશે. તેથી લોકોની ખરીદી વધારવા માટે સોના અને ચાંદીનો વેપાર કરનારાઓએ જુદી જુદી સ્કીમ પણ લોન્ચ કરી દીધી છે. જ્વેલર્સ મેકિંગ ચાર્જમાં 50થી 60 ટકાની છૂટ આપવાની જાહેરાતો કરવા માંડી છે.

સોના પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાથી ઓગસ્ટથી ડિસેમ્બરના ગાળાની તહેવારોની મોસમમાં સોનાની ડિમાન્ડમાં ખાસ્સો વધારો જોવા મળે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. 2012ની સાલમાં સોના પરની ડ્યૂટીમાં વધારો કરવામાં આવ્યો ત્યારે પણ તેની ડિમાન્ડમાં ખાસ્સો વધારો થયો હતો.



હા, સોનાની લગડી અને સોનાના સિક્કાની ખરીદીમાં વધારો જોવા મળ્યો હતો. સોનાની લગડી અને સિક્કાની ડિમાન્ડમાં 50

ટન સુધીનો વધારો જોવા મળી શકે છે. 2024ના ઓગસ્ટથી માર્ચ 2025 સુધીમાં આ વધારો જોવા મળી શકે છે, એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું માનવું છે.

સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યૂટી બજેટમાં 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરવી એ આવકારદાયક પગલું છે અને તેમાંથી જ્વેલરીની માગમાં વધારો થશે. આ જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગની લાંબા સમયની માગ હતી. આ જાહેરાત બાદ સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે, જેનાથી ગ્રાહકોને નોંધપાત્ર રાહત મળી છે. ડ્યૂટીમાં ઘટાડાથી સોનાની દાણચોરીમાં ઘટાડો કરવામાં પણ મદદ મળશે, સરકારની આવકમાં વધારો થશે. વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરામાં પ્રમાણભૂત કપાતમાં વધારો રૂ 50,000થી રૂ 75,000 અને આવકવેરાના દરોમાં તર્કસંગત કરવાથી લોકોના હાથમાં વધુ પૈસા જશે, કીમતી ધાતુઓની માગમાં વધારો થશે.

એક્સિઝ ટ્રેડ એટલે કે આયાત અને નિકાસના કાયદાઓના નિષ્ણાત એસ. વી. મોદી કહે છે, “દાણચોરી કરનારાં તત્વોની

અસર જોવા મળી છે.” વર્તમાન ભાવથી સોનાની ખરીદી કરી લેનારને આગામી દિવસોમાં વધનારા ભાવનો ઝંડવાન્ટેજ મળશે. તેથી લોકોની ખરીદી વધારવા માટે સોના અને ચાંદીનો વેપાર કરનારાઓએ જુદી જુદી સ્કીમ પણ લોન્ચ કરી દીધી છે. જ્વેલર્સ મેકિંગ ચાર્જમાં 50થી 60 ટકાની છૂટ આપવાની જાહેરાતો કરવા માંડી છે.



1

પ્લેટિનમ પરની આયાત ડ્યૂટી 15.4 ટકાથી ઘટાડી 6.4 ટકા કરી દર્ધને હીરા-માણેક જડેલા ભારતીય દાગીનાઓની આંતરરાષ્ટ્રીય બજારમાં ડિમાન્ડ વધારવાનો માર્ગ મોકળો કર્યો: ચોપીસ જુલાઈથી નવા દર લાગુ કરવામાં આવ્યા

2

સોલર પેનલ બનાવવા વપરાતા મટીરિયલ પરનો આયાતવેરો 7.5 ટકાથી ઘટાડીને શૂન્ય ટકા કરી સોલર પાવર પેદા કરવાના 2030 સુધીમાં 500 ગીગાવોટ સોલર પાવર પેદા કરવાના ટાર્ગેટને પહોંચી વળવા ભારત સરકારનું વધુ એક પગલું

3

પ્લેટિનમ પરની આયાત ડ્યૂટી ઘટતાં યુનાઇટેડ આરબ અમિરાત-યુએઈથી 80 ટકા ગોલ્ડનો સમાવેશ કરતા પ્લેટિનમ એલોયની આયાત કરવામાં આપતી આયાતમાં ઘટાડો થશે

4

સોનાની લગડી અને સોનાના સિક્કાની ખરીદીમાં વધારો જોવા મળ્યો હતો. સોનાની લગડી અને સિક્કાની ડિમાન્ડમાં 50 ટન સુધીનો વધારો જોવા મળી શકે

5

બજેટ પછી સોનાની લગડી-સિક્કાની ખરીદીમાં વધારો જોવા મળ્યો હતો. બંનેની ડિમાન્ડમાં 50 ટન સુધીનો વધારો જોવા મળી શકે

6


સોના-ચાંદી પરની આયાત ડ્યૂટીના ઘટાડાને પરિણામે સ્થાનિક બજારમાં સોનાની આયાત કરીને મૂલ્યવૃદ્ધિ કરનારાઓના માર્જિનમાં સુધારો થશે



પ્રવૃત્તિ ધીમે ધીમે મંદ પડી જશે. શુદ્ધ સોના અને શુદ્ધ ચાંદી પર 15 ટકા ડ્યૂટી હોવાથી જાતજાતના કીમિયાઓ અપનાવીને દાણચોરીથી સોનું દેશમાં ઘુસાડવામાં આવતું હતું.” દાણચોરીથી આવતું સોનું ઘટશે તો જ્વેલર્સ પાસેથી સોનું ખરીદવાના પ્રમાણમાં વધારો થશે. બીજી તરફ અશુદ્ધ ફોર્મમાં એટલે કે ગોલ્ડ ડોર અને સિલ્વર ડોર 14.35 ટકાથી ઘટાડીને 5.35 ટકા કરી દેવામાં આવી છે. શુદ્ધ સોના અને ચાંદીના સિક્કા પરની આયાત ડ્યૂટી પણ 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી દેવામાં આવી છે. સોના-ચાંદીના સિક્કા પરની આયાત ડ્યૂટી પણ 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરવામાં આવી છે.

બીજું, આયાત ડ્યૂટીના ઘટાડાને પરિણામે સ્થાનિક બજારમાં સોનાની આયાત કરીને મૂલ્યવૃદ્ધિ કરનારાઓના માર્જિનમાં સુધારો થશે. સોનાની લગડી કે ચાંદીની ઈંટ આયાત કરીને તેના દાગીના બનાવીને તેની સ્પર્ધાત્મક ભાવથી નિકાસ કરવાનો મોકો મળશે. પરિણામે સોનામાંથી દાગીના બનાવનારાઓના બિઝનેસને વેગ મળશે. દાગીનાની નિકાસમાં પણ વધારો થશે. આમ સોના ચાંદીના દાગીના બનાવવાના વ્યવસાયને બજેટના માધ્યમથી મોટો વેગ મળશે. નિકાસના બજારમાં ભારતની સ્પર્ધાત્મકતામાં વધારો થશે. સોના અને ચાંદીની જેમ જ પ્લેટિનમ પરની આયાત ડ્યૂટી પણ 15.4 ટકાથી નવ ટકા ઘટાડીને 6.4 ટકા

કરી દીધી છે. સોના કરતાં પ્લેટિનમની ધાતુ મજબૂત છે. તેથી માણેક જેવા કીમતી પથ્થરો અને હીરાના એટલે કે ડાયમંડના દાગીના બનાવવા માટે સોના કરતાં પ્લેટિનમ વધુ પસંદ કરવામાં આવી રહી છે. પ્લેટિનમમાં જડવામાં આવેલાં માણેક, મોતી કે હીરા પેટ્ટીઓ સુધી યથાવત જળવાઈ રહે છે. પહેલાં યુનાઈટેડ આરબ અમિરાત-યુએઈથી 80 ટકા ગોલ્ડનો સમાવેશ કરતાં પ્લેટિનમ એલોયની આયાત કરવામાં આવતી હતી. તાજેતરના મહિનાઓમાં તેની આયાતમાં ખાસ્સો વધારો જોવા મળ્યો હતો. તેને પરિણામે પ્લેટિનમના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર કરતાં ભારતીય બજારમાં ઓછા જોવા મળતા હતા. ભારત અને યુએઈ વચ્ચે કોમ્પ્રિહેન્સિવ



સોલર પેનલના પુરજાઓ પરની ડ્યૂટી ઘટાડી

સૌર ઊર્જાથી વીજળી પેદા કરવા પર ભારત સરકારનું આમેય ફોકસ છે, પરંતુ સૌર ઊર્જાથી વીજળી પેદા કરવા માટેની સોલર પેનલ ભારતમાં જ અને તેવી પણ ભારત સરકારની ઈચ્છા છે. સોલર સેલ અથવા સોલર મોડ્યુલ્સ પણ ભારતમાં જ તૈયાર થાય અને આયાત કરવાનો ખર્ચ ઘટે તેવી ભારત સરકારની લાગણી છે. તેથી જ સોલર પેનલ બનાવવા માટે વપરાતી કાચી સામગ્રી પરનો આયાતવેરો 7.5 ટકાથી ઘટાડીને શૂન્ય ટકા કરી દેવામાં આવ્યો છે. આમ સોલર પાવર પેદા કરવાના 2030 ટાર્ગેટને પહોંચી વળવા ભારત સરકાર સક્રિય બની છે. ભારત સરકારે 24માં નેશનલ ઈલેક્ટ્રિસિટી પ્લાનમાં નક્કી કર્યા મુજબ 2030ની સાલ સુધીમાં 448 ગીગાવોટ એટલે કે 4,48,000 મેગાવોટ વીજળી સૌર ઊર્જાથી પેદા કરવા માગે છે. ભારતની વીજળીની કુલ જરૂરિયાતના 32 ટકા વીજળી સૌર ઊર્જાથી પેદા કરવા માગે છે. બીજી 12 ટકા વીજળી વિન્ડ ઊર્જાનો એટલ કે પવન ઊર્જાનો ઉપયોગ કરીને પેદા કરવા માગે છે. આમ બજેટના માધ્યમથી આયાત ડ્યૂટીમાં ઘટાડો ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને વેગ આપવાનાં પગલાં પણ નાણામંત્રી નિર્મલા સીતારમણે કરીને લીધાં છે. ઈલેક્ટ્રોનિક્સ બજારના જાણકારોનું કહેવું છે કે આયાત ડ્યૂટી વધારે હોવાથી નબળી ગુણવત્તાના અને અજાણ્યા ઉત્પાદકો પાસેથી પુરજાઓની આયાત કરવામાં આવતી હતી. પરિણામે ફિનિશ ગુડ્સની ગુણવત્તા પણ નબળી જ રહેતી હતી. આ સ્થિતિમાં હવે બદલાવ આવશે. સારી ગુણવત્તાના પુરજાઓની આયાત થશે. સોલર પેનલની ગુણવત્તામાં પણ સુધારો જોવા મળશે. સોનાની ખરીદી કર્યા પછી પહેલાં ત્રણ વર્ષ બાદ વેચો તો તેના પર 20 ટકાના દરે કેપિટલ ગેઈન ટેક્સ લાગતો હતો. હવે ત્રણને બદલે બે વર્ષ બાદ વેચનારે કેપિટલ ગેઈન ટેક્સ ભરવો પડશે. આમ કેપિટલ ગેઈન ટેક્સ ગણવાનો સમયગાળો 12 મહિના ઘટાડી દીધો છે. હા, કેપિટલ ગેઈન ટેક્સ પર 20 ટકાથી ઘટાડીને 12.5 ટકા કરી દીધો છે. 23મી જુલાઈએ બજેટમાં જાહેરાત કરવામાં આવે તે સમયથી જ આ નવી જોગવાઈ લાગુ કરી દેવામાં આવી છે.

મત્સ્યઉદ્યોગને લાભ કરાવ્યો

મત્સ્યઉદ્યોગને લાભ થાય તે માટે સી ફૂડ-આહારમાં વપરાતા દરિયાઈ જીવોની જાળવણી કે અન્ય પ્રોસેસમાં વપરાતા પ્રિ-ડસ્ટ બ્રીડે પાવર પરની આયાત ડ્યૂટી 30 ટકાથી ઘટાડીને શૂન્ય ટકા કરી દેવામાં આવી છે. પ્રોન, શ્રીમ્પ અને ફિશ જેવા આહાર પરની આયાત ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવી છે. તેમ જ શીઆ નટ્સ પરની ડ્યૂટી 30 ટકાથી ઘટાડીને 15 ટકા કરી દેવામાં આવી છે.

ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ-સેપા હેઠળ કરાતી આયાતનું આકર્ષણ ઓછું થઈ જશે. તેથી પ્લેટિનમ એલોયની આયાત ઓછી થઈ જશે.

મોબાઈલના પુરજાઓ પરની આયાત ડ્યૂટી ઘટી

મોબાઈલ ફોન અને મોબાઈલ ફોન બનાવવા માટેના મહત્વના પુરજાઓ પરની આયાત ડ્યૂટી 20 ટકાથી ઘટાડીને 15 ટકા કરી દેવામાં આવી છે. પરિણામે વિદેશથી ભારતમાં આયાત કરવામાં આવતા મોબાઈલ સસ્તા થયા છે તેમ જ મોબાઈલ ચાર્જર, સેલ્યુલર મોબાઈલના ઓપ્ટર અને મોબાઈલ બનાવવા માટેની સરકીટ તથા મોબાઈલ ફોન બનાવવા



માટે વપરાતી પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલી પરની આયાત ડ્યૂટી પણ 20 ટકાથી ઘટાડીને 15 ટકા કરી દીધી છે. આમ મોબાઇલ બનાવવા માટેના પુરજા પરની આયાત ડ્યૂટીમાં પણ ઘટાડો કર્યો હોવાથી સ્થાનિક સ્તરે મોબાઇલનું ઉત્પાદન કરનારાઓનો ઉત્પાદન ખર્ચ નીચે આવશે. આજે ભારત મોબાઇલના ઉત્પાદન અને નિકાસમાં કાઠું કાઢી ચૂકેલો દેશ છે. હજીય તેમાં વધારો થાય તેવી ગણતરી સાથે સરકારે તેના પુરજાઓ પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. મોબાઇલના બજારના જાણકારોનું કહેવું છે કે



**એસ.વી.મોદી, નિષ્ણાત
ઇન્ડાયરક્ટ ટેક્સ**

સંભાવના છે. તેથી મોબાઇલની નિકાસમાં ખાસો વધારો થશે. તેમ જ સ્થાનિક સ્તરે મોબાઇલનું ઉત્પાદન કરવાની પ્રવૃત્તિને વેગ મળશે.

હેલ્થ સેક્ટરને પણ લાભ આપ્યા

આયાત ડ્યૂટી ઘટાડીને સરકારે આરોગ્ય સેક્ટરને પણ લાભ કરાવવાનો પ્રયાસ કર્યો છે. સૌથી પહેલો લાભ તો કેન્સરની આયાત કરવામાં આવતી દવાઓ પરની ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને શૂન્ય ટકા કરી દીધી છે. પરિણામે કેન્સરના દર્દીઓને આયાતી દવા ખરીદવાની નોબત આવે તો તેના પર દસ ટકા ઓછો ખર્ચ કરવો પડશે. જોકે કેન્સરની



દવા પર એમઆરપી લખવાની મર્યાદા પણ યોગ્ય રીતે નિશ્ચિત કરવામાં આવે તો તેને પરિણામે પણ કેન્સરની દવાનો યોગ્ય ભાવ મળી શકે છે. કેન્સરની આ દવાઓમાં ટ્રાસ્ટુગુમેબ, ડેરુકસ્ટેકન, ઓસિમેટિનિબ, દુરવાલુમેબનો સમાવેશ થાય છે.

બીજી તરફ મેડિકલ ડિવાઇઝ માટે પ્રોડક્શન લિન્ક ઈન્સેન્ટિવ સ્કીમમાં થાય છે તેમ ભારતમાં જ મેડિકલ ડિવાઇઝનું ઉત્પાદન વધે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસના ભાગરૂપે જ એક્સ-રે મશીન બનાવવા માટેની ટ્યૂબની આયાત પરની આયાત ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવી છે. દાંતની સારવાર, સર્જિકલ હેતુ કે પછી પશુઓની ચિકિત્સા અને સારવાર માટે વપરાતાં એક્સ-રે મશીન માટેની ટ્યૂબ અને અન્ય સાધનો પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ જ રીતે એક્સ-રે મશીન બનાવવા માટે વપરાતા ફ્લેટ પેનલ ડિટેક્ટર્સ પરની આયાત ડ્યૂટી પણ 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવી છે. આમ આરોગ્યના હેતુથી વપરાતી વસ્તુઓ પરની આયાત ડ્યૂટી ઘટાડીને આરોગ્ય ક્ષેત્રને પણ લાભ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.



ટેક્સટાઇલ યાર્ન-ચામડામાં વપરાતાં કેમિકલની સસ્તાં કર્યાં

સ્પેન્ડેક્સ યાર્નના મેન્યુફેક્ચરિંગમાં વપરાતા મિથિલીન ડાયફિનાઇલ ડાય-આઇસોસાઇનાઇટ(એમડીઆઇ) પરની આયાત ડ્યૂટી સાડા સાત ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવી છે. સ્પેન્ડેક્સ યાર્ન સામાન્ય રીતે કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે પહેરવામાં આવતાં સ્ટ્રેચેબલ કપડાં, સ્વિમિંગ માટેનાં કપડાં, ફેશન માટેનાં ચોક્કસ વસ્ત્રો, હોઝિયરી, ડેનિમ્સ, મોજાં અને શરીરના આકાર પ્રમાણેનાં વસ્ત્રો બનાવવા માટે વપરાય છે. સ્પોર્ટ્સમાં પહેરવામાં આવતાં કપડાં બનાવવા માટે પણ સ્પેન્ડેક્સ યાર્ન વપરાય છે. આમ સ્પેન્ડેક્સ યાર્ન બનાવવાના કે ચામડામાંથી જુદી જુદી વસ્તુઓ બનાવવા માટેના ખર્ચમાં ઘટાડો થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. યાર્નમાંથી અથવા તો ફિનિશ લેધર કે ચામડામાંથી કપડાં બનાવવા માટે, લેધર-ચામડાનાં જોડાં, કે પછી સિન્થેટિક યાર્નનાં જોડાં બનાવવા માટે વપરાતા ટેક્સટાઇલ યાર્ન માટેના વેટ વ્હાટી અને કસ્ટ પરની આયાત ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને શૂન્ય ટકા કરી દેવામાં આવી છે. આ જ રીતે નિકાસ માટે તૈયાર કરવામાં આવતાં ટેક્સટાઇલ કે લેધર ગાર્મેન્ટ બનાવવા માટે બતક કે પછી ગૂંજના મટીરિયલમાંથી બનાવવામાં આવતા અસલી મટીરિયલ પરની આયાત ડ્યૂટી 30 ટકાથી ઘટાડીને 10 ટકા કરી દેવામાં આવી છે. આ જ રીતે સસલા જેવા જીવોની રુવાંટી સાથેની ચામડીની આયાત કરવા પરની આયાત ડ્યૂટી 60 ટકા હતી તે ઘટાડીને 10 ટકા કરી દેવામાં આવી છે. ગેલ્લિયમ, જર્મેનિયમ, ઈન્ડિયમ, નાયોબિયમ, વાનાડિયમ પરની આયાત ડ્યૂટી 5 ટકાથી ઘટાડીને શૂન્ય ટકા કરી દેવામાં આવી છે. ચામડું કમાવવા જેવી પ્રક્રિયા કરીને કમાવવામાં આવેલી કાચી ફર સ્કિન પરની આયાત ડ્યૂટી 60 ટકાથી ઘટાડીને 20 ટકા કરી દેવામાં આવી છે.





બ્લિસ્ટર કૉપર પરની ડ્યૂટી ઘટાડી

બ્લિસ્ટર કૉપર પરની આયાત ડ્યૂટી પણ 5 ટકાથી ઘટાડીને શૂન્ય ટકા કરી દેવામાં આવી છે. બ્લિસ્ટર કૉપરનો ઉપયોગ ઇલેક્ટ્રોલાયસિસમાં કરવામાં આવે છે. સંભવતઃ હાઈડ્રોજન બનાવવા માટેની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોલાયસિસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે અને હાઈડ્રોજનનું ઉત્પાદન વધારવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત આગામી વરસોમાં હાઈડ્રોજનનો ઈંધણ તરીકે મહત્તમ ઉપયોગ કરવાનો ઈરાદો ધરાવે છે. પરિણામે તેનું ઉત્પાદન વધારવાની નેમ ધરાવે છે. તેથી જ બ્લિસ્ટર કૉપર પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

પીવીસી ફ્લેક્સ ફિલ્મ પરની ડ્યૂટી વધારી

પીવીસી ફ્લેક્સ ફિલ્મ પરની ડ્યૂટી 10 ટકાથી વધારીને 25 ટકા કરી દેવામાં આવી છે. ટેલિકોમના ઈકિવપમેન્ટ-સાધનોમાં વપરાતા પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ અંસેમ્બલી પરની આયાત ડ્યૂટી 10 ટકાથી વધારીને 15 ટકા કરી દેવામાં આવી છે. સોલર સેલ્સ કે સોલર મોડ્યુલ્સ બનાવવા માટે વપરાતા કાચ પરની આયાત ડ્યૂટી શૂન્ય ટકા હતી તે વધારીને 10 ટકા કરી દેવામાં આવી છે. આ ગ્લાસનું મેન્યુફેક્ચરિંગ ભારતમાં જ થવા માટે તેવી સરકારની ગણતરી છે. સોલર સેલ્સ કે સોલર મોડ્યુલ્સ બનાવવા માટે વપરાતા ટીન્ડ કૉપર ઈન્ટરકનેક્ટર પરની આયાત ડ્યૂટી શૂન્ય ટકા હતી તે વધારીને 5 ટકા કરી દેવામાં આવી છે. આ જ રીતે એમોનિયમ નાઈટ્રેટ પરની આયાત ડ્યૂટી 7.5 ટકા હતી તે વધારીને 10 ટકા કરી દેવામાં આવી છે.

પ્રૂફ ઑફ ઓરિજિનમાં ઉદાર શરતો મૂકવામાં આવી

કસ્ટમ્સ એક્ટ 1962ની કલમ 28 ડીમાં સુધારો કરીને અલગ અલગ પ્રકારનાં પ્રૂફ ઑફ ઓરિજિનને સ્વીકારી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રેડ એગ્રીમેન્ટના સંદર્ભમાં આ શરતો ઉદાર બનાવવામાં આવી છે. નવા ટ્રેડ એગ્રીમેન્ટમાં સેલ્ફ સર્ટિફિકેશનને માન્ય રાખવામાં આવતું હોવાથી કલમ 28 ડીને વધુ અનુકૂળ બનાવવા આવી છે.


ગોદામોમાં માલ રાખવાના નિયમોમાં ફેરફાર કર્યો

2024-25ના બજેટના માધ્યમથી નવી કલમ 65 (1) દાખલ કરવામાં આવી છે. ગોદામોમાં કયો માલ ન રાખવો તે અંગેની આ કલમ છે. આ કલમ હેઠળ કેન્દ્ર સરકારના સત્તા આપવામાં આવી છે. કયો માલ ગોદામમાં ન રાખવો તે અંગેનો સરકાર નિર્ણય લઈ શકે છે. તેમ જ ગોદામમાં શું ન કરવું તેની પણ સૂચના આપી શકે છે. તેનું દરેકે પાલન કરવું જ પડશે. 30મી જૂન 2017ના ગોદામમાં પડી રહેલા એટલે કે પહેલી જુલાઈ 2017ના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અમલમાં આવ્યો તે પૂર્વે ગોદામમાં પડી રહેલા માલ પરનો ક્લીન એન્વાયર્નમેન્ટ સેસ જતી કરવામાં આવી છે. હા, તેની સાથે એક શરત પણ મૂકવામાં આવી છે. એન્વાયર્નમેન્ટ સેસમાં માફી મેળવવા ઈચ્છનારે યોગ્ય પ્રમાણમાં જીએસટી કોમ્પેન્સેશન સેસ ભરેલી હોવી જરૂરી છે. આ સેસ ભર્યો હોય તેવી વસ્તુઓનો સપ્લાય પહેલી જુલાઈ 2017 પહેલા જ થયેલો હોવો જરૂરી છે.

લેબોરેટરી કેમિકલ્સ પરની કસ્ટમ્સ ડ્યૂટી ફરી ઘટાડી દીધી

લેબોરેટરીમાં વપરાતાં કેમિકલ્સની આયાત પરની કસ્ટમ્સ ડ્યૂટી 10 ટકાથી વધારીને 150 ટકા કરવાનો નિર્ણય નાણામંત્રી નિર્મલા સીતારમણે લીધો તે પછી સંશોધન સાથે સંકળાયેલી સંસ્થાઓમાંથી પ્રચંડ વિરોધ થતાં નાણામંત્રીએ તેના પરની કસ્ટમ્સ ડ્યૂટી 150 ટકાથી ઘટાડીને ફરી 10 ટકા કરી દેવાનો નિર્ણય લીધો છે. તેમના આ નિર્ણયને પરિણામે સંશોધનમાં વપરાતાં 40,000થી વધુ કેમિકલ્સ પરની આયાત ડ્યૂટી 140 ટકા વધીને 150 ટકા થઈ ગઈ હતી. તેને પરિણામે સંશોધન અને વિકાસના કામકાજ ખોરવાઈ જવાની દહેશત ઊભી થઈ હતી. બજેટ મંજૂર કર્યાના એક જ અઠવાડિયામાં તેની એક જોગવાઈ બદલી નાખવામાં આવી છે. ડ્યૂટીમાં 1400 ટકાનો વધારો કરી દીધા પછી તેમાં ઘટાડો કરવાના નિર્ણયને આવકારવામાં આવ્યો છે.

ત્રેવીસમી જુલાઈએ બજેટ રજૂ કર્યા પછી લગભગ પહેલી ઓગસ્ટના અરસામાં રિસર્ચ માટે વપરાતાં અંદાજે 40,000 કેમિકલ્સ પરની કસ્ટમ્સ ડ્યૂટી 150 ટકાથી ઘટાડીને 10 ટકા કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર હિતમાં આ સુધારો કરવામાં આવ્યો છે. સંશોધનના ઓઠા હેઠળ ગેરકાયદે આ કેમિકલ્સની આયાત કરવાનો પ્રયાસ કરનારાઓને દંડ તે માટેની કલોઝનો ઉમેરો બજેટના માધ્યમથી કરી દેવામાં આવ્યો છે. જોકે 10 ટકા કસ્ટમ્સ ડ્યૂટી ભરીને કેમિકલની આયાત કરનારાઓએ એફિડેવિટ કરીને કસ્ટમ્સના ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનરને ખાતરી આપવી પડશે કે તેમણે આયાત કરેલા કેમિકલ્સ માત્ર ને માત્ર સંશોધન અને વિકાસના કામકાજ માટે જ ઉપયોગમાં લેવામાં આવશે. તેનો ઉપયોગ માર્કેટમાં વેચવા માટે કરવામાં આવશે નહિ. તેમ જ તેનું ટ્રેડિંગ પણ કરવામાં આવશે નહિ. આ એફિડેવિટ કર્યા પછી આ કેમિકલ્સનો સંશોધન અને વિકાસ સિવાયના કાર્યના હેતુથી કરવામાં આવી રહેલો હોવાનું જાણવા મળે તો તેવા સંજોગોમાં તે આયાતકાર પાસેથી દંડ સાથે ઊંચા દરે કસ્ટમ્સ ડ્યૂટી વસૂલવામાં આવશે. કેટલાક આયાતકારો ઈથાઈલ આલ્કોહોલને લેબોપેચપી માટેનાં કેમિકલ્સ તરીકે જાહેર કરીને તેની આયાત કરતા હતા. અનડિનેચર્ડ ઈથાઈલ આલ્કોહોલ પર 150 ટકા કસ્ટમ્સ ડ્યૂટી લાગુ પડતી હતી.



ખેડૂતોની આવક વધારવા માટે 10,000 FPOની રચના કરશે

ના

શામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા 2024-25ના બજેટમાં દેશના કૃષિ ક્ષેત્ર માટે 1,32,469.84 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અત્યારે વૈશ્વિક અર્થતંત્રો માટેની નીતિઓમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે ત્યારે ભારતીય અર્થતંત્રનો વિકાસ જળવાઈ રહ્યો છે. આમ કૃષિ ક્ષેત્ર માટે ગયા વર્ષની તુલનાએ 4.58 ટકા રકમ વધુ ફાળવવામાં આવી છે. બજેટમાં કરવામાં આવેલી જોગવાઈને પરિણામે કઠોળ, તેલીબિયાંના પાક લેનારાઓને ફાયદો થશે. આ સિવાયનો પાક લેનારાઓને ફાયદો કરાવવા પર બહુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું ન હોવાનું જણાય છે. કુલ ફાળવણીમાંથી કૃષિકલ્યાણની યોજનાઓ માટે રૂ. 9941.09 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ જ રીતે મત્સ્યઉદ્યોગ, પશુપાલન માટે રૂ. 7137.68 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમ 2023-24માં કરવામાં આવેલી ફાળવણીની તુલનાએ તેમાં અંદાજે 27 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એકલા પશુપાલન માટે રૂ. 4521.24 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમાં 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મત્સ્યઉદ્યોગ માટે 2616.44 કરોડની ફાળવણી કરી છે. આ ફાળવણીમાં 53.8 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કૃષિ અને તેની સાથે સંકળાયેલાં સેક્ટર્સ માટે બજેટમાં કુલ મળીને 1,39,607.54 કરોડની

ફાળવણી કરવામાં આવી છે. બજેટમાં ફાળવવામાં આવેલી કુલ રકમમાંથી અંદાજે 73 ટકા રકમ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી સ્કીમ-મનરેગા અને કૂડ-ફર્ટિલાઈઝર માટે સબસિડી પેટે જ ખર્ચવામાં આવશે. જોકે તેને કારણે ગ્રામીણ વિસ્તારની આવક વધારવા પર ફોકસ થઈ રહ્યું ન હોવાનો સ્પષ્ટ સંદેશ મળી રહ્યો છે. ભારત સરકાર મનરેગા અને કૂડ અને ફર્ટિલાઈઝર પર સબસિડી પેટે વરસેદહાડે રૂ. 4.55 લાખ કરોડ વાપરી રહી છે.

પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ યોજનામાં રૂ. 5803 કરોડ ફાળવ્યા

પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ યોજના - પીએમ આશા યોજના માટે રૂ. 5804.03 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ યોજના હેઠળ અગાઉના વર્ષની તુલનાએ 73 ટકા વધુ ફાળવણી કરવામાં આવી છે. તેને કારણે કઠોળ અને તેલીબિયાંની ખરીદીમાં વધારો થવાની સંભાવના છે. સરકારે નક્કી કરેલા ટેકાના ભાવે તેની ખરીદી વધારવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી કરવા માટેની યોજના માટે રૂ. 6437.50 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સરકાર કઠોળ અને તેલીબિયાંના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માગે છે. આમ કઠોળ અને ખાદ્ય તેલની આયાત ઘટાડીને મહામૂલું વિદેશી ડૂંડિયામણની બચત

પણ કરવા માગે છે. સરકાર તેલીબિયાં અને કઠોળના ઉત્પાદનમાં વધારો થાય તે માટે પ્રયાસ કરશે. તેમ જ તેનો સંગ્રહ કરવાની ક્ષમતામાં ને તેના માર્કેટિંગની વ્યવસ્થાને પણ વધુ સંગીન બનાવશે.

અત્યારે દેશમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા અને મધ્ય પ્રદેશમાં કઠોળનો સૌથી વધુ પાક લેવામાં આવી રહ્યો છે, પરંતુ આ કઠોળના માર્કેટિંગ માટેની માળખાકીય

મગફળી, રાયડો, સોયાબીન,
તલ અને અનફલાપર તેલની
દેશની જરૂરિયાત પૂરી
કરવામાં ભારત સક્ષમ બને
તેવા પ્રયાસો કરશે

સુવિધાઓ આ

તમામ રાજ્યોમાં ઓછી

પડી રહી છે. હા, મધ્ય પ્રદેશમાં તેના માર્કેટિંગ માટેની સુવિધા અન્ય રાજ્યો કરતાં સારી છે. પંજાબ અને હરિયાણામાં કૃષિઉપજના વેચાણ માટેની સુવિધા ખાસ્સા સારી છે. આજની તારીખે ભારતમાં વપરાતા કુલ કઠોળમાંથી 15 ટકા કઠોળની ભારત આયાત કરે છે તેમ જ ભારતમાં ખાદ્ય તેલના થતાં કુલ વપરાશમાંથી 56 ટકા ખાદ્ય તેલ પોતાને દેશમાં ઉગાડવામાં આવતાં તેલીબિયાંમાંથી જ મેળવી લે છે. પ્રધાનમંત્રી-આશા

યોજનામાં વધુ ફાળવણી કરવામાં આવી હોવાથી તેમને લાભ થવાની ગણતરીએ વધુ ખેડૂતો કઠોળ અને તેલીબિયાંની ખેતી તરફ વળે તેવી સંભાવના છે. મગફળી, રાયડો, સોયાબીન, તલ અને સનફલાવર તેલની દેશની જરૂરિયાત પૂરી કરવામાં ભારત સક્ષમ બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


ક્લાઇમેટ ચેન્જનો પ્રતિકાર કરતી 32 વરાઇટી લોન્ચ કરાશે

ક્લાઇમેટ ચેન્જનો પ્રતિકાર કરી શકે તેવી પાકની 32 વરાઇટી લોન્ચ કરવામાં આવશે. આમ તો કુલ 109 વરાઇટી લોન્ચ કરવામાં આવશે. બાગાયતી પાક માટેની વરાઇટીઓનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વાતાવરણમાં કાર્બન ઉત્સર્જન વધી રહ્યું હોવાથી ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ હવે સહજ ઘટના બનશે. આ સ્થિતિમાં પણ ખેડૂતોએ રોપેલો પાક ટકી રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. પ્રજાની અન્નસલામતી માટે આ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

ડિજિટલ કૉપ સર્વે કરવામાં આવશે

ખરીફ મોસમમાં ડિજિટલ કૉપ સર્વે કરવામાં આવશે. તેને માટે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો

ઉપયોગ કરવામાં આવશે. દેશના 400 જિલ્લાઓને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તદુપરાંત ખેડૂતોને ક્યો પાક લેવો અને ક્યો પાક ન લેવો તેની સલાહ પણ તેના માધ્યમથી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ડિજિટલ કૉપ સર્વેને કારણે પાકની ઊપજના સરેરાશ આંકડાંઓમાં અત્યાર સુધી થતી આવેલી ભૂલ ઓછી થઈ જવાની શક્યતા રહેલી છે. દેશના મહત્વના પાકના વધુ સાચા અને સારા આંકડાઓ મેળવી શકાશે. આ



જિલ્લાઓમાં આબોહવામાં આવનારા ફેરફાર અંગેની માહિતી નિયમિત રીતે ખેડૂતોને મળતી રહે તેવી સુવિધા કરવામાં આવશે. તેને સામે માર્કેટિંગની અને ખેડૂતોને કોમોડિટીના કેવા ભાવ મળશે તેની સુવિધા પણ કરવામાં આવી રહી છે. પીએમ-આશા હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળનો ઉપયોગ માર્કેટિંગ ઈન્ટરવેન્શન માટે કરવામાં આવશે. તેમ જ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઊપજોની ખરીદી કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે ભાગીદારી કરશે. આગામી ત્રણ વર્ષમાં દરેક ખેડૂતોને અને તેમની જમીનોનો આ આયોજન હેઠળ આવરી લેવામાં આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડીપીઆઈ હેઠળ ૯ કરોડ ખેડૂતો અને તેમની જમીનનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવશે. જનસમર્થ આધારિત કિસાન ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવશે. આ વ્યવસ્થા પાંચ રાજ્યમાં લાગુ કરી દેવામાં આવી છે.

ગ્રામીણ વિકાસ પર પણ ફોકસ

સરકાર ગ્રામીણ વિકાસ પર પણ ફોકસ કરવા માગે છે. ગ્રામીણ વિકાસ માટે બજેટમાં રૂ. 2.66 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

શાકભાજી ઉગાડવા માટે ખાસ ક્લસ્ટર બનાવાશે

જોકે બહુ જ ઓછા દિવસો માટે ટકી શકે તેવા બાગાયતી પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવાની દિશામાં કોઈ જ પગલું લેવામાં આવ્યું નથી. પરિણામે બાગાયતી પાકની ખેતી કરનારા ખેડૂતો હતાશ થયા છે. જોકે તેની સાથે જ સરકારે શાકભાજીનો જંગી સ્તરે ઉત્પાદન માટેના ક્લસ્ટર ડેવલપ કરવાનું આયોજન કર્યું છે. તેની સાથે જ શાકભાજીની ઊપજની સપ્લાય પણ સરળતાથી થઈ રહે તેવી વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન પણ કર્યું છે.

સમગ્ર દેશના ખેડૂતો કાર્યદેસરની ગૅરન્ટી સાથેના ભાવનો ટેકો પૂરો પાડવાની માગણી કરી રહ્યા છે. તેને માટે ખેડૂતોને કરવા પડતા ખર્ચને ધ્યાનમાં રાખીને તેના ભાવ નક્કી કરી આપવાની ખેડૂતોની માગણી હતી, પરંતુ આ માગણી પર ધ્યાન આપવામાં આવ્યું જ નથી. એમઆઈએસ-પીએસએસ યોજના માટે 1 લાખ કરોડની અગાઉ ફાળવણી કરવામાં આવી હતી, આ ફાળવણી અત્યારે ઘટાડીને માત્ર 1500 કરોડ જ કરી દેવામાં આવી છે. બીજી તરફ પ્રધાનમંત્રી સન્માન નિધિ-પીએમ કિસાન યોજના હેઠળ જમીન ધારક ખેડૂતોને રોકડ પ્રોત્સાહન આપવાની યોજના હેઠળ કરવામાં આવેલી ફાળવણીમાં અગાઉની તુલનાએ કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. આ ફાળવણી રૂ. 60,000 કરોડ પર જ જાળવી રાખવામાં આવી છે. આ સાથે જ સરકારે નવા 10,000 ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન-એફપીઓની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેને માટે 2024-25ના બજેટમાં રૂ. 581.67 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 2023-24ના બજેટમાં તેને માટે રૂ. 450 કરોડની ફાળવણી કરવામાં આવેલી હતી. વેજિટેબલ સપ્લાય ચેઇન, સ્ટોરેજ અને કૉપ કલેક્શન તથા માર્કેટિંગ માટે સરકાર ફાર્મર પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન્સ બનાવશે.

સરકારે કુદરતી કે પ્રાકૃતિક ખેતી પર પણ ભાર મૂક્યો છે. આગામી બે વર્ષમાં વધુ એક કરોડ ખેડૂતો કુદરતી ખેતી તરફ વળે તે માટેના પ્રયાસ કરવાની જાહેરાત પણ નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી છે. રાસાયણિક ખાતરથી કરવામાં આવતી ખેતીને કારણે કેન્સર, ડાયાબિટીસ સહિતની સંખ્યાબંધ બીમારીઓ માનવશરીરમાં ઘર કરી રહી છે. જોકે 2023-24ના બજેટમાં પણ 1 કરોડ ખેડૂતોને કુદરતી ખેતી તરફ વાળવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ખરેખર કેટલા ખેડૂતો કુદરતી ખેતી તરફ વળ્યા છે તે અંગે કોઈ જ સ્પષ્ટતા થયેલી નથી. ખેડૂતોને કુદરતી ખેતી તરફ વાળવા માટે આ બજેટમાં રૂ. 459 કરોડની ફાળવણી કરવામાં આવેલી છે. પ્રાકૃતિક ખેતી કરનારાઓને ટેકો આપવા માટે તેમના પાકને પ્રમાણિત કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. તેમ જ તેનું અલગથી બ્રાન્ડિંગ પણ કરવામાં આવશે. આ હેતુને પાર પાડવા માટે સરકાર 10,000 બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની સ્થાપના કરશે.



**પાર્ટનરશિપ ડીડમાં કે પછી એલએલપી-લિમિટેડ
લાયેબિલિટી પાર્ટનરશિપ અંગ્રીમેન્ટમાં રેમ્યુનેરેશનનો
ક્લોઝ હોય તો જ કલમ 40 (બી) હેઠળ કરવામાં આવેલી
રેમ્યુનેરેશનની નવી જોગવાઈનો લાભ મળશે**

પગારની જોગવાઈનો લાભ તમામ ભાગીદારી પેઢીઓ નહિ લઈ શકે

પા

ર્ટનરશિપ ડીડમાં રેમ્યુનેરેશનની કન્ડિશન ઉમેરવામાં નહિ આવી હોય તો નાણામંત્રી નિર્મલા સીતારમણે કલમ 40 (બી) હેઠળ ભાગીદારી પેઢીના ભાગીદારોના પગારની મર્યાદા વધારી છે, પરંતુ તેનો લાભ મેળવવો કઠિન બની જશે. ભારતમાં અંદાજે 16 લાખ જેટલી ભાગીદારી પેઢીઓ અને એલએલપી તેમનાં રિટર્ન ફાઈલ કરે છે. પરિણામે એલએલપીની સંખ્યા 18થી 20 લાખ હોવાનો અંદાજ મૂકવામાં આવે છે. તેમણે તેમના પાર્ટનરશિપ ડીડ કે પછી એલએલપી અંગ્રીમેન્ટની શરતોનો અભ્યાસ કરીને પછી જ તેનો લાભ લેવાનું આયોજન કરવું જોઈએ. જૂની વ્યવસ્થા હેઠળ ભાગીદારી પેઢીઓની આવક રૂ. 3 લાખની હોય તો તેમાંથી રૂ. 1.50 લાખ કે 90 ટકા બેમાંથી જે વધુ હોય તે પગાર તરીકે લઈ શકાતી હતી. તેનાથી વધારાની આવકના 60 ટકા પગાર તરીકે ખતવી શકાય તેવી જોગવાઈ કરવામાં આવેલી છે. ઉદાહરણ આપીને વાત કરીએ. એક ભાગીદારી પેઢીનો નફો એટલે કે બુક પ્રોફિટ રૂ. 10 લાખનો છે તો પહેલા ત્રણ લાખની આવકના 90 ટકા પ્રમાણે તેઓ રૂ. 2.70 પગાર તરીકે ખતવી શકતા હતા. ત્યાર બાદના 7 લાખની આવકના 60 ટકા પ્રમાણે રૂ. 4.20 પગાર તરીકે ખતવી શકતા હતા. આમ ભાગીદારી પેઢીની રૂ. 10 લાખની આવકમાંથી 6.90 પગાર તરીકે લઈ શકાય છે. આમ 10 લાખની આવકમાંથી રૂ. 6.90 લાખ પગાર તરીકે લીધા બાદની રૂ. 3.10 લાખની આવક

પર 30 ટકા વત્તા સહિત અંદાજે 33 ટકાનો ટેક્સ ચૂકવી દેવો પડે છે. હવે કલમ 40 (બી)ના સ્વરૂપમાં નવી જોગવાઈ લાગુ કરવામાં આવી છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કરીમ લાખાણીનું કહેવું છે કે, “ભાગીદારી પેઢીના એક્ટિવ પાર્ટનરની ભાગીદારીના રેશિયો-પ્રમાણ મુજબ પગારની આવકનું વિતરણ ભાગીદારીની ટકાવારી પ્રમાણે ભાગીદારો વચ્ચે

આમ રૂ. 10 લાખની આવકમાંથી રૂ. 7.80 લાખ પગાર તરીકે દેખાડવાની છૂટ મળી છે. આમ જૂની વ્યવસ્થા હેઠળ જે રૂ. 6.90 પગાર તરીકે દર્શાવી શકાતા હતા તે નવા બજેટની જોગવાઈ મુજબ રૂ. 7.80 દર્શાવી શકાશે. બાકીના રૂ. 2.20 લાખ પર 33 ટકા પ્રમાણે આવકવેરો ચૂકવવો પડશે. આમ અંદાજે રૂ. 72000ની આસપાસનો ટેક્સ ચૂકવવાનો આવશે.”

ભાગીદારી પેઢીની માફક એલએલપી-લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ કંપનીઓ માટે પણ આ જોગવાઈ લાગુ કરવામાં આવેલી છે. નવી જોગવાઈનો લાભ લેવા માટે પાર્ટનરશિપ ડીલ કે એલએલપીના અંગ્રીમેન્ટ પ્રમાણે પેઢીએ અને એલએલપીએ તેના એક્ટિવ પાર્ટનર કોણ છે, તેમની હિસ્સેદારી કેટલા ટકાની છે તે પણ દર્શાવવાની આવશે. તેમ જ પગારનું વિતરણ કેવી રીતે કરવામાં આવ્યું તે પણ દર્શાવવાનું આવશે. કરીમ લાખાણીનું કહેવું છે કે, “રેમ્યુનેરેશનની લિમિટ વધારવા સાથે એક શરત મૂકી છે. પાર્ટનરશિપ ડીડમાં કે પછી એલએલપી-લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ અંગ્રીમેન્ટમાં રેમ્યુનેરેશનનો ક્લોઝ હોય તો જ રેમ્યુનેરેશનનો લાભ મળશે. ક્લોઝ ન હોય કે સુધારેલો ન હોય કે પછી કલમ 40 (બી) મુજબ આપણે ઈન્કમેટેક્સમાં રિટર્ન ફાઈલ કરીશું તેમ લખ્યું હોય તો તેવા સંજોગોમાં પાર્ટનરશિપ ડીડ કે એલએલપી-લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ કંપનીઓના કરાર રિવાઈઝ કરવા પડશે. આ કરારમાં કે ભાગીદારી પેઢીને ડીડમાં શું લખેલું છે તે અત્યારે મોટા



**કરીમ લાખાણી,
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ**

વિતરિત કરવી પડે છે. જુલાઈ 2024માં રજૂ કરવામાં આવેલા બજેટના માધ્યમથી પગાર લેવાની મર્યાદા રૂ. ત્રણ લાખથી વધારીને છ લાખ કરી દેવામાં આવી છે. આમ પહેલા છ લાખના 90 ટકા મુજબ રૂ. 5.40 લાખ પગાર તરીકે ખતવી શકાશે. ત્યાર બાદના રૂ. 4 લાખમાંથી 60 ટકા રકમ પગાર તરીકે ખતવી શકાશે.



પછી એલએલપી એગ્રીમેન્ટની ખરાઈ કરી લેવી જરૂરી છે.”

કલમ 194-ટીમાં કરવામાં આ વેલી જોગવાઈ પણ કરદાતાઓને માટે સમસ્યા ઊભી કરી શકે છે. તેમાં ભાગીદારોને આપવામાં આવતા પગાર, પાર્ટનરને વ્યાજની ચુકવણી, કમિશન આપો કે અન્ય કોઈ વળતર આપો તો તેના પર કલમ 194-ટી હેઠળ 10 ટકા ટીડીએસ-ટેક્સ ડિડક્શન એટ સોર્સ - કરકપાત કરવી પડશે. આ જોગવાઈ પહેલી વાર કરવામાં આવી છે. અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે પાર્ટનરને જે અપાય છે તે નફાની વહેંચણી જ હતી. તેના પર કરકપાતની જોગવાઈ નહોતી. પહેલી વાર ટીડીએસ 10 ટકાના દરે કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે.

ભાગની ભાગીદારી પેઢીના પાર્ટનર કે એલએલપીના પાર્ટનર ચેક કરશે નહિ. આ સંજોગોમાં પગારની ગણતરી કરતી વેળાએ દરેક ભાગીદારી પેઢીઓ અને એલએલપી નવી જોગવાઈ પ્રમાણે પગારની ગણતરી કરીને રિટર્નમાં દર્શાવી દેશે. આમ નવો લાભ ક્લેઈમ કરી લેશે. પાર્ટનરશિપ ડીડ અને એલએલપી એગ્રીમેન્ટમાં કલોઝ ન હોવાથી કે તેમાં સુધારો ન કર્યો હોવાથી 40 (બી)ના લાભ મેળવવાને પાત્ર ન હોય તો પણ જાણતાં કે અજાણતાં નવી કલમ 40 (બી)નો લાભ મેળવી લેવામાં આવે તેવી સંભાવના છે. આ સ્થિતિમાં ભાગીદારી પેઢી કે પછી એલએલપી પર ભવિષ્યમાં સ્કુટિની આવી શકે છે. તેના પર 33 ટકાના દરે ટેક્સ લાગી શકે છે. પાર્ટનરશિપ ડીડમાં જોગવાઈ ન હોવાથી અને એલએલપી એગ્રીમેન્ટમાં કલોઝ ન હોવાથી તે લાભ મળવાપાત્ર ન હોવા છતાં લેવામાં આવે તો તેવા સંજોગોમાં તે રકમ રિટર્નમાં અમાન્ય કરી દેવામાં આવશે. તેના પર 33 ટકાના દરે આવકવેરો ભરવો પડશે. તેમ જ તેના પર પેનલ્ટી અને વ્યાજ પણ લાગી શકે છે. આમ પગારની આવક તરીકે કલમ 40 (બી) હેઠળ ક્લેઈમ મૂકતાં પૂર્વે દરેક ભાગીદારી પેઢીઓ કે એલએલપીએ તેમનાં પાર્ટનરશિપ ડીડ કે

આ તો નફાનું વિતરણ છે. તેના પર મૂળભૂત રીતે ટીડીએસ થવો જ ન જોઈએ. કરીમ લાખાણી કહે છે, “દસ ટકા ટીડીએસ કરવામાં આવે તો ભાગીદારોના કેટલા બધા પૈસા બ્લોક થઈ જશે. તેમને લિક્વિડિટીની સમસ્યા નડશે. નાની નાની ભાગીદારી કંપનીઓએ ટાન નંબર એટલે કે ટેક્સ ડિડક્શન એન્ડ કલેક્શન અકાઉન્ટ નંબર લેવાની ફરજ પડશે, કારણ કે ટીડીએસ કરવાની મર્યાદા માત્ર રૂ. 20,000ની રાખવામાં આવી છે. આમ રૂ. 20,000ની મર્યાદા પગારના કિસ્સામાં બહુ જ નાની કહેવાય તેમ છે. ટીડીએસ કરીને તે જમા કરાવવો પડશે. ટીડીએસનું ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરવું પડશે. સૌથી મોટી સમસ્યા બુક પ્રોફિટ નક્કી કરવાની આવશે. વર્ષને અંતે બુક પ્રોફિટનો અંદાજ આવશે. બુક પ્રોફિટનો વર્ષના આરંભથી કે પછી વર્ષની મધ્યમાં કઈ રીતે ખબર પડશે.” તેથી ટીડીએસ વધારે કપાઈ જવાની શક્યતા રહેલી છે. આ વ્યવસ્થાની નાની

કલમ 40 (બી)નો લાભ લેવા માટે પાર્ટનરશિપ ડીડ કે એલએલપીના કાર શિવાઈઝ કરવા પડી શકે છે: શિવાઈઝ ન કરે તો સ્કુટિની આપી શકે ને પગાર ખર્ચ ડિસએલાપ થતાં ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ભરવી પડી શકે છે

નવી જોગવાઈના અમલીકરણની તારીખ પહેલી એપ્રિલ 2025 દર્શાવવામાં આવી છે. અહીં શંકા ઊભી થઈ રહી છે. પહેલી એપ્રિલ 2025ની તારીખ દર્શાવવામાં આવે તો તેના બે અર્થ થાય છે. કરીમ લાખાણી કહે છે, “વર્ષ 2024-25નું રિટર્ન ફાઈલ આકારણી વર્ષ 2025-26ને લાગુ પડશે. બીજો અભિપ્રાય એવો આવે છે કે નાણાકીય વર્ષ 2025-26થી એટલે કે આકારણી વર્ષ 2026-27થી લાગુ કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2025-26થી લાગુ કરવાનું હોવાનું હોય તો તેની જાહેરાત તેમણે આગામી ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવનારા બજેટના માધ્યમથી કરવી જોઈતી હતી. 2024-25ના બજેટમાં જાહેરાત કરી હોવાથી જ તે આકારણી વર્ષ 2025-26થી લાગુ પડી જશે તેમ માનવામાં આવે છે.” હવે 2024-25થી લાગુ કરવામાં આવે તો મોટી સમસ્યા થાય તેમ છે. 2024-25ના એપ્રિલ, મે, જૂન અને જુલાઈ મહિના વીતી ચૂક્યા છે. આ ગાળામાં ભાગીદારોને પેમેન્ટ પણ કરી દેવામાં આવ્યાં હોવાની શક્યતા રહેલી છે. તેના પર ટીડીએસ ન થયા હોવાની સંભાવના રહેલી છે. આ સ્થિતિમાં ટીડીએસ કઈ રીતે ગણવો તે એક સવાલ છે.”

ભાગીદારી પેઢીઓ અને નાની એલએલપીને બહુ જ મોટી તકલીફ પડવાની શક્યતા છે. કારણ કે તેમની પાસે રેગ્યુલર અકાઉન્ટન્ટ પણ ન હોવાની સંભાવના રહેલી છે. તેમની કોમ્પ્લાયન્સ કોસ્ટમાં ખાસ્સો વધારો થઈ જવાની પણ સંભાવના રહેલી છે. તેમની વર્કિંગ કેપિટલ પણ ટીડીએસની નવી જોગવાઈને કારણે બ્લોક થઈ જવાની સંભાવના રહેલી છે. સૌથી મોટી સમસ્યા તો બુક પ્રોફિટ નક્કી કરવાની જ આવવાની છે. હવે તેનાથીય આગળ વધીએ. તમે તમારો બુક પ્રોફિટ નક્કી કરી દો છો. ત્યાર બાદ તમારા હિસાબોનું ઓડિટ થાય છે. આ ઓડિટમાં બુક પ્રોફિટમાં વધારો કે ઘટાડો થાય છે. આ ચેન્જ પ્રમાણે ટીડીએસ નક્કી કરવો પડે છે. પ્રોફિટમાં થનારી વધઘટને પરિણામે નવો ગૂંચવડો ઊભો થવાની સંભાવના રહેલી છે. કેટલીક પેઢીઓ કે એલએલપીમાં એડહોક પેમેન્ટ પણ લેતાં હોય છે. ખાતામાં ચોક્કસ રકમ પડી હોય તો તેવા સંજોગોમાં એડહોક પેમેન્ટ લઈ લેતા હોય છે. તેમાં પણ ટીડીએસની નવી જોગવાઈને કારણે તકલીફ પડવાની સંભાવના રહેલી છે.

પગારનાં વધારેલાં ધોરણ પ્રમાણેનો ક્લેઈમ મૂકતાં પૂર્વે ભાગીદારી પેઢીએ-એલએલપીએ પાર્ટનરશિપ ડીડ અને એલએલપી એગ્રીમેન્ટમાં મૂકેલી શરતોનો અભ્યાસ કરીને નિર્ણય લેવો પડશે



ગુણવત્તા ગુજરાત અભિયાનનો અમદાવાદથી આરંભ થયો

ગુ

ણવત્તા ગુજરાતની ચળવળનો દાંડીયાત્રાની જેમ જ અમદાવાદથી આરંભ થશે. ગુજરાતીઓ બિઝનેસની અજબ કોઠાસૂઝ ધરાવે છે. ઇનોવેશન અને ક્વોલિટી તેમના ડીએનએમાં છે. તેથી જ દરેક ગુજરાતી અને દરેક ભારતીયના જીવનની ક્વોલિટીમાં સુધારો કરવામાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન જક્ષય શાહનું કહેવું છે, “ગુણવત્તાના મૂળભૂત પાઠ અમદાવાદમાંથી જ હું ભણ્યો છે. ગુજરાત સરકાર અને ગુજરાતના વેપારઉદ્યોગો ગુણવત્તા માટેનો સંકલ્પ કરી રહ્યાં છે. દરેક ગુજરાતીના જીવનનાં દરેક ક્ષેત્રમાં ગુણવત્તા-ક્વોલિટીમાં વૃદ્ધિ થાય તે માટેનો આ સંકલ્પ છે. જીવન ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રમાં, ગુજરાત ચલાવવા માટે રોજી મેળવવા માટેની તકમાં પણ ગુણવત્તા જોવા મળે તે માટેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને વાસ્તવમાં પલટવા માટે ગુણવત્તાનો સંકલ્પ કરવામાં આવી રહ્યો છે. આપણે સૌ સાથે મળીને ગુણવત્તાનું એક નવું જ સીમાચિહ્ન નિર્માણ કરીશું. તેની મદદથી વિકસિત ભારતના પ્રથમ વિકસિત રાજ્ય તરીકે ગુજરાતને વિકાસના માર્ગે લઈ જઈશું. આમ દરેક ગરવા ગુજરાતી માટે વધુ સમૃદ્ધિમય ભાવિ અને ઝળહળતું ભાવિ નિર્માણ કરવા માટેના અભિયાનનો આરંભ કરીશું.”

ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સેક્રેટરી જનરલ ચક્રવર્તી ટી. કમ્બને જણાવ્યું હતું કે, “વિકસિત ગુજરાત કઈ રીતે રૂપાંતર માત્ર સ્ટાન્ડર્ડમાં જ નથી થતું તેની સાથે ક્વોલિટીનું કલ્ચર પણ ડેવલપ થાય છે. આ કલ્ચર સમાજનાં દરેક પાસાંમાં જોવા મળે છે. આમ ગુણવત્તા-ક્વોલિટી અદ્ભુત કે અકલ્પનીય વિકાસનો મુખ્ય આધાર બની રહે છે. હરિયાણી કાન્તિએ જે રીતે દેશના કૃષિક્ષેત્રની શિકલ પલટી નાખી તે જ રીતે ક્વોલિટી પણ સમગ્ર વેપાર-ઉદ્યોગ અને સામાજિક જીવનની શિકલ બદલી નાખશે. આ ઝુંબેશનો આરંભ ગુજરાતથી થશે અને સમગ્ર દેશમાં તે ફરી વળીને પ્રભાવિત કરશે. આપણે આ દિશામાં માત્ર સફર શરૂ કરવાની નથી, પરંતુ ક્વોલિટીના સર્વોચ્ચ સ્થાન સુધી પહોંચવાનું પણ છે.” વિકસિત ગુજરાત માત્ર ક્વોલિટીમાં એક્સેલ નહિ



માત્ર ઉદ્યોગસાહસિકો ક્વોલિટીમાં સુધારો લાપે તે માટે આ અભિયાન ચાલુ નથી કરાયું, ક્વોલિટીમાં ધરમૂળથી બદલાવ આપે તે જરૂરી



કરે પણ સર્વોત્તમ આર્થિક વિકાસને પણ શક્ય બનાવશે. ગુજરાત ક્વોલિટી ઈકોસિસ્ટમ ડેવલપ કરશે. ગુજરાત અર્બન પ્રોફેશનલ જ નહિ, રૂરલ પ્રોફેશનલ પેદા કરવાની દિશામાં આગળ વધશે. ગુજરાત માત્ર સ્થાનિક બજારમાં સ્પર્ધાત્મક બનશે તેવું નથી. વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનશે. ગુજરાત પડકારને ઝીલી લે છે અને તેમાંથી નવી તકને નિર્માણ કરે છે. ક્વોલિટી કાઉન્સિલ થકી નિર્માણ થઈ રહેલી આ સંભાવનાને તકમાં પલટી નાખશે તેવો પણ વિશ્વાસ છે. ભાવિ જરૂરિયાતને ધ્યાનમાં લઈને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તેની ડિઝાઇન તૈયાર કરી આપશે. તેને માટે ભાવિ ટ્રેન્ડ્સને પણ ધ્યાનમાં લેવામાં આવશે. હવે હરિયાણી કાન્તિની જેમ આપણે ક્વોલિટી રેવોલ્યુશન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.

ક્વોલિટી ટ્રાન્સફોર્મેશનમાં શિક્ષણ ક્ષેત્ર, દરેક ક્ષેત્રમાં કાર્યકુશળ માનવબળનું નિર્માણ કરવા પર ફોકસ કરવામાં આવશે. આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારો કરવાની સાથે સાથે જ આરોગ્ય સેવા સસ્તી બને તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ગુણવત્તા પર ફોકસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગને વધુ સંગીન ફલક પર લઈ જવામાં આવશે. ઈ-કોમર્સમાં મૂલ્યવૃદ્ધિ કરીને તેનું રૂપાંતર કરીને અલગ લેવલ પર લઈ જવામાં આવશે. ગુજરાતના પર્યટનનું ગ્લોબલ હબ બનાવવા માટે ગુજરાતમાં પર્યટકો માટે ઉપલબ્ધ સુવિધાઓને

નેક્સ્ટ લેવલ સુધી લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે. માનવનાં જીવનધોરણ, સંસ્કૃતિ, રમતગમત સહિત સમાજજીવનના દરેક ક્ષેત્રમાં ગુણવત્તાનો ઉમેરો કરવામાં આવશે. તેનાથી જીવનની ગુણવત્તામાં થનારા સુધારાને જ સફળતાનો પાયો ગણવામાં આવશે. આમ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ગુજરાતની ક્વોલિટી સફર માટેનો સમગ્ર નકશો તૈયાર કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા યોજવામાં આવેલા સમારોહમાં બોલતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ક્વોલિટીના મોરચે સફળતા હાંસલ કરવા ગુજરાત વચનબદ્ધ છે. ગુજરાતના બિઝનેસ ઈન્ડસ્ટ્રીઝના તમામ મહત્વના ક્ષેત્રમાં એટલે કે આરોગ્ય, ઈ-કોમર્સ, એમએસએમઈનાં ઉત્પાદનોમાં, ઔદ્યોગિક ઉત્પાદનોમાં, શિક્ષણમાં, સ્કિલ ડેવલપમેન્ટમાં, સંસ્કૃતિ, રમતગમત અને સામાજિક વિકાસના મોરચે ક્વોલિટી-ગુણવત્તાને પ્રાધાન્ય આપવા મુખ્યમંત્રી વચનબદ્ધ થયા હતા. અમૃતકાળમાં વિકસિત ગુજરાતનું નિર્માણ કરવા માટે ગુણવત્તામાં વૃદ્ધિ કરવા માટે સર્વગ્રાહી સિસ્ટમ ડેવલપ કરવા ગુજરાત ગુણવત્તા સંકલ્પ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજથી થોડાં વર્ષ પહેલાં ભારતમાં ક્વોલિટી-ગુણવત્તા પર ફોકસ કરવામાં આવતું નહોતું, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની

સરકારે ક્વોલિટીને વેપારવિકાસ માટે મહત્વની ગણવાનો નિર્ધાર કર્યો તે પછી આ દિશામાં પ્રગતિ થવા માંડી છે. મોદી હૈ તો મુમકિન હૈ અહીં પણ જોવા મળી રહ્યું છે. મેક ઈન ઈન્ડિયા હોય કે પછી આત્મનિર્ભર ભારત કે પછી ડિજિટલ ઈન્ડિયા હોય, દરેક મોરચે ભારતે ખાસ્સી સફળતા મેળવી છે તે તેનો બોલતો પુરાવો છે. તેથી ક્વોલિટીના મોરચે પણ આપણે સફળતા મેળવીને જ રહીશું. તેને માટે શરૂઆત કરવાની છે. મારે આ કરવાનું જ છે અને ક્વોલિટી માટેના ખર્ચની ચિંતા કર્યા વિના જ આપણે આગળ વધીશું તો પાર પડી જશે. ક્વોલિટી સાથે ઈઝ ઓફ લિવિંગ પણ આવશે જ આવશે. 2047માં વિકસિત ભારતના નિર્માણનું સપનું પ્રધાનમંત્રી જોયું છે. તેમની જેમ જ આપણે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાની સાથોસાથ આપણે ગુણવત્તા-ક્વોલિટીના ક્ષેત્રમાં પણ સો ટકા સફળતા હાંસલ કરીશું તેવો મને વિશ્વાસ છે. ક્વોલિટી વિકાસ માટે એક સીમાચિહ્ન બની રહેશે. ગરવા અને વિકસિત ગુજરાતમાં ગરવું ગુજરાતમાં ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત ઉપરાંત ફાઈવ જીમાં ગુણવત્તા ગુજરાતનો પણ ઉમેરો થશે. નરેન્દ્ર મોદીએ લોકોને ક્વોલિટી શું છે અને તેનાથી આવનારા તફાવતનો અહેસાસ કરાવ્યો છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં પણ મલ્ટીસ્પેસિયાલિટી હોસ્પિટલ્સ અને મેડિકલ

01

ગુજરાત અર્બન પ્રોફેશનલ જ નહિ, રૂરલ પ્રોફેશનલ પેદા કરવાની દિશામાં આગળ વધશે. ગુજરાત માત્ર સ્થાનિક બજારમાં સ્પર્ધાત્મક બનશે તેવું નથી. વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનશે

વિકસિત ગુજરાત બનાવવા માટે દર વર્ષે 45 લાખ ઘર બનાવવા જરૂરી છે, આજે વર્ષે ગુજરાતમાં માત્ર 7.5 લાખ આવાસો બની રહ્યા છે

02

દરિયાળી કાન્તિએ દેશના કૃષિ ક્ષેત્રની શિક્ષણ પલટી નાખી તે જ રીતે ક્વોલિટી માટેનું અભિયાન પણ સમગ્ર વેપારઉદ્યોગ-સામાજિક જીવનની શિક્ષણ બદલી નાખશે. આ અંબેશનો આરંભ ગુજરાતથી થશે અને સમગ્ર દેશમાં તે ફરી વળીને પ્રભાવિત કરશે.

કે એન્જિનિયરિંગ કોલેજો ચાલુ થવા માંડી છે. દેશની પહેલી સેમિકન્ડક્ટર ચિપ્સ ગુજરાતમાં બનવાની છે.

ક્વોલિટી સ્ટાન્ડર્ડ દરેક ઉદ્યોગ સાહસિકના દિલમાં રહે તે જરૂરી છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા જુદાહરિયાળી કાન્તિએ જે રીતે દેશના કૃષિ ક્ષેત્રની શિક્ષણ પલટી નાખી તે જ રીતે ક્વોલિટી પણ સમગ્ર વેપાર ઉદ્યોગ અને સામાજિક જીવનની શિક્ષણ બદલી નાખશે. આ અંબેશનો આરંભ ગુજરાતથી થશે અને સમગ્ર દેશમાં તે ફરી વળીને પ્રભાવિત કરશે. જુદાં જુદાં સેક્ટર માટેના ક્વોલિટી સ્ટાન્ડર્ડ ક્વોલિટી કાઉન્સિલ ડિફાઈન કરશે. ક્વોલિટી પ્રોડક્ટ્સ ઉદ્યોગોના વિકાસ માટે કિંમતી છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને ગુજરાત તરફથી જોઈતો સંપૂર્ણ ટેકો આપવાનો અમે પ્રયાસ કરીશું.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે વિકસિત ભારત માટે ક્વોલિટી અત્યંત મહત્વની છે. વિકસિત ગુજરાત માટે પણ ક્વોલિટીની જરૂર છે જ છે. ડેવલપ કન્ટ્રી પર નજર નાખવામાં આવે તો તેમણે ક્વોલિટી ઓફ પ્રોડક્ટ અને ક્વોલિટી ઓફ લાઈફમાં ખાસ્સો ફરક લાવી દીધો છે. આપણી પ્રોડક્ટ્સ દેશમાં અને દુનિયામાં પહોંચે છે. ક્વોલિટીનો

લાસ્ટ માઈલ અચીવ કરવા માટે આપણે પ્રયાસ કરવાના છે. આ પ્રયાસો સફળ થયા પછી જ આપણે વિકસિત ભારત બની શકીશું. તેમ થશે તો જ આપણે એક્સપોર્ટના માર્કેટમાં છવાઈ શકીશું. તેમ જ વિદેશમાંથી દેશમાં ડ્રૂડિયામણ લાવી શકીશું. ભારત વિકસશે અને વૈશ્વિક પણ બનશે. ક્યૂસીઆઈની ભૂમિકા તેમાં બહુ જ મોટી રહેશે. ગાહેડના પૂર્વ પ્રમુખ શેખર પટેલે આ

અંગે બોલતાં જણાવ્યું હતું કે રિયલ એસ્ટેટની ઈન્ડસ્ટ્રીઝ રૂ. 27 લાખ કરોડની છે. આઈટી ઈન્ડસ્ટ્રીનો ફાળો મોટો હોવા છતાં ભારતના જીડીપી પર 50 ટકા જેટલી અસર કરી શકે છે. ગુજરાતને વિકસિત ભારત બનાવવા માટે દર વર્ષે 45 લાખ ઘર બનાવવા જરૂરી છે. અત્યારે દર વર્ષે 7.5 લાખ ઘર બની રહ્યા છે. બાંધકામ ઉદ્યોગ પણ ક્વોલિટી વર્ક પર ફોકસ કરશે.



03

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને વાસ્તવમાં પલટવા માટે ગુણવત્તાનો સંકલ્પ કરીને ગુણવત્તાનું એક નવું જ સીમાચિહ્ન ઘાંસલ કરવા ગુજરાતના ઉદ્યોગો મક્કમ

સ્પેન્ટ એસિડની વોટરલેસ ટ્રીટમેન્ટ કરી 5 લાખ લિટર એફ્લુઅન્ટમાં ઘટાડો કર્યો

નો

વેલ સ્પેન્ટના ચેરમેન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે નોવેલ સ્પેન્ટ વોટરલેસ ન્યુટ્રલાઇઝેશનની ફેસિલિટી વિકસાવી છે. ડાઇઝ ઇન્ટરમિડિયેટ, કેમિકલ અને ડાઇઝનું

ઉત્પાદન કરતી મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં ચાલતી પ્રોસેસ દરમિયાન સ્પેન્ટ સલ્ફ્યુરિક એસિડ આડપેદાશ તરીકે નીકળતો હતો. તેને હેન્ડલિંગ કરવો મુશ્કેલ હતો. તેને પરિણામે પ્રોડક્શન લોસ પણ આવતો હતો. ઇન્ડસ્ટ્રીઝને સતવાતા મોટા પ્રશ્નનો ઉકેલ લાવવા નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટની 2009માં સ્થાપના કરવામાં આવી હતી. નાના અને મધ્યમ કદના ઉદ્યોગની જીવાદોરીસમાન આ સંસ્થા છે. વોટરલેસ ન્યુટ્રલાઇઝેશન ફેસિલિટી કરવાથી રોજના 500 ટનને બદલે રોજના 1000 ટનનું ટ્રીટમેન્ટ-પ્રોસેસિંગ થઈ શકે છે. પરિણામે રોજનું 5 લાખ લિટર એફ્લુઅન્ટ ઓછું કરી શક્યા છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના મેમ્બર સેક્રેટરી જી. એમ. ઠાકરે કહ્યું હતું કે વોટરલેસ ન્યુટ્રલાઇઝેશનની સુવિધા ઊભી કરવામાં આવી તેને પરિણામે સીઓડીનાં નોર્મ્સ લાવવાં શક્ય બન્યાં હતાં. આ વ્યવસ્થાની ભારત કક્ષાએ અને વિશ્વકક્ષાએ નોંધ લેવામાં આવશે. દેશના બધાં જ સીઈટીપી અત્યારે સારી કામગીરી કરે છે. તેમણે પણ આ પ્રકારના આયોજનો કરવા જોઈએ. આ રીતે ટકાઉ વિકાસની કેડી પર આગળ વધી શકાશે.

નોવેલ સ્પેન્ટ એસિડની ક્ષમતા 2000 ટનના સ્ટોરેજની છે. જીપીસીબીના માર્ગદર્શન હેઠળ જીપીએસની સિસ્ટમથી સ્પેન્ટ સલ્ફ્યુરિક એસિડનું સમગ્ર ગુજરાતમાં હેન્ડલિંગ કરીએ છીએ. તેમાંથી રોજના 600 ટન જિપ્સમ બનાવવાની ક્ષમતા છે. નોવેલ

સ્પેન્ટ એસિડ પાસે એનએબીએલનું એક્રિડિટિશન ધરાવતી લેબોરેટરી પણ છે. આઈએસઓ સર્ટિફિકેશન પણ છે. ટેન્કર બુકિંગ માટે ખાસ એપ તૈયાર કરી છે. અત્યાર સુધીમાં 26 લાખ ટન સ્પેન્ટ એસિડનું હેન્ડલિંગ કર્યું છે. તેમાંથી 16 લાખ ટનની ટ્રીટમેન્ટ નોવેલ સ્પેન્ટ



સ્પેન્ટ એસિડની વોટરલેસ ટ્રીટમેન્ટની સુવિધા ઊભી કરીને ઉદ્યોગનો રૂ. 300 કરોડનો બોજ ઓછો કર્યો



એસિડમાં કરેલી છે. તેમાંથી 9.5 લાખ ટન જિપ્સમ બનાવીને રૂલ નાઈન હેઠળ પરમિશન લઈને સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને પૂરું પાડ્યું છે. તેમ જ 6.5 લાખ ટન સ્પેન્ટ એસિડ અમદાવાદના પરિસરના ટેક્સટાઇલ ઉદ્યોગને આપ્યું છે. છેલ્લાં ત્રણ વર્ષમાં બે લાખ ટન સ્પેન્ટ સલ્ફ્યુરિક એસિડ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને સપ્લાય કરેલો છે. આ રિઝ્યુસ, રિસાઈકલ એન્ડ રિયુજના સિદ્ધાંતને નોવેલ સ્પેન્ટ એસિડે સાકાર કરી બતાવ્યો છે. આમ સરક્યુલર ઇકોનોમી અથવા તો સિમ્બાયોસિસનું પણ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. જીપીસીબીના ચેરમેન આર. બી. બારડે જણાવ્યું હતું કે નોવેલ અને વટવા ગ્રીને પોલ્યુશનને કંટ્રોલ કરવા માટે ખાસ્સું સંશોધન કર્યું છે. તેને પરિણામે વિન વિન સિમ્યુએશન નિર્માણ થઈ રહી છે તે માટે તેઓ અભિનંદનને પાત્ર બની રહ્યાં છે. રિસર્ચમાં અમે જીપીસીબી તરીકે મદદરૂપ પણ થઈશું. જયપુરમાં કોસ્ટિક રિકવરી પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યો તેને માટે મૂડીખર્ચ મોટો કરવો પડ્યો હતો, પરંતુ ત્યાર બાદ તેમાંથી તેમને ખાસ્સી મોટી આવક થવા માંડી હતી. પર્યાવરણને જાળવવા માટે પહેલાં મોટો ખર્ચ થતો લાગે છે, પરંતુ સમય જતાં તે ખર્ચની સામે આવક કરાવનાર અને પોલ્યુશન ઘટાડનાર સાબિત થાય છે.

સ્પેન્ટ સલ્ફ્યુરિક એસિડમાં પહેલાં કલર વધારે આવતો હતો. કલરને ડિસ્ટ્રિબ્યુટ કરીને ન્યુટ્રલાઇઝ કરવાથી જિપ્સમની ગુણવત્તા પણ બહેતર બની છે. હવે કલરલેસ જિપ્સમ આપવામાં આવતો હોવાથી સિમેન્ટ ઇન્ડસ્ટ્રી ખુશ ખુશ થઈને તેનો ઉપાડ કરી રહી છે. તેનાથી ડાઇઝ અને ઇન્ટરમિડિયેટ ઇન્ડસ્ટ્રી પરનો રૂ. 300 કરોડનો બોજ ઓછો કરવામાં સફળતા મેળવી છે. સંસદસભ્ય હસમુખ પટેલે કહ્યું હતું કે, 1995-98ના અરસામાં જે દિવસો કેમિકલ ઉદ્યોગે જોવાના આવ્યા હતા તેવા દિવસો જોવાના ન આવે તે માટે સક્રિય થવું જરૂરી છે. તે અરસામાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બી. એન. કિરપાલનો ઓર્ડર આવ્યો હતો.



તમારા સંતાનને ભણવા કેનેડા મોકલવા માગો છો? ચેતી જજો

મો

ટાં સપનાંઓ લઈને ભારતીય અને ગુજરાતી વિદ્યાર્થીઓ કેનેડા ભણવા અને સ્થાયી થવા જઈ રહ્યા છે, પરંતુ ભારતીય વિદ્યાર્થીઓનાં સોનેરી સપનાંઓ હવે તૂટવા માંડ્યાં છે. પહેલાં કેનેડા જઈને સેટલ થાવ અને સમય જતાં અમેરિકામાં એન્ટ્રી મેળવી લેવાની માનસિકતા ભારતીય વિદ્યાર્થીઓ ધરાવતા હતા, પરંતુ આજે કેનેડાનો સંઘર્ષ એટલો વધી ગયો છે કે વિદ્યાર્થી માટે ટકવું અને સાથે ગયેલા પરિવારના સભ્યો એટલે કે પત્ની ને બાળકોને ટકાવવા કઠિન

ભણતાં ભણતાં જોબ કરીને માતાપિતાનો ખર્ચબોજ ઓછો કરવા માગતા વિદ્યાર્થીઓને જોબ ન મળતાં હોવાથી વિદ્યાર્થીઓ મૂંઝાઈ રહ્યા છે. કેનેડાની મોંઘવારીમાં અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બની ગયું છે. કેનેડામાં જોબ ન મળતો હોવાથી ભણતાં ભણતાં અઠવાડિયે 20થી 24 કલાક નોકરી કરીને ભારતમાં રહેતાં મા-બાપ પરનો ખર્ચ બોજ ઓછો કરવાનાં વિદ્યાર્થીઓનાં આયોજનો ખોરવાઈ રહ્યાં છે. સંતાનને કેનેડા મોકલવા માટે માતા-પિતા આખી જિંદગીની બચત ખર્ચી નાખે તો પણ પૈસા ખૂટી પડતા હોવાના કિસ્સાઓ બની રહ્યા છે. કેનેડા મોકલવાનો ખર્ચ કર્યા બાદ તેમને ત્યાં બે-ત્રણ વર્ષ નિભાવવાનો ખર્ચ પણ મોકલવાની નોબત આવવા માંડી હતી. પરિણામે 20થી 25 ટકા વિદ્યાર્થીઓ ગુજરાત કે ભારતમાં પરત ફરી ગયા છે.

કેનેડાની સ્થિતિમાં એકાએક પલટો કેમ આવ્યો. કેનેડામાં સેટલ થવા નીકળેલો યુવાન વિદ્યાર્થી કેમ સમસ્યાઓના કળણમાં ખૂંપવા માંડ્યો છે. કેન કન્સલ્ટન્ટના પ્રમોટર પંકજ પટેલ કહે છે, “ભારતમાંથી કે પછી ગુજરાતથી કેનેડા ગયેલા વિદ્યાર્થીઓને સૌથી મોટી સમસ્યા એમ્પ્લોયમેન્ટની થઈ ગઈ છે. તેમને જોબ જ મળતી નથી.” પરિણામે કેનેડાનું આકર્ષણ ઘટી રહ્યું છે. એક જમાનામાં ગુજરાત અને ભારતમાંથી પરદેશ ભણવા જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને માટે કેનેડા એક ફેવરિટ ડેસ્ટિનેશન હતું. પરંતુ હવે કેનેડા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા એકદમ ઘટી રહી છે. 2023ના વર્ષની વાત કરવામાં આવે તો ભારતમાંથી 3.2 લાખ વિદ્યાર્થીઓ ભણવા માટે કેનેડા ગયા હતા. જોકે 2024નો આરંભ થયો તે પછી કેનેડાની સરકારે સ્ટુડન્ટ વિઝા માટે આવવામાં આવતી પરમિટમાં 35 ટકાનો ઘટાડો કરીને 3,60,000 પર સીમિત કરી દીધી હોવાનું ઇમિગ્રેશન, રેફ્યુજી અને સિટિઝનશિપ

**2023ના ઑક્ટોબર-
ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં
કેનેડા ભણવા માટેની પરમિટની
માગણી કરનારા
ભારતીય વિદ્યાર્થીઓની
સંખ્યામાં 86 ટકાનો ઘટાડો**



**પંકજ પટેલ,
કેન કન્સલ્ટન્ટ**

બની ગયું છે. પરિણામે કેન કન્સલ્ટન્ટના પ્રમોટર અને વિઝા એક્સપર્ટ પંકજ પટેલ કહે છે તેમ “આજકાલ કેનેડા માટે અરજી કરનારાઓની સંખ્યા માંડ 15થી 20 ટકા જ થઈ ગઈ છે.”

આ રહ્યાં તેનાં કારણો. આજે કેનેડા ભણવા જતા વિદ્યાર્થીને જોબ મળતી નથી. કેનેડા સેટલ થવા જતા વિદ્યાર્થીઓને રહેવા માટે મકાન મળતાં નથી.



કેનેડા-આઈઆરસીસીના આંકડાઓ જણાવે છે. 2022 અને 2023માં કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર વિશ્વભરના દેશોમાંથી જનારા વિદ્યાર્થીઓમાંથી 37થી 41 ટકા વિદ્યાર્થીઓ ભારતના હતા. તેથી પણ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી જ ગઈ છે. પંકજ પટેલ કહે છે, “ફોરેન સ્ટુડન્ટ્સ માટે ઇમિગ્રેશનનો જે ક્વોટા રિલીઝ કર્યો તેના પ્રમાણમાં જોબ જનરેટ થતી નથી. તેમને રોજગારી મળતી નથી. તેમ જ તેમને માટે હાઉસિંગની પણ સુવિધા નથી. તેથી ઘરનાં ભાડાં સૌ ટકા વધી ગયાં છે. પરિણામે ગુજરાત અને પંજાબમાંથી કેનેડા ગયેલા વિદ્યાર્થીઓની ફરિયાદ વધી ગઈ. તેમણે જાહેરમાં વિરોધ પ્રદર્શન કર્યાં. તેથી કેનેડાની સરકારને રિવલાઈઝ થયું કે તેનાથી મોટી ભૂલ થઈ ગઈ છે. પરિણામે પરિસ્થિતિ સુધારવા માટે ઇમિગ્રેશનનો ક્વોટા ઘટાડી દેવાનાં પગલાં લીધાં છે.”

વર્ક પરમિટ ઘટાડવા ઉપરાંત કેનેડાની સરકારે વર્ક પરમિટનાં ધોરણો વધુ ચુસ્ત કરી દીધાં છે તેમ જ કેનેડા આવતા વિદ્યાર્થીઓની સ્કુટિની પણ વધુ કડક કરી નાખી છે. કેનેડા સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાને સ્થિર કરી દેવા માટે આ પગલું લીધું છે. તેમ જ કેનેડા આવીને ઘર વિના રજાવું ન પડે કે રોજગારી વિના ટટળવું ન પડે તે માટે પગલાં લીધાં છે. બીજું, કેનેડાના જુદા જુદા પ્રાન્તમાં વિદ્યાર્થીઓ ફેલાઈ જાય તેવી ગણતરી પણ કેનેડા સરકાર કરી રહી છે. તેથી મોટાં શહેરોમાંનો ધસારો ઓછો થઈ જાય. પરિણામે ભારતીય વિદ્યાર્થીઓને પરમિટ મેળવવામાં તકલીફ પડવા માંડી છે. પંકજ પટેલ કહે છે, “માસ્ટર ડિગ્રી કરનારા કે મેડિકલનો અભ્યાસ કરવા માટે જનારા વિદ્યાર્થીઓ સિવાયના તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને વર્ક પરમિટ આપવાનું જૂન, 2024 પછી બંધ કરી દીધું છે. તેથી કેનેડા જનારા વિદ્યાર્થીઓ માટે ભણતાં ભણતાં 20થી 24 કલાક નોકરી કરી લઈને પોતાના ખર્ચ કાઢી લેવાનું અને કેનેડા પહોંચ્યા પછી મા-બાપ પરનો

ખર્ચબોજ ઓછો કરવાનું આયોજન સદંતર ખોરવાઈ ગયું.” તદુપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડી માટે આવતા વિદ્યાર્થીઓને વર્ક પરમિટ આપવા માટેનાં ધોરણો બદલી નાખ્યાં છે. આ નિર્ણયે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જનારા વિદ્યાર્થીઓના ઉત્સાહ પર પણ ઠંડું પાણી રેડી દીધું.

ઓક્ટોબર-ડિસેમ્બર 2023ના ત્રિમાસિક ગાળામાં ભણવા માટેની પરમિટની માગણી કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 86 ટકાનો ઘટાડો આવી ગયો હતો. આ ત્રિમાસિક ગાળામાં અરજી કરનારાઓની સંખ્યા 1,08,940થી ઘટીને માત્ર 14,910ની થઈ ગઈ હતી. બીજું, વર્ક પરમિટ માટેનાં જડબેસલાક ધોરણો અને સતત વધારવામાં આવી રહેલી સ્કુટિનીને પરિણામે

ભારતીયોની અરજીમાં ઘટાડો થયો છે. હા, તેની અસર હેઠળ કેનેડા સરકારની આવકમાં પણ ઘટાડો થયો છે. કેનેડાના આર્થિક વિકાસ પર પણ વિપરીત અસર પડી હતી. એકલા પંજાબમાંથી કેનેડા ભણવા જનારા વિદ્યાર્થીઓ અંદાજે રૂ. 68,000 કરોડનો ખર્ચ કરે છે. ભારતમાંથી 2022માં કેનેડાના સ્ટુડન્ટ વિઝા મેળવનારા વિદ્યાર્થીઓની કુલ 2, 26,450ની હતી. તેમાંથી એકલા પંજાબમાંથી 1.36 લાખ સ્ટુડન્ટ્સ હતા. અત્યારે પંજાબના 3.4 લાખ વિદ્યાર્થીઓ કેનેડામાં ભણી રહ્યા છે. ગુજરાતમાંથી જનારા વિદ્યાર્થીઓની સંખ્યા પંજાબ પછી બીજા ક્રમે આવતી હોવાનું માનવામાં આવે છે, પરંતુ હવે કેનેડા ભણવા અને સેટલ થવા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ છે.

આ રહ્યાં કારણો: એક, કેનેડાની સરકારે વર્ક પરમિટની પોલિસીમાં કરેલો ફેરફાર પણ ભારતીયોની ઘટેલી અરજી માટે જવાબદાર છે. કેનેડા જવા માગતા વિદ્યાર્થીઓ અને તેમનાં માતાપિતાને માથે આવતો નાણાકીય બોજ વધી ગયો છે. બે, કેનેડા-ભારત વચ્ચે વધેલું રાજદ્વારી ટેન્શન પણ કેનેડા જતા વિદ્યાર્થીઓની સંખ્યાના ઘટાડા માટે જવાબદાર છે. કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર સામે કરેલા આક્ષેપોને પરિણામે ભારત-કેનેડા વચ્ચેના સંબંધો ખરાબ થઈ ગયા છે. તેથી પણ કેનેડા જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ગમે ત્યારે મુશ્કેલી આવે તેવા ભયને કારણે વિદ્યાર્થીઓએ કેનેડા જવાનું ટાળવા માંડ્યું. ત્રીજું, પાલિસ્તાની ત્રાસવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા થવાને મુદ્દે રાજદ્વારી વિવાદ થતાં ઓછા ભારતીય વિદ્યાર્થીઓએ અરજી કરી હતી, કારણ કે ભારત સરકારે વિદ્યાર્થીઓની પરમિટ ઈશ્યૂ કરતા કેનેડાના ડિપ્લોમેટ-રાજદૂતની હકાલપટ્ટી કરી હતી. ચોથું, વર્ક પરમિટનાં કડક કરેલાં ધોરણો પણ વિદ્યાર્થીઓની અરજીની સંખ્યા ઘટાડવા માટે જવાબદાર છે. પાંચમું, સ્ટુડન્ટ્સ વિઝા મેળવવા માટેની પાત્રતાનાં





ધોરણો કડક કરી દેવામાં આવ્યાં તેથી પણ અરજીઓની સંખ્યા ઘટી છે. છઠ્ઠું, દાયકામાં કેનેડા જવા માટેના ખર્ચમાં પણ ખાસ્સો વધારો આવ્યો છે. એક અંદાજ મુજબ કેનેડા જવા માગતા વિદ્યાર્થીઓએ પહેલાં 10,000 ડોલરનો ખર્ચ કરવો પડતો હતો. હવે આ ખર્ચ વધીને 20,635 ડોલરને આંબી ગયો છે. સાતમું, ઘરભાડાનો ખર્ચ બમણો થઈ ગયો. આઠમું, નોકરીના કલાકો ઘટાડી દેવામાં આવ્યા. એજ્યુકેશન ફી અને ટ્રાવેલિંગનો ખર્ચ પણ કરવો પડી રહ્યો છે. મોંઘવારી વધતાં ખાવાપીવાનો ખર્ચ પણ 25 ટકા વધી ગયો.

પંકજ પટેલનું કહેવું છે કે પહેલાં અન્ડરગ્રેજ્યુએટ કોર્સ માટે કે ડિપ્લોમા માટે જતાં વિદ્યાર્થીઓ 10,000 ડોલરના ખર્ચમાં કેનેડા પહોંચીને ભણી લેતા હતા. પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે આ ખર્ચ હવે વધીને 50,000 ડોલરની સપાટીને વળોટી ગયો છે. બીજું, ગ્રેજ્યુએશન કે પછી ડિપ્લોમા કોર્સ કરનારાઓને વર્ક પરમિટ જ આપવાનું કેનેડા સરકારે બંધ કરી દીધું છે.” પરિણામે આવક મેળવવાનો કોઈ વિકલ્પ જ તેમની પાસે રહેતો નથી. તેથી પણ કેનેડા જવાનો ઉત્સાહ ઠરી ગયો છે. પંકજ પટેલ કહે છે, “વર્ક પરમિટ મેળવવા માટે જ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશનના કે ડિપ્લોમાના કોર્સ કરવા માટે જતા હતા, પરંતુ તેમને વર્ક પરમિટ આપવાનું જ બંધ કરી દેવામાં આવતાં તેમનો જવાનો હેતુ જ પૂરો થઈ ગયો છે. સપ્ટેમ્બર, 2024થી લાગુ પડતા નવા નિયમ મુજબ કેમ્પસની બહાર કામ કરવાના કલાકની સંખ્યા મહત્તમ 20 કલાક કરી દેવામાં આવી છે. આમ આવતા મહિનાથી કેમ્પસની બહાર નોકરી કરવાનો રસ્તો પણ બંધ થઈ રહ્યો છે. ગ્રેજ્યુએશન કે ડિપ્લોમા કરીને વર્ક પરમિટ મેળવી લેવા માટે જનારા વિદ્યાર્થીઓની સંખ્યા 85થી 90 ટકાની આસપાસની છે. નોકરી કરી કમાવાની તક ન મળતી હોવાથી તેમણે તો જવાનું સાવ જ બંધ કરી દીધું છે.” ખાનગી કોલેજો પબ્લિક કોલેજના કરિક્યુલમ ચલાવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ કરિક્યુલમ ભારતીય વિદ્યાર્થીઓમાં ખાસ્સો

શિક્ષણનું ધોરણ કથળ્યું તેથી કેનેડા સરકારની ચિંતા વધી

આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ્સની સંખ્યા વધી જતાં કેનેડાની હાઉસિંગ સિસ્ટમ માટે રહેવાનાં ઘર પૂરાં પાડવાં કઠિન બની ગયું છે તેમ જ તેમને આરોગ્ય સેવાઓ આપવી મુશ્કેલ બની ગઈ છે. તેને પરિણામે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓની એજ્યુકેશનની ક્વોલિટી-ગુણવત્તા પણ કથળી છે. તેમાં ખાસ કરીને પ્રાઇવેટ કોલેજોમાં આપવામાં આવતા એજ્યુકેશનની ક્વોલિટી બગડી ચૂકી છે. તેથી આંતરરાષ્ટ્રીય સ્તરેથી કેનેડામાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા માટે તમામ નિયમોને કસીને ચુસ્ત કરવામાં આવી રહ્યા છે. આમ એજ્યુકેશનની ક્વોલિટી જાળવી રાખવા માટે કવાયત કરવામાં આવી રહી છે. બીજી તરફ સ્ટડી પરમિટ પર નિયંત્રણ મૂકવામાં આવ્યાં હોવાથી ઓન્ટારિયો અને બ્રિટિશ કોલંબિયા જેવા વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેની વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવાની સ્પર્ધા વધી જશે. તેથી એડમિશન મેળવવાં અઘરાં બની જશે. ઓન્ટારિયોમાં ભણવા આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 55 ટકાનો ઘટાડો થઈ ગયો છે. બ્રિટિશ કોલંબિયામાં એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટને માન્યતા આપવા માટેનાં ધોરણોમાં બદલાવ લાવવામાં આવ્યો છે. દરેક ખાનગી શૈક્ષણિક સંસ્થાના ઈન્સ્પેક્શન કરવામાં આવી રહ્યાં છે. ત્યાર બાદ જ યોગ્ય જણાય તો તેમની માન્યતા ચાલુ રાખવામાં આવી રહી છે. આ રીતે એજ્યુકેશનની ક્વોલિટી સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નોવા સ્કોટિયામાં શૈક્ષણિક સંસ્થાઓની ટ્યૂશન ફીની મર્યાદા નક્કી કરી દેવામાં આવી હોવાથી યુનિવર્સિટીઓને સ્ટુડન્ટ્સને ટકાવવા માટે વધારાનું ભંડોળ ખર્ચવું પડી રહ્યું છે. વિદ્યાર્થીઓ નોવા સ્કોટિયામાં સ્થિર થાય તેવો સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વિષમતા વચ્ચે સ્ટુડન્ટ પરમિટ માગનારા વિદ્યાર્થીઓની અરજી ક્લિયર થવામાં વિલંબ થઈ શકે છે. તેમ જ તેમની અરજીઓ રિજેક્ટ થઈ જવાની સંભાવના છે. તેથી ભણવા માટે બીજા દેશોમાં જવાનો પ્રવાહ વધશે. પંકજ પટેલ કહે છે, “હવે વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા અને અમેરિકા વધુ જવા માંડ્યા છે.”

બીજી તરફ સ્ટુડન્ટ વિઝા પર ક્યૂબેક, અલબર્ટા, સાસ્કેચવાન, ન્યુફાઉન્ડલેન્ડ, લેબ્રાડોર અને મનીટોબામાં જવા ઈચ્છનારા માટે માર્ગ ખૂલી શકે છે. આ વિસ્તારોમાં સારી ગુણવત્તાનું શિક્ષણ આપે તેવી સંસ્થાઓ ચાલુ થવા માંડશે. પરિણામે નવી સરકાર આવે તે પછી સમગ્ર પરિસ્થિતિમાં પરિવર્તન આવે તેવી આશા રાખી શકાય તેમ છે. હાલ પૂરતું કેનેડામાં ભણવા જવાની અટકી જ જવાની સંભાવના વધારે છે. પંકજ પટેલનું કહેવું છે, “આગામી બે વર્ષ સુધી આ સ્થિતિમાં કદાચ બહુ મોટો તફાવત આવે તેવું જણાતું નથી. કેનેડામાં નવી સરકાર આવે તે પછી તેમાં ફરક આવી શકે છે. વર્તમાન સરકારે બહુ લાંબું વિચાર્યા વિના ક્વોટામાં વધારો કરી દીધો છે.” આ ફેરફાર ન આવે ત્યાં સુધી ભણવાના ખર્ચ ઉપરાંત નિભાવ ખર્ચ માટે મા-બાપ પર જ નિર્ભર રહેવું પડશે.

કૈનેડા હવે કેમ જઈ નથી શકતા



કૈનેડા-ભારત વચ્ચે વધેલું રાજદ્વારી ટેન્શન પણ કૈનેડા જતા વિદ્યાર્થીઓની સંખ્યાના ઘટાડા માટે જવાબદાર છે.



કૈનેડાની સરકારે વર્ક પરમિટની પોલીસીમાં કરેલો ફેરફાર પણ ભારતીયોની ઘટેલી અરજી માટે જવાબદાર છે.

સ્ટુડન્ટ્સ વિઝા મેળવવા માટેની પાત્રતાના ધોરણો કડક કરી દેવામાં આવ્યા

A
BC

ભણતાં ભણતાં નોકરીના ક્લાસો ઘટાડી દેવામાં આવ્યા. એજ્યુકેશન ફી અને ટ્રાપેસિંગનો ખર્ચ પણ વધ્યો. મોંઘવારીને કારણે ખાવાપીવાનો ખર્ચ પણ 25 ટકા વધી ગયો.



ઘર ભાડાંનો ખર્ચ માસિક 800 ડોલરથી વધીને 1500 ડોલરથી પણ વધી ગયો

કૈનેડા જવા-ભણવા માટેના ખર્ચમાં પહેલાં 10,000 ડોલરનો હતો. હવે આ ખર્ચ વધીને 20,635 ડોલરને આંબી ગયો

કૈનેડા જવા માગતા વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાને માથે આવતો નાણાકીય ભોજ વધીય ગયો છે.



ખાલિસ્તાની ત્રાસવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવાને મુદ્દે રાજદ્વારી વિવાદ વધતાં ભારત સરકારે વિદ્યાર્થીઓની પરમિટ ધરતૂ કરતા કૈનેડાના ડિપ્લોમેટ-રાજદૂતની હકાલપટ્ટી કરી

1 + 2

વર્ક પરમિટનાં કડક કરેલાં ધોરણોને કારણે પણ વિદ્યાર્થીઓની અરજીની સંખ્યા ઘટી ગઈ. ગ્રેજ્યુએશન કે ડિપ્લોમા કરવા જનારાઓને વર્ક પરમિટ આપવાનું સંદેહ બંધ કરી દેવાયું.



પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે આ ખર્ચ હવે વધીને 50,000 ડોલર થઈ ગયો. પોસ્ટ ગ્રેજ્યુએટ્સ થયા પછી સ્ટોરમાં નોકરી કરવાની, ટેક્સી ચલાવવાની કે પછી રેસ્ટોરાંમાં બિલિંગ કરનારની નોકરી કરવાની પડી રહેલી ફરજ



લોકપ્રિય હતો. સરકારે તે પણ બંધ કરી દીધો છે. તેમને વર્ક પરમિટ આપવાનું અટકાવી દેવામાં આવ્યું છે. આ બદલાવ આવતાં ભારતીય વિદ્યાર્થીઓનો ઉત્સાહ ઠરી ગયો હતો.

તદુપરાંત માસ્ટર્સ અને ડૉક્ટરેસની ડિગ્રી માટે અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓની પત્નીઓને ઓપન વર્ક પરમિટ આપવાના નિયમો નવા બનાવવામાં આવ્યા હતા. તેથી ભારતીય વિદ્યાર્થીઓને સ્નાતકથી નીચે અભ્યાસક્રમો માટે એડમિશન લેવામાં રસ રહ્યો નહોતો. અન્ડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં અભ્યાસ કરીને કામ મળવાનું બંધ થઈ જતાં પોતાને અને પરિવારને ટકાવવો કઠિન બની ગયું હતું. તેની સાથે જ પહેલી ડિસેમ્બર, 2023થી લાગુ કરવામાં આવેલા નવા નિયમ મુજબ વિદેશી વિદ્યાર્થીઓને ભણાવતી દરેક સંસ્થાઓએ તેમણે સ્વીકારેલા દરેક પત્ર અંગેની જાણકારી સીધી ઈમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટિઝનશિપ કેનેડા-આઈઆરસીસીને સીધી જાણ કરવાની વ્યવસ્થા દાખલ કરી દેવામાં આવી છે. તેની સાથે જ કેનેડા ભણવા આવતા વિદેશી વિદ્યાર્થીઓ સાથે થતાં ફોડ અટકાવવા માટે સ્કુટિની કરવા માટે વધારાની વ્યવસ્થા કરવામાં આવતાં પણ ભારતીય વિદ્યાર્થીઓની માનસિક તાણમાં વધારો થઈ ગયો હતો. પોતાના સો ટકા કાગળો સાચા ન હોય અને પકડાઈ જવાનો ડર લાગે તેવા વિદ્યાર્થીઓએ પીછેહટ કરી લીધી છે, કારણ કે ગમે ત્યારે તેમની અરજીને ફોડ ગણાવી દેવામાં આવે તેવો ભય તેમને સતાવવા માંડ્યો હતો. આમ આ પ્રકારના અનેક નિર્ણયોને કારણે કેનેડા જવા માટે ભારતીય વિદ્યાર્થીઓની અરજીમાં ઘટાડો થયો હતો.

તદુપરાંત કેનેડામાં સ્ટડી પરમિટ પર જનારા વિદ્યાર્થીઓને માથે ભાડેથી ઘર લેવા માટેનો ખર્ચ વધી ગયો છે. તેથી આર્થિક તાણ અનુભવતા વિદ્યાર્થીઓએ કેનેડાને પસંદ કરવાનું જ અટકાવવા માંડ્યું છે. પંકજ પટેલ કહે છે, “જે ઘર માસિક 800 ડોલરના ભાડે મળતાં હતાં

તે જ ઘર હવે માસિક 1500 કે તેનાથી વધુ ડોલરના ભાડે મળી રહ્યાં છે.” પોસ્ટ ગ્રેજ્યુએટ્સને વર્ક પરમિટ આપવામાં આવે છે, પરંતુ મેડિકલની ડિગ્રી ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓને તેમની ડિગ્રીની તુલનાએ યોગ્ય ગણાય તેવી જોબ મળતી જ નથી. તેથી તેમણે ઉત્તર અમેરિકાના વિસ્તારોમાં જવું પડી રહ્યું છે. આમ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી કે મેડિકલની ડિગ્રી લીધા પછીય જોબ મળશે કે નહિ તેની ખાતરી નથી. મેડિકલનો અભ્યાસ કરીને ડિગ્રી મેળવ્યા પછી ટેક્સી ચલાવીને ગુજારો કરવો પડી રહ્યો છે. સ્ટોર્સમાં વર્કર તરીકે કામ કરવાની ફરજ પડી રહી છે તેમ જ રેસ્ટોરાંમાં બેસીને બિલ કલેક્શનનું કામ કરવું પડી રહ્યું છે. આમ મેડિકલ કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે કેનેડા જનારા વિદ્યાર્થીઓને પણ સમસ્યા ઝાઝી છે. તેમને પણ સંઘર્ષ વધી ગયો છે. તદુપરાંત કુળાવો વધતાં ખાધાખોરાકીનો ખર્ચ પણ ઊંચો ગયો છે.

વિદ્યાર્થી માંદા પડે તો આરોગ્યની જાળવણી માટેનો ખર્ચ તો પરવડે તેવી જ નથી. મહિનાના બે છેડા એક કરવા અશક્યવત્ બનવા માંડ્યા છે. ભાડાંનો ખર્ચ ઓછો કરવા માટે વિદ્યાર્થીઓને ભાડાંખર્ચ બચાવવા એક જ ઘરમાં પાંચથી સાત જણાને રહેવાની ફરજ પડી રહી છે. કેનેડા પહોંચ્યા પછી નોકરી કરીને પોતાને ટકાવવાની અને ભારતમાં રહેતાં માતાપિતાને પૈસા મોકલવાની વાત સાવ જ વીસરાઈ ગઈ છે.

ખાનગી કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરીને વર્ક પરમિટ મેળવતા હતા, પરંતુ ખાનગી કોલેજના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ કરનારા વિદ્યાર્થીઓને પણ વર્ક પરમિટ ન આપવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. 15મી મે, 2024થી આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. હા, ખાનગી કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વાઈફને ઓપન વર્ક પરમિટ હેઠળ કામ કરવાની છૂટ આપવામાં આવશે. તદુપરાંત પહેલી જાન્યુઆરી, 2024થી કેનેડિયન સ્ટડી પરમિટ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓને ગૅરન્ટેડ ઈન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ હેઠળ રોકવા પડતાં નાણાંના પ્રમાણમાં સો ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. આમ ટ્યૂશન ફીના ખર્ચ કર્યા ઉપરાંત વિદ્યાર્થીઓએ તેમના નિભાવ માટેના ખર્ચ 20,635 ડોલર રાખવા પડી રહ્યાં છે.





**નિયમનો ભંગ કરીને
એક્સપોર્ટ કરનારાઓને
તેમનાં એક્સપોર્ટનાં
કન્સાઇનમેન્ટ પહોંચી
ગયા પછી પાછાં મંગાવી
લેવાની ફરજ પડશે**

જંગલનો નાશ કરી વસ્તુઓ બનાવીને યુરોપ એક્સપોર્ટ કરશો તો રિજેક્ટ થશે

બા

રત સરકાર કૃષિ ઊપજમાં વેલ્યુ એડિશન એટલે કે મૂલ્યવૃદ્ધિ કરીને નિકાસ કરવા પર ફોકસ કરી રહી છે. કૃષિઉપજ પર પ્રોસેસ કરીને તેની નિકાસ વધારવાના પ્રયાસોમાં અને વિદેશી ડૂરિયામણની આવક વધારવાના પ્રયત્નમાં અવરોધ ઊભો થાય તેવો નિર્ણય બ્રિટનના ફોરેસ્ટ અંગેના નવા નિયમોથી આવી રહ્યો છે. જંગલની જમીનને ખેતી માટેની જમીનમાં રૂપાંતરિત કરવામાં આવે તો યુરોપિયન સંઘના દેશોનો જંગલની જમીન અંગેનો નિયમ લાગુ પડે છે. આ નિયમનો ભંગ કરવામાં આવે તો જે તે દેશને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવે અને તેમાંથી થતી નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે તેવી પણ વ્યવસ્થા નવા નિયમો હેઠળ કરવામાં આવી છે. તેમ જ તેમને મોટી રકમનો દંડ કરવામાં આવે તેવી જોગવાઈ પણ કરવામાં આવેલી છે. આ બાબતમાં ભારત સરકારની અને યુરોપિયન સંઘના દેશોની વ્યાખ્યા એકબીજાથી સદંતર અલગ જ છે.

યુરોપિયન સંઘની સંસદે 31મી મે, 2023ના દિને નવા નિયમો તૈયાર કરીને લાગુ કરવાનો નિર્ણય લીધો છે. યુરોપિયન સંઘનાં બજારો માટે આ નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. વનનો નાશ કરવાની અને વનનું આવરણ ઓછું થવાની બાબત સાથે સંકળાયેલા આ નિર્ણયને પરિણામે યુરોપિયન સંઘનાં ચોક્કસ ઉત્પાદનો અને કોમોડિટીઓની

નિકાસ કરવા પર પ્રતિબંધ આવી જશે. વનનો નાશ કરવાની ચાલી રહેલી પ્રવૃત્તિમાં યુરોપિયન સંઘના દેશોના ફાળાને ઓછો કરી દેવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. માત્ર ભારતમાં જ નહિ, વિશ્વના તમામ દેશોમાં વનનું આવરણ ઓછું થઈ રહ્યું હોવાથી આ નિયમ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. આ રીતે વાતાવરણમાંના કાર્બન ઉત્સર્જનને ઓછું કરવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. યુરોપિયન સંઘના દેશો પોતાના દેશમાં કાર્બન ઉત્સર્જન ઓછું કરશે તેમ જ કાર્બનના વધી રહેલા પ્રમાણને વૈશ્વિક સ્તરે બાયોડાયવર્સિટી પર પડી રહેલી અસરને અથવા તો ગ્લોબલ બાયોડાયવર્સિટીને થઈ રહેલા નુકસાનને અટકાવવાના ધ્યેય સાથે નિયમ તૈયાર કરવામાં આવ્યા છે.

સોયાબીન, પામ ઑઇલ, કોફી, લાકડાં, રબરની નિકાસ ઘટશે

યુરોપિયન સંઘ દ્વારા લાગુ કરવામાં આવેલા નવા નિયમોના અનુચ્છેદ-આર્ટિકલ 1માં કરવામાં આવેલી જોગવાઈને પરિણામે ભારતમાંથી કોફી, કોફી, પામ ઑઇલ, સોયાબીન અને સોયાબીનનું તેલ, લાકડું અને પશુધનની નિકાસ કરવા પર અવળી અસર પડી શકે છે. આ નિયમ કચરા તરીકે ફેંકી દેવામાં આવેલી વસ્તુઓમાંથી બનાવવામાં આવેલા પદાર્થમાંથી બનાવેલી વસ્તુઓનો તેમાં

સમાવેશ કરવામાં આવ્યો નથી. આ પદાર્થોને આમ પણ ફેંકી જ દેવાના હોય છે. આમ તેના સિવાયની વસ્તુઓ એટલે કે જીવંત ઝાડ કાપીને તેમાંથી બનાવેલી વસ્તુઓની આયાત પર યુરોપિયન સંઘના દેશોએ પ્રતિબંધ લગાવ્યો છે.

નિયમનો ભંગ કરીને એક્સપોર્ટ કરનારાઓને તેમનાં એક્સપોર્ટનાં કન્સાઇનમેન્ટ પહોંચી ગયા



પછી પાછા મંગાવી લેવાની ફરજ પડશે. આ રીતે રિટર્ન કરવામાં આવેલાં કન્સાઇનમેન્ટના સંદર્ભમાં નિકાસકાર દેશ કે પછી નિકાસકાર કંપની યુરોપિયન સંઘના દેશો સામે વિશ્વવેપાર સંઘ-વર્લ્ડ ટ્રેડ ઓર્ગનાઇઝેશનના વેપાર માટેના નિયમો હેઠળ

તૈયાર કરવામાં આવેલા વાજબી વેપારના નિયમોનો ભંગ કરવા બદલ યુરોપિયન સંઘના દેશો સામે કોઈ દાવો કરી શકશે નહિ. આજની તારીખે ભારતની કૃષિઉપજની નિકાસ 50 અબજ અમેરિકી ડોલરની આસપાસની છે. આ નિકાસમાં વૃદ્ધિ કરવા માટે ભારત સરકાર તનતોડ પ્રયાસ કરી રહી છે તેમ જ કૃષિક્ષેત્રમાં નવાં નવાં સંશોધન થાય અને કલાઈમેટ ચેન્જ સામે ટકી રહીને વધુ ઉપજ આપે તેવા પાકનાં બિયારણ તૈયાર કરાવી રહી છે. તેને માટે 5500 વિજ્ઞાનીઓને તૈયાર કર્યા છે. તેમના પ્રયાસના ફળસ્વરૂપે જ 109 નવાં બિયારણ ઓગસ્ટ, 2024માં લૉન્ચ પણ કર્યાં છે. જોકે કૃષિઉપજને આ નિયમ કઈ રીતે લાગુ પડશે તે એક સમજવાની બાબત છે.

યુરોપિયન સંઘના નવા નિયમોના આર્ટિકલ-3માં કઈ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવામાં આવશે તેની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વન કે જંગલનું આવરણ ઓછું ન થયું હોય અને વનમાં નાશ પામેલી અને કચરામાં જાય તેવી વસ્તુઓમાંથી જ પ્રોડક્ટ તૈયાર કરી હશે તો તેની આયાત કરવા દેવામાં આવશે. ભારતમાં વનની વસ્તુઓમાંથી પ્રોડક્ટ તૈયાર કરવા માટે નક્કી કરવામાં આવેલા નિયમ મુજબ જ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવ્યા હશે તો જ તેની આયાત કરવામાં આવશે. તેની સાથે ઝૂ ડિલિજન્સનું સ્ટેટમેન્ટ આપવું ફરજિયાત કરવામાં આવ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો તેમણે નિકાસ કરેલાં ઉત્પાદનો યુરોપિયન સંઘના નિયમોનો ભંગ ન થાય તે રીતે તૈયાર કરવામાં આવ્યાં હોવાનું પ્રમાણપત્ર આપવું પડશે. વનનું આવરણ ઓછું ન કરે તે માટે કરવામાં આવેલી વ્યાખ્યાને સમજવી પણ એટલી જ જરૂરી



છે. યુરોપિયન સંઘના નિયમોના આર્ટિકલ 2(3)માં કરવામાં આવેલી જોગવાઈમાં જણાવવામાં આવ્યું છે કે જંગલની જગ્યાને ખેતીલાયક બનાવીને તેના પર ખેતી કરવામાં આવતી ન હોવી જોઈએ. તેમ ન કરીને ખેતરની જમીન પર ઉગાડવામાં આવેલી

વન-જંગલમાંનાં આડવાં કાપીને તેમાંથી બનાવેલી કોઈ વસ્તુ એક્સપોર્ટ કરવામાં આપશે તો તેમને યુરોપિયન સંઘના દેશો બ્લૅક લિસ્ટ કરી દેશે, તેમના પર પ્રતિબંધ મૂકશે



વનસ્પતિમાંથી બનાવવામાં આવેલી પ્રોડક્ટ્સની જ નિકાસ કરી શકાશે. માનવે કરેલી દરમિયાનગીરીથી કે અન્ય રીતે જંગલની જમીન ખેતરમાં રૂપાંતરિત થઈ હશે તો તેમાં થતી ઉપજોને નિકાસને પાત્ર ગણવામાં આવશે નહિ. કૃષિવપરાશ માટેની જમીનની વ્યાખ્યા આર્ટિકલ 2 (5)માં આપવામાં આવેલી છે. તેમાં એગ્રિકલ્ચર પ્લાન્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખેતરના શેઢા પર લગાડવામાં આવેલી વનસ્પતિને પણ તેમાં આવરી લેવામાં આવેલી છે. યુરોપિયન સંઘના નિયમોમાં વનનું આવરણ ઓછું કરે તેવી ઉપજોનો એટલે કે રિફોરેસ્ટેશન ફીનો અર્થ સમજાવવામાં આવ્યો છે. પહેલું, 31મી ડિસેમ્બર, 2020 પછી જે પ્રોડક્ટ્સ જમીન પર ઉગાડવામાં આવેલી યોગ્ય કોમોડિટીઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી હશે અને તેને કારણે જમીન પરનું વનનું આવરણ ઓછું ન થયું હોય તેવી પ્રોડક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજું, 31મી ડિસેમ્બર, 2020 પછી વન કુદરતી રીતે ખતમ થયું હોય અને વનનું આવરણ ઓછું થયું હોય અને તેમાં કોઈ જ કાપણી કે લાણણી ન કરવામાં આવી હોય અને જે લાકડું મળ્યું હોય તે લાકડામાંથી બનાવેલી વસ્તુઓની જ નિકાસ કરી શકાશે. તેની સાથે ભારતના ફોરેસ્ટ કન્વર્ઝન એક્ટ 1980 અને સુધારેલા ફોરેસ્ટ કન્વર્ઝન એમેન્ડમેન્ટ એક્ટ 2023માં કરવામાં આવેલી સુધારેલી જોગવાઈને પણ ધ્યાનમાં લેવાની રહેશે. તેમાં ડિસેમ્બર 12, 1996 પૂર્વે વનની જમીનને બિનજંગલની જમીન તરીકેના વપરાશ માટે લેવાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આમ ભારતની વનની જમીન અંગેની વ્યાખ્યા અને યુરોપિયન સંઘના નવા નિયમો હેટળની વનની વ્યાખ્યા એકબીજાને મેળમાં નથી. તેથી જ યુરોપિયન સંઘના દેશો સાથે વનની વસ્તુઓમાંથી બનાવેલી ચીજવસ્તુઓનો વેપાર કરવા ઈચ્છનારે ધ્યાનમાં રાખવાની રહેશે. ભારતના નિયમો અને યુરોપિયન સંઘના નિયમોમાં સુમેળ નહિ હોય તો તેવા સંજોગોમાં યુરોપિયન સંઘના નિયમોને અનુસરવાનું રહેશે. આ બાબતને ધ્યાનમાં રાખીને

જ કોઈ પણ નિકાસકારે વેપાર કરવાનો રહેશે.

આ નિયમ અને તેને કારણે ઊભી થનારી પરિસ્થિતિનો સાર એ જ છે કે 31મી ડિસેમ્બર, 2020 પછી પરવાનગી વિના જ જંગલની જમીનનો ખેતીની જમીન માટે ઉપયોગ કરવામાં આવશે તો તેના પર ઉગાડવામાં આવેલી વસ્તુઓની નિકાસ યુરોપિયન સંઘના દેશોમાં કરી શકાશે નહિ, કારણ કે તેનાથી જંગલનું આવરણ ઓછું થાય છે. જંગલનું આવરણ ઓછું થવાની સાથોસાથ તે જમીન પર ઉગાડવામાં આવતી કોમોડિટીને આયાતને પાત્ર ગણવામાં આવશે નહિ.

જમીનનું ભૌગોલિક સ્થળ પ્રસ્થાપિત કરવાની જરૂરિયાત છે. અક્ષાંશ અને રેખાંશના પટ્ટા પર જે તે જમીન ક્યાં આવેલી છે તે પણ પ્રસ્થાપિત કરવું જરૂરી છે. આ શરતનું પાલન કરવું અત્યંત કઠિન કે મુશ્કેલ છે, કારણ કે તેને લગતા પુરાવાઓ 31મી ડિસેમ્બર, 2020થી આપવાના છે. આ અંગે ઘણી સ્પષ્ટતાઓ કરવામાં આવેલી છે. તેને માટેના ટેકનોલોજી આધારિત ઉકેલ પણ આપવામાં આવ્યા છે. 31મી ડિસેમ્બર, 2020ના જમીનનું સ્ટેટસ શું હતું તે તેનાથી પ્રસ્થાપિત કરી શકાશે. જંગલનું આવરણ ઓછું થયું હોય તેને માટે રિફોરેસ્ટેશન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આર્ટિકલ 2 (7)માં ફોરેસ્ટ રિગ્રેડેશનની વ્યાખ્યા આપવામાં આવેલી છે. તેનો અર્થ એ થાય છે કે જંગલના આવરણમાં માળખાકીય ફેરફાર થઈ ગયા હોય તેને જંગલના આવરણમાં ઘટાડો થયેલો ગણવામાં આવશે. પ્રાથમિક જંગલનું કે પછી કુદરતી રીતે ઊગતાં અને નાશ પામતાં ઝાડવાંઓના વિસ્તારને પ્લાન્ટેશન કરીને જંગલમાં રૂપાંતરિત કરવો તેને વનીકરણ ગણવામાં આવે છે. લાકડાંવાળી જમીન અથવા તો પ્લાન્ટેશન કરીને વિકસાવેલા જંગલ તરીકે ઓળખાવવામાં આવે છે. તેથી જ વનનું-જંગલનું આવરણ ઓછું થવા માટે એક વાત સ્પષ્ટ હોવી જોઈએ કે જંગલનો ઉપયોગ ખેતીની જમીનમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યો છે. જંગલમાં વસતા લોકોના અધિકારોનું રક્ષણ પણ થવું જરૂરી છે.

યુરોપિયન સંઘના દેશોએ રિફોરેસ્ટેશન અંગે

નક્કી કરેલા નિયમોને પરિણામે તેનાં ઉત્પાદનોનો વેપાર કરનારાઓ વેપારીઓ અને ઓપરેટર્સને માથે બહુ જ મોટી જવાબદારી આવી જાય છે. યુરોપિયન સંઘે તૈયાર કરેલા કાયદાના આર્ટિકલ 2/15માં ટ્રેડર-ઓપરેટર કોને કહેવામાં આવશે તેની વ્યાખ્યા આપવામાં આવેલી છે. વાણિજ્યિક પ્રવૃત્તિ થતી હોય તેવા વિસ્તારમાં તેની પ્રોડક્ટ્સને મૂકીને તેનો વેપાર કરતી હોય અને તેની નિકાસ પણ કરતી હોય તેવી વ્યક્તિને વેપારી કે ઓપરેટર ગણવાનું નક્કી કરવામાં આવ્યું છે તેમ જ ટ્રેડરની વ્યાખ્યા આર્ટિકલ 2/17માં પણ આપવામાં આવી છે. બજારમાં વિતરણ કરવા માટે કે વપરાશ કરવા માટે કે પછી ઉપયોગ કરવા માટે બજારમાં પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવનારને ટ્રેડર તરીકે ઓળખાવવામાં આવ્યો છે. સપ્લાય ચેઇનમાં ઓપરેટર ટ્રેડર તરીકે કામ કરતો હોય તો તેને પણ આ જ આર્ટિકલની જોગવાઈ લાગુ પડી શકે છે. કોઈ ભારતીય સપ્લાયરની શાખા યુરોપિયન સંઘના દેશોમાં હોય તો તેવા સંજોગોમાં તેને પણ ઓપરેટર તરીકે કે પછી વેપારી તરીકે ગણતરીમાં લેવામાં આવશે. હા, તેઓ કઈ રીતે કામ કરે છે તેને પણ ધ્યાનમાં લઈને તેને કઈ કેટેગરીમાં મૂકવો તે અંગે નિર્ણય લેવામાં આવશે.

ડિફરેન્સિયેશન નિયમનો ભંગ કરનારને દંડ થશે

આમ તો 29મી જૂન 2023થી ડિફરેન્સિયેશન ફી પ્રોડક્ટ્સ અંગેનાં નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યાં છે. આ કાયદાકીય જોગવાઈનો યુસ્ત અમલ 30મી ડિસેમ્બર, 2024થી થશે. આ નિયમોની બાબતમાં જાગૃત થઈ જવાની ઘડી અત્યંત નજીક આવી ગઈ છે. આ નિયમ કે કાયદાકીય જોગવાઈનો ભંગ કરનારા વેપારીઓને દંડ કરવામાં આવશે. યુરોપિયન સંઘના દેશોમાં આ પ્રોડક્ટ્સ મોકલનારને દંડ કરવામાં આવશે. પહેલાં તો તેમને ડિફરેન્સિયેશન માટે જવાબદાર



યુરોપિયન સંઘે તૈયાર કરેલા નવા કાયદાની જોગવાઈનો ભંગ કરનારા નિકાસકારોને બ્લૅક લિસ્ટ કરવામાં આપશે.



વિરપના તમામ દેશોમાં પનનું આપણા ઓછું થઈ રહ્યું હોવાથી અને પાતાપણમાંના કાર્બન ઉત્સર્જનને ઓછું કરવા નવો નિયમ લાગુ કરવામાં આપશે



ડિફરેન્સિયેશન માટે જવાબદાર પ્રોડક્ટ્સ બજારમાં મૂકી હોય તો તે પ્રોડક્ટ્સ પેચાઈ ગઈ હશે તો પણ તેના ખરીદનારા પાસેથી પાછી મગાવી લેવાની રહેશે અને તેમને નાણાં પરત કરવાં પડશે



યુરોપિયન સંઘના દેશોમાં પ્રોડક્ટ્સની નિકાસ કરનારાઓ માટે 30મી ડિસેમ્બર, 2024થી ડિફરેન્સિયેશન ફી પ્રોડક્ટ્સના કાયદાને લાગુ કરી દેવામાં આપશે અને કાયદાકીય જોગવાઈનો ભંગ કરનારા વેપારીઓને દંડ કરવામાં આપશે.



નિકાસ કરેલાં ઉત્પાદનો યુરોપિયન સંઘના નિયમોનો ભંગ ન થાય તે રીતે તૈયાર કરવામાં આવ્યા હોવાનું પ્રમાણપત્ર આપવું પડશે.

વૅરિપેક સ્ટરે બાયોડાયપ્લોમીનીને થઈ રહેલા નુકસાનને અટકાવવાના ધ્યેય સાથે યુરોપિયન સંઘના દેશો દ્વારા નિયમ તૈયાર કરવામાં આવ્યા

ડિફરેન્સિયેશન ફી પ્રોડક્ટ્સ માટે ઓપરેટરને પણ જવાબદાર ગણ્યા

ઓપરેટરને માથે પણ કેટલીક જવાબદારી નાખવામાં આવેલી છે. ઓપરેટરે દરેક પ્રોડક્ટ્સના સપ્લાયર દ્વારા આપવામાં આવતી સપ્લાય કાયદાકીય જોગવાઈ મુજબની છે કે નહિ તેની ચકાસણી કરવાની રહેશે. તેને માટે તપાસ કરવી પડે તો તપાસ પણ કરવાની રહેશે. તેને મળેલી માહિતીનું વિશ્લેષણ કરીને તારણ રજૂ કરવાનું રહેશે. આ તારણને દસ્તાવેજી સમર્થન પણ મળવું જોઈએ. તેમને ત્યાં મોકલવામાં આવેલી પ્રોડક્ટ્સ આર્ટિકલ 9માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ ડિફરેન્સિયેશન ફી છે. યુરોપિયન સંઘે તૈયાર કરેલા કાયદાના આર્ટિકલ 10ની જોગવાઈ મુજબ પ્રોડક્ટ્સ મોકલનાર દેશે કોઈ નિયમનો ભંગ કર્યો છે કે નહિ તેની ચકાસણી કે આકારણી કરીને તારણ રજૂ કરવાની જવાબદારી ઓપરેટરને માથે નાખવામાં આવેલી છે. કોઈ પણ પ્રોડક્ટને બજારમાં મૂકતાં પહેલાં આ વિગતો આપવાની રહે છે.

હોય તેવી પ્રોડક્ટ્સ માર્કેટમાં ન મૂકવા જણાવવામાં આવ્યું છે. આ પ્રકારની પ્રોડક્ટ્સ માર્કેટમાં આવતી અટકાવવાની તેમની જવાબદારી છે. તેમણે ડિફરેન્સિયેશન માટે જવાબદાર બની હોય તેવી પ્રોડક્ટ્સ બજારમાં મૂકી હોય તો તેવા સંજોગોમાં તે પ્રોડક્ટ્સ વેચાઈ ગઈ હશે તો તેના ખરીદનારા પાસેથી પાછી મગાવી લેવાની રહેશે. આ ગુના માટે ઓપરેટરને મોટી રકમનો દંડ કરવામાં આવશે. દંડની આ રકમ છેવટે તો ભારતના નિકાસકાર પાસેથી જ વસૂલવામાં આવશે. આ નિકાસકારને બ્લૅક લિસ્ટ કરી દેવામાં આવશે. નાના અને મધ્યમ ઉદ્યોગો માટે આ સંદર્ભમાં અલગ નિયમો-નિયંત્રણો રાખવામાં આવ્યાં

છે. તેથી જ નિકાસકારોએ યુરોપિયન સંઘના જે તે દેશ સાથે નિકાસ માટેના કરાર કરેલા હોય તો તેમણે તેમના કરારને નવેસરથી તૈયાર કરીને તેના પર સહીસિક્કા કરી લેવાના રહેશે. આ બાબતમાં સુસ્તી દાખવનાર નિકાસકારોએ સમય જતાં પસ્તાવું પડે તેવું બની શકે છે.

ઈ-કૉમર્સ કંપનીઓ સસ્તામાં વસ્તુઓ વેચી રિટેલર્સનો ધંધો તોડવાનું બંધ કરે



અં

મેઝોને નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 6000 કરોડની ખોટ કરી હોવાની બાબતે પ્રતિભાવ આપતાં કેન્દ્રના વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે છૂટક વેપાર કરતા દુકાનદારોના ધંધાઓ તોડી પાડવા માટે વિદેશી ઈ-કોમર્સ કંપનીઓ બજારભાવ કરતાં ઓછા ભાવે માલ વેચી રહી હોવાની ગંધ આવી રહી છે. દેશના દસ કરોડ છૂટક વેપારીઓ પર તેની વિપરીત અસર પડી શકે છે. આ અંગે અભ્યાસ થવો જરૂરી છે. બીજી તરફ ઈ-કોમર્સ કંપનીઓને સ્થાનિક વેપારીઓ તેમની દુકાનમાં વેચાતી પ્રોડક્ટ્સ પોર્ટલ પર વેચવા માટે મૂકે તો તેમને પણ ખંખેરી રહી છે. આ રહ્યું તેનું ઉદાહરણ. અમદાવાદની એક મોટી રિટેલ શોપના માલિકે ઓનલાઇન પોર્ટલ પર રૂ. 1.00983ના મૂલ્યની ઇલેક્ટ્રોનિક્સ આઈટમ્સ



મેઘરાજ ડોડવાણી,
પ્રમુખ, ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ

લ્યો કરો વાત, જુદી જુદી ફીને નામે ઈ-કૉમર્સ કંપનીએ રિટેઈલરની અંદાજે રૂ. 65,000ના મૂલ્યની વસ્તુઓ વેચીને દુકાનદારને રૂ. 27,000ની આસપાસની રકમ ચૂકવી દીધી

બુકરોર્સ, અનાજકરિયાલાની દુકાનો, રેસ્ટોરાં, બેકરી અને તેના જેવી અન્ય છૂટક દુકાનોના ધંધા ઈ-કૉમર્સના પ્લેટફોર્મ પર કેન્દ્રિત થયેલા વેપારને કારણે તૂટી રહ્યા

buy

ઈ-કોમર્સ કંપનીને આપી હતી. ઈ-કોમર્સ કંપનીએ તેમાંથી અંદાજે રૂ. 36,201ની વસ્તુઓ પરત કરી દીધી. બાકીની અંદાજે રૂ. 64,000ના મૂલ્યની વસ્તુઓ વેચીને દુકાનદારને રૂ. 35,739.25ની આસપાસની રકમ ચૂકવી દીધી. આમ રૂ. 65000ના મૂલ્યની ઇલેક્ટ્રોનિક્સ આઈટમ્સના રૂ. 35,739 જ મળ્યા. અમદાવાદના ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓના અસોસિયેશનના પ્રમુખ મેઘરાજ ડોડવાણીએ આ અંગે ફરિયાદ પણ કરી છે, કારણ કે તેમાંથી ટેક્સના રૂ. 2459.96, રિકોલ ફીના રૂ. 13,656.66 કાપી લીધા હતા. ઓએનએસ અમાઉન્ટના રૂ. 15,425.55, માર્કેટ પ્લેસના રૂ. 6040.51 અને એમપી રિબેલ ફીને રૂ. 28.71 કાપી લીધા હતા. આમ તેને મળવાપાત્ર રકમમાંથી 40 ટકા જેટલી રકમ કાપી લઈને વેપારીને વસ્તુના વેચાણ પેટે પૈસા આપવામાં આવ્યા હતા.

મેઘરાજ ડોડવાણીનું કહેવું છે, “ઈ-કોમર્સ કંપનીઓ આવી ત્યારે તેમનું પ્લેટફોર્મ દરેક વેપારીને વાપરવા દેવાની છૂટ આપવાની શરત હતી. હવે ઓનલાઈન કંપનીઓ પોતાની કંપનીઓ ઊભી કરીને વેપાર કરી રહી છે. તેમનાં ગોદામોમાં પોતાની કંપનીઓની વસ્તુઓ મૂકીને વેચી રહ્યા છે. ભારતીય કંપનીઓ અને રિટેલર્સનો માલ માત્ર નામ પૂરતો જ વેચી રહ્યા છે. તેની સામે સ્થાનિક વેપારીઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે હેવી ચાર્જ વસૂલી રહી છે. વેપારને બચાવીને દેશને બચાવવાનો સમય આવી ગયો છે.” પીયૂષ ગોયલનું કહેવું છે કે, “મોટી ઓનલાઈન રિટેલ કંપનીઓ કદાચ ઓછા ભાવે ચીજવસ્તુઓ વેચવાનું કામ કરી રહી છે તે દેશ માટે સારું નથી. તેનાથી શહેરી અને ગ્રામીણ વિસ્તારના 10 કરોડ છૂટક વેપારીઓના ધંધા તૂટી રહ્યા છે. આ રીતે ધંધો તોડી નાખવાની પ્રવૃત્તિ સામે તેમને રક્ષણ આપવું જરૂરી છે.” ઈ-કોમર્સની ભારતમાં રોજગારી અને ગ્રાહકોના કલ્યાણ પર પડતી ચોખ્ખી અસર અંગે પહેલે ઈન્ડિયા ફાઉન્ડેશને તૈયાર કરેલા અહેવાલને વહેતો કરવા માટે યોજવામાં આવેલા સમારોહમાં બોલતાં પીયૂષ ગોયલે ઉપરોક્ત



જશુભાઈ પટેલ,
ચેરમેન, કેમિસ્ટ અસોસિએશન

રજૂઆત કરી છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય અર્થતંત્રમાં ઈ-કોમર્સની ભૂમિકાનું કાળજીપૂર્વક મૂલ્યાંકન થવું જરૂરી છે. આ પ્રકારે થતાં ઈ-કોમર્સથી 10 કરોડ વેપારીઓ પર અવળી અસર પડે તેવી તોડફોડ ન જ થવી જોઈએ. 21મી ઓગસ્ટે એમેઝોન દ્વારા નાના વેપારીઓના ધંધા તોડી પાડવાની માનસિકતાથી ઈ-કોમર્સ કરવામાં આવી રહ્યો હોવાને મુદ્દે ચિંતા વ્યક્ત કર્યા બાદ વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલે આ સંદર્ભમાં 22મી ઓગસ્ટે મુંબઈમાં એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે કેન્દ્રની એનડીએ સરકાર ઈ-કોમર્સનો વિરોધ કરતી નથી. ઈ-કોમર્સના ક્ષેત્રમાં સીધા વિદેશી મૂડીરોકાણ-એફડીઆઈને

અમે આવકારીએ જ છીએ, પરંતુ ઈ-કોમર્સ કરનારાઓએ વાજબી રહીને પ્રમાણિકતાથી કામ કરવું જોઈએ. નાના વેપારીઓના ધંધા તોડી પાડે તે રીતે ભાવ રાખવા ન જોઈએ. ગ્રાહકો, સપ્લાયર્સ અને સ્થાનિક બિઝનેસનું હિત જળવાય તે રીતે વેપાર કરવો જોઈએ. નાના વેપારીઓને પણ સ્પર્ધા કરવાની વાજબી તક મળવી જોઈએ. ઈ-કોમર્સના ખાસ્સા લાભ છે. ઈ-કોમર્સને કારણે આમજનતાની સુવિધામાં વધારો થાય છે. ઈ-કોમર્સને કારણે ગ્રાહકને જોઈતી વસ્તુ ઝડપથી મળી જાય છે. ઈ-કોમર્સને કારણે લોકોને ઘણી જઠાંથી મુક્તિ પણ મળે છે. છતાં સામાજિક સમતુલા ન ખોરવાય તે માટે 10 કરોડ વેપારીઓના હિતને પણ જોવું જરૂરી છે. ભારત આજે વિશ્વનું ચોથા ક્રમનું મોટું છૂટક બજાર છે. 2023ના વર્ષમાં ભારતના છૂટક બજારનું કદ 820થી 840 અબજ અમેરિકન ડોલરનું હતું. તેમાંથી ઈ-કોમર્સનો હિસ્સો 60થી 70 અબજ ડોલરનો છે. 2027 સુધીમાં છૂટક વેચાણનું બજાર વધીને 1.1 લાખ અબજ ડોલરને અને ઈ-કોમર્સનું બજાર 300 અબજ ડોલરને આંબી જાય તેવી સંભાવના છે. સરકાર દ્વારા નવી ઈ-કોમર્સ પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે. આ પોલિસી તૈયાર કરવા પાછળનું ધ્યેય ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાની પ્રવૃત્તિને વેગ આપવાનો છે. તેમ જ ઈ-કોમર્સના માધ્યમથી એક્સપોર્ટ કરવાનો છે. તેની સાથે સાથે જ બજારની અસલ કિંમત કરતાં ઓછા ભાવથી ચીજવસ્તુઓ વેચીને નાના વેપારીઓના ધંધા તોડી નાખવાના કરવામાં આવી રહેલા પ્રયાસને કારણે ઊભી થતી

**ઓનલાઈન
રિટેઈલ કંપનીઓ
કદાચ ઓછા ભાવે
ચીજવસ્તુઓ વેચતી
હોવાથી શહેર અને
ગામડાંના 10 કરોડ
છૂટક વેપારીઓના
ધંધા તૂટી રહ્યા છે. ધંધો
તોડી નાખવાની પ્રવૃત્તિ
સામે વેપારીઓને
રક્ષણ આપવું જરૂરી**

અત્યારે કોઈ પણ પ્રોડક્ટ પર પેકિંગ સારું કરીને બેફામ એમઆરપી-મહત્તમ છૂટક કિંમત લખવાનું વલણ જોવા મળી રહ્યું છે. જેટલું પેકિંગ આકર્ષક તેટલા ભાવ ઊંચા. પરિણામે ગ્રાહકોને તેમણે ચૂકવેલાં નાણાંના પ્રમાણમાં મૂલ્ય ધરાવતી પ્રોડક્ટ્સ મળતી નથી. દવાના બિઝનેસમાં પણ તેવું જ છે. જે દવાની સ્ટ્રિપ કેમિસ્ટને રૂ. 6માં આપવામાં આવે છે. તે જ સ્ટ્રિપ પર એમઆરપી રૂ. 96 લખેલી હોય છે. તેથી કેમિસ્ટ તે દવા 70 ટકા કન્સેશનથી વેચતા હોવાનાં બોર્ડ લગાવીને વેચે છે. આ સંજોગોમાં ગ્રાહકને સસ્તી દવાઓ મળી હોવાની લાગણી થાય છે. વાસ્તવમાં દવાના અસલી મૂલ્યની તુલનાએ તે ત્રણથી ચાર ગણી કિંમત ચૂકવીને આવે છે. આમાં ગ્રાહકને ફાયદો નહિ, નુકસાન થાય છે. અખિલ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ અસોસિયેશનના વડા જશવંત પટેલનું કહેવું છે કે, “ઓનલાઈન ફાર્મસીને કારણે 15થી 17 ટકા કેમિસ્ટના ધંધા સાવ જ ઠપ થઈ જવાની શક્યતા રહેલી છે. આજે ભારતમાં 12.5 લાખ અને ગુજરાતમાં 32000થી વધુ કેમિસ્ટ છે. તેમના ધંધા પર બહુ જ મોટી અસર પડી રહી છે. તેમના અસ્તિત્વ સામે સવાલ ઊભો થઈ રહ્યો છે.” ઓનલાઈન ફાર્મસીને કારણે બીજી અવળી અસર પણ પડી રહી હોવાનું જોવા મળે છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ન મળી શકતી દવાઓ એટલે કે અલ્ટ્રાઝોલમ જેવી સાઈકોટ્રોપિક સબસ્ટન્સ તરીકે વેચાતી દવાઓ ઓનલાઈન ફાર્મસીઓ બેઝીકલ વેચી દે છે. તેનો ઉપયોગ યુવાનો નસો કરવા માટે કરી રહ્યા છે. ઓનલાઈન ફાર્મસીનું આ મોટામાં મોટું દૂષણ છે.


રમકડાની વાત કરીએ તો જે રમકડાની ઉત્પાદન કિંમત રૂ. 25ની

હોય અને બજારમાં હોલસેલર્સ તેને રૂ. 60માં વેચતા હોય તે જ વસ્તુ પર રૂ. 500થી 600ની એમઆરપી લખવામાં આવે છે. આ સ્થિતિમાં ગ્રાહક બાર્ગેન કરે તો પણ તે રૂ. 300માં ખરીદીને આવે છે. આમ જે વસ્તુ તેને રૂ. 75થી 100માં મળી શકે તેમ છે. તે જ વસ્તુને તેઓ રૂ. 300માં ખરીદીને આવે છે. આમ તેને ભયંકર નુકસાન થાય છે. આ સ્થિતિને બદલવા માટે એમઆરપી એક્ટ લાવવો પડે છે. એમઆરપી એક્ટમાં વસ્તુની મહત્તમ છૂટક કિંમત લખવાના નિયમ લાવવો જોઈએ. પહેલાં એક્સાઈઝ ડ્યૂટી હતી તેથી એક્સાઈઝ ડ્યૂટી વધુ ન ભરવી પડે તે માટે તેઓ મહત્તમ છૂટક કિંમત ઓછી લખતા હતા કે માપમાં લખતા હતા. ફેક્ટરીમાંથી બહાર કાઢતી વખતે જ એક્સાઈઝ ચૂકવવી પડતી હતી તેથી એક્સાઈઝ બચાવવા માટે તેઓ માપસર એમઆરપી લખવામાં આવતી હતી. હવે એક્સાઈઝ ન રહી હોવાથી એમઆરપી લખવા પરનો અંકુશ ચાલ્યો ગયો છે. ગર્ભપાતની દવાઓ પણ

ઓનલાઈન આડેધડ વેચાઈ રહી છે. ગર્ભપાતની દવાને કારણે મહિલાઓને જરૂર કરતાં વધારે બ્લીડિંગ થઈ જતું હોવાના કિસ્સાઓ બની રહ્યા છે. પરિણામે મહિલાઓના જીવ સામે પણ જોખમ આવી રહ્યું છે. ભૂતકાળમાં કેમિસ્ટ અને સરકારી અધિકારીઓએ સાથે મળીને તેના વેચાણ પર નિયંત્રણ લાવ્યા હતા. આજે ઓનલાઈન ફાર્મસીને કારણે ગર્ભપાતની દવાઓના વેચાણ પરનો અંકુશ ઓછો થઈ ગયો છે.

**એમઆરપી
એક્ટ લાવો,
વસ્તુઓ સસ્તી
થશે, બેફામ
લાવ નહિ
છપાય**

સમસ્યાનો પણ ઉકેલ લાવવાનો છે. ઈ-કોમર્સની નીતિ તૈયાર કરવા માટે સરકાર છેલ્લાં છ વર્ષથી તૈયારી કરી રહી છે. ઈ-કોમર્સની પોલિસી તૈયાર થઈ ચૂકી છે. સર્વોચ્ચ કક્ષાએથી તેને અનુમતિ મળે તેની જ રાહ જોવામાં આવી રહી છે. ઈ-કોમર્સ પોલિસી માટેનો કાયો મુસદ્દો 2019માં જ વહેતો મૂકી દેવામાં આવ્યો હતો, પરંતુ હજી સુધી તેના અંગે કોઈ જ નિર્ણય લેવાયો નથી, કારણ કે આ પોલિસીમાં રસ ધરાવતાં જૂથો અલગ અલગ લાઈન પર પોતાના મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. દેશના અર્થતંત્રમાં ઈ-કોમર્સની ભૂમિકા ચોક્કસ છે, પરંતુ અત્યારે તેની ભૂમિકા ખરેખર કેવી છે તે અંગે બહુ જ કાળજીપૂર્વક વિચાર થવો જરૂરી બની ગયો છે. ઈ-કોમર્સની ભૂમિકાને વધુ સુયોજિત કરી રીતે બનાવી શકાય તે અંગે પણ વિચાર થવો જરૂરી છે. પીયૂષ ગોયલે સવાલ કર્યો હતો કે, “ઈ-કોમર્સ કંપની દ્વારા બજારકિંમત કરતાં ઓછા ભાવે માલ વેચવો ઉચિત છે ખરો?” મોટી વિદેશી કંપનીઓ ભારતમાં મોટું ઈન્વેસ્ટમેન્ટ કરે છે ત્યારે તેઓ મોટી ખોટ બતાવવાના ઈરાદા સાથે જ આવતી હોય તેવું જણાય છે. એમેઝોન ભારતમાં એક અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરે છે ત્યારે આપણે ભૂલી જઈએ છે કે આ એક અબજ રૂપિયા દેશની સેવા માટે આવી રહ્યા નથી. દેશના અર્થતંત્રને સપોર્ટ કરવા માટે આવી રહ્યા નથી, કારણ કે આ કંપનીઓ તેમનાં સરવૈયા-બેલેન્સશીટમાં એક અબજ ડોલરની ખોટ બતાવી રહી છે. તેમને બેલેન્સશીટમાં લોસ બતાવવાની જરૂર હોવાથી તેઓ ભારતમાં ઈન્વેસ્ટ કરી રહી છે.



ઈ-કોમર્સના ક્ષેત્રની મોટી કંપનીઓ ખોટ બતાવવા માટે બિઝનેસ ટુ બિઝનેસના નિયમોને તોડીમરોડી રહી છે. આ પ્રકારની ઈ-કોમર્સ કંપનીઓએ માત્ર સ્થાનિક કે વિદેશી ઉત્પાદકોને માત્ર બિઝનેસ કરવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવાની જવાબદારી નિભાવવાની છે. કાયદાકીય જોગવાઈ હેઠળ બિઝનેસથી કન્ટ્રીમર એટલે કે તેઓ પોતે ગ્રાહકોને પોતે બનાવેલી ચીજવસ્તુઓનું વેચાણ કરી શકતા નથી. આ રહ્યું તેમની નિયમને તોડવામરોડવાની પ્રવૃત્તિનું ઉદાહરણ. ઈ-કોમર્સ કંપનીઓને કઈ પ્રોડક્ટની બજારમાં કેટલી ડિમાન્ડ છે અને ખરેખર તેનો કેટલો ઉપાડ થઈ રહ્યો છે તેની જાણકારી વેચાણના આંકડાંઓ પરથી મળી જ રહે છે. આ માહિતીનો દુરુપયોગ કરીને તેઓ તે પ્રોડક્ટ બનાવવા માટે પોતાની એક સબસિડિયરી ઊભી કરી રહી છે. આ સબસિડિયરી બહુ જ ચાલતી અને વેચાતી પ્રોડક્ટ્સ જેવી જ પ્રોડક્ટ્સ બનાવવા માંડે છે. જે કંપનીની પ્રોડક્ટ્સ બહુ ચાલતી હોય તેના કરતાં ઓછા ભાવે તે પ્રોડક્ટ્સ બજારમાં મૂકીને તેમના ધંધાને તોડી નાખવાનું કામ કરી રહી છે. આ રીતે ઈ-કોમર્સ કંપનીઓ કાયદાની છટકબારીઓનો ગેરલાભ ઉઠાવી રહી હોવાથી ઈ-કોમર્સ માટે નવી નીતિ તૈયાર કરવામાં આવી રહી છે. આ રીતે ધંધો તોડવાનું કામ કરતા અને માત્ર પ્લેટફોર્મ પૂરું પાડવાને બદલે પોતાનો ધંધો વધારી રહી હોવાની બાબતને ધ્યાનમાં આવી ગઈ છે. તેથી જ સરકારે ઈ-કોમર્સ કંપનીઓ સામે પગલાં લેવા માંડ્યાં છે. તેમને આ રીતે ઊભી કરેલી કંપનીઓ બંધ કરવાની ફરજ પડી રહી છે. તેનીય છટકબારી શોધીને ઈ-કોમર્સ કંપનીઓએ તેનો ગેરલાભ ઉઠાવવા માંડ્યો છે. તેઓ આ સબસિડિયરીને હવે બિઝનેસ ટુ બિઝનેસ કંપની તરીકે બતાવી રહી છે. આ રીતે તેમના બિઝનેસને નવા માર્ગે આગળ વધારી રહી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તમામ ગ્રાહકો આ પ્લેટફોર્મ પરથી તેમની જ કંપનીઓની પ્રોડક્ટ્સની ખરીદી કરી રહી છે. બિઝનેસ ટુ કોમર્સ એટલે કે કંપનીએ માત્ર પ્લેટફોર્મ જ પૂરું પાડવાનું છે. તેમણે પોતે પ્રોડક્ટ તૈયાર કરીને વેચવાની જ નથી. તેમ છતાં તેમની સબસિડિયરી કે સિસ્ટર કંપની ગણાતી કંપની બિઝનેસ ટુ બિઝનેસ સપ્લાય કરી રહી હોવાનું દર્શાવવામાં આવી રહ્યું છે. તેમની પ્રોડક્ટ ગ્રાહકોને વેચી રહી છે. પીયૂષ ગોયલનું કહેવું છે કે, “આ બાબત ભારત સરકાર અને ભારતના વેપારીઓના હિતને ધ્યાનમાં લેતા ચિંતાજનક જણાઈ રહી છે. આગામી દસ વર્ષમાં ભારતના 5 કરોડ વેપારીઓ પણ ઈ-કોમર્સ પ્લેટફોર્મનો હિસ્સો બની જશે. આ પણ એક મોટી ચિંતાનો વિષય છે.” ઈ-કોમર્સની અસર તો ખાસ્સી પડી રહી છે. તેની અસરનો અંદાજ

કોમર્સ કંપનીઓને કઈ પ્રોડક્ટની બજારમાં કેટલી ડિમાન્ડ અને પેચાણ છે તેના આંકડાઓ મેળવી પોતાની એક સબસિડિયરી ઊભી કરી તેવી જ પ્રોડક્ટ્સ બનાવી ઓનલાઇન પેચીને બ્રાન્ડેડ કંપનીઓના ધંધાને તોડી નાખવાનું કામ કરી રહી છે.



એમેઝોન ભારતમાં એક અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરે ત્યારે આપણે ભૂલી જઈએ છે કે એક અબજ રૂપિયા દેશની સેવા માટે કે અર્થતંત્રને સપોર્ટ કરવા માટે આવી રહ્યા નથી. કંપનીઓ તેમનાં સરવૈયાં-બેલેન્સશીટમાં એક અબજ ડોલરની ખોટ બતાવી રહી છે

તેને લગતી આંકડાંકીય વિગતો પરથી મળી રહી છે. આ વિગતોની પશ્ચિમના દેશોના ઈ-કોમર્સ સાથે સરખાવવામાં આવે તો અમેરિકા અને યુરોપિયન સંઘના દેશોમાં આવેલા મોમ એન્ડ પોપ સ્ટોર્સના વેપાર તૂટી રહ્યા છે. પરિણામે સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશને પણ નાના નાના છૂટક વેપારીઓ-રિટેઈલર્સના ધંધાઓ તૂટતા અટકાવવા તે અંગે ગંભીરતાથી વિચાર કરવાની ફરજ પડી છે. મોમ એન્ડ પોપ સ્ટોર્સ એટલે સામાન્ય રીતે નાના પરિવારના સભ્યો મળીને નાની-મોટી દુકાન ચલાવીને ગુજરાન ચલાવે છે. તેની આસપાસની વસતિના લોકોને જોઈતી

વસ્તુઓ વેચવાનું કામ કરે છે. તેમાં બુકસ્ટોર્સ, અનાજકરિયાણાની દુકાનો, રેસ્ટોરાં, બેકરી અને તેના જેવી અન્ય છૂટક દુકાનોનો સમાવેશ થાય છે. જોકે મોમ એન્ડ પોપ શોપ્સ હવે ઈ-કોમર્સના પ્લેટફોર્મ પર કેન્દ્રિત થયેલા વેપારને કારણે તૂટી રહ્યા છે. તેમને વાવટા સંકેલી લેવાની ફરજ પડી રહી છે. બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ અને ઔદ્યોગિક રીતે માન્યતા પ્રાપ્ત કરી ચૂકેલી પ્રોડક્ટ્સના બિઝનેસ પણ તૂટી રહ્યા છે. હા, તેની સામે એવી દલીલ કરવામાં આવે છે કે નવા બિઝનેસ આવે ત્યારે જૂના બિઝનેસ તૂટી જાય છે, પરંતુ ભારત સરકાર તેની સાથે સહમત નથી. ઈ-કોમર્સને કારણે સ્થાનિક બિઝનેસ પર અને રોજગારી પર અને તેમાંય ખાસ કરીને ફાર્મસીના બિઝનેસ પર પડી રહેલી અસરને સ્વીકારવા તૈયાર ન હોય તેવો નિર્દેશ આપવામાં આવ્યો છે.



WE CARE

About creating a cleaner planet
for a secure future





Focused on Healthcare, Power and Gas – necessities without which modern life is unimaginable.

